

જૈન સર્તી વાંચનમાળા નં. ૪૦ ફુ સં. ૧૯૮૬ વર્ષ ૧૧ મુ.

શ્રી મહાવીર—

અને



લેખક

શા. મણીલાલ ન્યાલયં

પ્રકાશક

જૈન સર્તી વાંચનમાળા—પાઠીતાણા.

વીર સંવત ૨૪૫૮

વિકલ સં. ૧૯૮૬

કિંમત ર. ૧-૮-૦

પ્રકાશક:—

જૈન સસ્તી વાંચનમાળા
પાલીતાણા
(કાઠીયાવાડ).

કાધપણું જાતનાં જૈન ધર્મનાં પુસ્તકો શાળાઓમાં ચાલતાં
ધાર્મિક અભ્યાસનાં અને સ્તરન સંજાયનાં પુસ્તકો—તેમજ
નેતેર ધર્તિહાસીક અવનવું સાહિત્ય મેળવવા લખેઃ—
જૈન સસ્તી વાંચનમાળા—પાલીતાણા. (કાઠીયાવાડ.)

પ્રકાશક—સર્વહળ સ્વાધીન રાખ્યા છે.

લાવનગર
ધી આનંદ પ્રી. પ્રેસમાં
શેઠ હેવચંહ દામજાએ
અષ્ટું.

સમર્પણ.

સ્વરૂપ એન સુરજ એન,

તમારા જેવાં ભદ્રિક-સરલ સ્વભાવી ધર્મશ્રદ્ધાળુ,
વયોવૃષ્ટ માતુ તુલ્ય એનને આપના સુખુત્ત શેઠ
મગનલાલ ઠાકરસીની સહાતુભૂતિથી આ પુસ્તક અર્પણુ
કરવાનો અસંગ ગ્રાસ થતાં આ પુસ્તક આપને સમર્પી
આનંદિત થાઉં છું અને આપના આત્માની પરમ
શાંતિ છંચું છું.

પ્રકાશક,

આભાર.

અમહાવાહનિવાસી શેડ મગનલાલ ઠાકરેણી (ગુસા
પટેલની પોળવાળા) ભાઈએ તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રી
સુરજ ઐનની યાદગીરી નિમિત્તે આ પુસ્તકની
બસો નકલના પ્રથમથી થાડક થઈ મારા કાર્યને
સહાનુભૂતિ આપી છે તે માટે તેઓશ્રીનો આભારી છું.

વાચક ગૃહસ્થો તેમનું અનુકરણુઃકરી સાહિત્ય
પ્રચાર સાથે અમારા કાર્યના સહાયક થશે તેમ
ધીમું છું.

દી. અચારતલાલ.

૨૭૦ શ્રી સુરજબહેનતું

જવન-સમરણ.

આર્થસજ્ઞારીઓના હૃદયમાં સ્વામીભક્તિ અને ધર્મપ્રેમની રસનયોત્ત સહાયે જાગૃત રહે છે. એ હીવડો કાળના ગમે તેવા અપારા આવે છતાંથે ખુઅાતો નથી. અમહાવાહના જાણીતા સ્વ૦ શેઠ ડાકરથી પુંજશાના ધર્મપત્ની બહેન સુરજબેનના જવનમાં સ્વામીભક્તિ અને ધર્મપ્રેમની જયોતસારી હતી. એ જયોતના ઉજવણ પ્રકારો તેઓશ્રીના સારાયે કુદુર્ભમાં સુંદર પ્રતિભા પાથરી હતી. સુરજ બહેનનો સ્વભાવ અતિ માયાળુ હતો. તેમના સ્નેહાળ સ્વભાવની છાયામાં સહુને આધ્યાસન મળતું. નિર્દેષ હૃદય અને નિખાલસ ભાવનાતું વહેતું

અરથ હતું આ સુયોગથી સુરજથેન પાસે સહુ ચોત
ચોતાના સુખદુઃખની વાત ઠાકુવતા અને સુરજબહેન
સહુને ભીહું આખાસન આપતાં.

આવી રીતે સુરજબહેનનો ગૃહસંસાર સ્નેહબાક્તાની
સૌરભવડે છલકાતો હતો અને ધર્મકાવનાના અમૃત તો
સુરજબહેનને શંખે શંખે ઢળતાં તેમની ધર્મલક્ષ્મિ
પ્રત્યે સહુને સંમાન હતું. સં. ૧૯૬૬ ના કાર્તિક વર્ષથિ
૧૦ ના દિવસે સુરજબહેન અવસાન પાઢ્યા.

૩૭૦ સુરજબહેનના સંકારી જીવને તેમના કુરુભ્રા
ઉપર સારી પ્રતિક્ષા પાડી હતી. આવાં સ્વી-રત્નોનાં
સંશારણાં સ્વભાવિક કૌને રહી જાય છે.

ગુકાશાકે.



શ્રી પાર્શ્વનાથાય નમઃ

શ્રી મહાવીર અને શ્રેણિક

૫

પ્રકરણ ૧ લું.

આપમાન.

વિશાળા નગરીના રાજમાર્ગ તરફ એક તાપસી ભનમાં
અનેક પ્રકારના વિચાર કરતી ચાલી જાય છે. કઈક વિચાર
આવતાં ક્ષાણુમાં તેણી સ્તબ્ધ થઈ જાય છે, ક્ષાણુમાં અરહુ-
પરહુ જોતી વિશાળાની મોટી મોટી ધ્રમારતો જોવામાં દીન
થાય છે. આવી વિચિત્ર ચેષ્ટાથી કોડો ‘શુ’ આ ગાંડી
હુશે ? ’ વગેરે અનેક પ્રકારના તર્કવિતર્ક કરતા હતા; જ્યારે
તાપસી તેમની ચેષ્ટાઓ (તર્કવિતર્ક) તરફ ધ્યાન નહીં
આપતાં પોતાના જ વિચારમાં એકચિત હતી. “ આહા !

૧

શ્રેષ્ઠક કુમારીએને હું શૈવ બનાવી મારી ભક્ત બનાવું તો કેવું ? એ રાજકુમારીએ મારી સેવા કરે તો હું પણ જગતમાં પૂજનિક થાડું, માટે ગમે તે રીતે શ્રેષ્ઠક કુમારીએને મારે શૈવ ધર્મનો બોધ તો આપવો જોઈએ; તો જ મારા ધર્મનું માહાત્મ્ય વધે, મારું પણ માન-સન્માન થાય.” ઇત્યાદિ વિચાર કરતી તાપસી રાજક્ષારે આવી પહેંચી. પહેર-ગીરને આશીર્વાદ દેવાથી, તેમને વૈરાગ્યનાં એ વચ્ચે ફેલવાથી રાજક્ષારમાં જવાનો માર્ગ તાપસીને માટે ખુલ્લો થાય ગવે.

પહેરગીરાની અનુમતિથી તાપસી રાજગઢનું અવલોકન કરતી શ્રેષ્ઠક કુમારીએની પાસે આવી, તેમને આશીર્વાદ આપી સામે ઉલ્લિ રહી. દાસીએ આસન લાવી આપ્યું, તે ઉપર તાપસી બેઠી. શ્રેષ્ઠક રાજકુમારીએ અને દાસીએ તેની સામે આસનો પડેલાં હતાં તે ઉપર બેઠી. “કયાંથી આવો છો ? આપના આગમનનો હેતુ શો છો ? ” શ્રેષ્ઠક રાજકુમારી સુનેષાએ પૂછ્યું.

રાજકુમારી સુનેષાનો પ્રશ્ન સાંશળી, શરીરના રોમરાય વિકસાવતી તાપસી બોલી “ પહેન ! અમારા જેવા ત્યાગી, વૈરાગી અને પ્રલુબભક્તિમાં જ લીન રહેનારા સંતજનોનો અહોંાં આવવાનો થીલો તો શું હેતુ હોય ? ”

“ તો શું આપને કઈ જોઈએ છો ? આપને ને અભિષ્ટ હોય તે કહો. આપને સંતોષવામાં આવશે, કારણ કે દાન દેવું એ તો ગૃહસ્થજનોનું ભૂષણ કહેવાય ! ” સુનેષા બોલી.

“ રાજકુમારી ! તારું કહેલું હીક છે, છતાં અત્યારે તો તમારી પાસે એક મહત્વના કાર્યપ્રસંગે હું આવી છું.” કહીક ખૂદ હાસ્ય કરતી તાપસી બોલી.

“ અને તે મહત્વનું કાર્ય ? ” ચેત્તણા કે જે સુજ્ઞેષાની નાની બ્હેન હતી તે બોલી.

“ તમારી સાથે ધર્મચર્ચા કરવાનું ! ”

“ એમ.....” સુજ્ઞેષા બોલી.

“ બ્હેન ! જગત ખંડું ભ્રમણુમાં ભૂલું ભાગે છે. કોઈ માથું સુંડાવે છે તો કોઈ લોચ કરે છે; કોઈ જરા વધારે છે તો કોઈ સ્નાનક્રિયાથી રહિત મેલાવેલાપણુમાં જ ધર્મ માને છે. આવી બાદ્ય અનેક પ્રકારની કિયામાં તને શું ધર્મ લાગે છે બ્હેન ? ” તાપસીએ મંગલાચરણ કરતાં ધર્મ-ચર્ચાની શરૂઆત કરી.

“ ત્યારે તમે શેમાં ધર્મ માનો છો ? ” કુનીયશા રાજકુમારી ચેત્તણાએ પૂછ્યું.

“ સાંભળો ! ધર્મ તો શૌચમૂલ તે જ કહેવાય. સ્નાન એ જ ધર્મ છે. સ્નાન કરવાથી જેમ શરીરની શુદ્ધિ થાય તેમ આત્માની પણ શુદ્ધ થાય; માટે જ શાંકાદેશે ગંગા, ગોમતી, રેવાળુ, સરસ્વતી વગેરેના પવિત્ર જળમાં સ્નાન કરવાની આજા કરેલી છે. એ પવિત્ર જળના સ્પર્શથી આપણાં

પાપકર્મ નાશ પામે છે ને ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. તમે પણ શૈચાચમૂલ આવો ઉત્તમ ધર્મ છોડીને શા માટે આડે માર્ગ હોરાયા છો ? તમે પણ વિહુષી છો, સમજુ શકે તેમ છો, જરા તા વિચારો ! ”

“ એકલા સ્નાનથી જ આત્મશુદ્ધિ થાય એ તો અ-
સંભવિત છે. સ્નાનથી પાપનો નાશ અને મોક્ષ મળે છે
એમ શું તમે માનો છો ? ” સુજેષા ખોલી.

“ એશક ! એમાં તમને શું શક લાગે છે. સ્નાન
એ જ મોક્ષનું કારણ છે. પાપીઓએ પણ ગંગાલ જેવા
પવિત્ર જળમાં સ્નાન કરીને મુક્તિ મેળવી છે તો આપણા
જેવા પાવત્ર જનોનો મોક્ષ એ તો નિઃસંદેહ છે.”

“ એ જ તમારી ભયાંકર ભૂલ છે. સ્નાનથી જ ને
મોક્ષ થતો હોય તો ગંગાલમાં માછલાં વગેરે અનેક જળચર
પ્રાણીઓ રાતદિવસ સ્નાન કરી રહ્યાં છે. કહેા, તેમની
મુક્તિ કેમ થતી નથી ? ”

સુજેષાનો પ્રક્ષ સાંભળી તાપસી સ્થંભી અછ. શું
જવાબ આપવો તે માટે વિચારમાં પડી, પણ વળી ખીની
તાત્કાલિક શુદ્ધિએ તેને તત્કાળ સુજેષાના મનનું સમાધાન
કરવા માંડયું. “ અહેન ! એ જળચર જીવોની વાત જૂદી
છે ને આપણી વાત જૂદી છે. તેમાંય એમનો મોક્ષ નહીં જ
થતો હોય તે માટે આપણી પાસે કાંઈ પ્રમાણ છે ? ગંગા,
ગોમતીમાં સ્નાન, એ તો પવિત્ર કહેવાય. એમનાં નામમાત્ર

અહણુ કરવાથી શુદ્ધ થવાય તો પછી એમાં સનાન કરવાથી તો અવશ્ય આપણાં પાતક નાશ થાય જ. ”

“ અરે બાઈ ! આ તમે શું એલે જવ છો. જે એમજ સનાન કરવાથી પાતક હુર થતું હોય તો કહવી તુંબડીને લાખ વાર સનાન કરાવી શુદ્ધ કરો. અવશ્ય એની કડવાશ હુર થશો કેમ ખરુંને ? ડોલસાને હોડવાર ગંગાના જળમાં ધોવાથી કાળાશ જય ખરી કે ? અરે જે સનાનથી જ મુક્તિ મળતી હોય તો તમે જણુવા છતાં પ્રતિહિવસ જળમાં કેમ પડી રહેતાં નથી ? ”

સુનેષાનાં વચન સાંકળી તાપસી વિચારમાં પડી. શું જવાય આપવો તે માટે તે અકળાવા લાગી. “ અરે ! આ તો બકરી કાઢતાં ઉંટ ઘૂસી ગયું. હવે શું થાય. ”

તાપસીને વિચારમાં પડેલી જેણ સુનેષા બોલી “ બાઈ ! ખચીત તું જ બૂલી છો. શાખમાં શુદ્ધિ પાંચ પ્રકારે કહી છે તેની તને ખખર છે ? ”

“ પાંચ પ્રકારની ! કયી ? કયી ? ”

“ પ્રથમ હ્યાશુદ્ધિ, બીજી સત્યવચનશુદ્ધિ, બીજી તપશુદ્ધિ, ચોથી ઈદ્વિદ્યમનશુદ્ધિ અને છેલ્લી-પાંચમી જલશુદ્ધિ કહેલી છે. પ્રથમની ચાર શુદ્ધિ વગર એકદી જળશુદ્ધિ તો નકામી છે. સમજી ? આ ચાર શુદ્ધિઓ ધર્મ લુનેખર ભગવંતે કહેલો છે અને જળશુદ્ધિ તો પાંચમી કહી છે. છતાં તું વસ્તુતત્વ સમજ્યા વગર લોકોને એટો ઉપદેશ

(૬)

મહાત્માર અને શૈખિક.

હેમ કરે છે ? એવા જોટા ઉપરેશથી લોગા લોડેને ભરમાવી તું આડ માર્ગ ઉતારે છે જેથી, તું પણ ભવસાગરમાં ઝૂણે છે ને બીજાઓને પણ ઝૂણાવે છે. ”

સુન્દરાનાં વચ્ચન સાંભળી તાપસી નિર્દ્દર થઈ ગઈ. એને નિર્દ્દર થયેલી સમજુ દાસીઓ પરસ્પર તાલી ફર્છ હુસી પડી. રાજકુમારીનો વિજય થયેલો માની દાસીઓ તાપસીની મશકરી કરવા લાગી. “ જેને બિચારી ઉપરેશ કરવા આવી છે તે ? ”

“ એ તો આપણી રાજકુમારીઓને ચેલી કરવા આવી છે—પોતાનો ધર્મ સાંભળાવા આવી છે. ” વળી બીજુ એક દાસી ભોલી.

“ અરે ! એને બહાર કાઢો, બહાર કાઢો ! ” બીજુ ભોલી.

દાસીઓએ એની ઠુઠી મશકરી કરવા માંડી. “ ઉઠ ! ઉઠ ! બાઇ ! હુંવે કયાં લગી અડો જમાવ્યો છે ? ”

તાપસી એક તો વાદમાં પોતે હારી ગઈ ને ઉપરથી અપમાન ! જડભરત જેવી બનેલી ગરીબ બિચારી તાપસી એટલી બધી સુંભાઇ ગઈ કે શું કરવું અને શું નહીં તેની એને ખખર પડી નહીં.

દાસીઓએ તાપસીને ગળચીમાંથી પકડીને રાજગઢની બહાર કાઢી ભૂકી.

—◆ફિલોમેન◆—

પ્રકરણ ૨ જી.

અદલો.

અપમાનની ધૂનમાં વ્યથ થયેલી તાપસી મનમાં અનેક પ્રકારના વિચાર કરતી વિશાળા નગરની બહાર આવી. નગરની બહાર ઉધાનમાં એક મોટા વડલાના વૃક્ષ નીચે એસી વિચારમાં પડી “ હવે મારે શું કરવું ? એ રાજકુમારી વિહુષી છતાં દાસીઓએ મારું અપમાન કર્યું ” તે જોઈ રહી. શા માટે એણું દાસીઓને ન અટકાવી ? એ ગર્વિષ્ટ રાજકુમારીને શિક્ષા તો કરવી જોઈએ. હું એક ગરિબ બિક્ષુકી, એનું શું અપ્રિય કરું ? છતાં મારે કર્દીક તો કરવું જોઈએ. ગરીબમાં ગરીબ માણુસ પણ વેરને અહ્લો સારી રીતે લધ શકે છે. ગરીબ ગણ્યાતા ભરવાડ પાસે એક રંક લીખારી પ્રાક્ષણું છ ખંડપતિ આદ્ધારત ચક્કીની આંખો શું નથી ફૈડાવી ? જરાકુમારના એક બાળુમાત્રથી વાસુદેવ, શ્રીહરિના પ્રાણ નથી ગયા ? હું પણ ખરી ડે એને કષ્ટમાં સપડાવ્યે જ છૂટકે.

મારે એને કયા કષ્ટમાં નાખવી ? હા, બરાખર ! એને શોકયોના કષ્ટમાં નાખું, કારણ કે જગતમાં સીઓને શોકયોનું સાલ બહુ જ જાણું હોય છે. સીઓને એના જેવું બીજું હું ખ કરું હોય ? એ સુંદરીનું સ્વરૂપ છથીમાં આણેખી મારી ચિત્રકળા સાર્થક કરું. એ ચિત્ર મુગધરાજ એણું નરપતિને લેટ ધરું. એને સુનેષા સાથે પાણિઅહુણું કરવા લલચાલું !.”

તાપસીએ સુજેષાને કષમાં પાડવાનો નિશ્ચય કરી સુજેષાનું રૂપ ચિત્રપટ ઉપર ચિત્રથું એ સુંદર ચિત્રપટ તૈયાર કરી તાપસીએ પોતાની કળા સાથે કરી. કઈ ભૂલ તો નથીને ? બારિકપણે તેણે એ ચિત્રપટનું અવલોકન કર્યું.
 “ વાહ ! શું સુંદર સ્વરૂપ ! હું ખી છતાં આ સ્વરૂપથી આકર્ષાઓ તો ખીએના સૌંદર્યના લાલચુ શ્રોણિક નરપતિની તો વાત જ રી ? બસ હવે ભગવાંતનું સમરણ કરી જવા દે રાજગૃહીને મારો. ”

તાપસી ચિત્રપટ લઈને રાજગૃહીમાં શ્રોણિકન રપતિની સભામાં આવી. પેલું ચિત્રપટ એણે શ્રોણિક નરપતિને જોવાને આશ્ચર્ય. ચિત્રપટનું સૌંદર્ય નિરાયતાં શ્રોણિક ચિત્રવત્ત સિથર થઈ ગયો. “ અરે ! આ તે હેવી કે માનુષી ? વિદ્યાધર કન્યા કે પાતાલ દોકની નાગઙ્કન્યા ? આવું ભુવન મોહનીય સૌંદર્ય શું જગતમાં હશે ? કે ફૂકા ચિત્રને આનંદ આપવા ચિત્રકારોએ જ આ કદ્યપનાથી ઉપજવી કાઢ્યું હશે ? ” શ્રોણિક એ ચિત્રપટ જોવામાં લીન થઈ ગયો.

“ મહારાજ ! આપ એકાથપણે શું જુએ છો ? શું વિચાર કરો છો ? ” તાપસી ખોલી.

“ આ ચિત્રપટ તું કયાંથી લાવી ? આ સ્વરૂપ સત્ય છે વા અસત્ય ? જગતમાં શું આવું સૌંદર્ય હશે ? કહે તો ખરી આ તે માનુષી છે કે કોઈ વિદ્યાધરી કે કિન્જરી ? ”

“ રાજજી ! એ તો વિદ્યાધરીએ નથી ને કિન્ફરી પણ
નથી. એ તો એક માતુધી છે, આપને યોગ્ય આ એક
રાજકન્યા છે. ”

“ આ રાજકુમારી છે ? કહે, કહે, આ બાળા ડોની
કુમારી છે ? શું ખરેખર તે આ પ્રમાણે જ સૌંદર્યવતી છે
કે મનને આનંદ આપવાને તે છબીમાં અને અધિક સૌંદ-
ર્યવતી અનાવી છે ? ”

“ ભગવાજ ! આ બાળાનું જેવું સૌંદર્ય છે તેવું
આપેખવાની તો મારામાં સંપૂર્ણ શક્તિ નથી, છતાં મારી
શક્તિ અનુસારે મેં એનું સ્વરૂપ આપેખ્યું છે. આ બાળા
વિશાળાપતિ ચેટક નરપતિની કુંવરી છે. તૃપ અને ગુણ-
સંપત્ત એ રાજકુંવરી છે. ”

“ શું તે હણુ કુમારી છે કે ? ” રાજએ વિશિષ્ટ-
ભાવથી પૂછ્યું.

“ હા, મહારાજ ! તેથી જ કહું છું કે આપને એ
યોગ્ય હું. સંસારમાં વિષયલોગવડે મનુષ્યજનમની સાર્થકતા
કરવા ધ્રુષ્ટા હો તો આ બાળાનું પાણિથુણુ કરી માનવ-
જીવ સફ્રણ કરે. અન્યથા તો એના વગર તમારી ભગવાની
રાજલક્ષ્મી અને અન્તઃપુર સર્વે નકાસું છે. ”

તાપસીએ શ્રેણ્યિક મહારાજનું મન ચેટક રાજકુમારી
તરફ આકષ્યું. શ્રેણ્યિક મહારાજે તાપસીને લેટ સોગાદથી
સંતોષી વિહાય કરી. તાપસી પોતાના વેરનો બહલો એ

પ્રમાણે ચુકવી. શ્રેષ્ઠું નરપતિને આશીર્વાદ આપી પોતાના આશ્રમે ચાલી ગઈ. બીજુ તરફ શ્રેષ્ઠું નરપતિએ પોતાના એક વાચાળ હૃતને વિશાળા તરફ ચેટક નરપતિના દરખારમાં મોકદ્યો.

વિશાળનગરીના વિશાળ રાજગઢમાં સિંહાસનારૂદ્ધ થયેલા ચેટક મહારાજની રાજસભામાં આવીને શ્રેષ્ઠું મહારાજનો હૃત નસ્યો. “ મહારાજ ! અમારા ભૂગધરાજ મહારાજ શ્રેષ્ઠું આપની રાજકુમારી સુજ્જેષાની માગણી કરે છે. કન્યાધન, એ તો આપ સારી રોતે જણ્ણો છે કે આપને પરાયું છે, તો અમારા સ્વામીને કન્યા આપવાથી આપની શોભામાં વધારો થશો. સુવર્ણમાં સુગંધ મળશે.”

હૃતનાં વચન સાંભળી ચેટક મહારાજ ભ્રકૃટિ ચઢાવતાં એલયા, “ રે વાચાળ ! તું એલવામાં ચાલાક જણ્ણાય છે પણ તારો સ્વામી પોતાનો જૂલી જય છે. કાગની કોટમાં મોતીની શોભા હોછ શકે જ નહિ. પોતે વાહીકુળનો થઈ હૈહ્યવંશની કન્યા યાચતાં શરમાતો નથી; અથવા તો બિખારીઓને લિક્ષાની યાચના કરતાં લજન કર્યાંથી હોય ? ”

“ આપ મહારાજ એવા શાષ્ટ્રો એલો એ તો અચુકતા કહેવાય. કન્યાની યાચના કરવાથી કાંઈ બિખારીપણું આવી જતું નથી. મોટા માણુસો ધર્મિત વસ્તુઓ મેળવવા પ્રયત્ન કરે એથી એમને ભાખારી કેમ કહેવાય ? ”

“તારું વાચાળપણું રહેવા હે. એ વાહીકુળના શ્રેષ્ઠિ-
કને હું મારી કન્યા આપીશ નહિ. જા, સ્પષ્ટ શરૂઆતમાં
તારા સ્વામીને કહે. ”

“મહારાજ ! ભગવાન શ્રેષ્ઠિક પણ ઉત્તમ કુળના
છે. આપ જેમ જૈનધરી શ્રાવક છો તેવી જ રીતે તેમના
પિતા પ્રસેનજીત રાજ પણ જૈનધરી શ્રાવક હતા અને તેઓ
પણ છે. ધર્મે, લક્ષ્મીએ, સત્તાએ અને ઠકુરાઈએ તેઓ
આપ સમાન છે તો એવા અમાનરહીલમાં કન્યા આપવાથી
આપની કીર્તિમાં વૃદ્ધિ થશે. આજે જેમના ચરણુમાં સમસ્ત
ભગવનું ઐશ્વર્ય, રાજ્યલક્ષ્મી જૂકી રહ્યાં છે, એમનાં બળ,
પરાક્રમ થીજના ચંદ્રની માદ્રક વૃદ્ધિ પામી રહ્યાં છે. આવી
અણુમોદ તકે નરેંદ્ર ! વારંવાર કાંઈ આવતી નથી. મહ-
રિના પ્રસંગે તો જીવનસરમાં કવચિતજ આવે છે.” હૃતે
પોતાની વાણીનું ચાતુર્ય દર્શાવ્યું. સ્વામીનું કાર્ય ગમે તેવા
વિકટ પ્રસંગમાં પણ સિદ્ધ કરવું તે એમનું લક્ષ્ય હોય છે.

“ખસ કર, તારા સ્વામીને મારો સંહેશો સાંભળાવવા
અહીંથી લુલતો ચાલી જા. તે કેવા કુળનો ને કેવો છે
તે તારી પાસેથી સાંભળવાની મારે જરૂર નથી. તારી વાગ્-
ભાળ બંધં કર.”

“શું આપનો આ જ જવાબ છે ? ” હૃતે પૂછ્યું.

“હા, એજ.”

વિશાળાપતિના દરખારમાંથી હૃત રાજગૃહ તરફ ચાલ્યો
ગયો. તેણે મહારાજ શ્રેષ્ઠિકને સર્વે સમાચાર કહી સંબંધાંયા.

આશાલંગ થયેલ શ્રેષ્ઠિક નરપતિ મનમાં અતિ ઉદાસ
થયા. કઇ રીતે કાર્યની સિદ્ધિ કરવી તે માટે વિચાર કરવા
લાગ્યા; કેમકે જતા, એક્સ્યર્ચ અને વૈભવમાં પોતાના કરતાં
વિશાળાપતિ અધિક સમર્થ હતો તે શ્રેષ્ઠિક મહારાજ સારી
રીતે સમજતા હતા, જેથી એમની સાથે ચુદ્ધમાં ઉત્તરવું
એ પોતાને હાથે પોતાનો વિનાશ નોતરવા જેણું હતું. અનેક
વિચારને પરિણું મેળવવામાં જ્યારે ચોણ ઉપાય જરૂરો નાહીં,
જેથી એમનું ચિત્ત જિન્હે રહેવા લાગ્યું. ધર્મિષ્ઠ વસ્તુ
મેળવવામાં જ્યારે મનુષ્ય નાસીપાસ થાય છે ત્યારે એ
હતાશ મનુષ્યની સ્થિતિ ઘણી કફ્ફેડી થાય છે. તેમાંથી પ્રાણી
ઓને સંસારમાં જીવનની, સ્વીની અને લક્ષ્મીની આકંક્ષા
તીવ્ર હોય છે. એ ધ્રીજીસત મેળવવા જતાં જ્યારે ડોકર ખાઈ
પાછો પડે છે ત્યારે એ એવો તો હતાશ, અગ્નાશ થાય છે
કે એ તો આપ-અનુભૂતીઓ જ સારી રીતે સમજું શકે છે.
એ સ્થિતિની કલપના તો અનુભવ વગર ન જ સમજાય.

મુગધરાજને [ચંતાતુર જાણી મહામંત્રી અલયકુમારે
એક દિવસ પિતાને તેનું કારણ પૂછ્યું. પિતાએ જે વસ્તુ
સ્થિતિ હતી તે સવિસ્તર કહી સંબંધાવી.

અલયકુમારે પિતાના મનને શાંત કરી આશ્વાસન
આપ્યું. બાયુ ! શા માટે વ્યર્થ એદ કરો છો ? જે કાર્ય

બળથી નહી થાય તે કળથી કરશું. એવું કયું કાર્ય છે કે જગતમાં જે ખુલ્લને અસાધ્ય હોય ? ”

અભયકુમારનાં દિવાસાયુક્ત વચન સાંસળી શૈલ્પિકને શાંતિ થઈ, અને તે માટે ગમે તે પ્રયત્ન કરવાને રાજીએ અભયકુમારને આજા કરી.



પ્રકરણ ઉ જી.

ચેટકકુમારી.

ઉધાનનો પાછલી બાળુએ લતાએથી શોલી રહેલા એક નવપદ્મવિત લતામંડપ આગળ ચેટકકુમારી પોતાની સખીઓની સાથે આવી. રાત્રિના પ્રથમ અહુરનો સમય ખુશનુમા હતો. સ્વચ્છ આકાશ ચાંદનીનાં કિરણોથી પોતાની શોભામાં વધારો કરી રહ્યું હતું. સખીઓનો હર્ષ અત્યારે હૃદયામાંથી ઉલરાધ જતો હતો. ચેટકરાજકુમારી સુજેષા અને ચૈદ્યણા એ હર્ષમાં ભાગ લઈ ભાગયાપદ્ય બતાવી રહ્યાં હતાં. “ બહેન ! સુજેષા ઐન ! આ નિશાપતિ પોતાની સહચરી સાથે એકમેક થઈ અત્યારે કેવો અણકી રહ્યો છે ? ” એક સખી બોલી.

“ હા, કોણ સુંદર પુરુષ પોતાની માણુપ્રિયાની સાથે કીડા કરતો શોલે તેમ ખર્દને ? ” જીલુ સખી બોલી.

“ અતી સરદા ! તું વળી આવું બધું કયાંથી શીખી લાવી ? પુરુષ શું ? પ્રયા શું ? તારી તો વાત જ બધી નવાઈની ? ” ચેહેણું બોલી.

“ નવાઈ તે કેમ નહિ ? પરણ્યાં ન હોય તો પાટવે પણ શું ન બેઠાં હોય ? ” એક બીજી સખી બોલી.

“ હા, બેન હા. તું બોલવેચાલવે કયાં ઓછી ઉત્તરે તેમ છે ? તારી અતુરાઈની વાત તે કયાં થવાની છે ? ” સુજેષ્ટા બોલી.

“ સાસરે, વળી બીજે તે કયાં ? એના પતિની આગળ. ” બીજી સખીએ કહ્યું.

“ જવા દો એ વાત, કાંઈ બીજુ વાત કરો. ધર્મ-ચર્ચા કરો, વૈરાગ્યની વાત કરો, સંસારની પાપકુઠલીમાં નાહક વણત શું કરવા જોવો ? ” સુજેષ્ટા બોલી.

“ કાંઈ ભગવંતનું નામ-રમરણ કરો જેથી આપણું પાપનો નાશ થાય. ” ચેહેણું અનુમોદન આપ્યું.

“ સંસારથકી તારનાર એક વૈરાગ્ય જ છે. ભગવંતની સેવા-કાર્યાલાયનું કરાય છે. મનુષ્યજન્મનું એનાથી વધારે બીજું લક્ષ્યબિંદુ કર્યું ગણ્યાય છે ? ” સુજેષ્ટાએ કહ્યું.

“ એ બધો વૈરાગ્ય એક દિવસે સુકાઈ જશે ફળેન ! સુભય સભયનું કામ કરે જ છે. ” એક સખી બોલી.

“ શામાટે સુકાઠ જાય ? કેમ સુકાઠ જાય ? એવી કથી વસ્તુ છે કે તે વૈરાગ્યને સુકવી શકે ? ” સુજેષાએ ટકોર કરી.

“ સંસારનું બંધન, પ્રેમબંધન, પતિના સ્નેહનું બંધન. સમજણાં એન કે નહીં ? ” વચ્ચમાં મોહિની બોલી ઉઠી.

“ તે બધું તું સમજુ ગઈ. પરણી છો એટલે એમ બોલતી હૃદિશ, પણ દરેકની સરળી સ્થિતિ હોય છે એમ તું સમજે છે કે ? ” બેદ્ધાણું બોલી.

“ એશક, મારું કથન તમારે ગળે અત્યારે ન ઉતરે, એ સ્વાભાવિક છે. મનુષ્યને આપઅતુલવ વગર સંસારની વિચિત્રતા સમજતી નથી. ” મોહિનીએ જખ્યાંયું.

“ સંસારના બંધનની આટલી બધી મહત્વતા તું કેમ વખાણે છે ? મોહિની ! સંસારમાં શ્રેષ્ઠ શું પતિ કે પ્રભુ ? ” સુજેષાએ પૂછ્યું.

“ સંસારમાં તો પતિ શ્રેષ્ઠ એન ! જ્યારે પ્રભુની જરૂર પડે ત્યારની વાત તો ત્યારે, પણ કીને પતિ એ જ સંસારમાં તો શ્રેષ્ઠ ગણ્યાય. ”

“ ત્યાં જ તારી ભૂલ થાય છે. જે પતિ જ સંસારમાં શ્રેષ્ઠ હોત અને એનાથી કાર્યસિદ્ધ થતી હોત તો કોઈ કી પ્રભુને લજે નહિ. આજે તો પતિનો ત્યાગ કરીને પણ પ્રભુને અજનારી કીએ જગતમાં બહુધા જોવાય છે. ”

“ છતાંય પતિને ભજનારી સ્વીચ્છાથી તો ઓછી જ, સમજયાં એન ? ”

“ પતિ તો એવા અનંતા થયા ને થશે, પણ એથી શું ? પ્રભુ એક જ વાર મણ્ણા કે બસ કાર્યની સિદ્ધિ. જીમળ ? ”

“ એ તો કોઈ સમયે પતિ શ્રેષ્ઠ તો કોઈ સમયે પ્રભુ શ્રેષ્ઠ. લોગની લાલસાવાળી સ્વીચ્છાને પ્રભુ શા કામના ? એમને તો પતિ શ્રેષ્ઠ ? ત્યારે વીતરાગ થવાની દયાવાળી સ્વીને પ્રભુ શ્રેષ્ઠ. ” ચેહ્ણાંએ વચ્ચમાં એલી બન્ને વચ્ચનો કણૂલ રાખતાં કહ્યું.

“ અરે ! પણ એક વાત તો કહેવી તમને ભૂલી જાઉ શું એન ? ધણા દિવસથી કહું કહું પણ કહેવાતી નથી. આજે ટીક યાદ આવી. ” ગુણવંતીએ એલી.

“ એલને, તારી વળી શું વાત છે ? વાતમાં કાંઈ માલ છે કે ખાલી દમામ ? ” સુજેષા એલી.

“ વાતમાં માલ છે કે નહિ એ તો પછી, પણ તમારે સાંસણવામાં કાંઈ અડયાણ છે ? સાંસણ્યા પછી તમેજ જેમ ટીક લાગે તેમ કરજયોને. માલામાલ તો ટીક પણ આનંદની વાત તો છે જ ! ” ગુણવંતીએ કહ્યું.

“ કહે લેઉ તારી વાત. ” આતુરતાથી સુજેષાએ કહ્યું.

“ આપણા રાજગઢની નજીકમાં હમણ્યાં એક કોઈ પરદેશી વણિક રહેવા આવેલો છે. તે હમેશાં એક ચિત્રની ફેલની જેમ પૂજા કરે છે. ”

“ કોનું ચિત્ર છે ? કોઈ દેવતાનું હશે કહાય ? ”

“ ના બહેન ! છે તો મનુષ્યનું, પણ ચિત્ર જોતાં તો તે મનુષ્ય કરતાં કઈક અહિભૂત લાગે છે. મનુષ્યમાં આવું અથાગ સૌંદર્ય ન સંભવે ! ”

“ શું કોઈ ખીની છણી છે કે પુરુષની ? ” સુજેષાએ પૂછ્યું.

“ પુરુષની, એ સૌંદર્ય, એ રમણીયતા, એ લાલિત્ય, એ છટા, અભિનયકળા, શૌર્યતા એ બધાં તો એમાં અહિભૂત જ એન ! ”

“ લાવજે તો સહી, આપણે જોઈશું એ કોણું છે તે. ” સુજેષાએ બેદરકારીથી જોવાની પોતાની આતુરતા હેખાડી.

“ એ સુંદર પુરુષની દેવથી પણ અધિક એ વણિક સેવા કરે છે. બહુમાન સાચવે છે. આહ ! શું એનો ભક્તિ ! એ ચિત્ર ઉપર પ્રીતિ ! એનો પૂજયલાવ ! ”

“ ઠીક લાવજે એ ચિત્રપટ, ખાલી જોટાં તો વખાણું નથી કરતી ને ? ”

“ એન ! આ વાત બનાવટી છે કે સત્ય એ તો આપ ચિત્ર જુઓ. પણી કે કહેલું હોય તે કહેનો. ”

“ સારું, ત્યારે જોયા પુણી વાત. ”

“ એન ! પણ એ ચિત્રપટ તમારે શું કામનું છે ? એ કંઈ પ્રભુનું નથી સમજયાં ? ” સમય વતીને મોહિની બોલી.

“ બદેને પ્રભુનું ન હોય, કેાઈ પુરુષનું હશે એથી શું ? જોવાથી કંઈ ઓછું વળગી પડે છે ? ” સુજેષ્ટાને કહ્યું.

“ પણ એન ! એવાં ચિત્રકારના કળાનિપુણ ચિત્રો ન જોવાં એ જ ઢીક છે. જોયા પછી વળી રખે કંઈ ઉત્પાત મચે. ફુનિયામાં જે ઉત્પાતો મચ્યા છે તે કંઈ જોયા કે સાંભળ્યા પહેલાં મચ્યા નથી. એન ! મારી તો સલાહ છે કે તમારે એ ચિત્ર ન જોવું.”

“ કારણ ઓનું ? કહે તો ખરી કે શા માટે મારે ન જોવું ? શું જરાક જોવું એમાંય પાપ છે ? ” સુજેષ્ટાને પોતાના બન્ને હાથ આમળતાં કહ્યું.

“ હા એન ! એમાં જ પાપ છે. ભવિષ્યના મોટા પાપનું નિમિત્ત એ નાતું પાપ છે. તમારી આ ભાવના ને જોયા પછીની ભાવનામાં રખેને કુરક પડે !”

“ અરે ગાંડી ! તું તો લોળી છે લોળી. એ જોવાથી કંઈ ચોંડી પડતું નથી. આ તો ઢીક, ગુણી આટલાં બધાં વખાણું કરે છે તો આપણે એક વાર જોતું. કેાઈ દેવની છણી હશે, ચિત્રકારે એમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હશે; ખીંચું તે શું હશે ? ”

“ આપની વૃત્તિ જ જ્યારે આકર્ષય છે તો ચેટ ખરીને એઈ હોય. એક વાર. ”

“ તો ગુણિયલ ! આવતી કાલના તે ચિત્ર પેતા વખુંડ
પાસેથી લેતી આવજે ત્યારે.” સુજેષાએ ઝરમાંયું.

તે પછી સર્વે સખીઓ પોતપોતાના ઘર તરફ ગઈ.
સુજેષા અને ચેલ્લાણી પોતાના આવાસ લુચનમાં આવી
નિદ્રાહેવીને જોળે પડી.



પ્રકરણ ૪ થું.

અલયકુમાર.

માનવજીવન એ જગતમાં અતિ ઉચ્ચ જીવન ગણ્યાય
છે. એ મહત્વના જીવનમાં મનુષ્ય અનેક કાર્યો કરી શકે
છે. એ જીવનમાં કર્દી કર્યી અભિલાષાઓ, મહત્વાકંક્ષાઓ
ઉત્પત્ત થાય છે. ઉત્પત્ત થયેલી એ આકંક્ષાઓમાં કેટલીક
પૂર્ણતાને પામે છે, કેટલીક અનેક પ્રયત્નો છતાં એમ જ
લય થધ જય છે. અભિલાષા પૂર્ણ કરવા માટે મનુષ્ય
અનેક પ્રકારના ઉધમ કરે છે. એક વાર નિષ્ઠળ થાય તો
બીજી વાર, ત્રીજી વાર પ્રયત્ન કરી પોતાનું કાર્ય સિદ્ધ કરવાને
તે ઉત્સુક રહે છે. દ્રોધી, બળથી કે કળથી એટલે યુદ્ધથી
યાને યુક્તિથી પોતાનો ઉધમ તે જરી રાખે છે. જગતનો
ધ્વનાર જ એવો છે કે દ્રોધ વગર તો કોઈ પણ કાર્ય,
નાનું સરખુંચ થઈ શકતું નથી; માટે દ્રોધની આવશ્યકતા
તો હરેક કાર્યસિદ્ધ સાથે નિકટ સંબંધ ધરાવે છે. જેટલી

ದ್ರಬ್ಯನೀ ವಿಪುಲತಾ ತೆಟಲ್ಲಿ ಜಲಹಿ ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಏ ತೋ ಸ್ವಾಭಾವಿಕ ಛೇ; ಛತಾಂ ಪಣ ದ್ರಬ್ಯ ಸಿವಾಯ ಬಣ ಅನೇ ಯುದ್ಧಿ ಏ ಅನ್ನಮಾಂಬಣಥೀ ಕಾಮ ಲೈವಾನೆ ಮಾನವೀಹೃದಯ ಸ್ವಾಭಾವಿಕ ರೀತೆ ಜ ಗ್ರೇರಾಯ ಛೇ. ಜ್ಯಾರೆ ಬಣ ಚಾಲತುಂ ನರ್ಥೀ ತ್ಯಾರೆ ನೋ ಯುದ್ಧಿವಂತ ಹೊಯ ತೋ ಯುಕ್ತಿಜ್ಞಾನಿ ಕಾರ್ಯಸಿದ್ಧಿ ಕಡೆ ಛೇ.

ಮಗಧರಾಜ ಶ್ರೇಷ್ಠಿಕ ಮಹಾರಾಜನೇ ಪಾಂಚಸೋ ಮಂತ್ರಿಜ್ಞಾನಾಂ ಅಳಬಯಕುಮಾರ ಮಹಾಮಂತ್ರಿ ಯಾನೆ ಸುಖ್ಯ ಪ್ರಧಾನ ಹುತೋ. ಅಳಬಯ-ಕುಮಾರ ಮಹಾಅಮಾತ್ಯ ಹೊವಾ ಉಪರಾಂತ ಮಗಧರಾಜನೋ ಪಾಟವೀ ಪುತ್ರ ಹುತೋ. ಅಳಬಯಕುಮಾರನೆ ಪೂರ್ವಭಾವನಾ ಕ್ಷಯೋಪಶಾಭ್ಯಥೀ ಯುದ್ಧಿ ವರೆಲ್ಲಿ ಹುತೀ. ಗಮೇ ತೆವಾಂ ಕಾರ್ಯ ತೇ ಯುದ್ಧಿಥೀ ಕರೀ ಶಾಫತೋ ಹುತೋ. ಮಗಧರಾಜನೀ ರಾಜಕೀಯ ಅನೇಕ ಶುಂಚವಣ್ಣೋ ತೇ ಕ್ಷಾಣುಗಾತ್ರಮಾಂ ಹ್ವರ ಕರತೋ ಹುತೋ. ಪೋತಾನೀ ಯುದ್ಧಿ-ಶಾಙ್ಕಿತಿಥೀ ರಾಜ್ ಅನೇ ಪ್ರಜಾ ಅನ್ನನೇ ತೇ ಅಷ್ಟಕಸರಜ್ಞೋ ಪ್ರಿಯ ಹುತೋ. ತೇ ಪೋತಾನೀ ಭಾಲ್ಯಾವಸ್ಥಾಭ್ಯಾಂಥೀ ಜ ಪಾಂಚಸೋ ಪ್ರಧಾನಾಂ ಸುಖ್ಯ ಅಮಾತ್ಯ ಥಯೋ ಹುತೋ. ಅಷ್ಟೇ ಪೋತಾನೀ ಯುದ್ಧಿಥೀ ಲೋಡಾನೆ ಆಶ್ರಯಚಿಕಿತ ಕರ್ಯಾ ಹುತಾ. ಏ ಜ ಯುದ್ಧಿನಾ ಪ್ರಜಾವೇ ಶ್ರೇಷ್ಠಿಕ ಮಹಾರಾಜನು ಅರ್ಧ ರಾಜ್ಯ ಮೆಣವಾನೆ ಭಾಜ್ಯ-ಶಾಣೀ ಥಯೋ ಹುತೋ. ಮಗಧರಾಜೇ ಪೋತಾನೀ ಘಣೆ ಸುಸೇನಾನೀ ಪುತ್ರಿ ತಾರಾ ಸಾತ್ಯ ಅಳಬಯಕುಮಾರನಾಂ ಲಂಗ ಕರೀ ಆಜ್ಯಾಂ ಹುತಾಂ. ತೇ ಉಪರಾಂತ ಥಿಳ್ಳಿ ಪಣ ಕೆಟಲೀಕ ರಾಜಕಂಪಾಯೋ ಸಾತ್ಯ ಪಾಂಚಿ-ಶಫುಣ್ಣ ಕರಾಂತ್ಯು ಹುತು. ಸುಖಮಾಂ, ಸಂತೋಷಮಾಂ, ಧರ್ಮಕಾರ್ಯಮಾಂ ಪ್ರಿತಿವಾಗೋ ಅಳಬಯಕುಮಾರ ಮಗಧರಾಜನಾ ಸಾಆಜ್ಯನೆ ವಿಶಾಖ ಅನಾವಿ ರಹ್ಯಾ ಹುತೋ. ಶಾಮ, ದಾಮ, ದಂಡ ಅನೇ ಲೇಹಥೀ ಮಗಧರಾಜನು ಸಾಆಜ್ಯ ಅಷ್ಟೇ ವಧಾರ್ಯು ಹುತು. ರಾತಾಧಿವಸ ಸಾಆಜ್ಯನೀ

બૃદ્ધિના કાર્યની ચિત્તા કરતો અભયકુમાર પોતાની સમય એ રીતે વ્યતીત કરી રહ્યો હતો; કેમકે બૃદ્ધિવંત મનુષ્યોને જગતમાં એવું કયું કાર્ય છે કે જે પોતાની બૃદ્ધિથી અસાધ્ય હોય ?

એ અરસામાં પેઢી તાપચીએ કેટકુમારી સુજેષાનું ચિત્રપટ આપી મગધરાજને વ્યથ કર્યાં. કોઈ પણ પ્રકારે કાર્યોસિદ્ધિનો ઉપાય હાથ ન લાગવાથી એમની ચિત્તામાં વધારો થયો. અભયકુમારે મગધરાજને હિલાયો આપીને શાંત કર્યાં.

અભયકુમારે શેખુંક મહારાજનું એક સુંદર ચિત્ર આપેલયું. એ આખેહુણ ચિત્રમાં પોતાની સર્વો બૃદ્ધિનો ઉપયોગ કર્યો. પોતાની કળામાં ડેટલું કૌશલ્ય હતું તે બધું આ ચિત્રપટથી સ્પષ્ટ થતું હતું. એ સર્વોંગસુંદર ચિત્રપટ તૈયાર કર્યાં પછી ગુટિકાના પ્રલાભથી સામાન્ય વણિક જેવું સ્વરૂપ ધારણું કરી કાર્યોપુરતાં મનુષ્યો સાથે અભયકુમાર વિશાળા નગરીમાં આવ્યો. રાજદરખારમાં જ્યાં અંતઃપુરનો ભાગ આવેલો છે તેના દરવાજાનું બહાર નથુકમાં એક હુકાન લઇને બેઠો, અને રાજદરખારમાં જતી-આવતી હાસીએનું આકર્ષણી થાય તેવા પ્રયત્ન કરવા લાગ્યો. રાજદાસીએને તે સર્વો માલ આપવા લાગ્યો તેમજ અનેક મધુરાં વચ્ચેનોથી તેમને સંતોષવા લાગ્યો. રાજદાસીએ સાથે ઓળખાણું થયા પછી તે વણિક જ્યારે જ્યારે હાસીએ અને ત્યાં કઈ લેવા આવતી અથવા તો એ રસ્તેથી ગમનાગમન કરતી

ત્યારે તે પેલા સુંદર ચિત્રપટની પૂળ કરતો. એ ચિત્રપટ તેમણી નજરે પડે અને તેમનું આકર્ષણી થાય તેવી રીતે તે વર્તતો હતો. દાસીએ પણ જ્યારે આ ચિત્રપટ ઉપર નજર પડતી ત્યારે સ્થંભી જતી અને એકચિંતા તેના સૌંદર્ય તરફ જોયા કરતી.

“ અરે ભાઈ ! આ કોણું છે ? ”

“ એ અમારા દેવ-રાજ છે. માગધરાજ શ્રેષ્ઠિક નરપતિ છે.” તે વણિક પ્રત્યુત્તરમાં જવાબ આપતો.

“ શું આ મનુષ્ય છે ? માનવીનું આવું અથાગ સૌંદર્ય ? ” દાસીએ આકૃત્ય પામતી હતી.

“ એ અમારા મહારાજ છે. અમારા જીવનના આધાર છે. અમારું જીવન સર્વસ્વ આ નરરાજ છે જેથી એમે દેવની માર્ગક એમણી સેવા કરીએ છીએ.”

આવું સૌંદર્યયુક્તા ચિત્રપટ દાસીએને પોતાની શોઠાણી સુજેષાને ખતાવવાનું મન થયું, જેથી એક દાસીએ સુજેષાને વાત કરી તેના પ્રત્યુત્તરમાં સુજેષાએ તે ચિત્રપટ લાવવાની દાસીને આજા કરી હતી.

એ રાજહરખાર નજીક હુકાન લગાવીને એઠેલો વણિક અભયકુમાર પોતેજ હતો. પેલું ચિત્રપટ માગધરાજ શ્રેષ્ઠિક નરપતિનું હોવાથી અભયકુમાર પ્રતિહિવસ એની પૂળ

કરતો હતો, અહુમાન, લક્ષ્મિ, પૂજયલાવ પોતાની પોતાની લક્ષ્મિ ત પ્રગટ કરતો હતો.

સુલેષણી આજ્ઞા પછી થીને જ દિવસે દાસી તે વણિકની હુકાને આવી તો તે વણિક પેલા ચિત્રપટ ઉપર પોતાની લક્ષ્મિનો વરસાદ વરસાવી રહ્યો હતો. તેને આવું અહુમાન કરતો જોઈ પેલી દાસી બોલી. “ અરે ભાઈ ! રોજ ને રોજ તમે આ શું કર્યું કરે છો ? એ છે એક મનુષ્ય ! હેવ તો નથી કે જેનાથી તમને ઈચ્છિત પ્રાપ્ત થાય. એના કરતાં તો કોઈ હેવની આટલી લાક્ષ્મિ ફરે તો તમને ઈચ્છિત વરદાન આપે.”

“ અરે ભાઈ ! હેવ કરતાંથી મારે મન એ અધિક છે. એમણે મને ધણું આપ્યું છે. આજે એમની દૃપાથી મારા સુખમાં શી કર્મિના છે. ઋદ્ધિ, સિદ્ધિ, ઔથર્ય, ઠકુરાઈ સર્વ કર્ય આજે મારે ઘેર છે. ”

એ વણિકના શણહોં સાંભળી દાસી હસી. “ વાહ ! તમારી ઠકુરાઈ ! આજ તમારી ઠકુરાઈને ? ગાંડા થઈ ગયા લાગો છે. વૈભવ, ઠકુરાઈનો તમને જ્યાલ જણ્ણાતો નથી. સો રૂપીયા મળવાથી ગરીણ માણ્યુસ પોતાને બાદશાહ માને છે એવી તમારી વાત છે. ભાઈ ! વૈભવ, ઠકુરાઈની મીઠાશ તો કોઈ ન્યારી જ છે. ”

“ તું કહે છે એ સર્વે સ્વરૂપ હું સારી રીતે સમજું

છું, જેથી જ આ અમારા નરપતિની હું રોજ બક્તિ કર્યા કર્દું છું. સમજુ ? ”

“ ટીક લાઇ ત્યારે આ તારી છણી થોડીવાર મને આપીશ કે ? ” દાસીએ પોતાનો મૂળ ઉદેશ કદ્દી સંભળાવ્યો.

દાસીનું વાક્ય સંભળી વણિક ચમક્યો હોય તેવો આડંખર કર્યો. “ તું આ છણીને શું કરશે બાઇ ? કોઈ દિવસ નહિ ને આજે તેં છણી મારી એ તો નવાઇ ! ”

“ નવાઇ શેની, જરાક જેવી છે. ધારી ધારીને નિરખવી છે કે જેને તમે રોજ પૂજો છો એ ડેવાક સોહામણું છે.”

“ તેં તો જેઠ છે. ધણીય વાર ધારી ધારીને નિરખી છે. હવે એમાં જેવાનું શું બાકી રહ્યું છે કે તું જેવા મારે છે ? ” વણિકે પૂછ્યું.

“ મેં જેઠ એટલે થઈ રહ્યું. શું જગતમાં બીજું કોઈ જેનાર જ નથી કે તમે એમ ઓલો છો ? ” દાસી ગુણુવંતી ઓલી.

“ ત્યારે કોને જેવાની છંચા છે ? જરા સ્પષ્ટતાથી તો કહો. ”

“ અમારી બાઇ ચેટક રાજકુમારી મુજેષાને જેવાની છંચા થઈ છે. જેમ બને તેમ તાકીદે લઈ આવવાની મને આજા થઈ છે.”

“ એ.....મ, ત્યારે તો નહિં મળે જ. હું કોઈને

તે આપતો નથી. મારી નજર આગળથી જરા પણ ફૂર્ઝ કરતો નથી. ”

“ હું તમને હમણું જ પાછી આપી જઈશ. તમારી જેવી છે તેવી જ તમને સોંપી જઈ, પછી શું હુરકત છે ? ”

“ ના, તે નહિ બની શકે. ”

“ ભલેલા થઈને આપ, મારી બાઈનું મન જોવાને અધીરું થઇ રહ્યું છે; તેથી જ તારી ખાસે આટલી આળજી કરું છું. ”

“ ના, તે મારી છણી ખગાડી નાખે તો, એની આશાતના કરે તો ? ”

“ જરાય આશાતનાનો કય રાખશો નહિ. મારી બાઈને બતાવી હમણું જ હું તમને પાછી આપી જઈશ. ”

“ તારા આટલાખધા આથડું આગળ હું લાચાર છું. જે કે આ ચિત્રપટ આપવાનું મને મન થતું નથી તાં તને આપું છું; તો તારી બાઈને બતાવી એમને એમ પાછું આપી જાને. ”

એ વણિકે તરત જ ચેલું ચિત્રપટ હાસીને આપ્યું. હાસી ચિત્રપટ લઈ ત્વરાથી અંતઃપુરના માર્ગે રવાના થઈ.

ચિત્રપટને લઈ જતી હાસીને જેઠ અભયકુમાર મનમાં હસ્યે. “ ચાલો! કાર્યસિદ્ધિની શરૂઆત થતી જણાય છે.

આ ચિત્રપટ જોતાં જ અવસ્થય સુજ્ઞેષાના મનમાં પરિવર્તન થશું જોઈએ. લોહચુંબકની માઝક એતું આકર્ષણું થાય તો જ કાર્ય સિદ્ધ થાય. ટીક, ત્યારે કાર્યે સાધ્ય કરવા માટે આ તો વિજયનું પ્રથમ મંગલાચરણ ! ”

—●●●●—

પ્રકરણ ૫ મું.

આકર્ષણું.

“ લુગારથી ચાહશો તો, લુગર સાથે જરી હેશું;
કદર જે પ્રેમની કરશો, કદમ્ભોમાં હરળીજ રહેશું.
સમર્પી દિલ અને હેદર, તમારું દિલ હરી લેશું;
જુવાની લંદામાં, ખરી લહેજત લરી હેશું. ”

મનોહર ચિત્રપટ તરફ અનિમેષ નયનોએ જોતી ચેટક-
કુમારી ઉપર પ્રમાણેના શાફ્ફો બોલી એકાથ વૃત્તિએ અને
વિદ્ધણ મને જેમ જેમ તે ચિત્રને વિશેષપણે જોતી ગઈ
તેમ તેમ એના હૃદયમાં અનેક વિચાર ઉત્પન્ન થવા લાગ્યા.
જે ભાવો અત્યારસુધીમાં જન્મ્યા નહોતા એ ભાવો હવે
નાગૃત થયા. “ અહા ! શું આ મંગધરાજ ઓણીક નરપતિ
પોતે જ છે ! શું એમનું સ્વરૂપ ! એમને જોઈ મારા મનમાં
કઈ કઈ ભાવો ઉત્પન્ન થાય છે. શું એમાં ખામી છે ?
વિધિએ ખચીત કુરસદે જ ન ધક્યા હોય ! આવા સુંદર

પુરુષને મેલાપ ભાગ્ય વગર થતો નથી. જે ભાગાએ મોટાં પુરુષ કર્યાં હુશે તેને જ આવો. પતિ મળો. સ્વરૂપ, સૌભાગ્ય, વૈક્ષણ, ઠકુરાઈ, શૌર્ય, કુલિનતા, ચારુર્ય સર્વ કર્દી એમાં નજરે પડે છે. જે પરણીશ તો આ પુરુષ સાથે જ; અન્યથા વૃત અંગીકાર કરીશ. ” ચેટકકુમારી સુજેષાના જ એ શર્ષદો હતા. ચિત્રપટ જોતાં જ એનું ચિત્ર વિહૃળ થયું હતું. વારંવાર જોવા છતાં એનાં નથનો અતૃપ્ત રહેતાં હતાં. ભાવતંધ્યતાને યોગે એનું હૃદય આ ચિત્રપટવાળા પુરુષને પ્રત્યક્ષ જોવાને અધીક્રં થઈ રહ્યું હતું, એની આંખો જૂદુ કામ કરતી હતી, મનમાં જૂહા જ આવો જગ્યા હતા.

“ ધરીશું લંઘાયું અરણોમાં, જરીશું તમારા નામની માળા; ગણીશું આવાર હૈયાના, રહીશું ના લેશપણ ન્યારા. ”

એકાંતમાં સુજેષા ચિત્રપટને નિરખતી પોતાના ભાવો પ્રગટ કરી રહી હતી. તે અરસામાં એની નાની એન ચેદ્વણા પોતાની એનને શોધતી ત્યાં આવી અડી. તે પ્રચ્છન્ન-પણે સાંભળતી ડલી રહી, ફણ પ્રેમમાં મસ્ત બનેલી સુજેષાને ચેદ્વણાના અગમનતું કયાંથી લાન હોય ?

“ એન ! શું છે એ ? તું શું એલી રહી છે ! ” ચેદ્વણને છથીની વાતની ખબર હોવાથી તેમજ ચિત્રપટ સુજેષાના હાથમાં હોવાથી એણે અનુમાન કર્યું કે છથી જોતાં જ એનતું મન લોભાયું જણાય છે.

ચૈહ્નાણને જોતાં સુજેષા શરમાઈ ગઈ, સાવધ થઈ. એને પશ્ચાત્યાપ થયો કે પોતે ઠરેલ છતાં ઉતાવળથી જેમ તેમ બડી ગઈ. તરત જ તેણી બોલી. “ ચૈહ્નાણ ! જેણું આ ચિત્રપટ. આપણે કાલે જોવા મંગાન્યું હતું તેજ આ ચિત્રપટ દાસી લાવી છે. ” એમ કહીને ચિત્રપટ સુજેષાએ ચૈહ્નાણને આપ્યું.

ચૈહ્નાણ પણ ક્ષણભર એ ચિત્રપટ જેઠ સ્થાંભી ગઈ. “ અહો ! કેવું સુંદર ચિત્રપટ ! શું મગધરાજ શ્રેણીક નરપતિ આવા રૂપવંત હુશે કે ? ”

“ જરૂર, બલ્કે એથીય વધારે. ” પેઢી દાસીએ વચ્ચમાં આવીને ટહુકો કર્યો.

“ એ....મ, ત્યારે તો જે સ્ત્રીના એ પતિ હુશે એ ઓ તો પૂરી નશીભદ્દાર ! ” ચૈહ્નાણ બોલી.

“ એશક, મોટા પુષ્ય વગર સ્ત્રીઓને મનગમતો વર કયાંથી મળે ? ” સુજેષા બોલી.

સુજેષા અને ચૈહ્નાણ અર્થસૂચક દિલ્લિથી એકખીનને અરસપરસ જોવા લાગી. “ પણ મોટી બેન ! તમે મારા આંધ્યા પહેલાં શું બોલતાં હતાં ? ” ચૈહ્નાણએ પૂછ્યું.

“ તે જણીને તું શું કરશે ચૈહ્નાણ ? એ હૈયાની ભાવના હૈયામાં જ સમાવા હે. બહાર પાડવાથી રખેને કંઈક મુરશેલી ઉભી થાય. ”

“ એમાં મુશ્કેલી શું ? આ દાસી આપણી વિશ્વાસુછે ને હું.....હું તો જે તમે કરશો તે હું કરીશ. તમે ક્યાં જર્શો ત્યાં તમારી સાથે આવીશ. તમારાથી જૂદી તો હું ન જ રહી શકું. ”

“ ચૈક્ષણા ! તું આ શું બાબે છે ? મારી સાથે ક્યાંથી આવીશ ? જેમ આપણી મોટી બેનો લગ્ન થયા પછી જૂદી પડી ગઈ તેમ આપણે પણ લગ્ન થયા પછી તો અવશ્ય જૂદાં થશું જ. ” ચૈક્ષણાના હૈયાનો આશય જાળવાને સુજેઠાએ પૂર્ણશું. સુજેઠા ચૈક્ષણાના હૈયાની પણ પરીક્ષા કરતી હતી.

“ આપણે શા માટે જૂદાં પડશું ? જે તમારા પતિ થશે તે મારા પણ. આપણે બન્ને એક જ ડેકાણે રહેશું-એક પતિને વરીશું. ”

“ ચૈક્ષણા ! એ કેમ બનશો ? સરી બેનો શું શોકયો થઇ શકે છે ? એ તો તું ન બનવાતું બનાવી શકે છે. તે સમયે આપણું આવું હેત કેટલું ટકી શકે છે તે તું શું જાણે ? ઉલટાં ઊરવેર વધે છે. સમજુ ? ”

“ તે હશે, તેમ થવાતું કારણ પણ હું જાણું છું, પણ મને તમારો સમાગમ બહુ ગમે છે. આપણા સ્નેહ આગળ થીનાં સુઝો હું તૃશુમાત્ર ગણું છું; તેથી જ હું મારી સાથે રહેવા ધ્રુદ્ધા રાખું છું મોટી બેન ! ”

“ અસ્તु, જેવી તારી ભરળુ. મારું દ્વિતી પણ તારૈના
વિયોગ સહેવા માગતું તો નથી. આપણે સાથે જ રહેશું:
હવે એ વાત જવા હે. જે ચેલ્લાખા ! એક વાત કહું તે
હાલમાં ધર્મની જ શુદ્ધિ રાખજે. હાસી તું પણ ધ્યાન રાખજે.”

“ અને તે વાત ? ” ચેલ્લાખા બોલી.

“ જે આ ચિત્રપટમાં ચિત્રેલ પુરુષ તને ગમે છે ?
હું તો મનથી એ પુરુષને વરી ચૂકી છું. એ મુગધપતિને
હું મારા સુગટમણી બનાવવા હશ્ચા રાખું છું.”

“ તો બેન ! જે તમારી હશ્ચા તે જ મારી. મને
પણ ચિત્રપટ જોઈ એ પુરુષ ઉપર મોહ થાય છે. ખરીત
આપણી અવિત્યતા કાંઈ હવે જૂદી જ જણાય છે.”

“ પણ એ બધું બને શી રીતે ચેલ્લાખા ? તું જણે
છે ? પિતાજીના દરખારમાં એમનો હૃત મારું માશુ કરવાને
થાડા દ્વિવસ પહેલાં આવ્યો હતો તેનો તિરસ્કાર કરી
પિતાજીએ પાણો વાજ્યો છે.”

“ ખરીત, ત્યારે તો આપુંએ આપણો ખેલ બધો
અગાઉયો છે.” ચેલ્લાખા બોલી.

“ ત્યારે હવે શું ઉપાય ? ” હાસી બોલી. “ એ
મુગજળના જેવી આશા છોડી દો ત્યારે.”

“ શા માટે છોડે ? ચેલ્લાખા ! મારા તો આ ભવમાં એ

જ પતિ છે. અન્યથા હું તો વત અહણુ કરીશ, સમજુ ? ”
જુસ્તાથી સુનેધા એલી.

“ જે તમારી ગતિ તે જ મારી. ” ચૈહ્નણાએ અનુ-
મેદન આપ્યું.

“ તો આપણે એ માટે કઈ ઉપાય કરશું ; પણ જ્યાં
સુધી આપણું કાર્ય સિદ્ધ ન થાય ત્યાં લગી આપણી આ
ખાનગી વાત બહાર ન જવા પામે. રખેને જરા પણ વાત
જે કૂઠી જાય તો આખરેના કાંકરા થાય, જગતને મોં પણ
ન બતાવાય. ”

“ એન ! તમારી વાત સત્ય છે. અત્યારે અહીંયાં સર્વ
શાંત છે—એકાંત છે. ” ચૈહ્નણા એલી. “ આ હાસી જેની
પાસેથી ચિત્રપટ લાવી તો આગળનું કામ પણ ભલે એની જ
માર્દતે થાય. ”

“ દીક છે, કાંધ માર્ગ તો કાદશું જ ને ? મહેનત કર્યા
વગર કૃળ કાંધ ઓછું જ મળવાતું છે. ” સુનેધાએ કહ્યું.

“ બાઇ સાહેબ ! તમે જે કહો તે કરવાને હું તો
તૈયાર છું. તમે મારા ઉપર વિશ્વાસ રાખી જે કઈ ખાનગી
વાત કરશો તો આ હાસી એવજા નહિ થાય. પ્રાણુંતે પણ
આપણું કાર્ય કર્યા વગર તો ન જ રહું. ”

“ તો એક કામ કર. ” સુનેધા એલી. એણે ચારે
તરફ નજર કરી શુપચુપ શાંતિથી હાસીને ઘણા જ ધીમા

સ્વરે કહ્યું. “આ ચિત્રપટ જેની પાસેથી લાવી તેને જ વાત કર, તે આપણો રસ્તો કાઢશો. કોઈ રીતે અમને તે મેળવી આપશો.”

“હા, હા એન ! એ રસ્તો ઠીક છે. આ યુક્તિથી જરૂર આપણે ઇસોહ મેળવીશું. આપણાં કાર્ય આપણે સિદ્ધ કરીશું.” ચેહારાએ અનુમતિ આપી.

“એ વણિક પણ ભલો દેખાય છે. કાંઈ રસ્તો દેખાડે તો દેખાડે.” હાસીએ જણાવ્યું.

“તો જ ને ઇસોહ કરી અટ ઠેલી આવ. આ ચિત્રપટ પણ તેને આપતી આવ. જોને તારા કાર્યમાં તું સાવધાન રહેજો” સુજેષ્ટાએ છણી હાસીને આપી અને જણાવ્યું.

“એન ! કોઈ પણ રીતે એ વણિકને સમજાવી આપતું કાર્ય હું પાર ઉતારીશ. આપને સુખી કરીશ.” એમ કહેતી હાસી પેલું ચિત્રપટ લઈ અંતઃપુરમાંથી વણિકની ફૂકાન તરફ રવાના થઈ.

શાળાએમાં ચાલતાં ધાર્મિક અવ્યાસનાં દરેક મુરતકો શુદ્ધ, સારાં અને સરતાં મળવાતું વિશ્વાસપાત્ર સ્થાન—

જૈન સરકારી વાંચનમાળા.

પાલીતાણા (કાડીયાવાડ).

પ્રકુરણુ દું.

પરોપકારને માટે.

જ્વેતાંથી નભરીની હિશા તરફ પ્રયાણુ કરી રહેલા એક ત્યાગી પુરુષ તરફ હવે આપણું ક્યાન આકર્ષિય છે. હેખાવે જગતમાં જેણી ડોઈપણું જેડી નથી એવે સોચાયને નિધિ છતાં આ પુરુષ પાસે વખતનું પણ ડેકાણું નહોંતું. પોતે એકાકી છતાં નિરસિમાન અને નિર્ભયતાથી જંગલનો માર્ગ તે પુરુષ ઉદ્ઘન કરી રહ્યા હતા. બાદ્યતાથી જેતાં આ ત્યાગી પુરુષ એક સામાન્ય લિક્ષુક જેવા જણ્યાતા, છતાં આંતરિક ઋદ્ધિ-સમૂહના એ નિધાન હતા. અનંત આત્મસમૂહિ પ્રગટ કરવાને સંસારનાં બંધનો એમણે તબ્યાં હતાં, અસંખ્ય જીવેના ઉપકાર માટે સંસારનો ત્યાગ કરી, જગતની મોહમાયાને છંડી કોઇ અપૂર્વ ઋદ્ધિ મેળવવાને ભગીરથ પ્રયાસ કરી રહ્યા હતા. વખતાત્તું ડેકાણું નહોંતું, ખાવાપીવાની એ મહાપુરુષને પરવા નહોતી. જ્યાં જ્યાં એ મહાનુ પુરુષનાં પગલાં થતાં ત્યાંથી લોકો એમના સૈંહ્યથી આકર્ષાઈ ધન આપતા, આભૂ-ખણ્ણો આપતા, રાજાઓ પોતાતું રાજ્ય એમના ચરણોમાં સમ-ર્પતા હતા, અનેક મેવા, મીઠાઈ, પકવાજ વગેરે રસવતી

જમવાને લોકો પ્રાર્થના કરતા; પણ એ ત્યારી મુર્દુષ કશાની પરવા કરતા નહિ. તે તો પોતાના આત્મધ્યાનમાં જ મગ્ન રહેતા. જગત જ્યારે મોહુડ્રી નિદ્રામાં નિરંતર પોછેલું હતું ત્યારે એ મહાપુરુષ એ મોહ-નિદ્રા-ત્યારી જગૃત થયા હતા. લોકો એમને ધાણું ય પૂછીતા, એમને બોલાવવાને ધાણો ય પ્રયત્ન કરતા; પણ એ મહાપુરુષ માનવત ધારણું કરી જગતના પરિચયથી હું મેશાં ફૂર રહેતા હતા. એમને જેઠ લોકાના મનમાં અનેક સંકલ્પવિકલ્પ થયા કરતાઃ “અહા ! કેવા રૂપાણા છે ? સાભાળયના બંડાર છે છતાં કયા હું એ એમણે સંસાર તન્યો હશે ? આવી નાની વધમાં કેવો અપૂર્વ વૈરાગ્ય ! સંસારની ઉદાસીનતારૂપ વૈરાગ્ય ભાવનાથી જ એમનું હૈયું ભરેલું છે. અરે ! કયા હું એ એમને આવો વૈરાગ્ય આવ્યો હશે ?”

જગતની પોતાની તરફ અખૂટ ભક્તિ, પૂજ્યભાવના છતાં એ મહાપુરુષને એની જરા પણ દરકાર નહોંતી. જે વસ્તુ મેળવવાને એમણે સંસાર તન્યો હતો તે વસ્તુ પ્રામ કરવા તરફ જ એમનું લક્ષ્ય હતું. સંસારના એ મોહમાયાનાં બંધનો તરફ એમનો જરાય સહભાવ નહોંતો. વસ્તુસ્વરૂપના શાતા હોવાથી એમને વિશેષ સમજવાની જરૂર નહોંતી; તેથી જ જગતની એમની તરફ અનુપમ ભક્તિ છતાં એમને તેમની તરફ પક્ષપાત નહોંતો—અથવા તો કોઈ ઉપસર્ગ કરે, હું ખ આપે કે સુખેથી કદુવચન કહી પોતાની હુઝેનતા હાખવે છતાં એની તરફ અણુગમો નહોંતો. આવી રાગ-ક્રેષ રહીત મધ્યસ્થસ્થિતિ જેવા ઉચ્ચ સ્થાનકે ધીરાજમાન આ મહાપુરુષનું

જીવન ખચિત અલાક્ષિક હતું. જગતનું ધ્યેય જ્ઞાહું હતું જ્યારે આ મહાપુરુષનું ધ્યેય નિરાળું જ હતું.

જે જે ગામ, નગર કે શહેરોમાં એ મહાપુરુષનાં પગલાં થતાં તે તે શહેરની નારીઓ તો એમના સૌંદર્ય ઉપર મરી શીટતી હતી, એ અથાગ સૌંદર્ય આગળ રૂપગર્વિતા નારીઓ પણ પોતાનો ગર્વ છોડી એમની પ્રાર્થના કરતી, એમની આગળ પોતાનું સર્વસ્વ અર્પણ કરતી, ધન, દૌલત અને દિવ એમના ચરણુમાં અર્પણ કરી હાવભાવોથી એમનું મન વશ કરવાને પ્રયત્ન કરતી; છતાં એ મહાપુરુષને સંસારનું આવું નાટક કાંઈપણ અસર કરતું નહિ-એ મોહનાં અનુકૂળ બંધને પણ એમને અડચણ કરતાં નહિ. એમના સૌંદર્યથી ઘેલી અનેલી નારીઓની હાવભાવભરી પ્રેમચેષ્ટાઓ પણ આ મહાપુરુષને તો વૈરાગ્યમાં જ વધારે. કરનારો થતી હતી. એને તો સંસારની કોઈપણ સ્વી ગમતી જ નહોંતી તો પણી એવા મોહનબંધનેં એને શું કરે ? અરે ! એ મહાપુરુષને તો એક એવી અજ્ઞાન સ્થીરી લાલચ લાગેલી હતી કે એ પુરુષ તે રમણીની વરમાળ લેવાને આતુર થયા હતા. એની વરમાળ આગળ જગતની સુંદરીઓની વરમાળ એમને તુંચ જણ્ણાતી હતી; તેથી જ એ મહાપુરુષ અત્યારે આ સ્થિતિએ હતા.

શ્વેતાંણી નગરીના માર્ગે જતાં અનુકૂળે એ રસ્તા આપ્યા; એક રસ્તો ઉજજડ હતો જ્યારે બીજા રસ્તા ઉપર અનેક મનુષ્યોનું આવાગમન હતું; છતાં એ મહાપુરુષ ઉજજડ

રસ્તે ચાલ્યા. એમને આ ઉજજડ રસ્તા તરફ જતા નોઈ
પથિછ લોડો કંદેવા લાગ્યા—“હે હેવાર્ય ! હે સંતપુરુષ ! એ
ઉજજડ રસ્તા તરફ ન જશો. આગળ જતાં એ માર્ગ ધણો
ભયંકર છે—લુધનને વિનાયર કરનારો છે. એક દૃષ્ટિવિષ સર્પના
ઝુલમથી એ રસ્તો હાવમાં ખાર વર્ષથી બંધ થઈ ગયો છે.
ધણો મનુષ્યોનો એણું લોગ લીધો છે, તેથી કોઈ ત્યાં જતું
નથી ને આપ પણ એ રસ્તો ન જશો.”

વટેમાર્ગાણી આવી સ્નેહલદી મીઠી વાણી પણ એ પુ-
રુષેન સાંસળી અને તેજ માર્ગે એ મહાપુરુષ આગળ ચાલ્યા.
રસ્તો ઉજજડ હોવાથી અનેક પ્રકારની મુશ્કેલી અનુભવતા
એ મહાપુરુષ આગળ વધ્યા. મધ્યગાળે આવતાં એક ભયંકર
દૃષ્ટિવિષ સર્પ ફૂરથી પોતાની તરફ ધસ્તી આવતો એમણે
નેચો. એ ત્યાણી ત્યાં જ એના આગમનની માર્ગપ્રતીક્ષા કરતા
કાયોતસર્જમુદ્રાએ સ્થિર રહ્યા, નિર્બયપણે ત્યાં મેરૂપર્વતની
માર્ગેક અડગ રહ્યા.

પોતાની હુદમાં કુરવા નીકળેલો દૃષ્ટિવિષ સર્પ કુરતાં
કુરતાં આ તરફ આવી ચખ્યો ત્યાં આ પુરુષ ઉપર ફૂરથી એની
નજર પડી. “ઓહો ! આજ બાર બાર વધે મનુષ્ય પ્રાણી !
શીકર નહિ, ક્ષણુમાત્રમાં હું મારી જવાળાથી એને બાળી ભરેમ
કરી દઈશ, એની માનવતીલા સંકેલી લઈશ.” એણે પોતાની
દૃષ્ટિમાંથી જવાળાએ છોડવા માંડી. એક પછી એક ઉંઘ
જવાળાએ છોડવા માંડી પણ એથી આ મહાપુરુષ ઉપર

કાંઈ અસર થઈ નહિ. કોધથી ધમધમતો અને અપમાનને નહિ સહન કરતો એ સર્વ એકદમ એ મહાપુરુષની ઉપર ખસી આવ્યો. અને સ્વર્ણની સામે દાખિ કરી વિશેષ જવાળાઓ છોડવી શરૂ કરી. છતાં મેરની માફુક અડગ ઉલેલા આ મહાપુરુષને જોઇ વિશેષ ફૂરતા ધારણું કરતો તે એ મહાપુરુષના ચરણુકમળને ડંખ્યો, અને ફૂર ખસી ગયો. વારંવાર એ મહાપુરુષને કરડીને ફૂર ખસી જતો કે એના પડવાથી રખેને પોતે હબાઈ જય. ઘણ્ણીવાર ડંસ હેવા છતાં આ પુરુષને અડગ ઉલેલા જોઇ એ સર્વ આશ્ર્ય પામ્યો ને આ અજબ માણુસ તરફ વારંવાર જોવા લાગ્યો. “ આ શું ? આટલું આટલું એણ અજમાવવા છતાં આ પુરુષ પરાબબ કેમ પામતો નથી ? એની જીવનલીલા કેમ પૂરી થતી નથી ? ” એટલામાં પોતે ડંખ મારેલી જયા તરફ એની નજર ગઈ તો ત્યાંથી ફૂધની ધારા વહી રહેલી એની નજરે પડી. “ અહુ ! આ શું ? મનુષ્યના શરીરમાંથી ફૂધિરને બદલે ફૂધ નીકળે એ તો નવાઈ ! ત્યારે આ કોણ ? ” એનાં નેત્ર સ્તરખ થઈ ગયાં, ગાત્ર શિથિલ થઈ ગયાં, એનો કોધ, ગર્વ બધાં અદૃશ્ય થયાં, એના જીવનમાં અજબ હૂારદેર થયો. એક માણુસ પોતાની સર્વશક્તિ અજમાવવા છતાં જયારે નારીપાસ-હતાશ થાય છે એવો વિલખો થયેલ તે સર્વ એ મહાપુરુષને વારંવાર જોવા લાગ્યો.

મહરહિત થએલો એ સર્વ જયારે તહીન શાંત થઈ ગયો. ત્યારે એ મહાપુરુષે એની તરફ કર્દાણુંની અમૃતમય નજીર ઝેંકી: “ ચંદ્રકાશિક ! કેમ સુંખાય છે ? સમજ ! સમજ ! દું

કોણું હતો ? ને અત્યારે કોધથી કૃથી સ્થિતિ પામ્યો છે તે ચાંદ કર. ”

એ મહાપુરુષનાં અમૃતમય વચન શ્રવણ કરતાં સર્વ વિચાર કરવા લાગ્યો. “એ મહાપુરુષ ખર્ચીત કોઈ મહાનું પુરુષ છે, ત્યાગી-વીતરાગી છે. એમણે શું કહ્યું ? આટલી બધી મેં એમની કદર્થના-વિડંબના કરી છતાં મારી ઉપર કરણા કરી જાણે મારી ઉપર કાંઈ ઉપકાર કરવા માગે છે. અને એમની દાખિમાં જરાપણ વિડાર છે ? કેવી સ્નેહુલીની દ્વારાપૂર્ણી છે, સમર્થ છે, શક્તિસંપત્ત છે એ તો. મારા પરિશ્રમથી જ જોવાઈ અણું. મારી એક જ દાખિમાં ગમે તેવો પુરુષ દાખ થાપ જાય તો. આટલી બધી મારી શક્તિનો ઉપયોગ કરવા છતાં એ મહાનું પુરુષને એનો કંઈપણ અસર થઈ નહિ, એ જ એનું પરાક્રમ સ્વીકારે છે. છતાં મારી ઉપરની કૃપાને લઈને મારી બધી વિટંબના એમણે સહન કરી. ખર્ચીત, સમર્થ પુરુષોમાં ક્ષમા એકોઈ અજાણ વસ્તુ છે. એમણે મને શું કહ્યું ? “સમજ ! સમજ ! તું કોણું હતો ? આજે કણાં છે ? કૃથી સ્થિતિમાં છે ?”

“એ મહાપુરુષનાં શાખદો કેવા મીઠાશથી ભરેલા છે ? હું કોણું છું ? હું તો સર્વઃ વળી તેથ દાખિલિખ સર્વ. એક દાખિ-માત્રમાં સર્વને ભાગી ભર્યમ કરી હઉ, એવો મહાનું, ઉત્ત્ર, અયંકર સર્વ. શું હું સર્વ છું ? નહિ, આ મહાનું પુરુષે જે જે શાખદો કદમ્બા એમાં કંઈક લેદ છે. શું લેદ છે ? એ તો કાંઈ સમજું શકાતું નથી.” પોતાની દાખ સન્મુખ ઉલેલા સુરાધ્ય,

શાંત અને મનોહર કાંતિવાળા ત્યાગી પુરુષને જેઠ તે સર્વ અનેક પ્રકારના વિચાર કરવા લાગ્યો. વિચાર કરતાં કરતાં એને ભાસ થયો કે આવો વેશત્વાગ મેં કયાંક જોયો છે. પણ કયાં ? તે યાદ આવતું નથી. તે વારંવાર યાદ કરવા લાગ્યો. વિચાર કરતાં એને પૂર્વભવને સૂચ્યવનાડું જાતિસમરણ જ્ઞાન થયું. જ્ઞાન થતાંની સાથેજ એહે પોતાના પૂર્વના ભવો જોયા. “અહા ! હું કોણ ? પૂર્વજન્મમાં હું તપસ્વી સાધુ હતો, છતાં કોધ કરવાથી એ તપ, એ સાધુત્વ હું હારી ગયો. ને તે પછી ચંદ્ર કાશિક તાપસ થયો, તે ભવમાં પણ મેં કોધને ચોયો. તો એ જ કોધમાં ભૂત્યુ પામી આજે ઉચ્ચ કોધવાળો દસ્તિવિષ સર્વ થયો છું, અને એ ભયંકર કોધને પોષી રહ્યો છું. અહા ! ધિક્કાર છે મને ! હું એ મહાક્ષલને આપનાડું મહાવત હારી ગયો! કોધને વશ થઈ નીચે ઉત્તરતો ગયો, તેમ છતાં ખરીત હળ મારા ભાગ્ય જગૃત છે કે આ મહાપુરુષનું મને દર્શન થયું. એમણે મારી ઉપર ઉપકાર કર્યો. આહ ! શી એમની સજ્જનતા ? મારી આટાટલી કદર્થના સહન કરી એમણે મને નરકમાં જતાં બચાવ્યો. ખરીત આ ભવમાં મેં ઘણી જીવાહંસા કરી છે, અનેક લોગ લીધા છે અને હળુ કેટલાય લોગ હું લેત. એ બધાય પાપોના ઝળ હું નરકગતિમાં જરૂર ભયંકરપણે લાંબાકાળ પર્યાત લોગવત. અરે ! આ મહાપુરુષે મારી રક્ષા કરી. એમનાં તે હું શું વખાણ કરું ? એમનો હું શું શું સત્કાર કરું ? ” એ ત્યાગી, શાંતમૂર્તિને ત્રણુ પ્રદક્ષિણા દેહ સર્વ એમના ચરણમાં પહ્યો. જાણે પોતાના અપરાધીની

ક્ષમા યાચતો હોય, કરેલી ભૂતોનું પ્રાયશ્વિત કરતો હોય તેમ એ મહાપુરુષના ચરણ આગળ આપોટવા લાગ્યો. પોતાના જીવનકારનાં પાપ કૃત્યોથી ઉદ્ઘેગ પામ્યો હોય તેમ હવે ફરીથી એવા પાપકૃત્યો ન કરવા મનમાં સંકલ્પ કરવા લાગ્યો.

પ્રશાંત થયેલો તે સર્વ એ મહાપુરુષને પોતાના અપરાધી ક્ષમાવતો હવે ફરીથી એવા અપરાધીનન કરું એવી જાણે પ્રતિજ્ઞા કરતો હોય ને જાણે સંસારનો ત્યાગ કરતો હોય તેમ તેણું પોતાનું મોઢું રાઙ્ડામાં રાખી આખું શરીર બહાર રહેવા હીથું. એ રીતે સમતાદ્ર્ય રસનું પાન કરતો તે પ્રાયશ્વિત કરવા લાગ્યો.

આ મહાપુરુષને આ ભયંકર અટવીમાં કુશલક્ષેમ નોઈ વટેમાર્ગુંએ. તેમજ ગોવાળો આ રસ્તેથી આવાગમન કરવા લાગ્યા. આ મહાપુરુષથી સર્વના જીવનમણ શાંત થયેલો નોઈ સર્વ વિસ્મય પામી ગયા. રાઙ્ડાની અંદર મુખ રાખીને રહેલા પહેલા દૃષ્ટિવિષ સર્વથી બીતા ગોવાળીયાએ વૃક્ષના અંતરમાં સંતાઈ એને જોવા લાગ્યા. વિશ્વાસ આવતાં ધીરે ધીરે લાકડીએવડે એને અડવા લાગ્યા, છતાં પણ એનો શાંત સ્વભાવ નોંધ ગોવાળીયાએ. વિસ્મય પાની ગયા. આ નહિ બનવા ચોઝ ફેરફાર નોઈ આ મહાપુરુષને ધન્યવાહ દેવા લાગ્યા. એમના ઉપર પૂજ્યાયુદ્ધ ધારણું કરવા લાગ્યા. આ વાર્તા આજુખાનું ફેલાતાં લોકો આ સર્વના દર્શન કરવાને ત્યાં આવવા લાગ્યા.

કેટલીક ગૌવાલણોએ હૂધ, દહી અને ધીથી એ સર્પનું પૂજન કર્યું. એક વખતનો અથંકર સર્પ અત્યારે આ મહાપુરુષના દર્શનથી શાંતરસમાં નિમભ થઈ પોતાની કાયા ઉપરથી પણ મમત્વ રહિત થયો.

સર્પને શરીરે હૂધ, દહી વગેરે ચાપડેલ હોવાથી એની ગંધથી આકર્ષાઈ તીક્ષ્ણ સુખવાળી કીડીએ ત્યાં આવી. કીડીએએ હૂધ, દહી અને ધીનું ભક્ષણ કરતાં સર્પનું શરીર આરણીના જેવું છિદ્રવાળું કરી દીધું. કીડીએના અનેક ચટકાઓને સહન કરતો સર્પ પોતાના પૂર્વના કૃત્યો. ચાદ કરી પ્રશ્નાતાપ કરવા લાગ્યો: “ અહા ! મને આટલું હુઃખ થાય છે તો પછી મેં હુલરે જીવાના પૂર્વે લોગ લીધા છે તેમને તેવું હુઃખ થયું હુશે ? અરે, તેમના મરણુકષ આગળ મારું હુઃખ શા હિસાખમાં છે ? આ કીડીએ તો બિચારી મારા ઉપકાર કરનારી છે. જે જે જીયંકર વેદનાઓ મારે આગામી કાળે નરકમાં જઈને લોગવાની હતી તે આ લોકમાં જ હિસાખ ચૂકુતે કરે છે; માટે મારી ઉપર એવો અનુપમ ઉપકાર કરનારી આ અદ્ય બળવાળી કીડીએ મારા શરીરના દાખાણુથી પીલાએ નહિ. ” એમ ચિંતવતો તે સર્પરાજ હુસ્સાહ વેદનાઓને સહન કરતો છતો પણ પોતાનું શરીર જરા પણ હુલાંયા વગર એમ જ પડી રહ્યો.

પંદર હિવસ પર્યાંત એવી હુસ્સાહ વેદનાઓને સહન કરતો અને શાંતરસનો નિધિ તે સર્પ મૃત્યુ પામી આ મહા-

પુરુષના પ્રાસાદથી નરકલોકમાં જવાને બહલે આઠમા હેવ-
લોકમાં હેવપણે ઉત્પજ્ઞ થયો—ભવિતવ્યતાને ચોગ્ય નરકને
બહલે તે આઠમી સ્વર્ગભૂમિનો અતિથિ થયો.

લગભગ ખાર ખાર વર્ષના લાંખા કાળાવધિથી આ બંધ
પડી ગયેલો શ્વેતાંધી તરફ જવાને રસ્તો આ મહાપુરુષના
પ્રભાવથી ઝુલ્લો થયો. લોકોનો માર્ગ નિષ્કર્ષક થયો, સર્પ
ભયંકર સર્પખુનો ત્યાગ કરી શાંતરસમાં નિમન્ન થઈ
પોતાનું કાર્ય સાધી ગયો. એવી દીતે આ મહાપુરુષના પ્રભા-
વથી એક સાથે એ કામ થયા.

જગતમાં જેનું લુલન પરોપકારને માટે છે તેઓને
પોતાના સ્વાર્થની લેશ પણ દરકાર હોતી નથી. જેઓને
પોતાનો સ્વાર્થ હોય છે તે પરોપકાર સાધી શકતા નથી.
આવા પરોપકારી પુરુષો તો જગતમાં ભાગ્યયોગે જ જન્મ
હે. પછી એ મહાપુરુષ ત્યાંથી અન્યત્ર ચાહ્યા ગયા.



જે વરસે શ. ૩) માં ઔર્તિહાસિક નવીન ચાર મુસ્તકો હજર
ઉપરાત પાનાના મેળવવા વાંચનમાળાના આહક થવા આઠ આનાની
દીક્ષાટ બાબો.

લૈન સરસ્તી વાંચનમાળા-પાલીતાલ્લા.

પ્રકુરણુ અ મું

શ્વેતાંધી નગરીમાં.

ન જાણ્યા જીવનના પંથ, જીવ્યા તો શું સુવા તો શું ?
ન જાણ્યા મુદ્દિતના પંથ, જીવ્યા તો શું સુવા તો શું ?
વિસ્તારી રાહ હુનિયાના, ગયા જે ત્યાગને પંથે;
વગાડી પડ્હ અમારીના, ગયા જે મુદ્દિતને પંથે.

પેલા નાગરાજને પ્રતિષ્ઠાધી એ મહાપુરુષ કૃતા કૃતા
શ્વેતાંધી નગરીએ આવ્યા તેમના આગમન પહેલાં જ માર્ગ
ખુલ્લો. થવાની તેમજ નાગની પરિવર્તન ભાવનાની વાતો
અહીંચાં આવી ગયેલી હોવાથી આ મહાપુરુષનાં દર્શન કરવાને
શ્વેતાંધી નગરીનો જનસમાજ હુણીમળી રહ્યો. આખું ય નગર
એમના દર્શન કરી પાપમલ ધોંડ નાખવાને આતુર અન્યું. એ
મહાપુરુષનાં પગલાં શ્વેતાંધીના પાદરમાં થયાં કે આ નગરનો
રાજ-પરદેશી રાજ મોટી સમૃદ્ધિથી એમના દર્શન કરવાને,
પગો લાગવાને આવ્યો. નગરમાં વાત પ્રસરતાં આખું ય નગર
દર્શન કરવાને વેલું વેલું થઈ ગયું. જગતની પ્રવૃત્તિ જૂદી હતી.
આ મહાનું પુરુષની ભાવના કોઈ એર જ હતી. જગતનો ને
તેમનો માર્ગ નિરાણો હતો. જગતની બાધ્ય ઉચ્ચાધિમાં રક્તા
અનો કોઈ ધનની છબ્બા કરી રહ્યા હતા, રોણીએ નિરોણી
થવા મથી રહ્યા હતા, બિખારીએ લોજન મેળવવાને ઝંકાં-

મારી રહ્યા હતા, કોઈ નામના માટે મથી રહ્યા હતાં, કોના લાલસુચો સ્વી મેળવવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે આ મહાપુરુષનું લક્ષ્ય તદ્દન જૂદું જ હતું. એમનાં અંતરચ્છુ ઉઘડી ગયાં હતાં. જાનરૂપી હિંબ્ય ચક્ષુઓથી સંસારનું સ્વરૂપ નિહાળી કોઈ અણુમોદ વસ્તુ મેળવવાનો તે પ્રયાસ કરી રહ્યા હતા.

એ મહાપુરુષ નગરની ખાડાર પ્રતિમા ધારણું કરીને રહ્યા. સ્થાનથી એક સ્થાનકે, મૌનથી અને ધ્યાનથી કાયા ઉપરનું મમત્વ છોડી અંતરદિશી કોઈ અણુમોદ અનનો શોધી રહ્યા હતા. એ અણુમોદ અનનો પ્રાસ કરવા માટે એમણે સંસારની મોહમાયા, રાજક્ષિદ્ધ, લોગોપદોગ સર્વ તન્યા હતા, માતાપિતા, સ્વી, ભાઈ આહિનાં સ્નેહબંધનો. એમણે તોઢ્યાં હતાં, તેમજ સગાં-કુદુંબ આહિ બહેળો. પરિવાર પણ એમણે તરછોડ્યો હતો. હુનિયા જેને માટે રાત્રિદિવસ પ્રયાસ કરી મનુષ્ય જીવન કલેશિત કરી નાખે છે એ સર્વ એમણે છોડ્યું હતું. સ્વી, ભાઈ, માતા, પિતા, પરિવાર, ધન, દૌલત, વૈકાશ, ઠકુરાઈમાં એ મહાપુરુષે જરાય સુખ ન જોયું. કાર્યની સિદ્ધિ-જીવનનું કથેય એમાં લગાડે ન હેખાયું. કાર્યની સિદ્ધિ મેળવવા-મનુષ્ય જીવનનું ઉચ્ચ લક્ષ માટે કરવા એમણે એ બધું છોડી હીધું. તપ કરવામાં, અધ્યાત્મ્ય પાળવામાં, ત્યાગમાં, આત્મધ્યાનમાં જ એમને કાર્યસિદ્ધિનો ભાસ થચો. એમાં જ એમણે અપૂર્વ સુખ જોયું. સંસારમાં તો આધિ, વ્યાધિ અને ઉપાધિ સિવાય બીજું તે શું હોય ?

પરહેશી રાજ ભારે ઠાડમાઠથી એ મહાપુરુષનાં દર્શને આવ્યો. એની પછ્યવાડે આખુંચ ગામ દર્શન કરવાને ઉલટયું, છતાં એ મહાપુરુષની મૌનતા, માધ્યસ્થતા અજ્ઞાન હતી. આજની આટલી લોકોની પૂજયભાવના છતાં એનો જરા પણ વિકાર એ મહાન દિલમાં ન હેતો, છતાં જેવી પેલા સર્વે તરફ મીઠાશ હતી તેવી જ મીઠાશ અહીંયાં પણ હતી, તે સ્પેષ સમજાતું હતું. લોકો પોતપોતાની ભક્તિનું કુળ મેળવતા હતા. એમને જોઈ ઘેલાં જેવા થઈ જતા હતા, કેમકે મહાન પુરુષોનું દર્શન જ મહાન કુળને આપનાડું છે. એમના દર્શનમાં જ સર્વ સિદ્ધિઓ રહેલી હોય છે તો પછી એમના વચનની તો જરૂર જ શી?

પરહેશી રાજ એ મહાન પુરુષનાં દર્શને કરી નમી—પગે લાગી, એમની સ્તુતિ કરવા લાગ્યો : “હે નરશ્રેષ્ઠ ! ખર્ચીત જગતમાં તમે જ અહૃદ્યુત છો. કે જેમણે દેવની સમાન ઋદ્ધિઓ છેડી ત્યાગનો. માર્ગ સ્વીકાર્યો. અનંતશક્તિ, અથાગ—કોઈ કાળે ખૂટે નહિ તેવું બળ છતાં એક તુચ્છમાં તુચ્છ પ્રાણીની પણ તમે કદર્થના સહન કરો છો. મનગમતા ભાવતા લોજન મળવા છતાં આપ આવું કષ્ટદાયક તપ કરી અથાગ સૌંદર્ય કરમાવી રહ્યા છો. રૂપગર્વિતા લલનાઓ. આપને જોઈ લોગને માટે આપની પ્રાર્થના કરતી આપની પાછળ ગાંડી ગાંડી થઈ કરે છે, છતાં આપ તેની સામે નજર સરળીય કરતા નથી; એ શું એછું ધૈર્ય છે ? હે નરોત્તમ ! તમારા સર્વ કંઈ આચારવિચાર, હિયા, શક્તિઓ એ બધું લોકોત્તર છે.

આમારી અદ્ય બુદ્ધિ એનું માપ ન કાઢી શકે. કયાં આપ ? કયાં અમે ? કયાં કુંજર અને કયાં કુડી ? કયાં રાજ ને કયાં રંક ? ” રાજએ નરશ્રેષ્ઠની પૂજા સ્તવના કરી પોતાના આવાસભુવન તરફ ચાલ્યો. અન્ય લોકો પણ દર્શાન કરીને પોતપોતાને મફાને ગયા. પ્રતિમાધારી કાઉસગાસુદ્રાએ રહેતા એ નરશ્રેષ્ઠ રાત્રીએ પણ ત્યાં જ રહ્યા.

પરહેશી રાજ નાસ્તિકનો શિરોમણી હતો. લુખિંસા, મિથ્યાત્વ વળેદે અનેક કદુક વિચારાથી એ અસ્ત હતો. પુષ્યના શુભ ઋણાનુષ્ઠાને પરહેશી રાજને પાર્શ્વનાથ લગવાનના ગણ્યધર કેશીકુમાર ગણ્યધરનો મેલાપ થયો. એમણે અનેક દ્રષ્ટાંતોથી પ્રતિભોધ આપી રાજને ધર્મનો રંગ લગાયો. લુખાલુખાદિકતું સ્વરૂપ સમજાયું, અને જે લુખની સુદૂર અસ્તિત્વતા સ્વીકારતો ન હતો એને લુખનો સિદ્ધાંત સમજાયો. પરહેશી રાજને ગળે તે વાત ઉત્તરી અને કેશીકુમાર ગણ્યધરનો એ બક્ત બન્યો. તે સાથે જૈનધર્મમાં પણ સ્થિર થયો. એવી રીતે અવિતૃયતાને ચોગે નરકના અતિથિઓ પણ સ્વર્ગની સોહામણી વાટે ચાલ્યા જાય છે; ત્યારે કેટલાકના કાંઈ આવેલા વહાણ અંધકારની ગહુન અર્તીમાં નીચે ગબડી પડે છે કે જે ધણ્ણા સમય સુધી પાછા ઉંચે આવી શકતા નથી.

એ નરશ્રેષ્ઠ શેતાંઝી નગરીથી આગળ ચાલ્યા. એમને વિચાર થયો કે—“ હજુ ક્યાં સુધી હુંકર્માં અસ્તિત્વમાં છે ત્યાં હળી કાર્યસિદ્ધિ થવાની થવાની નથી, માટે હુંકર્મોના નાશને માટે અનાર્થભૂમિ તરફ ગમન કરવું જોઈએ; કારણું કે કષ્ટ

સહન કર્યો વગર કર્મોનો ક્ષય નથી. કર્મના ક્ષય વગર કાર્યની સિદ્ધિ નથી. માટે કંઈક ઉપસર્ગો થાય તો જ સત્ત્વર કાર્ય સિદ્ધ થાય. જે કે તપશ્ચયાંથી પણું કાર્ય સિદ્ધ તો છે જ છતાં તપશ્ચયાં કરતાંથી આકસ્મિક જે ઉત્પાત થાય છે તે જે ક્ષમાપૂર્વક સહન કરવામાં આવે તો તેથી જલ્દી કાર્ય સિદ્ધ થાય છે ” એવો વિચાર કરી એ મહાપુરુષ ત્યાંથી આગળ ચાલ્યા. સંસારમાં બધાય સરળી ગ્રહૃતિના મનુષ્યો હોતા નથી. કોઈને ક્ષમા ગમે છે, કોઈને કલેશ-વઠવાડ-તોક્ષાન ગમે છે, કોઈને શાંતિ ગમે છે તા. કોઈને વિના કારણે પણું બીજને હેરાન કરું એમાં મળ પડે છે. તે બધી જગતની વિચિત્રતા છે.

ખરાખર એ જ રસ્તેથી જગ્યોતિર્વિઘાનો જાણું એક પાઈદા ત્યાંથી નીકળ્યો. એ નરશ્રેષ્ઠના ચરણુન્યાસનાં ચકાહિકના ભૂમિ ઉપર પડેલા ચિહ્ન જેઠ પેદો સામુદ્રિક વિચાર કરવા લાગ્યો. “અચીત આ માર્ગથી કોઈ ચક્કવતી ગયેતા જણ્યાય છે. તેઓ હાલમાં જણ્યાય છે તો એકાડી. શું ત્યારે એમને રાન્યે નહિ મળ્યું હોય ? અથવા તો કોઈએ પ્રપંચથી પડાવી લીધું હશે ? આવા એકાડી ચક્કવતી પણું સેવા કરવા ચોણ્ય છે. અત્યારે એકલા હોવાથી તેઓ જરૂર સેવકને ઇચ્છાતા હશે, માટે હું તેમની સેવા કરું કે જેથી માર્દ ભવનું દારિદ્ર જટ ફર થઈ જાય.” એમ વિચાર કરતો એ સામુદ્રિક ઉત્તાવળે પગલે આગળ ચાલ્યો. તો આગળ કોઈ ગામની નજરીક અશોક વૃક્ષની નીચે એ નરશ્રેષ્ઠ પ્રતિમા ધારીને ઉલા હતા. તેમને જેઠ પેદો સામુદ્રિક વિચારમાં પડ્યો : “ એડો ! આ હું શું જોઉં

જું ? એમના હૃદય ઉપર શ્રીવત્સનું લાંછન છે છતાં અલાં-
કારથું નામ નથી. મસ્તક ઉપર સુશુટણું ચિનહુ હતું છતાં
કાંઈ સુગુટ ન હતો. બજે ભુનાયો ચડાદિકના લાંછનયુક્ત
હતી પણ વસ્તુ કે અલાંકારથી રહિત હતી. બજે હાથ જો કે
શૈખનાગની જેવા વિસ્તીર્ણ હતા ” ધીન સર્વ લક્ષ્યોપેત-
યુક્ત આ પુરુષ જણ્યાયો છતાં એ એકાકી અને બિક્ષુક હુલત
નેઈ પેલો સામુદ્રિક પુણ્ય કુરી વિચાર કરવા લાગ્યો : “ આવા
લક્ષ્યોવાળો પુરુષ પણ આવી બિક્ષુક હુલતમાં છે ત્યારે
ખ્યાત મને લાગે છે કે શાસ્ત્રનો અનાવનાર કોઈ અવિચારી
પુરુષ જણ્યાય છે. મને આંક્ષી થાય છે કે આવા જોટા શાસ્ત્રો
એમણે શા માટે રચ્યા હશે ? જગતને ઠગવાડ્યે તેના
પ્રયત્નને તે આજસુધી શ્રમપૂર્વક આવી વિદ્યા ભણુનાર મારા
જેવા પુરુષને ધિક્કાર છે કે મર્ગભૂમિમાં જાંઅવાનાં જળ નેઈ
જેમ મૃગ હોડે તેમ આ પુરુષની પાછળ હું હોડીને આંયો ”
ઇત્યાદિક વિચાર કરતો તે મહા ગેહ કરવા લાગ્યો.

શાસ્ત્રને ફૂષણું આપતો અને પોતાના પરિશ્રમને
ધિક્કારતો એ પુણ્ય નિમિત્તિયો પાછો કર્યો. એટલામાં એક
મહાનું સમૃદ્ધિવંત ચક્રવર્તી સમાન ઋદ્ધિ, વેલાવ અને
ઠકુરાધ્વાળા પુરુષને પરિવાર સહિત પેલા ત્યાણી નરશ્રેષ્ઠને પગે
પડતાં જોયો. પેલો સામુદ્રિક વિચારમાં પડ્યો “ આરે ! હું
આ શું જોઈ છું ? ” તે પાછો કુરી પેલા નવીન પુરુષ પાસે
આંયો. આંક્ષર્થયુક્ત આ દશ્ય જોવા લાગ્યો. “ કેમ શું
વિચાર કરે છે ? ” પેલા આગંતુક પુરુષે કહ્યું. પ્રત્યુત્તરમાં
પુણ્યે સર્વ વાત કહી સંભળાવી.

“ અરે ભલા માણુસ ! તું વૃથા જેહ કરે છે. હજી આ પુરુષની તને ઓળખાણુ નથી તેથી જ તું જેહ કરે છે. એ તો ચક્કવતીએના પણ ચક્કવતી છે. જગતમાં અદ્વિતીય પુરુષ હુ. તારું શાસ્ત્ર, એ લક્ષણો સર્વ સત્ય છે. વૃથા જેહ કર નહીં. મારા જેવા સમૃદ્ધિવંત કંઈક પ્રાણીએ એમના ચરણમાં પડી એમનું શરણ માગી રહ્યા છે. તું એક તુચ્છ લક્ષમીના મોહમાં આ નરોત્તમ-દોકાતર પુરુષનું માહાત્મ્ય કેમ ભૂલી જાય છે ? એમના દર્શનથી ગમે તેવા હુંકર્મનો નાશ થાય તો પછી લક્ષમી પામ-વાની તો વાત જ કુયાં ? ” એમ કહીને ખેલા સમૃદ્ધિવંત પુરુષે પુષ્પસામુદ્રિકને એના મનગમતું દર્શય આપી સંતોષ્યો. તે પછી અદ્ય સભમયમાં તે પુરુષ પરિવાર સહિત સામુદ્રિકના જોતાં-જોતાં અદૃશ્ય થઈ ગયો.

“ અરે એટલી વારમાં આ પુરુષ કુયાં ગયો ? આવા સમર્થ પુરુષો પણ જેમના ચરણોમાં પડેલા છે એવા આ નરશ્રેષ્ઠ સર્વ લક્ષણોયુક્ત હોવા છતાં મેં મિથ્યા ચિંતાનું તે માટે હેઠું હું તમને ખમાવું છું. અરે મારા જેવા કંઈક અજ્ઞાન લુંબો. આપની જણુતા કે અજ્ઞાણુતા આશાતના કરતા હશે ! છતાં એ સર્વ પ્રતિકૂળ ખાબતો સહન કરી આપ પોતાનું દોકાતરપણું બતાવી રહ્યા છો. ખચીત આ કોઈ સમર્થ હેવ હુશે કે જેમણે આ નરશ્રેષ્ઠ ઉપરની પોતાની ભર્કિતથી મને ધૂચિંદત “આએચુ” ” ધૂત્યાદિક વિચાર કરતો તે પુષ્પ એ પુરુષો-તમ પુરુષને નમી-ખમાવી પોતાને ડેકાણે ચાદ્યો ગયો.

પ્રકરણ ८ મું.

રામનું સ્વરૂપને ભરતને ઝખ્યું.

“શું જાણો કે હૃદય ધરતાં, વાજ છે લાગવાના;
શું જાણો કે પ્રીતિ કરતાં, આંસુ છે પાડવાના.”

વિશાળા નગરના રાજગઢના અંતઃપુરમાં આવેલી એક શુંત સુરંગના મુખ આગળ કોઈ નવયૌવન બાળા આતુરતાથી કોઈના આગમનની રાહુ બનુંચે. એના મનમાં અત્યારે કંઈ કંઈ વિચારે રમી રહ્યા છે. “આહ્યા ! પિતા જન્મારે આ વાત જાણુંશે ત્યારે શું વિચાર કરશે ? દોકો શું ધારશે ? સગાસં-
ખંદી શું કહેશે ? અરે આવી શુભ્યિયદ બાળા પણ માતાપિતાની રણ વગર અન્યની સાથે લાગી ગઈ—નાશી ગઈ. મારે માટે દોકો એવા હુલકટ વિચારે કરશે ? અસ્તુ. ગમે તે કહેતેથી શું ?
આ સિવાય બીજે કોઈ રસ્તો જ નથી. પિતાજીએ જે એમની ઇચ્છાનો સત્કાર કર્યો હોત તો આજે આમ ચોરીછુંઘીથી કાર્ય કરવાનો વખત ન આવત; પણ શું કરીએ ભવિતવ્યતા બળવાન છે. સંસારમાં પતિથી બીજું શું અધિક છે ? આજે એ બધું સમજાય છે. જ્યાં સુધી માણુસને જે ચીજની જરૂર નથી હોતી ત્યાં લગી તે વસ્તુની કીંમત સમજાતી નથી. જન્મારે ગરજ પડે છે ત્યારે ક્ષુદ્ર વસ્તુ પણ મહત્વની લાગે છે તો પછી જેમની સાથે જીવનનો સંપૂર્ણ ભાગ વ્યતીત કરવાનો છે તેવી મહત્વની ભાગતોની તો વાત જ શી ? ફુનિયા ગમે તે કહે

મને એની પરવા નથી. કયારે મારો પ્રિયતમ આવે ને એમની સાથે હું ચાલી જઉં-ગાળયશાળી થાડું. ” ઈલ્યાદિક વિચાર કરનારી બાળા સુજેષા સુરંગના દ્વાર આગળ મગધરાજના આગમનની રાહ જોતી ઉલ્લી હતી. વાટ જોતાં જોતાં એની આંખોથી થાડી ગઈ. “ સમય તો થઈ ગયો. કેમ હળ નહિ આવ્યા હોય ? આવાં શુંત ઠાર્યો તો અટ થવાં જોઈએ. વાર લાગવાથી ઉલ્લાસ એમાં હાનિ પેઢા થાય છે. ડોણું જાણે કેમ વાર થઈ હશે ? જરૂર આવવા તો જોઈએ. ”

સુજેષા વિચાર કરતી હતી એટલામાં ચેલણું આવી પહોંચ્યી. બન્ને એનો મગધરાજ આવે કે તેમની સાથે રથમાં એસી પદાયન કરી જવાને તૈયાર થઈ આતુરતાથી રાહ જોવા લાગી. એટલામાં કંઈક અવાજ આવ્યો. બન્ને એનો વ્યાઙુણ ચિત્તે જોવા લાગી તો થાડીકવારે શુક્ષમાંથી આસ્તે આસ્તે અવાજ આવતો હોય એવો ભાસ થયો, ને જોતજોતામાં મગધરાજ શ્રેણ્યિક નરપતિ પોતાના અંગરક્ષકો સાથે રથમાં એસીને ત્યાં આવી પહોંચ્યો. સુરંગના દ્વાર આગળ આવતાં જ શ્રેણ્યિક રથમાંથી ઉત્તરી પડ્યો. બન્ને એનો ઉલ્લી હતી ત્યાં મંદમંદ ડગલાં ભરતો તેમની પાસે આવ્યો.

સુજેષાએ ચિત્રપટને અનુસારે શ્રેણ્યિક નરપતિને ઓળખા ને આવા સુંદર સૌભાગ્ય યુક્ત પતિનો સમાગમ પામી સુજેષા એહહ ઝુશી થઈ. નરપતિને જોઈ શરમથી નીચે જોયું: “ વાહ ! ચિત્રપટમાં મેં જેવું ઝ્યું હતું એનાથી દેખા-

માત્ર પણ નયું નથી. આજે પ્રત્યક્ષપણે જોવાથી મારી આંખો પણ સાર્થક થઈ.” એક-બીજાની સામે જોઈ અનેચે મૃહુ હાસ્ય કર્યું. “સુનેષા ! ચાલો, તમારા સ્નેહથી આકર્ષાઈ અહીં સુધી તમને તેડવા આગામી છું તો જટ ચાલો. વિશેષ સમય અહીંચા રોકાવું ઉચિત નથી.”

“ હા ! અમે તૈયાર છીએ. આપના આગમનની અમે આતુરતાથી ક્યારનાય રાહ જોતાં હતાં. આપરે આપના દર્શન થયા, અમારાં નેત્ર સફ્રેલ થયાં.” સુનેષાએ સ્વાગત કર્યું.

“ધ્યાન આગય મારાં કેંતમારા જેવાં ક્રી-રત્નને! મને મેળાપ થયો. મારો મનુષ્યભવ સફ્રેલ થયો.” શ્રેષ્ઠું નરપતિએ કહ્યું. અનેને એક-બીજાના દર્શનથી અનુરાગ ઉત્પન્ન થયો હતો.

સુનેષાએ ચેલવણ્ણા તરફ ફરીને કહ્યું : “ એન ! ચાલો રથમાં એસી જઈએ ” એમ કહી બજે એનો રથમાં ચઢી એડી. એટલામાં સુનેષાને કંઈક યાદ આવવાથી તરત જ રથમાંથી નીચે ઉતરી શ્રેષ્ઠું નરપતિને કહેવા લાગી: “ મહારાજ ! હું રનનાં આભરણું ભૂલી આવી છું તે લઈને આ આવી ” એમ કહી જવાબ સાંભળ્યા વગર તે ચાલી ગઈ. ચોડીવાર સુધી રાહ જોઈ પણ કોઈ આગામી નહિં, જેથી મગધરાજના અંગરક્ષકો બોલ્યાં : “ મહારાજ ! કાર્ય સિદ્ધ થયા પણી શરૂના આંગણામાં વિનાકારણે વિલંબ કરવો તે હિતાવહ નથી, માટે સત્તવર આપણે અહીંથી ગમન કરવું જોઈએ.”

રથમાં બેઠેલી ચૈહેલણુંને સુજેષા ધારી શ્રેષ્ઠિકે તરત જ રથને પોતાના નગર તરફ રવાના કર્યો. એની પાછળ એના અત્રીશ અંગરક્ષકો પણ પોતપોતાના રથ ચ્યાલાવવા લાગ્યા.

થાડીવારમાં સુજેષા આવી પહોંચી તો કોઈ જેવામાં આંધું નહિં. પોતે એકાડી જેહ વિદખી થઈ ગઈ. “ અરર ! આ તો બધો જેલ બગડી ગયો. શું ધાર્યું હતું ને શું બની ગયું. બકરી કાઢવા જતા ઉંટ ધુંસી ગયું. લર્તાર લેવા જતાં એનને પણ જોઈ એઠી. હેવે બુંડી કરી હવે શું કરું ? ”

તરત જ એણે ખૂમેણું પાડવા માંડી: “ અરે ! કોઈ હોડા, હોડા ! મારી એન ચૈહેલણુંને કોઈ ઉપાડી જાય છે. પકડો ! પકડો ! ! ”

સુજેષાની ખૂમરાષ્ટુથી આપો રાજદરખાર ગાળુ રહ્યો. ચેટકનરપતિ તરત જ પુત્રીની ખૂમ સાંભળીને શાસુ સલુ ત્યાં સુરંગ આગળ ધસી આવ્યો, પણ તેનો સારથિ વીરંગક મહાભળવાન હતો તેણે કહ્યું: “ સ્વામિન ! આવા કુદ્ર કાર્ય માટે આપનો પ્રયાસ થો ? હું એ કુદ્ર શરૂને જીવતો કે મુવો પકડી આપના ચરણુમાં હાજર કરીશ.” ચેટકનરપતિએ વીરંગકને આશા આપી.

વીરંગક તરત જ શાખાખ્યથી સંજિજ્ઞત થઈ સુરંગની અંદર ઉત્તરી પદ્ધ્યો. વેગથી ધસુમસ્યો. વીરંગક પેલા રથેણી નશુક આવી પહોંચ્યો. એટલે શ્રેષ્ઠિકનરપતિ તેમની સામે સુધે છરવાને આવ્યા.

તેમના અંગરક્ષકોએ તેમને અટકાવ્યાઃ “ મહારાજ ! આપ નગર લેગત થઈ જાવ, અમે એને જવાખ આપવાને તૈયાર છીએ. અમે એનો માર્ગ રોક્કાએ છીએ એ હરમિયાન આપ સહિસલામત નગરમાં પહોંચી શકશો માટે આપ જલદી પધારો.”

શ્રેણુક મહારાજ રથમાં એસી આગળ ચાલ્યા. પેલા અંગરક્ષકો વીરંગનો માર્ગ રોક્કા એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. સુરંગમાં વીરંગક અને અંગરક્ષકો કે ને સુલસા આવિકાના બત્તીશ પુત્રો હતા એમની સાથે જબર્ડસ્થ યુદ્ધ ચાલ્યું. યુદ્ધમાં વીરંગકે કોધ કરીને સુલસાના એ બત્તીશ પુત્રોને મારી નાખ્યા. એમના બત્તીશે રથો હૂર કરવામાં વીરંગનો કેટલોક સમય પસાર થયો એ અરસામાં શ્રેણુક સહિસલામત સુરંગ બહાર નીકળી જઈ પોતાના નગરમાં પહોંચી ગયા.

વીરંગકે પાછા કુરી ચેટકનરપતિને સમાચાર આપ્યા કે “ શ્રેણુકના બત્તીશે અંગરક્ષકોને મેં મારી નાખ્યા છે પણ સુરંગમાં વિશોષ જગ્યા ન હોવાથી એ રથો હૂર કરતાં વાર થઈ એ સમયમાં શ્રેણુક આપની કુમારીને લઈને છદ્દકી ગયો છે. હવે તો નિર્દ્દ્દ્યાય ! ”

શત્રુના સુભટોને માર્યો એ હર્ષ અને પુત્રીના હરથુલો શોક એમ કંધક હર્ષ અને કંધક શોકથી ચેટકનરપતિએ એ સમાચાર સાંભળ્યા. સુન્દેશાએ પણ આ સમાચાર જાણીને

ધણો શોક કર્યો પણ હવે શું થાય ? આવેલી બાળ તે હારી ગઈ હતી. આ તો રામનું સ્વપ્નનું ભરતને ઝયું એવી વાત થઈ ગઈ. હવે ઉપાય ન હતો.

સંસારના પ્રથમ થાસે જ ભક્ષિકઃ આવવાથી સુજેષાને હવે સંસાર પર વૈરાગ્ય આવ્યો. એ દગ્ધાઓર વિષયો ઉપરથી એનું ચિત્ત ઉડી ગયું. એણે પોતાનું મન ત્યાગ તરફ વાહયું. તપશ્ચયી તરફ દિલ પરોંયું. અનુક્રમે પિતાળની અનુમતિ મેળવી સુજેષાએ દીક્ષા અહણું કરી પોતાની કરેલી પ્રતિજ્ઞા સઙ્ગ્રહ કરી.

મગધરાજ શ્રેણિકનરપતિ રથમાં એઠેલી ચેલલણુને સુજેષા ! સુજેષા ! કહી યોલાવવા લાગ્યા, પણ ચેલલણું બોલ્યો : “ સ્વામિન ! હું કાંઈ સુજેષા નથી, કિંતુ એની નાની બેન ચેલલણા છું. ” ચેલલણુને પણ આવો પતિ મળવાથી હુર્ખ અને બેનના વિચોગથી શોક થયો.

“ તું ચેલલણા હો કે સુજેષા ! તું કાંઈ સુજેષાથી ઉત્તરતી નથી. તું પણ એના સરખી સ્વરૂપવાન છે. મારે મન તો તું પણ સુજેષા છે. ” શ્રેણિકનરપતિએ ચેલલણુને સંતોષી.

ચેલલણાનું હરણું થતાંની સાથે જ પેલો વણિકકુમાર વિશાળાના દરખારની નળુક રહેલો તે તરત જ ત્યાંથી રાજ-ગૃહને માર્ગે પડી ગયો. પોતાનું ઇપ પરિવર્તન કરી રાજગૃહમાં જઈ પોતાના પિતાને મખ્યો. શ્રેણિકનરપતિએ મોટા

મહેતસપૂર્વક ચેહેલાણું સાથે ગાંધર્વનિધિએ વળન કર્યા. પોતાની સર્વે રાણીઓમાં ચેહેલાણુંને પદૃરાણી પદે સ્થાપન કરી.

પોતાના અત્રોશ અંગરક્ષકો અને સુલસા શ્રાવિકાના પુત્રો એકસાથે મૃત્યુ પામવાથી પોતાને પણ ધણો એહ થયો. સુલસા શ્રાવિકા અને નાગ સારથી પુત્રોના શોકથી કદ્યાંત કરવા લાગ્યા. તેમને ઘેરે જઈ શ્રેણીક અને અભયકુમારે દિલાસો આપી શાંત કર્યા.

એ વણિકના સ્વરૂપમાં રહેલા અભયકુમારની યુક્તિથી મગધરાજનું કાર્ય સહેલે ઇણીભૂત થયું. બળથી ને કાર્ય થઈ ન શક્યું તે કળથી થયું. સુરંગના દ્વાર પાસે ઉલેલી સુનેષા એ અધો આ અભયકુમારની યુક્તિનો જ પ્રભાવ હતો; કેમકે સુનેષા પાસેથી ચિત્રપટ લઈને દાસી જ્યારે પેલા વણિકને આપવા ગઈ તે વખતે પોતાની જાહની સ્થિતિ કહી સંભળાવી અને કોઈ પણ રીતે બજે એકત્ર થાય એ માટે કંઈપણ ઉપાય કરવાની દાસીએ વણિકના સ્વરૂપમાં રહેલા અભયકુમારને સૂચના કરી. અભયકુમારને તો એટલું જ જોઈતું હતું. એણે રાજગૃહથી વિશાળાના રાજદરખારના અંતઃપુર સુધી એક મોટી સુરંગ કરાવી. એમ શુમતાથી એ કાર્ય થયું કે જેની કોઈને ખખર પણ પડી નહિ. સુરંગ તૈયાર થતાં બજેના મેળાપનો એક દિવસ અભયકુમારે સુકરર કર્યો. એ સુકરર કરેલ સમયે સુનેષા શ્રેણીકનરપતિની રાહ નેતી સુરંગના દ્વાર આગળ ઉલ્લી હતી, છતાં એ આશાભરેલી સુનેષાના મનના મનોરથ્યા

મનમાં જ સમાઈ ગયા અને અણુધારી રીતે ચૈલણું ક્રિંદું
મેળવી ગઈ એ બધા કર્મરૂપી નટના ખેલ છે. ચૈલણુંએ પતિ-
પ્રેમથી પ્રતિજ્ઞા સદ્ગુરુ કરી ને સુન્દરાચે, દીક્ષા લઈને પોતાની
પ્રતિજ્ઞા સાર્થક કરી. રામતું સ્વાનું ભરતને ફંજું એ મુજબ
સુન્દરા જે પતિ મેળવવાને રાત્રિહિવસ આતુર હતી તે પતિ
સ્વાભાવિક રીતે ભાગ્યયોગે ચૈલણુંને મળી ગયો. શ્રેણિક
નરપતિ જેવો પતિ મેળવી ચૈલણું સુખી થઈ ને દેવતાની
માદ્રક તેઓ મનુષ્યકાવમાં સુખ લોગવવા લાગ્યા.

ને કે શ્રેણિકમહારાજને ખુદ્ધધર્મનો રંગ લાગેલો હતો
ને ચૈલણું હતી પરમ શ્રાવિકા ! છતાં એકણીજના ધર્મમાં
આડા આવી તેઓ પોતાનો સંસાર બગાડે એવા નાહાન
ન હોતા. બજે પોતપોતાનાં ધર્મમાં ચુસ્ત હતાં. અને એક-
ણીજને પોતપોતાના ધર્મમાં આકર્ષણાને કોઇ અનુકૂળ સમયની
રાહ જોતા હતાં. એમાં વિધિ કેને સહાય કરશે ? એ તો
આગળ જોવાનું, પણ આખરે જે સત્ય હશે તે જરૂર ફૂલશે એ
વાત તો નિઃસંદેહ સત્ય છે. બજે ધર્મોમાં ને સત્ય હશે તેને
આખરે વિજય જ છે અસ્તુ.



પ્રકરણ નું મું.

વિડાના.

“ દુર્જનઃ પરિહર્તવ્યો, વિદ્યાલંકૃતોડપિ સન् ।
માણિના ભૂષિતઃ સર્પઃ, કિમસૌ ન ભયંકરઃ ? ”

ભાવાર્થ—વિદ્યાથી પરિપૂર્ણ એવો મનુષ્ય પણ જો હુજુન હોય તો તે છોડના ચોગ્ય છે કેમકે સર્પના મસ્તક ઉપર મણિ હોય એથી કાંઈ એની ભયંકરતા એણી થતી નથી.

જગતમાં મોટા પુરુષોને જ વિજ્ઞો આવે છે. સામાન્ય માણુસો જ્યારે પ્રાયઃ એક સરળી સ્થિતિમાં પોતાનું જીવન વ્યતિકરે છે ત્યારે ચઢતી-પડતીના ચ્યામ્પકારો તો બનતા લગી મહાપુરુષોને જ જોવાનો સમય આવે છે. પ્રાયઃ કરીને સંસારમાં જેવું હું અ તેવું સુખ અને જેવું સુખ તેવું હું અ પણ ગ્રાણીઓને અવશ્ય લોગવવું પડે છે, પુષ્પની પરાગનો આસ્વાહ લેનાર ભ્રમરને જેના પ્રાયશ્ચિત્ત રૂપે એમાં જ શુંગણાધિને મરવાનો વખત આવે છે, રૂપલુણ્ધ પતંગીયું હિપકની જ્યોતમાં પડી ક્ષણુમાત્રમાં પોતાની કાયાને હોમી હેછે, રૂપર્શી ઈદ્રિયના સુખમાં લુણ્ધ થયેલા ગજરાજેને પણ વધ-અધનાદિક અનેક પીડાઓ સહન કરવી પડે છે; કારણું કે સાંસારક સુખો ભૂળથી જ પાપખંધન ચુક્ત હોવાથી એ સુખની પાછળ પાપના ઝળરૂપ તેની હું ખરૂપ શિક્ષા

પણ સહન કરવી પડે છે. છતાં પંચંદ્રિયના વિષયોમાં આકષ્યાચેલ પ્રાણી એનાથી છુટવા પામતો નથી એથી ઐભું આક્ષ્યર્ય કસું ?

પુણ્ય નામનો સામુદ્રિક ઈચ્છિત મેળવી ત્યાંથી સ્વસ્થાનકે ચાલ્યો ગયો. તે પછી એ નરશ્રેષ્ઠ પણ આ મૃત્યુલોકની ભૂમિને પાવન કરતા અનેક થામ નગર વગેરે સ્થળોને અલાંકૃત કરતા કોઈ ગામની નળુક આવીને પ્રતિમા ધારણું કરીને રહ્યા. ચોમાસાના ચાતુર્મસિમાં ચાર ચાર માસ પર્યાંતના આહારપાણીના ત્યાગની તપક્ષ્યર્થીએ કરતા, અનેક પ્રકારના અભિયંત્રો ધારણું કરતા. છુટું, અફુલ જેવી તપક્ષ્યર્થી તો એ મહાપુરુષનો હું મેશનો લગભગ જ્વલસાય હતો. અનેક પ્રકારની તપક્ષ્યર્થી ઉપરાંત જ્યાં ત્યાં પ્રતિમા ધારણું કરી કાચોત્સર્ગમુદ્રાએ રહી ધ્યાનમાં જ મળન રહી કર્માની નિર્જરા કરી રહ્યા હતા. અત્યારે પણ આ પુરુષ કોઈ ગામની નળુક પેઢાળ નામના ઉધાનમાં રહેલા એક ચૈત્ય આગળ પ્રલુબ આવ્યા અનેત્યાં મહાપ્રતિમા ધારણું કરીને રહ્યા.

જ્યારે મોટી મોટી કસોટીમાંથી પસાર થવાય છે ત્યારે જ મહાપુરુષ થવાય છે, ત્યારે જ એમના સત્યની કસોટી થાય છે. જગત પણ એમના સત્યથી અનિયત થાય છે કે એક મનુષ્ય છતાં હેવ કરતાં પણ કેવી અધિક શક્તિ ધરાવે છે ત્યારે જ એ મહાપુરુષો મનુષ્ય મરી હેવથી પણ આગળ વધીને હેવાધિહેવ થઈ શકે છે ને ઈચ્છિત સંપદા મેળવી શકે છે.

ખરાખર તે જ સમયે આ નરશ્રેષ્ઠની સુધર્મ હેવલોકની સ્થાનમાં શકેંદ્રના સુખથી પ્રશંસા થઈ. જ્ઞાનદિષ્ટી ઈદ્રે આ

મહાપુરુષની આવી અચળ સ્થિતિ જોઈ એણે સભામાં હેવોની આગળ હાડ્લ કરી. “અરે હેવતાચો ! આ મહાપુરુષની ધ્યાન શ્રેષ્ઠિ-શક્તિ અજાબ છે. મનુષ્ય તો શું ખલ્ટે સમર્થ હેવતા પણ એમને ચલાયમાન કરવાને અશક્ત છે. એવા આ સર્વ શક્તિ-માન મહાપુરુષને મારા વંદન છે.”

સૌધર્મેશનાં આવાં લક્કિતયુક્ત વચન સકલ સભામાં રહેલા હેવતાચોએ સાંભળ્યા અને એમાં અનુમતિ આપી, છતાં બધાય એક સરખા હોય તેવું તો જગતમાં ભાગ્યે જ ખની શકે છે. એક મહાસમર્થ અને શક્તિસંપન્ન સામાનિક હેવતા સૌધર્મેશના વચનની અશ્રદ્ધા કરતો એલયો : “સુરેંદ્ર ! ખરીત એક સામાન્ય સાધુનાં તમે હૃદથી એહદ વખાણું કર્યો છો. એતમારી પ્રભુતા છે. એવા એક મનુષ્યમાત્રને ચલાયમાન કરવો એમાં આપણું જેવાને શું મોટી વાત છે ? આપણી શક્તિનો પ્રભાવ ક્યાં તમે નથી જાણુતા ? કે જેથી આવાં ખુશામતનાં વાક્ય બાદો છો ? જેનાં શિખરો આકાશ સાથે વાતો કરી રહ્યાં છે, અને જેનાં મૂળ પાતાળને ઝંધીને રહ્યાં છે એવા સુમેરગિરિને પણ એક ઢેકાની માદ્ક જે લુંજવડે હેંકી હેવા સમર્થ છે. કુણિગિ સહિત બધી પૃથ્વીને બોળી હેવાનો જેનો પ્રગટ વૈશન છે એવા સાગરને પણ એક કોગળામાત્રમાં પાન કરી જવાની જેમની તાકાત છે, એવા અતુલ ખરાડુંભી હેવતાચો આગળ એ પામર મનુષ્ય કોણું માત્ર છે ? હું

પોતે જ એને ધ્યાનથી લેશમાત્રમાં ચલાયમાન કરીશ.
તમારી આ ભરી સભામાં બોલાયલી વાણી અન્યથા કરીશ.”

પોતાની ખન્ને ભુજાયો સભામંડપમાં ડેક્ટો તે
સંગમ દેવતા એકદમ ફોધથી વહુ નેત્ર કરતો ઉલ્લો થઈ
ગયો. એની આવી ચેષ્ટા જોઈ ઈદ્ર વિચારમાં પડી ગયા.
“ અરે આ એક મગતરો એના મનમાં શું સમજે છે ? એ
મહાપુરુષને તો આ પામર ચલાયમાન કરવાને શક્તિમાન
નથી, પણ આ મારા ભક્તિયુક્ત વચ્ચનોને અન્યથા કરવા
આ હૃષ્ટ નક્કી એ મહાપુરુષને અત્યંત વિડાના પમાડશે;
પણ અત્યારે તો લાચાર ! હું એને અટકાવી શકું છું.
જો મારી શક્તિથી એને અટકાવીશ તો એ હુરાતમા એમ
કુલેશો કે એ તો તમારી શક્તિથી અખંડ તપ કરે છે, છતાં
એ મહાપુરુષો તો પોતાની શક્તિ ઉપર સુસ્તાક હોય છે.
હા ! આ તો ઠીક ન થયું.” પેલા સંગમસ્થરને આ
પ્રમાણે તપેલો જોવા છતાં શકે મૌન રહ્યા-એ હૃષ્ટ સૂરની
ઉપેક્ષા કરી. ભયંકર વેગથી બ્યાંકુળ ચિત્તવાળો તે દેવતા
સભામંડપ છોડી આગળ ચાલ્યો.

એક નિમેખમાત્રમાં તે દેવતા એ મહાપુરુષ સમક્ષ
સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર હાજર થયો. “ આહા ! આવા એક
પામર મનુષ્યની શક્તિનાં ઈંદ્રે કેવાં એટાં વખાણુ કર્યાં !
હુમણું જ એનાં વચ્ચન અન્યથા કરી હું સ્વર્ગલૈંકમાં પાછે
જાઉં છું.” એણે એ મહાપુરુષ ઉપર ધૂળની વૃષ્ટિ કરી, સર્વે

અગો ઢાંકી ધીધાં, શ્વાસોધ્યાસ પણ ન લઈ શકે એવી સ્થિતિ કરી; છતાં પણ એ મહાપુરુષે ધ્યાનની એકતાનતા છોડી નહિ ત્યારે વજભુખવાળી કીળીએ ઉત્પજ્ઞ કરી, ડાંસ ઉત્પજ્ઞ કર્યો, વીઠી ઉત્પજ્ઞ કર્યો, નોળીયા વગેરે ઉત્પજ્ઞ કર્યો ને એ મહાપુરુષના શરીરને વેદના કરવા લાગ્યા. એ હેવે ચોતાની સર્વ શક્તિનો વ્યય કરી નાખ્યો, પણ એ મહાપુરુષે ચોતાનું ધ્યાન છોડ્યું નહિ. અનેક પ્રકારના એવાં જિન્હે ઉપસગે કરવા છતાં એ નરશ્રેષ્ઠ જ્યારે ચલાય-માન થયા નહિ ત્યારે ઉચ્ચ કોધાયમાન થઈને પ્રાણુનો નાશ કરનારું એક કાગચક ઉત્પજ્ઞ કર્યું. “કારણું કે પ્રાણુનો નાશ થતાં એનું ધ્યાન આપોઆપ છુટી જશે.” રાવણે જેમ કૈલાસને ઉપાયો તેમ ચક્કને જોરથી ઉપાડી એ નર-શ્રેષ્ઠ ઉપર તે હેવે નાખ્યું. સસુદ્રમાં જેમ વડવાનળ અજિન પડે તેમ એ ચક્ક મહાપુરુષ ઉપર પડતાં એના પ્રહારથી જન્તુ સુધી તે પૃથ્વીમાં મગન થઈ ગયા; છતાં પણ ધ્યાનથી ચલિત થયા નહિ, ભરણું પામ્યા નહિ. જ્યારે સર્વ શક્તિ-એ અજમાવી ત્યારે સંગમસ્તુર લગ્નાશ થઈ ગયો. એના મનમાં થયું કે “જ્ઞાર શસ્ત્રાસ્થી આ પુરુષ અગોચર છે, માટે અનુરૂપ ઉપસગથી એને ક્ષોલ ઉત્પજ્ઞ કરું.”

એમનાં માતાપિતા એમની આગળ પ્રત્યક્ષ થઈ કર્યાંત કરવા લાગ્યાં: “અરે પુત્ર ! તેં આ શું હુંકર કાર્ય આરંભયું છે ? સાધુપણું છોડ ને ઘેર ચાલ ! કયા હુંએ તારે

આવાં હુસ્સણ કષ્ટ સહન કરવાં પડે છે ? અરે સૌભાગી ! અમારી અવગણુના કર ના ? તારો ભાઇ નંદિવર્ધન પણ અમને તળ ગયો ને તું પણ અમારો ત્યાગ કરી જય તો પછી આ અવસ્થાએ અમારે કોનું શરણ ? મુત્રો તો એ જ કે જે માતાપિતા ઉપર લક્ષ્મિમાન હોય.” એવા અનેક કદમ્પાંતો એ મહાપુરુષ આગળ તે કરતાં, પણ પરમાર્થ તત્ત્વને જાણુનારા આ મહાપુરુષના હૃદયની પેલા તુચ્છ સંગમસૂરને કયાંથી ખબર હોય ? જેનું જ્ઞાન, તપ, ઐશ્વર્ય, શક્તિ, વૈભવ અને ઠફરાઈ અપૂર્વ છે એવા એ નરશ્રેષ્ઠ આવા કુદ્ર પ્રયાસોથી ચણે ખરા કે ? જે આપા જગતનો ઉપકાર કરવામાં સમર્થ છે, બધા વિશ્વની મનોવાંછના પૂરનારા છે અને સંપૂર્ણ તત્ત્વના જ્ઞાનાપુરુષ છે તેની પેલા કુદ્ર હેવને કયાંથી ખબર હોય ?

‘વિધવિધ પ્રકારની શક્તિએ નિષ્ઠળ ગંધ હવે શું કરવું ?’ સંગમસૂર વિચાર કરવા લાગ્યો. કંઈક યાદ આવતાં તે વિમાનમાં બેસી પોતાનું હેવપણું મહાન ઐશ્વર્ય વિકુર્વી એ મહાપુરુષ આગળ પ્રગત થયો. “અરે નરશ્રેષ્ઠ ! તમારા ઉચ્ચ તપથી, તમારી અપૂર્વ શક્તિથી હું પ્રસ્તુત થયો શું તો મારી પાસે કંઈક માગો. કહો ? હું તમને શું આપું ? તમારા મનમાં જે અલિલાખા હોય તે વ્યક્ત કરો. એમ ન સમજશો કે હું નહિ આપી શકીશ. તમારી જે કંઈ છચ્છા હશે તે સર્વ હું આપી શકીશ. અમે હેવતાએ સર્વશક્તિમાન છીએ. સર્વ કંઈ આપવાને સમર્થ છીએ.”

સંગમની આવી વાગ્યાળ છતાં એ મહાસત્વવધારી પુરુષ મૌન રહ્યા. એમને તો એનાં વાક્યો સાંભળવાનીય કુરસ્થ નહેણી. ધ્યાનની એકત્રાનમાં જ એમની ચિત્તવૃત્તિ હતી. તેમની મૌનતા જોઈ સંગમ ઝરી જોખ્યો: “ અરે જો તમારી ઈચ્છા હોય તો જ્યાં ઈચ્છામાત્રથી બધા મનોરથો પૂર્ણ થાય છે એવા સ્વર્ગદ્વારકમાં તમને આ હેઠળી જ લઈ જાઉં અથવા તો સર્વ કર્માંશી સુકૃત અને જ્યાં એકાંત પરમાનંદમય સુખ રહેલું છે એવા મોક્ષમાં તમને લઈ જાઉં. હે મહામતે ! શા માટે આવું હુંકર તપ કરે છો ? તમારા તપથી હવે સર્યું. તમારા તપનું કેળ તમને આપવાને તમારા ભાગ્યચોગે જ હું અહીંયાં આવ્યો છું. કહો તો મોટા મોટા મંડલેશ્વરો જેમનાં ચરણોમાં મસ્તકો નમાવી રહ્યા છે, એવું જગતનું ચક્રવર્તીપણાનું સામાજય આપું. કહો, કહો, હે મહાપુરુષ ! હે પુરુષશ્રેષ્ઠ ! તમને શું આપું ? તમારી શી ઈચ્છા છે ? ” સંગમની આટલી બધી વાક્યાતુર્યતા છતાં એ મહાપુરુષ તા ધ્યાનમાં જ મળન રહ્યા.

આ દાવમાં પણ નિષ્કળ જવાથી સંગમે છેલ્લામાં છેલ્લો એક પ્રયત્ન કરી જેવા ઈચ્છા કરી કે જે પ્રયત્નથી ગમે તેવા પણ ચલાયમાન થધ જાય. એ પ્રયત્નથી હુનિયામાં ઘણ્યાં કામો થયાં હશે ને કંઈક કાર્યો એ ઉપાયથી સિદ્ધ થાય છે. ત હાવ અથવા તો પ્રયત્ન તે આ જ !

સંગમે મનોહર હેવકુમારીએ ઉત્પજ્ઞ કરી તેમને આજા કરી: “ બાળાએ ! જાવ ! આ ધ્યાનમાં એક ચિત-

વાળા પુરુષને ક્ષયાનભૂત કરે। એની આગળ સંગીત,
નાટારંગ, હાવભાવ, ભૂલંગ વગેરે તમારી ચતુરાઇથી એનું
મન વશ કરે। એને કામહેવનો સેવક બનાવો। શરીરની
અનેક ચૈધાઓ, ભાવો એની આગળ પ્રગટ કરી એનું મન
દોખાવો। કામહેવને ઉત્પન્ન કરનારી પદુ ઋતુઓ ઉત્પન્ન
કરી તમારી કળા તમે સાર્થક કરો ! જાઓ, મારી આજા
સિદ્ધ કરી મને પાછી સોયો ! ” દેવભાગાઓ સંગમની આજા
પામીને એ મહાપુરુષની આગળ આવી. એક સાથે કામ-
હેવની પદુ ઋતુઓ ઉત્પન્ન કરી, સંગીત, નાટારંગ શરૂ
કર્યું. એ હાવભાવો, એ ભૂપ્રક્ષેપ, એ અભિનયો, ખીઓની
કળાઓથી પણ્ણુ હતાં. તેમાંથી આ દેવભાગાઓ ! એમના
સૌંદર્યમાં, રમણીય અભિનયોમાં, હાવભાવલયી વિલાસો
સર્વેચ અપૂર્વ હતાં. એ દેવભાગાઓએ પૂર્વે અનેક ઋષિ-
મહર્ષિઓનાં તપ પોતાની કળામાં દોખાવી અંગ કર્યો હતાં,
અનેક મહર્ષિઓને પોતાના સૌંદર્યમાં લુણ્ધ બનાવી કામ-
હેવના સેવક બનાવ્યા હતા. અરે ! એક હાડ-માંસ અને
મળ-મૂત્રની ભરેલી છતાં ઉપરથી સુંદર દેખાતી મનુષ્ય-ખીના
હાવભાવોમાં સમર્થી પણુ ગણડી પડયા છે તો પછી શુદ્ધ
અને હિંય અંગવાળી, હંમેશ નવીન ઘોરનવાળી દેવભાગા-
ઓના વિલાસો આગળ કયો પુરુષ ટકી શકે ?

એ મહાપુરુષનું ક્ષયાન અંગ કરવાને દેવભાગાઓએ
પોતાના વિલાસો છોડી મૃક્યા, કામહેવને ઉત્પન્ન કરનારા

દરેક સ્થાધન ખડાં કર્યાં, અનેક ભીડાં વચ્ચેનોથી, અંગની ચેષ્ટાઓથી એમને સ્પષ્ટલાયમાન કરવાને પોતાની સર્વ શક્તિઓ ખર્ચી નાખી. કોઈ હિવ્ય સ્વરવડે અનેક રાગ-રાગળીઓ ગાવા લાગી, કોઈ મૃદુંગ, વાન્જિંત્ર, ચપટી, તાલ આદિ અન્નવાં લાગી, કોઈ આકાશ અને પૃથ્વીમાં ઉછળતી અનેક હાવખાવ અને દિલિલાવો ભતાવતી નૃત્ય કરવા લાગી, કોઈ અંગમરોડથી કંચુડીના બંધનો તોડતી અને લુલાઓના અલિનયો ભતાવતી હુહ્યપ્રહેશને પ્રગટ કરવા લાગી, કોઈ નાલીમંડળને ભતાવતી તો કોઈ અન્યોઅન્ય દફ આદિંગન કરવાવડે લોભાવવા લાગી, કોઈ પોતાના ઉત્તરીય વચ્ચેને સ્પષ્ટલાયમાન કરતી નિતંખ પ્રહેશો ભતાવવા લાગી, કોઈ પોતાના પુષ્ટ સ્તનવાળા વક્ષઃસ્થળને વારંવાર ભતાવવા લાગી, કેટલીક એમને મિષ્ટ વચ્ચેનોથી લોભાવવા લાગી: “હે નરશ્રેષ્ઠ ! ચાલી ચલાવી અમે તમારી આગળ પ્રેમની કિલ્ફા માગવા આવીએ છીએ તો શા માટે ઉપેક્ષા કરો છો ? અમારા જેવી સુંદરીઓ મોટા લાગ્યે જ મળે છે તો અમારો સ્વીકાર શા માટે કરતા નથી ? ”

“અરે મુનિ ! આવું તપ કરવાનું કેળ પણું સુંદરીઓનો સમાગમ જ છે, અને તે કેળ આપવાને અમે સ્વર્ગમાંથી અહો આવ્યા છીએ તો અમારી સાથે લોગ લોગવી આ જીવનની સાર્થકતા કરો. અરે જુઓ ! જુઓ ! કામહેવ અમને પીડી રહ્યો છે. હે મહાપુરુષ ! એનાથી અમારી સ્ક્ષા

કરો ! રક્ષા કરો ! ” છતાં એ મહાપુરુષ તો ધ્યાનમાં જ મજન રહ્યા.

“ અરે પરોપકારરસિક ! કંઈ નહિ તો અમારી ઉપર ઉપકાર કરવાની ખાતર અમને સ્વીકારો ! આ કામરાજની પીડા થકી બચાવો ! અમારા અંતરમાં મહનની કંબાળાએ પ્રગટી રહી છે તેને શાંત કરો ! અમારી ઉપર ઉપકાર કરો ! તમારા જેવા સુજા પુરુષને અમે વિશેષ શું કહીએ ? ”

“ શામાટે તમે અમારી સામે નજર પણ કરતા નથી ? અરે ! આટલો નજીવો ઉપકાર કરવા જેટલી તમારા હૃદયમાં ઉદારતા નથી, તો જગત ઉપર ઉપકાર તમે શી રીતે કરી શકશો ? હે પ્રાણુનાથ ! તમારી કઠોરતા છાડી ધો. મધુર સ્વિમત કરી અમને આતિંગન આપી અમારા મનોરથ પૂરી ધો. ! ”

એ એસરાએના હાવભાવ, નિલાસો, ચાદુ વચ્ચેનો, સંગીતાદિક સર્વ કંઈ ચૈષાએ એ મહાપુરુષની આગળ વ્યર્થ ગઢ. આખરે નિરાશ થઈ તે પાછી ફરી.

ક્રૂકત એક જ રાત્રિમાં એવી રીતે એ સંગમહેવે વીશ બોટા ઉપર્સર્જ કર્યો, છતાં પણ આ મહાત્માના ધ્યાનને સખલિત કરી શક્યે. નહિ ત્યારે એણે વિચાર કર્યો. “ ખરે ! આ કોઈ અજબ શક્તિવાળા હેવાથી મારા બધા પરિશ્રમે વ્યર્થ થયા. હવે પ્રતિશાભ્રષ્ટ થઇને હું શું મોં લઈ સ્વર્ગમાં જાઉ ? હવે તો બલે એની સાથે જ રહું ને કોઈપણું

છળ મેળવીને એ મુનિને ક્ષેત્ર પમાડું તો જ મારી પ્રતિજ્ઞા સ્ફેર થાય. અન્યથા લીજ દેવતાઓને હું શું સુખ બતાવું ? ”

પ્રાતઃકાળ થતાં પ્રલુબે—એ મહાપુરુષે ત્યાંથી આગળ ચાલવા માંડયું. પેલો સંગમ સુર પણ એમની પાછળ રહ્યો. છ-માસપર્યંત એમની પાછળ ક્રીયો પણ એ મહાપુરુષના પરિણામ લગ્ન કરી શક્યો નહિ. એના સર્વ પ્રયત્નો બ્યર્થ ગયા. “ અરે છ-છ માસપર્યંત દેવલોકના અનુપમ સુખ છોડી આ મહાપુરુષને ભાઈ કરવા એની પાછળ ભર્યો, પણ એ મહાપુરુષ જરાપણ ક્ષેત્ર પામ્યા નહિ ને હજુ હું લાંબા સમયપર્યંત ઉપરન કરું છતાં એ અચીત પોતાના ક્ષાનથી અલિત થશે નહિ. પર્વતને તોડવામાં હાથી નેમ નિષ્કળ થાય તેમ મારા બધા પ્રયત્નો આમને વિષે નિષ્કળ થયા. ” તે પણી મનમાં લબ્જન પામતો, પ્રતિજ્ઞાભાઈ થયેલો તે સંગમ સુર મલિન સુચે એલયો: “ હે મહાતમજ ! શકેદે સુધર્મા સભામાં સમસ્ત દેવો આગળ જેવી તમારી પ્રશંસા કરી હતી તેવા જ અદ્વિતીય શક્તિવાળા તમે છો. તેમના વચ્ચન ઉપર શક્તા નહિ કરીને મેં તમને ઉપરન કર્યા તે માટે હે ક્ષમાનિધાન ! મારા અપરાધ ક્ષમાં કરો. તમે સત્ય પ્રતિજ્ઞાવાળા છો. હું ભાઈપ્રતિજ્ઞ છું. મેં આપની કહર્થના કરી તે સારું કર્યું નથી. આપને ઉપરસર્જ કરવા છોડી દઈ હું હવે સર્વદોકમાં જાઉં છું. તમે સુખપૂર્વક આહાર-પાણી અહંક કરો. છ-છ માસપર્યંત આપને શુદ્ધ આહાર

પાણી ન મળ્યાં તે મારી જ શક્તિનો પ્રભાવ હતો. હવેથી આપ લિક્ષા માટે નગરમાં જાઓ અને નિર્દેખ એવી લિક્ષાને શહણુ કરો. ”

એ મહાપુરુષને પ્રણામ કરી સંગમ મલિન સુધે પદ્ધાતાપ કરતો ઈશ્વરી તરફ ચાહ્યો. નિરાશ થઈ એને જતો જોઈ એ મહાપુરુષની આંખમાંથી હ્યાનાં આંસુ પડ્યાં. આટઆટલી વિડાના કરનારા તરફ પણ એ લોકોત્તર પુરુષની હ્યાસરી જ વૃષ્ટિ હતી. “ અરે ગરિબ બિચારો ! છ-છ માસપર્યંત આણે મારી સેવા કરી છતાં મારાથી એને તો કાંઈ લાલ પ્રાસ ન થયો. ”

પણ આટલો બધો વળત આહોં સુધમ્હી સભામાં શું ? છ-છ માસપર્યંત આ મહાપુરુષની થતી કદથેના શકેદ ચોતાની સભામાં એરી જ્ઞાનથી જ્ઞાયા કરતા હતા પણ શું કરી શકે ? એ દેવલોકના ગાન, તાન, સંગીત, અંગરાગ અધું નરમ પડો ગયું. ઈશ્વરસહિત દેવતાઓ મનમાં ઐદ ધારણ કરતા સમય પસાર કરવા લાગ્યા. શકેદ તો ભારે ગમ-ગીન થઈ ગયા. “ અરે ! આ મહાપુરુષની કદર્થનાતું ભૂળ કારણું હું છું. મેં જયારે એમની પ્રશંસા કરી ત્યારે જ આ અધમ કોપાયમાન થયો. ” શકેદ હુઃએ હુઃએ થઈ ગયા. જાગવાનનું હુઃએ જોતાં જોતાં એમણે છ માસ શોકમાં જ નિગમન કર્યો.

આપરે છ-છ માસને અંતે ચેલો પ્રતિશાખ્ય, શ્યામ સુખવ હો સંગમ સુધર્મા સલામાં આવી પહોંચ્યો. સંબમને જેઠ ઈંદ્રે અતિરોષાતુર થઈ સર્વે દેવતાઓને કહ્યું: “ અરે ! આ પાપી છે, કર્મચંડાળ છે. એનું સુખપણુ જોવા ચોણ્ય નથી. એણું આ મહાપુરુષને વિંભના પમાડી મારો મોટો અપરાધ કર્યો છે. એને દેવલોકમાંથી બહાર કાઢો. ” એમ કહીને શકેંદ્રે એક લાત મારી, જેથી ઈંદ્રના સુભાટોએ તેને દેવસભામાંથી બહાર કાઢ્યા. સર્વ દેવતાઓ એને તિરસ્કાર કરવા લાગ્યા, દેવતાઓની ઊંઘો હાથના કરકડા મરડી આંકોશ કરવા લાગી, ડેટલાક એનું હાસ્ય કરવા લાગ્યા.

સર્વેના તિરસ્કારને સહુન કરતો તે દેવ પાનક નામના વિમાનમાં એસી ત્યાંથી મેર્ઝપર્વતની ચૂલ્હિકા ઉપર ગયો. એની ઊંઘો પણ ઈંદ્રની આજા પામીને એની પાછળ ગઈ. પોતાનું બાકી રહેલું એક સાગરોપમનું આચુષ્ય ત્યાં જ પૂર્ણ કરી કરેલા અશુભકર્મીનાં ફ્રેલો લોગવવાને અન્યગતિમાં તે ચાલ્યો જશે.

સંગમ અભવિ હોવાથી આ મહાપુરુષનાં દર્શન થવા છતાં પણ એને કંઈ લાભ થયો. નહિ, જેથી જ એ મહાપુરુષની આંખમાંથી અશુભનાં બિંહુએ ટપક્યાં હતાં.



પ્રકરણ ૧૦ મું.

આશારણુના શરણું.

“ અહા ! આ માનવબળમાં મારે સુખની શી કમોના છે ? ધન, દૌલત, આખરું, ધજજત, વૈષણવ, ઠકુરાઈ સર્વ કંઈ આજે મને પ્રાસ થયાં છે. સી, પુત્ર, નેકર, ચાકર, કુદુંબ પરિવારની પણ કયાં ન્યૂનતા છે ? આવા સંસારના સુખોનો ઉપલોગ કરતાં પાણીના પ્રવાહની માઝક લુંઢગી ચાલી ગઈ. ચુબાની ગઈ ને વૃદ્ધાવસ્થાનાં આમંત્રણ પણ આવી ગયા. દીર્ઘકાળપર્યાંત માનવબળનું સુખ લોગુંયું. એ બધે કોનો પ્રભાવ છે ? પૂર્વે કરેલા સુકૃતોનો. પૂર્વે કોઈ મોદું પુષ્ટય કરેલું તેના ફળ તરીકે આ લબમાં સંપૂર્ણ સુખ લોગુંયું; પણ હવે આવતા જીવને માટે શું ? પૂર્વનું પુષ્ટય તો અદાસ થવા આવ્યું, માટે હવે મારે જગૃત થણું જોઈએ. હશુ પણ અવકાશ છે તો સંગાંસંબંધી વગેરેની અનુજ્ઞા મેળવી હું કોઈ મોદું તથ કરું કે જેથી આવતા જીવમાં પણ મને સંપૂર્ણ સુખ મળે.” ઇત્યાદિક વિચાર કરતો એક ગૃહસ્થ પુરુષ પોતાની શાયામાં પદ્ધો પદ્ધો મીટા પ્રભાતના વિચારમાં-ઉડા વિચારમાં ગરક હતો. ત્રણ પ્રહર રાત્રી વહી ગઈ હતી, ચતુર્થ પ્રહર પણ પૂરો થવાની તૈયારીમાં હતો. એવા સ્વમયમાં વિદ્યાર્થીની તળેટીમાં આવેલા ઓલેલ નામના ગામમાં પૂરણ નામે એક સંપૂર્ણ સુખી

ગૃહસ્થને જવિતંયતા યોગે સંસારના સંખ્યૂર્ણ સુખમાં છતાં તેને આવા વિચારો આવ્યા. એટલે પ્રાતઃકાલે પોતાને પરિવાર એકઠો કરી, એમને સમજાવી, અનુજ્ઞા મેળવી, પોતાના પુત્રને પોતાના પદે સ્થાપન કરી પૂરણ નામનો ગૃહસ્થ તાપસી દીક્ષા લઈ તાપસ થઈને ઉત્કૃષ્ટ તપ કરવા લાગ્યો.

પોતે પ્રણામ^૧ જલિનો તાપસ થયો. તેણે બિક્ષા લેવા માટે ચાર પડવાળું કાઢતું પાત્ર અહણુ કર્યું. જ્યારથી તે તાપસ થયો ત્યારથી નિરંતર છુટ્ટ-છુટ્ટની તપસ્યા કરવા લાગ્યો. પારણુને દિવસે તે પેલા પાત્રમાં બિક્ષા અહણુ કરી, પહેલા પડમાં પડેલી બિક્ષા સુસાક્ષરાને આપતો, ધીજા પડમાં પડેલી બિક્ષા ઠાગડા વગેરે પક્ષીઓને આપતો, ત્રીજા પડમાં આવેલી બિક્ષા જલચયર જીવોને આપતો ને ચોથા પડવાળી બિક્ષા રાગદ્વેષરહિત પોતે આતો હતો.

બાર-બાર વર્ષપર્યંત એ પ્રમાણે તપ કરી છેવટે બિલેલ ગામની દીશાન દિશાએ તેણે અણુશણુ અહણુ કર્યું. એક માસનું અણુશણુ પાળી એ પુરણ તાપસ બાળતપથી મૃત્યુ પામી લુબનપતિનિકાયના અસુરકુમારનિકાયની દાદ્દિણ દિશાએ ચમરચંચા નગરીમાં એક સાગરાપમના આચુષ્યવાળો મહાસમર્થ ચમરેંદ્ર થયો. હૃપ્ન થતાંની સાથે અવધિશાનદ્વારા નેત્રથી એણે ધીજાં લુબનો જોવા માંયાં.

૧ સર્વને પ્રણામ કરવા એ જ મુખ્ય ધર્મ છે જેનો એવો તાપસ.

અનુહંમે એણે ઉર્વભાગે દૃષ્ટિ કરો તો સુધર્મપતિને જોયા. એ સૌધર્માવિતંસ નામના વિમાનનાં સુધર્મા સલામાં બેઠેલા શકેંદ્રને જોઈ કોધ કરતો ચમરેંદ્ર બોલ્યો. “ ઓહ ! આ કોણુ હુરતમાહેવ મારા મસ્તક ઉપર પગ રાખીને વિલાસ કરે છે. ”

એના સામાનિક વર્ગેરે દેવતાઓ મસ્તકપર અંજલી જોડીને બોલ્યા. “ સ્વામી ! મહા પરાહુમી અને પ્રચંડ શક્તિવાળા સૌધર્મકટપના એ છાંદ છે. ”

સામાનિક દેવતાઓનાં આ પ્રમાણેનાં વચન સંભળી ચમરેન્દ્ર અધિક કોધ કરતો બોલ્યો. “ અરે ! શું મારા કરતાં તે અધિક શક્તિવાળો છે ? તમે મારી શક્તિને જાણુતા નથી માટે એનાં વખાણુ કરો છો. હું એ સૌધર્મપતિને શિક્ષા કરી મારું બળ તમોને બતાવીશ. ”

“ પ્રભુ ! શામાટે મિથ્યા ગર્વ કરો છો ? અનાહિ-કાળનો આવો નિયમ ચાલ્યો આવે છે. આ ગાઢી ઉપર આપના જેવા કદ્દિક ચમરેન્દ્રો ભૂતકાળમાં થઈ ગયા ને અવિષ્ય કાળમાં થશે. સર્વેની આમ જ વ્યવસ્થા હોય છે. ચમરેન્દ્રો કરતાં શકેન્દ્રો અધિક પરાહુમવાળા અને પ્રચંડ શાસનવાળા છે, છતાં આપને ગળો એ વાત કેમ ઉત્તરતી નથી ? ”

“ અરે ! આ તમે શું બોલો છો ? મારા સેવકો થધ એની પ્રશંસા કરો છો ? તમને એણે લંઘચાંચા તો નથી ને ? ” અસુરપતિ બોલ્યો.

“ હેવેંદ્ર ! એવું કદાપિ અન્યું છે કે બની શકે ? આપનો એ ખાલી જ્યાલ છે. અમે તો ને સત્ય વસ્તુ છે તે જ આપને કહી છે. આપ તેમ છતાં ને શકેન્દ્ર પ્રત્યે વિરોધ કરી તોક્કાન કરશો તો હાંસીને પાત્ર થશો. ” સામાનિક હેવતાઓએ કહ્યું.

“ એ જ તમારી જયંકર ભૂલ છે. સૂર્યનો ઉદ્ઘય થતાં ખળુંઓ ક્યાં સુધી ટકી શકે છે ? કદિ કાગડો હાથીની પીડ ઉપર એસી ગયો એથી કાંઈ મહારથી થઈ શકતો નથી. એ મહોન્મત અત્યારસુધી નિર્વિદ્ધને રદ્ધો પણ હવે મારો કોધ થતાં તે રહી શકશો નહિ સમજ્યા ? ”

“ અરે મહારાજ ! એમનાં તેજ, સૌભાગ્ય, સંપત્તિ, સમૃદ્ધિ અને પરાક્રમ તમારાથી ધણ્ણા અધિક છે. પૂર્વભવના કોઈ અગણિત ઉપાર્જન કરેલા મહાનુષુદ્ધથી સુધમી નામે પ્રથમ દેવતોના તે પતિ થયેલા છે. તમે તમારા પુણ્ય પ્રમાણે અમારા સ્વામી થયા છો. તો એ પુણ્યથી પ્રાપ્ત થયેલા વૈબવોમાં તમારે ધર્મિની નહિં કરવી જોઈએ. તેમ છતાં કદાચ એમની સામે તમે કાંઈ પણું પ્રયત્ન કરશો. તો મેઘની આગળ અધારદની જેમ તમારા જ અધઃ-પતનને માટે થશો; માટે હે હેવેન્દ્ર ! શાંત થાઓ, શાંત થાઓ. અમારાથી થતા વિધવિધ વિનોદો જેઈ વિલાસોમાં-નાટકો જોવોમાં તમારો કાલ નિર્ગમન કરો. ” પ્રધાન હેવતાઓએ સમજ્યવવા પ્રયત્ન કર્યો.

“ નહિ, કહિ નહિ, હું એ અધમ સુરેન્દ્રને હવે સહન કરી શકીશ નહિ. તમે બીતા હો તો તમે અહિયાં જ રહો. હું એકલો એની સાથે ચુદ્ધ કરવા જઈશ. એક નિમેષમાત્રમાં એને જીતી લઈશ. સુર કે અસુરોનો તેકે હું એક જ ધંડ હોવો જોઈએ. એક ભ્યાનમાં એ ખડ્ગા રહી શકે જ નહિ.” કોથથી રક્ત નેત્ર કરતાં પ્રચંડ કાયાધારી ચમરેન્દ્ર વીરહાડ વગાડતો ને હાથથી હાથ આમણતો પોતાના સિંહાસનથી એકદમ ઉલો થઈ ગયો. તરતજ તે પોતાની આચુધશાળામાં ગયો. એક મોટો સુદ્ગળ શહુણ કરી તેને ઉંચો, નીચો, આડો ત્રણ વાર ફેરંયો.

મહાસ્વરૂપવાન અને અતૂલ બળવાળો ચમરેન્દ્ર ચરણુના આધાતથી પૃથ્વીને ફોડતો પોતે એકલો પોતાની રાજધાનીમાંથી સુધર્માપતિને જીતવાને નીકળ્યો. જતા એવા ચમરપતિને અસુરકુમારીએ શૂરવીર ધારીને કામનાથી જેવા લાગી, અન્ય દેવતાએ કૌતુકભરી નજરે જેવા લાગ્યા. સામાજિક દેવતાએએ અજ ધારીને ચમરની ઉપેક્ષા કરી એવો ચમરપતિ ચમરચંચા નગરીમાંથી નીકળ્યો.

અસુરકુમારનિકાયની દશ્શિષ્ટ દિશામાં આવેલી ચમરચંચા નગરનો એ અધિપતિ ચમરેન્દ્ર, ભુજાએના બળથી ગર્વિત થયેલો અને બીજના પરાક્રમને નહિ જાણ્યોતો, હિતકારી સામાજિક દેવતાએની સત્તાહની અવગણુના કરતો શક સાથે ચુદ્ધ કરવાને નીકળ્યો. માર્ગમાં પોતાના પૂર્વના

કોઈ શુલ કર્મવશે એને શુલ વિચાર આવ્યો. “ અરે ! આ મારા સામાજિક દેવતાઓ માર્દ અહિત કરનારા તો નથી, તેમજ એમને અસલ્ય ઘોલવાનું પણ કાંઈ કારણ નથી. માનો કે તેઓ કહે છે તેવી રીતે શક કદાચ મારા કરતાં અધિક બળવાન હોય, તો પછી તેનાથી પરાજ્ય પામેલા મારે કેને શરણું જવું ? કારણ કે કાર્યની ગતિ તો વિષમ હોય છે; માટે એના કરતાં અધિક પરાક્રમીનું શરણ લેધ એની સામે ચુંદ કરવા જાઉં.” એમ વિચારી ચમરપતિએ પોતાના જ્ઞાનરૂપી ચક્ષુથી એવા સમર્થ પુરુષનું અવકોદન કરવા માંડ્યું.

ખરાખર આ જ સમયે પ્રલુબ સંગમસુરના ગમન પછી વિહાર કરતા ને જગતની ભૂમિને પાવન કરતા સુસુમારપુર નામના નગરમાં પધાર્યા હતા. ત્યાં અશોકવાટિકામાં અશોક વૃક્ષની નીચે કાઉસસગ મુદ્રાએ ઉલેલા એ નરશ્રેષ્ઠને ચમરપતિએ જેથા. તરતા ક્ષણુમાત્રમાં તે મહાપુરુષ પાસે આવી, પોતાના હૃથિયાર હુર મૂકી, ત્રણ પ્રદિક્ષણ કરી નર્યો. એમની સ્તુતિ કરી. “ હે બગવન ! હે નરશ્રેષ્ઠ ! આજે તમાર્દ શરણ અંગીકાર કરી મહાહર્જ્ય એવા શકપતિ સાથે ચુંદ કરવા જાઉ છું. હે પુરુષોત્તમ ! તે ગમે તેવો કવચધારી અને બળવાન હશે તો પણ તમારા પ્રભાવથી હું એને ક્ષણુમાત્રમાં જીતી લઈશ ; કારણ કે એ અહુંકારથી મહોનમત થયેલો મારા મસ્તક ઉપર પગ રાખીને રહેલો હોવાથી મારા ચિત્તમાં બહુ પીડા થાય છે. માટે કાં તો હું

નહિ અથવા એ નહિ. આપના પ્રભાવથી મારે વિજય થાઓ ! અથવા એનાથી મને આપનું શરણ થાઓ ! ”

એ પ્રમાણે એ નરશ્રેષ્ઠની સ્તુતિ કરી પોતાનાં આચુધ વગેરે સણ્ણ લિધને ઈશાન દિશામાં આવ્યો. વૈષ્ણવ સમુદ્ધાતથી પોતાનું એક લાખ જોજન પ્રમાણ શરીર રચી તે અધા વિશ્વને ક્ષેત્ર ઉત્પજ્ઞ કરવા લાગ્યો. શ્થામકાંતિવાળું એ મહા પ્રચંડ શરીર જાણે નાંદીશર ક્ષીપને જરૂર અંજનગિરિ હોય તેવું હેખાવા લાગ્યું. એ પ્રચંડ શરીર ખરેખર ભયંકર હતું. એના વક્ષસ્થળથી સૂર્યમંડળ આચ્છાદિત થઈ ગયું. લુણ-ઓના આસ્ક્રોટનથી થહુ, નક્ષત્ર અને તારાઓ ખરી પડવા લાગ્યા. એવા અતિ લાંબા જનુપર્વતની ચૂલ્લિકાના ઝ્વાંભાગને અડતા હોવાથી આચ્યર્ય ઉપજલવતા હતા. અત્યારે કોધથી ધમધમતાં એનાં અધાં અંગોપાંગ જગતને ભયંકર હતાં.

એ ભયંકર શરીરધારી ચમરાસુર અધા અધાંડને હુચ-મચાવતો, વ્યંતરેને બીવરાવતો, જન્યેતિષ્ક દેવોને ત્રાસ ઉત્પજ્ઞ કરતો, સુધર્મપતિ તરફ વેગથી ચાલ્યો. તે ક્ષણું માત્રમાં સૂર્ય-ચંદ્રના મંડળનું ઉત્ત્વંધન કરી શક્કમંડળમાં આવી પહોંચ્યો. આ ભયંકર સ્વરૂપધારી મહામૂર્તિને અકસ્માત વેગથી ખસી આવતી જોઇ કિલિવિષ હેવતાઓ ભયના માચોં બિચારા જંતાધ ગયા, આબિયોગિક દેવતાઓ આ ઉથ રૂપધારી ભૂર્તિને જોઇ ડરથી નાશકાગ કરવા.

લાગ્યા, શક્કપતિનું સૈન્ય અને સેનાપતિઓ તો એને જોઈ પલાયન કરી ગયા, સેબ, યમ, વડણું, કુમેર આહિ હિંગપાળો પણ નાશભાગ કરતા સંતાવાની જગ્યા શોધવા લાગ્યા. શકેશના આત્મરક્ષક દેવતાએ કે છીદ્રાર દેવતાએ કેાઈ પણ આ અસુરના વેગને અટકાવી શક્યા નહિ. એને જોતાં જ બિચારા લયના માર્યાં ડઘાઈ જ ગયા. ખીંજ ત્રાયસ્કંશત દેવતાએ “ અરે આ ડાણું ? અહીં કેમ આવ્યો ? ” એમ બોલતા ચમરપતિને જોઈ વિસ્તમય પામી ગયા—આશ્ર્યમાં, સ્થંભાઈ ગયા. ઈદ્રની સમાન ઔથર્ય શક્તિવાળા ઈદ્રના સામાજિક દેવતાએ આ લયંકર મૂર્તિને જોઈ આયુધે સંભાળવા લાગ્યા. એને જવાબ આપવાને, એનો ગર્વ ઉત્તરવાને તૈયાર થઈ ગયા. એ સામાજિક દેવતાએએ હોપથી જોયેલો ચમરપતિ વેગથી સુધર્મા સભામાં ધર્સી આવી એક પગ પૃથ્વી-વેદિકા ઉપર સ્થાપન કરી ખીંલે ચરણ સુધર્મા સભામાં મુક્યો. પોતાના સુદ્ગાર નામના આયુધવડે ઈદ્રકીલને ત્રણ વાર તાડણ કરી લયંકર ભ્રગુઠી ચડાવી કોધથી ધમધમતો ચમર ણોલ્યો. “ હે ઈદ્ર ! આવા ઝુશામતીયા દેવતાએની સોખતમાં પડી મારી શક્તિને નહિ જાણુતો અધારિ તું મારા માથા ઉપર ચરણ રાખી રહ્યો છે; પણ હવે હું તને મારાથી પણ નીચો પાડી ફિશ-તારો ગર્વ બધ્યો ઉતારી ફિશ. ”

નેમણે પ્રથમ કોઈવાર આવું કઠોર વચ્ચન સાંભળ્યું

નહોઠું, એવા શકેદ્રે શીકારીની હાક જેમ કેશરીસિંહ સાંખ્યે
તેમ સાંખળી હુદ્ધા. “ અરે તું કોણ ? ” વિસમય પાખ્યા.

“ હું કોણ ? શું મને નથી ઓળખતો ? ભારા બાહું-
અળથી હમણું જ તને ઓળખાણું આપું છું. આ ચમરચંચા
નગરીના સ્વામી ચમરપતિ, વિશ્વને વિષે અસદ્ધ પરાક્રમ-
વાળા મને તું કૃયાંથી જાણે ? પર્વત ઉપર કાગડાની જેમ
તું અહિં ધણા કાળથી રહ્યો છે. આવા માખણીયાઓથી
તું લોળવાઈ ગયો છે પણ જે હવે કે તારા શું હાલ
થાય છે. ? ” ચમરપતિએ ભયંકર પરિધ આખું હંડના
ઉપર ઉગામ્યું.

શાનદાપ નેત્રથી આ ચમરેંદ્રને જાણી કોધથી ધમધમતા
શક યોદ્ધા. “ અરે ચમર ! તું નાસી જા ! નાસી જા !
મૂર્ખી આ તને શું સુઅયું ? ચાલીચલાવી કાળના સુખમાં
પડવા આવ્યો ? હજુ તો હમણું જ ઉત્પજ થયો છે, દેવ-
તાનાં સુખ લોગવી એટલામાં શું તું કંટાળી ગયો ? તો કે
તારી ઉદ્ઘતાઇનો બદ્દલો ! ” સોહમપતિએ તરતજ બ્રગુણી
ચડાવી વજ હાથમાં લીધું. એ સોહમપતિની કોધથી ધમ-
ધમતી ભયંકર આકૃતિ, અગ્નિની જ્વાળાએ પ્રગટાવતું
એ વજ જોતાં જ ચમર ઉધાધ ગયો. પ્રલયકાળના અગ્નિ
સમું એ વજ શકે ચમર ઉપર છોડયું.

સમસ્ત દેવતાઓને ત્રાસ ઉત્પજ કરતું વજ પેલા
ચમરપતિ તરફ દોડયું. એ વજને જોવાને પણ અસમર્થે

અમરાસુર તડતડ શાણ કરતું, અગિન વરસાવતું વજને આવતું જોતાં જ ભયથી બ્યાંકુલ થયેલો અધોમુખવાતો થઈ ગયો, અને તત્કાલ ચિત્રથી ચમરીમૃગ ભાગે તેમ ત્યાંથી પલાયન કરવાને પાછો કુરતો એ મહાપુરુષને શરણું આવવાની હિચ્છાથી ત્યાંથી ભાગ્યો. અને ભયથી ભાગતો જેઈ દેવતાઓ એનું ઉપહાસ્ય કરવા લાગ્યા.

મહાપ્રચંડ દેહ ધારણું કરીને આવ્યો હતો પણ નાસતા સમયે લઘુદેહ ધારણું કરી ત્વરાથી નાસવા લાગ્યો. વજ એની પાછળ પણ્યું, આગળ ભયથી નાસભાગ કરતા ચમરની પાછળ વજ અગિનના તણુખા ઐરવતું ચમરને પકડવાને ધસ્યું.

વજ છોઝ્યા પછી સોહમપતિને એકદમ વિચાર થયો. “કોઈપણ અસુરની અહીં સુધી આવવાની પોતાની શક્તિ નથી, છતાં આ અસુર અહીં સુધી આવ્યો તેથી કદાચ કોઈ કોઈ સમર્થ પુરુષનું શરણ લઈને આવ્યો હશે.” ઈંદ્ર અવધિસાનરૂપી નેત્રથી જોયું તો જણાયું કે “ચમર આ મહાપુરુષનું શરણ લઈને આવ્યો હશે ને પાછો એમને જ શરણું ગયો છે. અરે ! હું માર્યો ગયો. અચિત માર્દ વજ એ મહાપુરુષને અડચણું કરશે.” તરતજ ઈંદ્ર વેગથી વજને પકડવાને વજને માર્ગે ધસ્યો. આકાશમાંથી એક થીજને પકડવાને વેગથી અધોભાગે ચાંદ્યા. આગળ ચમરેંદ્ર, તેને પકડવાને પાછળ પડેલું વજ, અને તેને પકડવાને વેગથી ધસ્યો આવતો સોહમપતિ !

વજ જેવું ચમરેંદ્રની સમીપમાં આવી પહોંચ્યું અને જેવું તેના ઉપર ધા કરવા જાય છે તેવામાં તો ચમરપતિ કુંશું આ-
તું શરીર ધારણુ કરી પેલા મહાપુરુષના એ ચરણુની વચમાં
ભરાઈ ગયો. વજ એ મહાપુરુષના ચરણથી ચાર તસુ છેદું
રહ્યું એટલામાં સર્પને વાહી પકડે તેમ ઈંદ્રે તે વજને સુધિથી
પકડી લીધું. એ મહાપુરુષને ત્રણ પ્રદક્ષિણ્ણા દઈ વંદન કરી
સ્તુતિ કરી. “હે સ્વામી ! આ ઉદ્ઘત ચમરેંદ્ર આપના પ્ર-
ભાવથી મારો પરાલવ કરવા હેવલોએ સુધી આવ્યો હતો, તે
મારા જાણુવામાં નહોતું, જેથી મેં એની પાછળ વજ છોડ્યું
એ મારો અપરાધ હે મહાપુરુષ ક્ષમનો.” એમ કહી ઈશાન
હિશાએ જઈ પોતાનો રૈખ ઉત્તારવાને વામચરણ ત્રણ વાર
ભૂમિ ઉપર પછાડ્યો.

તે પછી ચમર પાસે આવી શર્કેંદ્ર એલયો: “હે
ચમર ! તું આ કંગવંતના શરણે આવ્યો તે બહુ સાર્ડં કર્યું”,
અને તેથી વેર તળુને મેં તને છોડી દીધો છે. હવે તું
ખુશીથી પાછો તારી ચમરચંચા નગરીમાં જઈ તારી
સમૃદ્ધિને લોગવ. ” ચમરને આખિયાસન આપી, એ મહા-
પુરુષને નમન-વંદન કરી ઈંદ્ર પોતાને સ્થાનકે ગયા.

સૂર્યાસ્ત થતાં જેમ ધુવડ પોતાની શુક્કામાંથી બહાર
નીકળે તેમ ચમરેંદ્ર તે મહાપુરુષના એ ચરણમાંથી બહાર
નીકળ્યો, અને એ નરશ્રેષ્ઠને નમી એમની સ્તુતિ કરવા

લાગ્યો “હે લગભગ ! તમારું શરણુ પ્રાણુઓને કેવું અમોદ સુખ આપનારું છે, એ તો પ્રત્યક્ષ અનુભવ થાય ત્યારે જ સમજાય છે. અચીત તમે અશરણુના શરણુ છો. જગતમાં તો કષાગોથી ભરેલા સર્મર્થ પુરુષો પણ નિરાધાર છે. એ નિરાધારના તમે આધાર છો. તમારે શરણુ આવતાં આ સંસારથી સુકૃત થવાય તો પછી આવાં તુચ્છ ફળને તે શું હિસાબ છે ? હે સ્વામી ! પૂર્વે અજ્ઞાનતાથી મેં આગતપણ કર્યું હતું, તેથી જ આ અજ્ઞાનતાર્થી અસુરેંદ્રપણાતું ફળ મને મળ્યું; અને એ અજ્ઞાનતાથી જ આવો અનર્થકારી પ્રયત્ન મેં આદર્થી હતો કે જેથી મને પોતાને જ એમાં ગેરલાભ થયો ને આપને શરણે આવ્યો. તો જ સલામત રહ્યો. ને પૂર્વે ભવે જ તમારું શરણુ અંગીકાર કરીને તપ, જપ, ધ્યાન વગેરે હિયાએ કરી હોત તો અચ્છુતેંદ્ર કે અહમિંદ્ર-પણુની સમૃદ્ધિ મને મળી હોત, અથવા તો આપના શરણુથી મોક્ષની અનંત લક્ષમી મળે છે તો આ ઋદ્ધિ તે કોણું માત્ર છે ? ” એ મહાપુરુષની ભક્તિપૂર્વક સ્તવના કરી, નમી અસુરેંદ્ર પોતાની રાજ્યાની ચમરચંચા નગરીમાં આવ્યો. પરાજ્યવડે લજ્જાથી અધોમુખવાળો ચમરેંદ્ર સિંહાસન ઉપર એકો, પણ અત્યારે એનામાં ઉત્સાહ નહોતો, હર્ષ નહોતો, પૂર્વનાં એ તેજ, ગૌરવ, પ્રભા સર્વે કંઈ અત્યારે હરાઈ ગયાં હતાં.

એના સામાજિક ઢેવતાએ ચમરેંદ્રનું સ્વાગત

પુછવાને આંયા. “હે સ્વામી ! અમે તમને સત્ય વાત કહી હતી પણ તમારા ધ્યાનમાં આવી નહિ.”

તેમના જવાબમાં અમરપતિ યોવ્યો : “ અરે હેવો ! તમે મદ્દયસ્થપણે શકેંદ્રને જેવો વર્ષાંયો હતો તેવો જ તે છે, પણ અશતાથી એ વાત મારા સમજવામાં આવી નહિ. હું એની સભામાં જેવો ગયો કે તરતજ ફોખથી ઈંદ્રે મારી ઉપર વજ છોડી દીધું. એનાથી ભય પામી આજે મૃત્યુદોકની ભૂમિને પાવન કરી રહેલા ત્રણે જગતને પૂજવા યોગ્ય ભગવંતને શરણે ગયો, તો જ હું જીવતો રહ્યો, ને ઈંદ્રે મને છોડી દીધેણ જેથી હું અહિ આંયો છું. તો ચાલો ! આપણે અધા એ મહાપુરુષ આગળ ભક્તિથી સંગીત કરી વંદી નમસ્કાર કરીએ. આપણો હર્ષ, આનંદ પ્રગટપણે વ્યક્ત કરીએ.”

તે પછી ચમરેંદ્ર પોતાના પરિવાર સહિત એ મહા-
પુરુષને વંદન કરવાને આંયો. ભક્તિથી ભગવાનને વાંદી
એમની આગળ સંગીત કરવા માંડયું. ચમર ભગવંત આગળ
પોતાની મહાભક્તિ વ્યક્ત કરી સંગીત કરી પરિવાર સહિત
પોતાની નગરી તરફ ચાલ્યો ગયો.



પ્રકરણ ૧૧ મું.

કોશાંધીમાં.

વિહાર કરતા કરતા એ મહાપુરુષ કૌશાંધી નગરોમાં આવ્યા ત્યાં એમણે એવો અભિયાન ધારણું કર્યો કે “કોશાંધી સતી અને સુંદર રાજકુમારી છતાં હાસીપણું ને પામેલી હોય, તેના પગમાં લોધાની એડી પડી હોય, માથું સુંદળ કરાવેલું હોય, ત્રણ દિવસના ઉપવાસવાળી હોય, એક પગ ઉમરાની બહાર અને બીજે પગ અંદર રાખીને ઉલ્લિ હોય, રડતી હોય, આંખમાં અશ્વ હોય એવી સ્થિતિમાં તે રાજકુમારી મને જો અડદ વહોરાવે તો મારે પારણું કરવું; અન્યથા ત્યાં સુધી મારે ઉપવાસ છે.” આવો કઠળું અભિયાન લઈને એ મહાપુરુષ પ્રતિદિવસ ભિક્ષા સમયે ભિક્ષાને માટે નગરમાં ઉચ્ચનીય ગૃહે કરતા, પરંતુ આવો હુંકર અભિયાન હોવાથી લોકો અનેક પ્રકારનાં ઉત્તમ લોજન આ મહાપુરુષને વહોરાવતા પણ તે લીધા વગર જ તે પાછા કરતા હતા.

પ્રતિદિવસ આ પ્રમાણે થતું હોવાથી લોકો પોતાના આત્માની નિંદા કરવા લાગ્યા. “અરે આ મહાપુરુષ શામાટે ભિક્ષા લેતા નથી? આપણું દિવસમાં કેટલીવાર કુલ્લિબારિ કરીએ છીએ ત્યારે આ મહાત્મા ભિક્ષા વગર, અત્રપાણી વગર તાઠ-તાપ સહન કરતા દિવસો નિર્ગમન કરે છે.” પ્રતિદિવસ ભિક્ષા વગર આ મહાત્માને જોઇ નગરના લોકોને

અહુ જ એહ થયો. “અરેખર શું ભાવી નિર્માણ થયું હશે ? કંઈ સમજાતું નથી.”

આ જ પ્રમાણે બિક્ષા માટે નગરમાં કરતાં કરતાં એ મહાત્માને એમજ ચાર માસનાં જ્હાણાં વહી ગયાં છતાં પણ ભાવીશ પરીષહ સહન કરતા અને એલાનપણે તે નગરમાં બિક્ષાને માટે હમેશાં કરતા હતા. એક દિવસ એ નરક્ષેપ ગોચરને માટે કરતાં રાજના સુગુમ નામના મંત્રીને ગૃહે ગયા. આ મહાનુ પુરુષને પોતાતું ગરીબ આંગણ પાવન કરતાં જેઠ મહા અમાત્યની નંદા નામની પત્ની પરમ સુર્ખીલ. અને શુણુવતી હતી તે એકદમ હર્ષથી ખડાર દોડી આવી. “ભગવન્ ! પધારો ! પધારો ! મારું રંકતું આંગણ પાવન કરો ! નિર્દેખ બિક્ષા આપ પૂજય થણુણુ કરો !” વિનયથી ભક્તિયુક્ત વચ્ચેનો બોલતી નંદા ભગવાનને ઉત્તમ પદાર્થી વહોરાવવા લાગી; પણ ભગવાનને અભિગ્રહ ડોવાથી કંઈ પણ લીધા વગર ત્યાંથી પાછા કર્યો.

બિક્ષા લીધા વગર આ નરક્ષેપ ચાલ્યા ગયા જાહી નંદા આનંદ રહ્યાત મંદ હૃદયવાળી થઈ ગઈ. એને પારાવાર એહ થયો. “અરે હું અભાગણી છું. મને ધિક્કાર છે ! ભગવાન મારે ઘેરથી પાછા કર્યો. હા ! મારા કયા પાપ ઉદ્ય આવ્યા કે જેથી મારો મનોરથ આજે પૂર્ણ થયો નહિ !” વલોપાત કરતી નંદા રડી પડી. એની આંખમાંથી અશ્વાશો રપકવા લાગ્યા.

નંદાને પારાવાર એહ કરતી જેઠ તેની દાસી બોલી:

“ બાઈ સાહેબ ! શા માટે એહ કરો છો ? આ હેવચિં આજે જ આવી રીતે ચાલ્યા ગયા છે એમ નથી; પરંતુ દરરોજ તે નગરમાં બિક્ષાને માટે કૂરે છે ખરા પણ એવી રીતે બિક્ષા લીધા વગર જ દરેક ઠેકાણેથી ચાલ્યા જાય છે.”

દાસીનાં વચન સાંભળી અશ્રપૂર્ણ નેત્રવાળી નંદા દાસીની સામે જોઈ રહી. “ શા માટે અગવાન બિક્ષા નહિ હેતા હોય ? એમણે કઈક પણ અભિશ્રહ ધારણ કરેલો હશે; અન્યથા બીજું તો એ મહાપુરુષને શું કારણ હોય ? ” નંદા બોલી.

“ ગમે તે કારણ હોય, પણ આજ લગભગ ચાર-ચાર માસ થયાં હું એ મહાપુરુષને આવી જ રીતે આહાર-પાણી વગરના જોઉં છું.” દાસી નંદાના જવાબમાં બોલી.

“ ચાર-ચાર માસ આહારપાણી વગર ! ઓય મા ! ” નંદા અત્યંત શોંક કરતી રહી પડી. એ શોંકસાગરમાં મચ થયેલી નંદાને બહુ સમય થયો નહિ એટલામાં સુગુમ મંત્રી ગૃહે રાજકાર્યથી પરવારીને આવી પહોંચ્યો. શોંકમાં નિમગ્ન થયેલી પોતાની પતનીને જોઈ પ્રધાન આવ્યો.

“ પ્રયે ! આજ કેમ ઉદ્ધિમ ચિત્તવાળી હેખાય છે ? શુ મારો કંઈ અપરાધ થયો છે ? અથવા તો કોઈએ તારી આજા ઉત્થાપી છે ? જે હોય તે કહે. તારી ઉદાસીનતાનું કારણ શું છે ? ”

“ સ્વામી ! કોઈએ મારી આજા વિરાધી નથી તેમજ તમારો પણ અપરાધ થયો નથી; પણ આજે આપણે ઘેર ભગવાન પદ્ધાર્યો એમને હું પારણું કરાવી શકી નહિ તેથી મને એહ થાય છે.” નંદાએ ચોતાના શ્રોકનું કારણું પતિ આગળ વ્યક્ત કર્યું. એ અરસામાં પદ્મરાણીની વિજયા નામની છડીદાર સીતાં આવી હતી તે આ વાર્તાલાપ સાંબળવા લાગી.

“ પણ હેવી ! એમ બનવાનું કારણ ? શા માટે એ ભગવાને આપણે ઘેરથી બિક્ષા અહણું ન કરી ? શું આહાર-પાણીની જોગવાઈ નહોંતી કે બીજું કાંઈ કારણું હતું ? ”
સુગુમ મંત્રીએ પત્નીને પૂછ્યું.

“ આજે આમ બનન્યું છે એમ નથી કાંઈ. એ મહાપુરુષ ચાર-ચાર માસ થયાં આપણી નગરીમાં બિક્ષાને સમયે આહારને માટે કરે છે, પણ લીધા વગર ચાલ્યા જાય છે. કોઈ પણ પ્રકારને! એમને અપૂર્વ અભિયહુ હોવો જોઈએ કે ચાર-ચાર માસ વહી ગયા છતાં એ અભિયહુ પૂર્ણ થતો નથી. ચાર-ચાર માસ થયાં એ મહાપુરુષ અજ્ઞપાણી વગર ને આપણે દિ ઉંધે કેઢા સુધી ઠાંસ્યા કરીએ ! હા ! કહેશો જરી આ વાત સાંભળી કોને એહ ન થાય ! ” નંદાએ પતિને કહ્યું.

“ ચાર-ચાર માસ થયા બિક્ષા વગર એ મહાપુરુષ રહ્યા છે ને હું તો કાંઈ જાણુતો નથી. તેં આજે છલ્યું તે ટીક જ કર્યું.”

“ હે મહામંત્રી ! તમે કોઈ પણ રીતે એમનો અભિયાન ન જાણી શકો તો બીજાના ચિત્તને ઓળખનારી તમારી અછિ શું કામની છે ? કોઈ પણ રીતે એ મહાપુરુષનો અભિયાન પૂર્ણ થાય, આપણા મનોરથ સકૃદળ થાય. ”

“ પ્રિયા ! એમનો અભિયાન જેવી રીતે જણુંયો તે પ્રથારે જાણવાને હું પ્રાતઃકાળથી પ્રયત્ન કરીશ. તું નિશ્ચિંત રહે. ” પ્રધાન સુણુંયે પત્નીને દિલાસો આપ્યો.

કાશબીપતિ શતાનિક રાજાની પદૃરાણી મૃગાવતીને અને નંદાને સર્ભીપણું ડાવાથી આ સમયે પદૃરાણીએ કાર્યપ્રસંગે વિજ્યાને નંદા પાસે મોકલેલી. તે વિજ્યા મંત્રી અને મંત્રી-પત્નીની ઉપર પ્રમાણેની વાતચીત સંભળી પોતાનું કાર્ય કરી પોતાની બાધ પાસે ચાલી ગઈ, અને આ પતિ-પત્નીને સંવાદ પોતાની શોઠાણીને કહી સંભળાડ્યો.

વિજ્યાના સુખથી આ વાત સંભળી પદૃરાણી મૃગાવતી બહુ જ હુંઘી થઈ. એ નરેશર પ્રત્યે અકિલવાળી આ મહિષી એમનો અભિયાન પૂર્ણ કરવાની ઉત્કંઠાવાળી થઈ ગઈ. શોકથી વિહુકળ થયેલી પદૃરાણીને રાજાએ શોકતું કારણ પૂછ્યું. તેના જવાણમાં મૃગાવતી ભાલી. “અરે સ્વામી ! તમારા જેવા રાજહુષ્ધ પુરુષોને કહેવાથી શું ? રાજાએ તો હૃતકારા ચરાચર અધા જગતને જાણી શકે છે ત્યારે તમે તો આપણા શહેરમાં શું અને છે તેની વાત પણ જણુતા નથી. ”

“ અરે ! એવું તે શું બન્યું છે તે જરા સ્પષ્ટતાથી કહે. ” રાજએ આતુરતાથી પૂછ્યું.

“ હેવેંદ્રો અને મનુષ્યો જેની સેવા કરે છે એવા ભગવાન આપણા શહેરમાં પધાર્યો છે તે તમે જાણ્યો છો ? તેઓ કોઈ પણ પ્રકારના અભિયંત્રથી ભિક્ષાને માટે કરે છે પણ વગર ભિક્ષાએ તે પાછા ચાલ્યા જાય છે. આજ ચાર-ચાર માસ થયાં એ મહાપુરુષની આ સ્થિતિ છે, તેની તમને શું ખખર હોય ? ” કંઈક રેખથી મૃગાવતી બોલી.

“ હેવી ! મને એ સંબંધી કંઈ ખખર નથી. તેં મને ચેતન્યો એ ઠીક કર્યું. હવે હું એ માટે કંઈક ઉપાય કરીશ. ” રાજએ રાણીને દિવસો આપ્યો.

“ તમને કૃયાંથી ખખર હોય ? રાજ્યસુખમાં પ્રમાણી થયેલા હે સ્વામી ! તમને, મને અને આપણા અમાત્યને ધિક્કાર છે કે જેમના નગરમાં આટલા આટલા દિવસો સુધી ભગવાન ભિક્ષા વગર રહ્યા છે. ”

“ હે ધર્માચતુરે ! વૃથા શોક ન કરો ! એ ભગવંતનો કોઈ પણ પ્રકારે અભિયંત્ર જાણી પ્રાતઃકાળે હું તેમને પારણું કરાવીશ. ” રાજએ કહ્યું.

પ્રાતઃકાળે રાજએ મંત્રીને બોલાવ્યો ને તેને બધી વાત કહી સંભળાવી. “ હે મંત્રી ! ચાર-ચાર માસ થયાં મારી નગરીમાં આ મહાપુરુષ આંહારપાણી વગર રહે તે

ઠીક નહિ, માટે ગમે તે રીતે તેમનો અભિયંત્ર તમારે જાણ્યું હેવો કે જેથી હું તેમને અભિજાથી પારણું કરાલું. ”

“ મહારાજ ! એમના મનમાં ધારણું કરેલો અસુક વિશિષ્ટ પ્રકારનો અભિયંત્ર જાણ્યું શકાતો નથી તેથી મને પણ જેહ થાય છે; છતાં એને માટે કંઈક ઉપાય તો કરવો જોઈએ.”

“ શું ઉપાય કરવો જોઈએ તે કહો ત્યારે ? ”
રાજાએ પૂછ્યું.

“ તે માટે ધર્મશાસ્કના જાણુનાર પંડિતોને જોવાવો,
શાસ્કોમાં અભિયંત્રાનું જે વર્ણન લગેલું હુશે તે તેમનાથી
આપણું જણાયો. ”

પ્રધાનનું વચન સાંખળી રાજાએ તરતજ તથ્યકંઈ
નામના ઉપાધ્યાયને જોવાઓ. “ હે મહામતો ! તમારા શાસ્ક-
માં સર્વ ધર્મના આચારો કહેલા છે તો આપણા નગરમાં
આવેલા આ મહાપુરુષને કૃયો અભિયંત્ર હુશે તે કહો ? ”
રાજાએ ધર્મશાસ્કમાં વિચક્ષણ એ ઉપાધ્યાયને પૂછ્યું.

“ હે રાજજ ! મહુવિંઘ્નાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને
કાવથી અભિયંત્ર ધર્યા પ્રકારના હોય છે. આ મહાત્માને
કયા પ્રકારનો અભિયંત્ર હુશે એ તો વિશેષ શાન વગર
જાણ્યી શકાય નહિ. ”

રાજાએ ઉપાધ્યાયને શીખ આખ્યા પછી મંત્રી સાથે

મંત્રણું કરીને નગરમાં આદ્યોપણું કરાવી કે “ અભિગ્રહને ધારણું કરનાર આ મહાપુરુષને લોકોએ અનેક પ્રકારે બિક્ષા આપવી. ”

રાજની આ ઉદ્ઘોષણાથી લોકોએ તેમ કર્યું તે પણ અભિગ્રહ પ્રમાણે નહિ થવાથી એ કાગવાને બિક્ષા અહણું કરી નહિ. આ પ્રમાણે લિક્ષા રહેત રહેવા છતાં વિશુર્દ્ધ ધ્યાનવાળા લગવનું અમ્લાન સુએ રહેતા હતા ત્યારે લોકો લજના અને એહથી આકૃગંધાકૃળ થઈ, દિવસેદિવસે વિશેષ એહણુંકર અની આ મહાપુરુષને જોતા હતા.

એ અરસામાં કૌશંધીપતિએ ચંપા નગરીને ઘેરી લીધી. ત્યાંનો રાજ દધિવાહન સયથી આકૃગંધાકૃળ થઈને નારી ગયો. કૌશંધીપતિ શતાનિક રાજએ ચંપાનગરી કુંટાવી હીધી. એની સેનાને પોતાપોતાને જે ગમ્યું તે મેળવીને કૌશંધી પાછા ઇર્યા. એક ઉંટવાળાના હાથમાં રાજની પદુરાણી ધારણીદેવી અને તેની વસુમતી રાજપુત્રી સપડાઈ ગયાં. ધારણીદેવીના સૌર્દર્યથી દિવાના થયેલા તે ઉંટવાળાએ ધારણીદેવીને પોતાની પત્ની થવાને કર્યું. તેના જવાણમાં એ એક પતિવાળી-પતિપ્રતા ધારણીદેવી લુલ કરી મૃત્યુ પામી ગઈ.

તેણુંને મૃત્યુ પામેલી જ્ઞેર્ય ઉઠવાળો ગભરાયો ને પશ્ચાત્તાપ કરવા લાગ્યો. “ રખેને એની છોકરી પણ મારા

કઠોર વચનથી મૂત્યુ પામે. ” એમ વિચારી મીડાં વચનથી ભોલાવતો તે તેણીને કાશાંખી નગરી લાવ્યો.

આ સુંદર ભાલાને જેઠ પેલા ઉંટવાળાની સ્વી ભડકી. “ રેણે આ સુઅએ આને પોતાની સ્વી બનાવે ! ” તેણીએ તાહુકીને કહ્યું “ સુઅા ! તું આને હાલ ને હાલ બજરમાં વેચી આવ ; નહિંતર હું રાજને ફર્યાદ કરવા જાઉં છું. ”

ભયથી વ્યાકુળ થયેલો ઉંટવાળો વસુમતીને બજરમાં વેચવા માટે ઉપાડી લાવ્યો. એ અરસામાં ધનાવહ નામનો શાહુકાર ત્યાં આવી ચહ્યો. વસુમતી ઉપર તેની નજર પડતાં મનમાં અસુક નિશ્ચય કરી બહુ મૂલ્ય આપીને તેને પોતાને વેર લઈ ગયો.

પોતાને વેર તેડી લાવી ધનાવહ શેઠે તે ભાળાને પૂછ્યું. “ વત્સે ! તું કેની આળા છે ? તારા કુટુંબીએ ડોણ છે ? તેમનાથી તું કેમ વિખુટી પડી ? તે બધું લય પામ્યા વગર કહે. તું મારી પુત્રી જ છે એમ જાણુનો. ”

ધનાવહ શ્રેષ્ઠીનાં વચન સંભળી વસુમતી શું જવાબ આપે ? પોતાના કુલની મહત્ત્વા આવે સમયે કહેવી તેને ટીક ન લાગવાથી આળા મૌન રહી. અધ્યાતુએ ભૂમિ પોતરવા લાગી.

શ્રેષ્ઠીએ પોતાની સ્વી મૂળાને કહ્યું. “ આ આપણી પુત્રી છે માટે યત્નથી એતું પાલન કરવું. ” પોતાના સર્વ માણુસોને એ આજા સંભળાવી દીધી. આળા વસુમતી પોતાના ધરની

માઝેક ત્યાં રહેતી સર્વને પ્રિય થઈ પડી. શ્રેષ્ઠોએ બાળાનું ચંદના એવું નામ રાજ્યું.

મનોહર ચંદનાને જેઈ શેઠાણી મૂળાની દાનત બગડી. “ શેઠ આ છોકરીને પુત્રીની પેઢ ગણી છે પણ આના ડૃપથી મોહિત થઈ એની સાથે પરણે તો મારી શ્રી ગતિ થાય ? માટે અવસર મળ્યે આને રસ્તો કરવો જેઈએ.” મૂલાની છિધ્યામાં પ્રતિહિવસ વધારો થતો ગયો. એક દિવસ એવી ઘટના બની ગઈ કે તે જેવાણી મૂળાએ પોતાનો વિચાર તરત જ અમલમાં મૂકી દીધ્યો.

ભારીએ ઉભાં ઉભાં મૂળા શેઠાણીની નજર કર્યાં પડી ? ચંદના અહારથી આવેલ ધનાવહ શેઠના પગ ધોાતી હતી તે સમયે તેનો કેશકલાપ અંગની શિથિલતાથી છૂટો થતાં કાદવમાં પડ્યો, જેને શેઠ લાકડીવતી ઉંચો ધરી રાજ્યો. આ બનાવ જેઈ મૂળાની શંકા દફ થઈ.

શેઠ બહાર ગયા એટલે નાપિતને ખોલાવી ચંદનાનો કેશકલાપ કપાવી નાખ્યો, એના પગમાં બેડી નાખી લતા-પ્રહારથી તાડન કરી રૈખ ઉતારો ને ધરની અંદર એક અંધારા લોંઘરામાં પુરી તાળું લગાવી પોતાના માણસોને સાયત તાકીદ કરી કે “ શેઠને આ વાત કોઈએ કહેવી નહિ તેમ છતાં કોઈ કહેશે તો મારા કોપનો તે લોગનથશે.” એમ કષી તે પોતાને પિયર ચાલી ગઈ.

શેઠ સાંજના વેર આંદ્યા પણી ચંદનાની તપાસ કરી

પણ સમાચાર મળ્યા નહિ. રાતના પણ ખખર ન પડી. એને દિવસે પણ પતો લાગ્યો. નહિ ત્યારે તેમને શંકા તો પડી, પણ એનાં માણુસો મુગાની બાકથી સત્ય વાત કરે નહિ. ત્રણુ-ત્રણુ દિવસ થઈ ગયા ત્યારે શેડે સર્વ માણુસોને બોલાવી સખત તાકીદ કરી. કોધથી શેઠનું ઉચ્ચ સ્વરૂપ થયું ત્યારે એક વૃદ્ધાચે ચંદનાના સમાચાર આપ્યા. જે એરદીમાં બંધ કરી હતી ત્યાં જઈને તે બતાવી.

શેડે કોઈ પ્રકારે તાળું તોડીને મલીન સુખવાળી ને આંખમાં અશુદ્ધાળી ચંદનાને એ અંધારા ગુહમાંથી લંઘાર લાવી પરસાળમાં બેસાડી, ને રસોડામાં આવાનું શોધવા ગયો. હૈવ્યોગે ત્યાં કંઈ લોજન તૈયાર ન હોતું; પણ સુપણાના ખુલ્લામાં થોડા અડદ પડેલા હતા તે ચંદનાને આપતાં કણ્ણું. “હે વત્સ ! તું આ કુદમાષ (અડદ) તું લોજન કર એટલામાં હું તારી બેડી તોડવાને લુહારને બોલાવી લાખું છું.” એમ કણ્ણી શેડે લુહારને તોડવા ગયો.

આપા ચંદના વિચાર કરવા લાગ્યિ: “ઓહો ! કયાં મારો રાજકુળમાં જન્મ અને કયાં બેડીઓ ? કર્મની ગતિ કેવી વિચિત્ર છે કે આજ અફુમ તપને પારણું પણ ખાવામાં અડદ મલ્યા છે ! જે કોઈ અતિથિ આવે તો હું તેને આપીને પણી પારણું કરું.” આપા ચંદના એ પ્રમાણે વિચાર કરતી હતી એ અસામાં બિક્ષાને માટે દૂરતા દૂરતા ભગવાન ત્યાં આવી ચક્કા. એમને જોઈ આપા ચંદનાએ

વિનંતિ કરી. “ ભગવાનું ! આ સોજન આપને ઉચિત તાનથી છતાં મારી ઉપર કૃપા કરીને આપ અહુણું કરો. ” એમ બોલતી બાળા ચંદના ધરના ઉમરમાં એક પગ અંદર ને બીજો બહાર એવી સ્થિતિમાં ઉલ્લી રહી ગઈ; કારણું કે બનને પગમાં એડીઓ હોવાથી તેમજ તણું-તણું હિવસના ઉપવાસહોવાથી એડીવાળા પગે ઉમરો એણંગવાની ઓનામાં તાકાત નહેતી.

બાળા ચંદનાને આવી સ્થિતિમાં લેઇ એ મહાપુરુષે પોતાનો અભિશબ્દ પૂર્ણ થયો છે કે નહિ તે જોયું તો તેની આંખમાં આંસુ નહિ હોવાથી ભગવાન પાછા કુર્ચ્છા. ભગવાનને પાછા કુરૈલા લેઇ પોતાના ભાગ્યને નિંદાતી ચંદના રડવા લાગી. “ અરે ! હું મંદ ભાગ્યવાળી છું કે આવા દ્વારા પુરુષો પણ મારી સામે નજર કરતા નથી. ”

શોક કરતી ચંદના તરફ ભગવાને નજર કરી તો પોતાનો ન્યૂન રહેલો અભિશબ્દ પૂર્ણ થયેલો દીઠો. તરત ભગવાન પાછા કુર્ચ્છા ને એ અડઠની કિસ્થા અહુણું કરી. લગભગ છ માસે આ પ્રમાણે આ મહાપુરુષનો અભિશબ્દ પૂર્ણ થવાથી પંચ દિવિય પ્રકટ થયાં. દેવતાઓ પણ ત્યાં પ્રકટ થયાં. ચંદનાની એડીઓ અંગર (નુખર) બની ગયાં ને ભર્સતકે ડેશકલાપ નવીન પ્રગટ થયો. ડેટલાક દેવતાઓ આકાશમાં સંગિત કરવા લાગ્યા. દેવતાઓનો આનંદ ને ભગવાનનો અભિશબ્દ પૂર્ણ થયેલો જણુવાથી શતાનિક રાજ, રાણી, મંત્રીઓ વિગેરે ભગવાનનાં દર્શન કરવાને હોડી

આવ્યાં. તે વખતે દધિવાહનનો કંચુંકી રાજાએ કેદ કર્યો હતો. તેને છોડી મૂક્યો. તે પણ ભગવાનનાં દર્શિન કરવાને દોડી આવ્યો. ત્યાં વસુમતીને જોતાં રડી પડ્યો. રાજાએ એના રડવાનું કારણું પૃથ્બું: “ અરે લદ ! મેં તેને કેદ-આનામાંથી મુક્તા કર્યો તે માટે તારે ખુશી થવું જોઈએ છતાં રડે છે કેમ ? ”

“ અરે મહારાજ ! હું શું વાત કહું ? અને કેટલી કહું ? આ બાળાને આપ ક્યાંથી જાણો ? ચંપાપતિ દધિવાહન રાજાની આ રાજકુમારી ! કર્મવશો આજે એ અન્યને ત્યાં દાસીપણું પામી છે, એ જાણ્ણી હું રડું છું : ”

એ કંચુકીનાં વચન જાંબળી કૌશાંભીપતિએ કહ્યું: “ લદ ! શા માટે શોષ કરે છે ? આ કુમારીએ તો નણ જગતને પૂજવા ચોગ્ય આ ભગવાનનો અલિંગન આજે પૂર્ણ કર્યો છે. આ બાળા તો મોટી જાગ્યવંતી છે. ”

“ અરે ! ધારણી તો મારી એન થાય, તેની જ આ ફુહિતા વસુમતી ! ” એમ બોલતી મૃગાવતી ચંદ્નાને લેઠી પડી. રાજાએ પોતાની જાણોજ જાણોને પોતાને ઘેર રાખી. ભગવાન પારણું કરી ત્યાંથી અન્યત્ર ચાલ્યા ગયા. ધનાવહ શ્રેષ્ઠી આ બનાવથી પોતાની ચંદ્નાને ધન્યવાદ આપવા લાગ્યો. ને પેલી અનર્થનું મૂળ મૂળાને એણે ધરમાંથી બહાર કાલી મૂડી. ફર્યાનમાં તત્પર એવી મૂળા અનુકૂમે મૃત્યુ પામી નરક ગતિમાં ગઈ.

પ્રકરણ ૧૨ મું.

યુદ્ધ અને તેમનો ધર્મ.

રાજગૃહપતિ ભગવાજ શ્રેણિકને ચેલણા પ્રસુખ અનેક રાણીઓ હતી. કાળે કરીને તેમને અભયકુમાર, મેધ-કુમાર, નંદિષેણ, કોણિક, હલ્લ, વિહુલાદિક ધણા કુમારો થયા. સર્વે રાણીઓમાં ચેલણાને પદૃરાણીપદ આપવામાં આંદું હતું. રાજ શ્રેણિક ચેલણા સાથે વાણીવિનોદ આહિ અનેક પ્રકારનું સુખ લોગવતાં પોતાનો સમય સુખમાં પસાર કરતા હતા. ભગવાજ યુદ્ધના બાક્ત હોવાથી રાજ-ગૃહમાં યુદ્ધના અનેક વિહારો (આશ્રમસ્થાનો) હતા, જેમાં અનેક ઔદ્ધ સાધુઓ આશ્રમસ્થાન પામી લોકોને પોતાના ધર્મમાં આર્કષતા હતા. એધિસત્તવ પ્રાસ કરી ચૂકેલા યુદ્ધ લોકોને ઉપરેશ કરી પોતાના માર્ગમાં આકર્ષી, બાદ નામે નવીન મત હુમણાં કેટલાંક વર્ષથી ચલાંયો હતો. એના ધણ્યાય શિષ્યો અનેક દેશોમાં ફરી લોકોને ઔદ્ધધર્મી બનાવી રહ્યા હતા. તે સિવાય યુદ્ધ પણ ભગવાજ શ્રેણિક વળેરે રાજાઓને પોતાના બાક્ત બનાયા હતા. શ્રેણિક વારંવાર યુદ્ધના સમાગમમાં આવતો હતો. તેના નિર્મોદ્દી, સિદ્ધાંતો પોતાને મનગમતા અને અતુકૂળ હોવાથી રાજ એનો પરમરાગી અની ગયો હતો, જેથી તેણે રાજગૃહી

સિવાય થીને પણ અનેક ડેકાણે ખાડુવિહારો સ્થાપન કરી એને આશ્રમ આપ્યો હતો. તે સિવાય એ ધર્મના અસ્યુદ્ધ માટે બીજુ પણ અનેક સખાવતો કરતો હતો. ખાડુ સાધુ-ઓએ એના મગજમાં ચુક્તિ-પ્રચુક્તિથી એવી તો શર્દી જેસાડી હતી કે વિશેષ પરિશ્રમ વગર એ શર્દી દૂર કરવી અશક્ય હતી. મગધરાજ શ્રેષ્ઠિક પદૃરાણી ચૈલદાણાની આગળ પોતાના બુદ્ધદેવનાં, તેમના સાધુઓના અનેક પ્રકારે વખાણું કરતો હતો. “રાણી પણ બૌદ્ધધર્મમાં જોડાય તો કેવું? જિચારી અજ્ઞાનતાથી સત્યમાર્ગને છોડી અવળે માર્ગ ચડી ગઈ છે. હશે, ધીરે ધીરે એના મગજમાંથી એ શલ્ય હું દૂર કરીશ. એને બુદ્ધ ભગવાનની પરમ શિષ્યા કરીશ.”

૩૦ વરસની ઉમરે સંસાર તલુ સિદ્ધાર્થ સંસારત્યાગી થયો. ત્યાગી થયા પછી તપ કરવા માંડયો. તપ કરીને કંટ્રાળવાથી તેમજ શરીર દુર્ખણ થવાથી એમણે તપ કરવું છોડી દીધું. એક દિવસ એક વૃક્ષની નીચે બેઠેલા તેમને લાગ્યું કે “મારી શંકાઓ નાશ પામી ગઈ છે. મારું ચિત્ત થાંત થયું છે. મને હુને સંખ્યૂર્ણ જીબ થયું છે.” પછી તેમણે લોકોને કાશીનગરીના મૃગવનમાં પ્રથમ ઉપરેશ ઢેવો શરૂ કર્યો. પોતાના નવીન સિદ્ધાંતો જાહેર કરી એ મતમાં લોકોને એંચી પોતાના નવીન મતની સ્થાપના કરી. શરૂઆતમાં સામાન્યવર્ગના લોકોમાં પોતાનો ઉપરેશ શરૂ કર્યો. જેમ જેમ લોકો એ મત તરફ આકષ્ણાવા લાગ્યા તેમ તેમ રાજનોને પણ તે મતમાં એંચવા માંજ્યા.

ગામોગામ પોતાનો મત હેલાવતા યુદ્ધ એક દિવસ રાજગૃહી નગરીમાં આવ્યા. તેમના આગમનની અભર પડતાં શ્રેણીક પરિવાર સહિત યુદ્ધને વંદન કરવાને આવ્યો. યુદ્ધ અનેક પ્રકારે પોતાના ધર્મનાં તત્ત્વ સમજલી તેને ખૌદ્ધમતમાં સ્થિર કર્યો.

“ ભગવન ! યુદ્ધધર્મ હમણું હમણું જગતમાં ડીક પ્રસ્તરતો જાય છે.” મગધરાજ શ્રેણીક કહ્યું.

“ એમજ છે. આખરે લોકોને જાત્ય વસ્તુ તો ગમે જ છે. લોકોને અનુકૂળ થાય એવી શૈક્ષીથી જે ઉપદેશ કરવામાં આવે તો આપણો ધર્મ રાષ્ટ્ર-ધર્મ થાય. ભારતમાં તે અવિચણ થાય.” યુદ્ધ કહ્યું. પોતાનો ચલાવેલો માર્ગ અવિચણ કેમ રહે, એ જ માત્ર એની હવે મહાનવાકાંક્ષા હતી-એના જીવનતું એ જ ધ્યેય હતું. તપથી લોગવેલ કષ્ટ પોતાનો ધર્મ જગતમાં પ્રયત્નિત થાય તો વસુલ થાય તેમ હતું.

“ ભગવનું ! આપનો પ્રયત્ન છે તો તે પણ અવશ્ય શરો. યાદુધર્મ અવશ્ય રાષ્ટ્ર-ધર્મ બનશો.” રાજાએ કહ્યું.

“ હા, તેને માટે હું રાત્રિદિવસ પ્રયત્ન કર્યા કરું છું. ધર્મને દિગંત બનાવવા માટે મારા અનેક શિષ્યોને મેં અનેક સ્થળે રવાના કર્યો છે.”

“ આપનો પ્રયત્ન સર્કણ થશો, કારણું કે આપનો માર્ગ એટલો બધીએ કિલાએ નથી કે જેથી લોકો ન પાળી શકે.”

“ નહિં, રાજુ ! આપણી શરતો ધાણી ઉદ્ધાર છે.

જેવી રીતે આપણે હૃધ, પાણી વગેરેનું પાન કરીએ છીએ
તેવી રીતે સુઅતું અનાયાસે ભદ્રિપાન મળી આવે તો એમાં
શું હરકત છે ? વિધિએ જગતમાં જે ચીજે અનાવી છે તે
અવશ્ય ઉપયોગી જ હોય. જે કે સર્વે જીવે ઉપર કરણા
નજર રાખવી છતાં કોઈ જીવ આયુષ્યક્ષયે ભરણું પામે તો
તેના કલેવરનું માંસ ભક્ષણું કરવામાં કંઈ હોષ નથી. નિર્મા-
લ્યમાં નિર્માલ્ય ગણ્યાતી ચીજ પણ જગતને તો ઉપયોગી જ
છે.” બુધ્યે ચોતાના વિચારેનું પ્રતિપાદન કર્યું.

“તેથી જ આપનો ધર્મ રાજા વગેરેને પણ અતુક્લુસ આવે
તેમ છે, કારણું કે માંસ, ભદ્રિ, શિકાર વગેરે રાજાએથી
ફુસ્ત્યાન્ય હોય છે લારે આપના વિચારે. એને અતુ-
મોદન આપે છે એથી વિશેષ આનંદની વાત બીજી તેક્યી
હોય ? ” રાજાએ કહ્યું.

“સત્ય છે માટે જ. જે જમાનો ઓળખે તે જ માણુસ.
સમયને જાણ્યા-પીછાણ્યા વગર, મતુષ્ય-હૃદયની પરીક્ષા
કર્યા વગર એને ન ઝોયે તેવો માર્ગ બતાવવો તે અયુક્ત
વાત છે. ધર્મનાં ફરમાનો ધણ્યાં જ સખત રાખવાથી તે ધર્મ
કોઈપણ કાળે વિશ્વધર્મ કે રાષ્ટ્રધર્મ અની શકતો નથી.”

“આપનું કથન સર્વાંશે સત્ય છે. જે મોટામોટા
રાજાએ આપના શિષ્યો થાય તો પછી પ્રભામાં તો સહેજે
પ્રગતિ થાય; કારણું કે પ્રભ તો રાજના માર્ગને અનુસરનારી છે.”

“ મારે પણ એવો જ વિચાર છે. તું જેમ મારે

ભક્તા થયો તેમ વિશાળાપતિને પણ મારો ભક્તા બનાવવા વિચાર છે. ” ખુદ બોલ્યા. જાણ્યુ કંઈક યાદ કરતા હોય તેમ ઝરીને રાજને હંદું. “ પણ રાજનુ ! તારી પદૃરાષ્ટી ચેલ્લાણુા વિશાળાપતિની હીકરી છે નહીં વાર ? ”

“ એમજ છે ભગવાનુ ! ”

“ તે કયો ધર્મ પાળે છે વારં ? તેની આગળાં તું આપણુા ધર્મનું મહાત્મ્ય વર્ણવે છે કે નહિ ? ” ખુદ્દે પૂછ્યું

“ ભગવાનુ ! લોંસ આગળ ભાગવત નકામું છે. એ તો જૈન ધર્મની રાગિણી છે. એ ધર્મમાં એ એટલી અધી ચુસ્ત છે કે મારી હરકોઈ વાત એને ગળે જ ઉત્તરતી નથી. એ તો આપ ઉપરેશ કરીને એને આપની શિષ્યા અનાવો તો કદાચ બને ! ”

“ એમ છે ! જે એ આપણી ધર્મશિષ્યા થાય તો પછી એના પિતાને પણ બોધ કરતાં વાર ન લાગે. ” ખુદ્દે અનુમોદન આપ્યું.

“ આપ જેવા ત્યાણી મહાપુરુષનો ઉપરેશ જરૂર અસર કરશો. આપ પૂર્ણજ્ઞાની અને બોધિસત્ત્વ પામેલા છો, ભગવાન સ્વરૂપ છો. આપની શક્તિથી પત્થર પીંગળે તો એ મતુષ્ય માત્ર તે કોણ છે. ? ” રાજને ભક્તિયુક્ત કચ્ચનોથી હંદું.

“ રાજન ! બોધિસત્ત્વ મતુષ્યને જસ્તુરે ગ્રાસ થાય છે

ત્યારે એનામાં જરાપણું શાનની ન્યૂનતા રહેતી નથી, એને કંઈપણ કરવાપણું રહેતું નથી. સર્વ કિયા અને તપને આંતે એ એધિસ્તવપણું મને પ્રાપ્ત થયું છે. હવે તો જગતને ઉપદેશ કરવાનું એક જ કામ માથે બાકી રહ્યું છે.”

“ આજે એ કામ પણ લગભગ સફ્રેલ થયું છે. આપના અનેક શિષ્યોનાં એ કામ આપતું પૂર્ણ થયું છે ભગવન્ ! ”

“ પણ જ્યાં સુધી તારી પદૃરાણી વ્યાધ ન પામે ત્યાં હળી તો અપૂર્ણ જ કહેવાય ને ? ” બુધે સુદ્ધાની વાત હરી.

“ આપ એક વખતે આહારપાણી માટે અમારે મંદિરે પદ્ધારો. એને દર્શન આપી ધર્મભૂતતું પાન કરાવો ” રાજને કહ્યું.

“ એ તો ઠીક પણ તારી સાચે દર્શન કરવાને તે કેમ અહીં આવતી નથી બદા ? શું તારી સાચે આવવા જેટલી પણ તેનામાં બહિત નથી વાર્દું ? ”

“ ભગવન્ ! વિશેષ શું કહું ? તે જેટલી ચુસ્ત શ્રાવક ધર્મની રાગિણી છે કે અન્ય ધર્મના દેવ અને ગુરુઓનાં દર્શન માત્ર કરવા સરખો ય વિવેક સાચવતી નથી. ”

“ છતાં રાજન ! તું એને ક્રરજ કેમ પાડતો નથી. ગમે તેમ તો પણ એ તારી સી છે. તાર્દું વચ્ચે માનવું એ એની ક્રરજ છે. અવળે માર્ગે જતી પોતાની સીને સન્માર્ગ વાળવી એ તારી ક્રરજ શું નથી ? ” બુદ્ધે રાજને કહ્યું.

“ ભગવન્! એ સ્વતંત્ર વિચાર ધરાવતી રાજહુહિતાને અગાતકારે કૃરજ પાડી ધર્મ મનાવવો, તે મને અણુગમતી વાત છે. સર્વ સ્ત્રીઓમાં એ મારે પ્રાણુથી પણ અધિક છે. એનું હિંદુઃભવનું એ શું મને ઉચ્ચિત છે ? ” રાજાએ પોતાનો વિચાર કર્યો.

“ તો ત્યારે એને પ્રીતિથી સમજવ ! પણ કોઈ થી શીતે એને આપણા ધર્મમાં લાવી યુદ્ધની શિષ્યા તો અનાવ ! ”

“ ટીક છે ભગવન્ ! આપનો જ્યારે આવો આખુફ છે તો હું એ માટે અવશ્ય પ્રયત્ન કરીશ . ” રાજાએ યુદ્ધના વચનને અનુમતિ આપી.

“ અસ્તુ ! તારો પ્રયત્ન સર્કલ થાવ ! ” યુદ્ધે આશ્રિત આપી.

“ છતાં આપ પણ અમારા મંહિરે લોજન માટે પદ્મારશો. પદ્મરાણીને આપનાં દર્શન થશો, આપને ઉપદેશ કરવાની તક મળશો; એક સાથે એ કામ થશો. ”

“ રાજન ! અમારું આગમન તો અશક્ય છે. તરતમાં જ અમારે અન્ય સ્થળો જવાનું હોવાથી અમે તો જશું, પણ તમારા વચનને માન આપી મારો એક વિદ્ધાન શિષ્ય બોક્કા-ચાર્ય તમારે ત્યાં આવશો. તે ચેલલાણે પ્રતિયોધઃકરશો. ”

“ એનાથી કાર્ય થવું એ શું શક્ય વાત છે ? ” રાજાએ શંકા કરી.

“ જે કદાચ એમ બનશે તો છીજુ વખત આવીને હું અવસ્થ એને પ્રતિઓધ કરોશ.” યુદ્ધ હતું. રાજ તે પણ યુદ્ધને નમીને પોતાને સ્થાનકે ગયો. થોડા જ દિવસમાં ગૌતમ યુદ્ધ પણ પોતાના એક વિક્રાન આચાર્યને ભૂકી પોતાના પરિવાર સાથે અન્યત્ર ચાલ્યા ગયા.



પ્રકરણ ૧૩ મું.

આતે ધૂર્ત્તા કે ચુક્તિ ?

ચુક્તિ-પ્રચુક્તિથી શ્રેષ્ઠિક મહારાજને ખોડના સાધુઓએ પોતાના ધર્મનો એવો તો રંગ લગાડ્યો હતો કે નેથી બીજાના ધર્મની સત્ય વાતો પણ એના હૃદયમાં ઉત્તરવી મુશ્કેલ હતી. એ યુદ્ધ ધર્મની પ્રામિથી રાજ પોતાને કૃત-કૃત્ય માનતો હતો. જીવનનું ઉચ્ચયમાં ઉચ્ચય સર્વોત્તમ કર્તાંય્ય તેના હૃદયમાં આવી ગયું હોય, એમ પોતાને માનતો હતો. પોતાની પદુરાણીને આવા સત્ય ધર્મની પ્રામિ કેવી ચુક્તિથી કરાવવી તે માટે તે વિચાર કરતો હતો. ચૈદ્ધાણ્યાદેવી મગ-ધરાજની ઠહાલામાં ઠહાલી પત્ની હતી. પોતાને ધર્ષાખરો સમય તે ચૈદ્ધાણ્યાની સાથે મોજશોખમાં પસાર કરતો હતો. ચૈદ્ધાણ્યા જ એનું સર્વસ્વ હતી. જીવનનું ધ્યેય કહો કે ગમે તે સંસારમાં એનું સર્વ કંઈ ચેલાણ્યા જ હતી. એની સાથેના

વિનોહોમાં એ રાજકાર્ય પણ ભૂતી જતો હતો ને દેવતાની માર્ગક ગતસમયને પણ રાજ જાણુતો નહિ.

એકદા રાણી ચેલલણું સાથે વિનોદ કરતો રાજ આનંદમાં બેઠો હતો તે સમયે રાજએ ચેલલણું રાણીને પૂછ્યું “મિયા ! જગતમાં સારમાં સાર એક યુદ્ધધર્મ છે. એ યુદ્ધધર્મના સ્થાપક યુદ્ધ ભગવન् સર્વજ્ઞ અને યોધિ-સત્ત્વ પામેલા છે. જન્મ-મરણના ફેરા એમના દૂર થયેલા છી-કૃતકૃત્ય થયેલા છે.”

રાજના શુરુ ધર્મચાર્ય યુદ્ધદેવનાં વખાળું સાંભળી રાણી મૌન રહી. કૈન ધર્મનાં તત્વોને જાણુનારી રાણી સમજતી હતી કે ‘સર્વજ્ઞ કોણું કહેવાય છે ? ધૂર્ત બાદું સાધુઓએ રાજને અરાબર લોળયો છે.’ “સ્વામી ! તમારા યુદ્ધ ભગવાન ખ્યાત શું સર્વજ્ઞ છે ? સર્વજ્ઞ કોને કહેવાય એ તો આપ જાણો છો ને ?”

“હા વળી, ભૂત, જીવિષ્ય અને વર્તમાન, ત્રણે કાળની વાત ને જાણી શકે છે તે જ સર્વજ્ઞ કહેવાય.”

“તમારા યુદ્ધદેવ એકલા જ સર્વજ્ઞ છે કે તેમના શિષ્યો પણ સર્વજ્ઞપણું પામેલા છે સ્વામી ?” રાણીએ પૂછ્યું.

“અરે ! યુદ્ધ ભગવાન ઉપરાંત એમના શિષ્યો પણ સર્વજ્ઞ જ છે. આજે એક ખૌદ્ધાચાર્ય પોતાના પરિવાર સાથે આપણે ત્યાં લોજન કરવાને પદ્ધારવાના છે. તે પણ પૂરું સર્વજ્ઞ છે.”

“ પ્રાણુનાથ ! પૂરા છે કે અધૂરા એ તો સમયે જણુશે. કંઈ વાતો કરવામાં હિ વળી જતા નથી. જ્યારે કસેટીથી કસવામાં આવે છે ત્યારે પૂરા—અધૂરાની તો ખાત્રી થાય છે. ”

“ તે તાર્દ કથન વ્યાજળી છે. જ્યારે તને ખાત્રી થાય ત્યારે તો તું માનીશને ? ” રાણએ કહ્યું.

“ જરૂર, શા માટે નહિ ? ખાત્રી થતાં તો સર્વ કોઈને માનવું પડે છે સ્વામી ! ”

“ તો હું તને તેની ખાત્રી કરાવી આપીશ. અરે ! એ સર્વશ તો એવા સમર્થ છે કે રોજ દેવતાઓના સ્વામી દુંડુંને ઉપદેશ કરવાને આ બાદ્ધાચાર્ય સ્વર્ગમાં જાય છે. ”

“ એ...મ, ત્યારે તો તમારા બૌદ્ધાચાર્ય બહુ જ જથરા ! ઈદને ઉપદેશ કરનારા કંઈ જેવા તેવા શક્તિવાળા હોય નહિ. ” બ્યંગથી ચેહેણું બોલી.

“ નહિ જ ! તેથી જ હું તને કહું છું કે આવો ઉત્તમ માનવ જન્મ પામીને આવી ધર્મ કરવાની જોગવાઇ છતાં તું કેમ ભૂલી જાય છે ? ખુદ ખુદ ભગવાને પણ તને યાદ કરી છે. ”

“ ખુદ ભગવાનને યાદ કરવાનું કારણ કાંઈ ? ” રાણીએ પૂછ્યું.

“ કારણ શું વળી ? કોઈ રીતે તું સત્ય ધર્મનું પાલન કરે, અમારા ખુદ ભગવાનના ઉપદેશનું પાન કરે, ખુદ ભગવાનની શિષ્યા બને ! ”

“એમની વાતો બધી સત્ય છે કે અસત્ય એ માટે તમને કહાચ ખાત્રી હશે, પણ એ બધી ધૂર્તા હું કેવી રીતે કણૂલ કરી દઉં ? ” રાણીએ કહ્યું.

“શા ઉપરથી કહે છે કે આ બધી ધર્તા છે રાણી ! હું તને સત્ય વાત કહું છું તે પણ તારા ગળે ઉત્તરતી નથી કેમ ? ”

“ નથી ! એની આપણે ખાત્રી કરશું. તમે કહ્યું કે અમારા શુરૂ સ્વર્ગમાં ઈંડને ઉપરેશ કરવા જાય છે તે વાત જ મારે ગળે તો ઉત્તરતી નથી.”

“ નથી ઉત્તરતી, ચાલની ત્યારે આપણે ખાતરી કરીએ તો ખબર પડે. રેણુ પ્રાતઃકાળના તે સ્વર્ગમાં જાય છે, પહુંચ દિવસ પછી તે પાછા પથારે છે તો આજે જ ચાલ હું તને ખાત્રી કરાવી આપું કે શુરૂ સ્વર્ગ ગયા છે કે નહિ ? ”

“ હા, ચાલો.” રાણી રાજ સાથે બૌદ્ધ આશ્રમમાં જવાને તૈયાર થઈ.

પદુરાણી ચેલ્લણ્ણા સાથે રાજ શેલ્લિક બૌદ્ધાચાર્યના આશ્રમમાં આવ્યો. ત્યાં આવીને આચાર્ય જોવામાં આવ્યા નહિ જેથી બૌદ્ધ સાધુને પૂછ્યું હે—“ મહારાજ ! શુરૂ કર્યાં છે ? ”

“ શુરૂ તો ઈંડને બોધ કરવા સ્વર્ગમાં ગયા છે.” તે બૌદ્ધ સાધુનું કથન સાંભળી રાજએ પદુરાણી સામે

બૌદ્ધ સાધુનું કથન સાંભળી રાજએ પદુરાણી સામે

નેથું. ગધી જોખ સાધુ તરફ કુરી રાજ હોયાયો. “ પાછા તે ક્યારે પદ્ધારશે ? ”

“ એ નક્કી શે કહેવાય ? મધ્યાહ્ન સમય પણ લાગે. ઈદ્દ એમનો પરમ ભક્ત છે નેથી જરા ઠેણું-મોડું પણ થઈ જાય. ”

“ ત્યારે ચાલો આપણે ચાલશું કે થોબવું છે ? ” રાજાએ રાણીને ઉદેરીને કહ્યું.

રાણીએ કંઈક ઈરાહાપૂર્વક એનો જવાબ આપ્યો. “ સ્વામી ! આપના શુરુ સ્વર્ગમાં ગયા છે તો તેઓ સ્વર્ગમાંથી ઉત્તરે એટલે સ્વર્ગમાંથી ઉત્તરતા એ શુરુનાં દર્શન કરીને જ આપણે પાછા કુરીએ. ”

“ ડીક જેવી તારી મરળ. ” રાજાએ રાણીના વચનને અનુમોદન આપ્યું.

રાજ રાણી શુરુના આગમનની રાહ નેતાં ત્યાં બેઠાં. તેમને બોકને થોડીએક વાર થઈ એટલામાં અચાનક એ બૌદ્ધ આશ્રમમાં અચિ પ્રગટ થયો. અભિએ બૌદ્ધાશ્રમને વૈરા ઘાસ્યો. ચારે કોર ધૂમાડાના ગોટે ગોટા પ્રસરવા લાગ્યા, નેથી બૌદ્ધ સાધુઓ આશ્રમમાંથી નાશકાગ કરવા લાગ્યા. પ્રજ્વલિતા અજિનને નેથિને રાજ રાણી પણ બહાર નીકળી ગયાં. રાજ રાણી જેવાં બહાર નિકળવા જાય છે તેવામાં જોદ્ધા-ચાર્ય જોંયરામાંથી બહાર નીકળતા ચેલ્લાથુણાં ચર્પણ દૃષ્ટાં

પહ્યા. તરતજ ચૈદ્ધણ્ણા એલી. “ રવામી ! જુઓ ! જુઓ !
તમારા શુરૂ સ્વર્ગમાંથી ઉત્તરે છે તે ! ”

ચૈદ્ધણ્ણાના શાહદોએ રાજનું લક્ષ્ય જોંચ્યું. રાજએ તે
તરફ નજર કરી તો ઐઝશુર લોંઘરામાંથી ગભરાયેલા, લાન-
ભૂલા અહાર નીકળતા એમની તરફ આવતા રાજએ જોયા.

એમને જોઈ રાજ પગે લાગતાં એલ્યો. “ શુરૂ ! શુ-
ત્યારે આજ આપ સ્વર્ગમાં નથી ગયા ? આપના શિષ્યે તો
મને આપ સ્વર્ગમાં ગયા છો તેમ કહું હતું. ”

ગભરાયેલા શુરૂ રાજને જોઈ સાવધ થયા. વિશેષ ગભ-
રાયા. આ તો પોગળ ખૂલ્લું પડી ગયું. હવે શું બચાવ કરવો ?
માંડમાંડ ઓદ્ધારાર્ય પોતાને બચાવ કરતાં એલ્યો. “ રાજનુ !
મારા હું મેશના સ્વર્ગગમનના અસ્થાસથી તેઓએ એમ કહું
હશે, પણ આજે તો હું સ્વર્ગમાં ન જતા અહીં લોંઘરામાં જ
ધ્યાન કરતો એઠો હતો ” સાધુએ બચાવમાં જણુંયું. એ
ધૂર્તિનું વચન રાજએ તો સત્ય કરી લાણ્યું.

“ ત્યારે શું આપ કોઈક દિવસ સ્વર્ગમાં નથી પણ જતા
કે શું ? ” રાજએ પૂછ્યું.

“ હા, જ્યારે ધ્યાન કરવાનું હોય ત્યારે ન પણ જઈ
શકાય; પણ રાજનુ ! આજે આ આશ્રમમાં અચાનક અભિ
પ્રદિસ થયો એનું શું કરશું ? ” ઓદ્ધારાર્ય અભિ પ્રદિસ
થવાની રાજ આગળ શાંકા કરી.

રાજને પણ શાંકા તો થઈ કે અજિન ડેવી રીતે પ્રગટ થયો ? “ કોઈ હુશ્મને ઉત્પજ્ઞ કર્યો હશે કે કંઈ કાવતર્ડ રચાયું હશે ? કંઈ સમજાતું નથી છતાં મહારાજ ! હું તપાસ કરીશ.”

એ અચિ ઉપર પુરપાટ પાણુનો મારો લાગવાથી અચિ શાંત થયો ને રાજ-રાણી પોતાના સ્થાનકે ચાલ્યાં ગયાં.



પ્રકરણ ૧૪ મું.

દંબનો સંક્ષેપ.

રાજ રાણી પોતાને સ્થાનકે તો આવ્યાં, પણ રાજનું મન આને ચિંતાતુર હતું. ડેવી રીતે ખૌધ્ય સ્થાનકમાં આગ લાગી તે માટે રાજ વિચારમાં હતો. આઠલો અધ્યો રાજને વિચારમાં પડેલો જેઠ રાણી ચેલલણું હેવીએ પૂછ્યું. “ સ્વામી ! શું વિચારમાં છો ? ”

“ એ ; ખૌધ્યાશ્રમમાં આગ લાગી તેતું કારણ મારા ધ્યાનમાં આવતું નથી તેથી વિચાર કર્દ છું.” રાજએ ચિંતાતું કારણ સમજાવ્યું.

“ પણ એમાં આઠલો અધ્યો વિચાર શો ? આપના શુરૂ તો જાની છે ને ? તેમને પૂછશે તો જાનથી જાણુને તેઓ કહેશે.” રાણીએ ખુલાસો કર્યો.

“ તેઓ શું ખુલાસો કરશે ? તેમણે જ જોયું નહિ શાંકા કરી હતી ને ? ”

“ તે વખતે તેમણું ચિત્ત અસ્વસ્થ હોવાથી કારણ જાણી હોવાથી નાણી શકશે .” રાજની આગળ રાખીએ દલીલ કરી. એ તો જાણુતી જ હતી કે એ અધી બૌદ્ધ સાધુઓની ધૂર્તા સિવાય ઓઝું કાંઈ પણ ન હતું; પણ એ ધૂર્તા રાજ કેવી સીતે જાણી શકે તે સમજવવાનો પ્રયાસ હતો.

“ હા, આપણે ત્યાં લોજનને માટે મધ્યાહ્ન સમયે પધારવાના છે તે વખતે હું તેમને ‘પૂજી જોઇશ.’ ”

રાજ તે પણી રાખીને કેટલીક વાતો કહી રસોઈ વગેરે તૈયાર કરાવવાની આજા કરી પોતાના સભામંડપમાં ગયો. ચેલણું પણ સ્વામીની આજા પામી એ બૌદ્ધ સાધુઓનો સત્કાર કરવા માટે, એમને લોજન કરાવવા માટે અનેક પ્રકારની રસોઈ કરાવી, એક સુખ્ય રસોયાને કેટલીક સૂચના આપી દીધી. તે સાથે એક ખાનગી વાત પણ કરી દીધી અને તે વાત ઉપર રસોઈયાતું ખાસ લક્ષ્ય એંબું.

બરાબર યથાસમયે બૌદ્ધાચાર્ય પોતાના પરિવાર સાથે રાજમહેલમાં આવી પહોંચ્યો. રાજએ અને રાજપુરષોએ એમનો ચોંચ સત્કાર કર્યો.

એ અરસામાં ચેલણું આજા પામેલા સેવક રસોઈયાએ

બૌદ્ધાચાર્યના ઉપાનંદ (પગરખાં) શુસ્ત રીતે ઉપાડી લાવી તેના સૂક્ષ્મ સૂક્ષ્મ હુકડા બનાવી દૂધમાં નાંખી, એની ખીર બનાવી હીથી. પીળ બધી રસોઈ તૈયાર હતી પણ ખીર બનાવવાની વાર હતી, તે બૌદ્ધ સાધુઓના આવ્યા પછી થાડી જ વારમાં બની ગઈ. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે સેવકોએ આવીને રાજને ખખર આપ્યા. રાજને બૌદ્ધાચાર્ય અને તેના પરિવારને ગ્રીતિપૂર્વક જમાડ્યા. બૌદ્ધ સાધુઓ પણ એ ઉત્તમ રસોઈનાં વખાણું કરતાં બહુ જ સારી રીતે જમ્યા.

જમી પરવાર્યા પછી રાજને આશ્રમમાં આગ લાગવા સંબંધી હકીકત બાદગુરુને પૂર્ણ પણ એવી લોકોની જ્ઞાનવાળી બાબતો એ શુરૂ શી રીતે જાણી શકે ? જેથી શુરુએ પોતાનું અજ્ઞાપણું બતાવ્યું. આડીઅવળી ડેટલીક વાતો કરી, ધર્મચર્ચા કરીને બાદગુરુ જવાને માટે ઉક્ખ્યા. પોતાના ઉપાનંદ શોધવા લાગ્યા તો તે પણ મળે નહિ. અચારા આમતેમ ફાંઝાં મારવા લાગ્યા. શુરુને આમતેમ જોતા જોઈ એમના શિષ્યો પગરખાં શોધવા મંડી ગયા; પણ એનો પત્તો હવે કૃયાં લાગે ?

શુરુના ઉપાનંદ શુસ્ત થયા જાણી રાજને પોતાના સેવકાને હુકમ કર્યો, એટલે તરત જ ચેલણું દેવીએ રાજને કહ્યું. “ મહારાજ ! આપના શુરૂ જ્ઞાનથી જાણી લે કે એમનાં પગરખાં કર્યાં છે ? ”

ચેલણાનું વચ્ચે સંભળી બૌદ્ધાચાર્ય ગલાનિ પામી

ગયા, અને પોતાના આશ્રમ તરફ પરિવાર સહિત ઘેઠયુક્ત ચિત્તવાળા ચાલ્યા ગયા. તેમના ગયા પછી રાજી રાણી સાથે વિચાર કરતો એઠો હતો, એ હરમિયાન થોડી જ વારમાં એક ઔદ્ધ સાધુ રાજની આગળ આવીને કૃશિબાદ કરવા લાગ્યો. “ મહારાજ ! આજે આપને ત્યાં લોજન કરીને અમે અમારા આશ્રમમાં ગયા તે પછી એદું એ સાધુઓને ઉલટી થઈ. એમાં એમનું જમેલું બધું નીકળી ગયું એ તો ટીક, પણ એ લોજનમાંથી ચામડાના સૂક્ષ્મ ટુકડા નીકળ્યા એ કંઈ સમજાતું નથી.”

“ એ તમારી ભ્રમણું હશે. અમારા લોજનમાં ચામડાના કકડા, એ તો અસંભવિત વાત ! ભરાબર તપાસ કરીને જુઓ. કદાચ તમે ભૂલતા હશો.” રાજએ કહ્યું.

“ નહિ મહારાજ ! સત્ય વાત છે. જુઓ આ રહ્યા તે.” સાધુએ સાખીતી માટે તે કકડા અતાવ્યા. એ સૂક્ષ્મ કકડા જોઈ રાજ વિચારમાં પડ્યો.

“ આ સંબંધી કંઈ સમજણું પડતી નથી કે ચામડાના કકડા તેવી રીતે નીકળ્યા ? એ ગમે તેમ હોય, બાકી અમારા લોજનમાં એવો કંઈ પણ દોષ ધારશો નહિ.” એમ કહી ઔદ્ધ સાધુને રાજએ વિદાય કર્યો.

ઔદ્ધ સાધુના ગયા પછી રાજએ ચેલણું તરફ નજર કરી. “ રાણી ! આ બધું કેમ બન્યું હશે ? એમાં તને કંઈ સમજ પડે છે ? ”

‘

રાજાની વાત સાંભળી રાણી મંદ હાસ્ય કરતી ગોલી. “મહારાજ ! પ્રથમ હું એક વાત કહું, તે ઉપર આપ લક્ષ આપશો તો આપને બધી સમજણું પડી જશે.”

“શ્રી છે તારી વાત ?” રાજા આતુરતાથી સાંભળવા લાગ્યો.

“સ્વામિન ! કોઈ ગોમમાં એ વણિક રહેતા હતા. તેઓ અને પરસ્પર મિત્ર ને એકજ જ્ઞાતિના હતા. હૈવ્યોગે તેમની સ્વીએ એક સાથે ગર્ભવંતી થવાથી બેચે વણિક મિત્રો પરસ્પર કહેવા લાગ્યા કે—“આપણું જે એકને પુત્ર અને ધીજને પુત્રી જન્મે તો એકણીના સાથે એમનો વિવાહ કરવો.” અજેઓ તે વાત કયુલ કરી. પાછળાથી કોઈ કરી ન જય એ માટે એમણે પાડું લખત કર્યું. હવે ગર્ભનો સમય પૂર્ણ થતાં એકને પુત્રી અવતરી ને ધીજી સ્વીને સર્પ અવતર્યે.

એ સર્પને પોતાની પુત્રી આપવાની ના પાડવાથી સર્પ-વાળા વણિકે રાજ આગળ ફર્યાઈ કરી પેલું લખત હાજર કર્યું. જેથી વણીકને રાજના હુકમથી પોતાની પુત્રી સર્પસાથે પરછુાવવાની ફરજ પડી ને સર્પ સાથે પોતાની પુત્રીના વિવાહ કર્યું.

લગ્ન થયા પછી રાતે હંપતી શયનગૃહમાં ગયાં. ત્યાં અનેના પલંગ જ્યુદ્ધ જ્યુદ્ધ હતા. તે ઉપર તેમણે શયન કર્યું. તે સમયે એ સર્પના શરીરમાંથી એક ડિવ્ય કાતિમાન પુરુષ નીકળ્યો. તે પેલી કન્યા સાથે ઢીડા કરવા લાગ્યો. પ્રાતઃકાળે તે પાછો સર્પના શરીરમાં જ સમાચ ગયો.

કન્યાએ આ વાત પોતાના સંબંધીજનોને કહી, જેથી તેઓ ખુશ થયાં; પણ એ હિંય કાંતિવાળો પુરુષ પોતાના સ્વરૂપમાં જ કાયમ રહે તે માટે શું કરવું ? એ વિચાર કરવા લાગ્યાં.

એકદા એક ખુદ્દિમાન પુરુષને આ પરિસ્થિતિ સમાજવતાં તે ચતુર પુરુષે એમને એક ચુક્કિ બતાવી કે “ જ્યારે તે સર્પમાંથી સુંદર પુરુષ ઉત્પત્ત થઇ કન્યા સાથે કોડા કરવા જાય ત્યારે એ સર્પનું કલેવર તમારે બાળી ભર્યું કરી દેવું; પછી તે હુમેશાં પોતાના સ્વરૂપમાં જ રહેશે.” એ ખુદ્દિમાન પુરુષની આ ચુક્કિ ઠીક પડવાથી રાત્રીને સમયે તેમણે સર્પનું કલેવર બાળી નાખ્યું જેથી એ પુરુષ પોતાના હિંય સ્વરૂપમાં જ રહ્યો .”

જેવી રીતે એ પુરુષ પોતાના હિંય સ્વરૂપમાં રહ્યો તે જ પ્રમાણે હે સ્વામી ! મેં પણ વિચાર કર્યો કે આપના ગુરુ હુમેશાં સ્વર્ગો જતા હશે, તો તે હિંય દેહ ધારણ કરીને સ્વર્ગો જતા હશે અને જ્યારે હિંય શરીર સ્વર્ગો જતા હશે ત્યારે તેમનું મૂળ શરીર અહીંયાં જ મૂકી જતા હશે. આપણે જ્યારે એમને દર્શને ગયાં ત્યારે ગુરુ સ્વર્ગો ગયેલા જાણી મેં ધાર્યું કે એમનું માનવ કલેવર અહીંયાં પડેલું હશે એને જો સંગાળવી દીધું હાય તો હુમેશાં હિંય સ્વરૂપે ગુરુ અધિનને દર્શન આપે. એમ ધારીને મેં એ જૌઢ આશ્રમમાં અજિ પ્રગટાયો કે જેથી પેલા કલેવરનો અંત આવે, પણ સારી

એ વાત તો મનમાં જ રહી ગઈ ને તમારા શુરૂ તો જીવતા-
જગતા ગભરાયેલા લોંથરામાંથી અહાર નીકળ્યા. અને જોયું
કેવા લોંડા પડી ગયા હતો ? એ બાધી આપને લોળવવાની
એમની ચુક્તિ હતી.” રાણીએ વાર્તા કહીને તત્પર્ય સમજોયું.

“ ત્યારે એના ઉપાનહનું શું થયું તે કહે જોઈએ ? ”
રાણી પૂછ્યું.

“ ઉપાનહનું શું થાય વળી ! આપના શુરૂ પરમ જ્ઞાની
છે તો ઉપાનહ કયાં ગયાં એટલું પણ જાણી શક્યા નહિ ?
અરે ! એ ઉપાનહ તો એમની પાસે જ હતાં, એમના પેટમાં
હતા ! ” રાણીએ કહ્યું.

“ તે કેવી રીતે વાર્તા ? ”

“ કેવી રીતે શું ? એ પગરખાંના સૂક્ષ્મ દુકડા કરાવી
ક્ષીરાદિક લોજન વગેરેમાં ન ખાવી લોજન તૈયાર કરાયું
હતું. એ લોજન એમણે આકંદ પર્યાંત ખાધું. છતાંય એ
જાણી શક્યા નહિ કે મારા ખોરાકમાં શું આવે છે ? આપના
શુરૂનું આ તે કેવું જાન ? જાનથી તો ન સમજ્યા પણ
જીહાના સ્પર્શથી પણ ન સમજ્ય શક્યા. આ તે જીહા-
દીદ્ધિયની કેવી બોલુપતા ? વાહ ! કેવા આપના શુરૂ ! ”
ચેદ્ધાણુદેવી રાજના શુરૂનાં વખાણું કરતી હુસ્કવા લાગી.

આવી રીતે ખેતાના શુરૂની પરીક્ષા કરેલી જોઈ શ્રેષ્ઠ
જંખવાણો પડી ગયો. ખેતાના શુરૂનું આવું હુશ્ચારિત્ર જાણુવા

છતાં એણિકના મનમાં શંકાઓ તો થઈ છતાંયે બૈદ્ધ
ધર્મ ઉપરથી જરા પણ રાગ ઓછો થયો નહિં. એણે પણ
મન સાથે નક્કી ઠરાવ કર્યો કે “એજુલ્યુને મારા શુરૂની અવ-
હેલના કરી છે તો પણ જેણ મુનિએનું પોગળ ખુલ્લું કરીશ.
એના શુરૂની કુચેદાંઓ હું એને પણ બતાવીશ.”



પ્રકરણ ૧૫ મું.

એ મહાપુરુષ તે કોણું ?

દ. સ. પૂર્વે પલ્લ ની સાતમાં જે સમયમાં, મગધમાં
બિંબિસાર રાજુનું રાજ્ય હતું. જે સમયે વિશાખા નગરીમાં
એટકમહારાજુનું રાજ્ય હતું, માળવામાં બેડપ્રદોતતું રાજ્ય હતું
તે અરસામાં મગધમાં આવેલી રાજગૃહી નગરી અને વિશાખાના
આંતરમાં ક્ષત્રીયકુંડ નામે આમ આવેલું હતું. ત્યાં સિદ્ધાર્થ
નામનો રાજ રાજ્ય કર્તો હતો. સિદ્ધાર્થનું રાજ્ય બહું મોદું
હોય એમ જણ્ણાતું નહેતું છતાં રાજ સિદ્ધાર્થ શુદ્ધ ક્ષત્રીય,
વૈશવ, ઠકુરાદ અને સત્તાવાળો હતો. એનો દોરદમામ, ઠાડમાઠ
મોટા રાજ મહારાજ જેવો વિશાળ હતો અને એની સ્પેનું
નામ ત્રિશલા ક્ષત્રિયાણી હતું.

આ મહાપુરુષ જ્યારથી ત્રિશલાદેવીના ગર્ભમાં આવ્યા
ત્યારથી સિદ્ધાર્થના રાજ્ય વગેરે વ્યવસ્થામાં અજમ

પરિવર્તન થવા લાગ્યું. અને આંગણે ઝડ્ધિ, સિદ્ધિ, સૌભાગ્ય, દિનઉગે વૃદ્ધિ પામવા લાગ્યાં. જ્યારે એ નરશ્રેષ્ઠ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે એમની માતાએ જગતમાં ઉત્તમોત્તમ ગણ્યાતાં ચૈદ મહાસ્વરૂપનો જોયાં. એવાં મહાસ્વરૂપન કૃપચિતજ કોઈ મહાપુરુષની માતા જુએ છે. સિદ્ધાર્થ રાજએ પ્રાતઃકાળે જયોતિર્વિદ પુરુષોને બોલાવી એ ચૈદ સ્વરૂપનું મહાકુલ પૂછ્યું. એમણે પોતાના અંથેમાં જે જે કુલ હતું તે રાજને કહ્યો બતાવ્યું. “રાજન! એ ચૈદ સ્વરૂપ ચક્રવર્તીની માતાએ અથવા તીર્થીકરની માતાએ જુએ છે. તમારો પુત્ર ચક્રવર્તી અથવા તો તીર્થીકર થશે. રાજ થશે તો. ચક્રવર્તી અથવા તો ધર્મ-ચક્રવર્તીને તીર્થીકર પોતે જ.

એવું મહાકુલ સાંલળી રાજ રાણી પ્રસન્ન થયાં. દાન-દક્ષિણાથી સત્કાર કરી જયોતિરીઓને વિહાય કર્યાં. અતુક્કે ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો. જે કંઈ વ્યવસ્થા, નિયમો, રીતિ-નીતિનું પાલન કરવાનું હતું તે સર્વ કંઈ નિશાલાહેવી પાલન કરી ગર્ભને પોષવા લાગ્યાં. ગર્ભમાં રહેલા જીવની જેટલી મહત્તમ હતી તે સંપૂર્ણ તો નિશાલા કે સિદ્ધાર્થ જણુતાં ન હોતાં. છતાં જેટલું તો એમના લક્ષ્યમાં અવક્ષ્ય હતું કે આપણે ત્યાં ડોધ મહાપુરુષનો જન્મ થશે તે અવતારી પુરુષ થશે.

એ ગર્ભમાં વૃદ્ધિ પામતો જાલક વિચારવા લાગ્યો. કે “મારા હુલન-ચલનથી રહેને મારી માતાને હુઃખ થાય” એમ

ચિતવી હુલનચલનની કિયા બંધ કરી ચોગીની માર્કડ નિશ્ચલ
સ્થિર થઈને રદ્દો ગર્ભને હુલનચલન કિયા રહિત જાણી
માતાને જેહ થયો કે ” અરે હું હણુણી ! મારી ગઈ. મારો
ગર્ભ કેમ હાલતો નથી ? ” અનેક કુશં કાણો થવાલાગી. સખીઓ
બધી વલોપાત કરવા લાગી. ગામમાં એ સમાચાર દેખાતાં ર-
ગરાગ બધા બંધ થઈ ગયા. ઘેર ઘેર ને આંગણે આંગણે
ઉદાસી છવાઈ ગઈ. આવી સ્થિતિથી રાજ પણ ગભરાયો.
એવી સ્થિતિમાં ઉપચારો પણ શું કરે ?

આસમંડળને શોકાકુલ જાણી ગર્ભ જરી હાલ્યો. માતાને
એ વાતની અખર પડતાં એના દિવને શાંતિ થઈ. એ હર્ષના
સમાચાર ક્ષણમાત્રમાં બધે પ્રસરી ગયા. એ મહાભાગકે ગર્ભમાં
રદ્દાં વિચાર કર્યો.” આહ ! હજ તો હું ગર્ભમાં છું ત્યાં
માતાનું મારી ઉપર આટલું બધું હેત છે તો પણ માતા મને
લેશે ત્યારે તો શુંચ કરીના રહેશે. અચીત આ માતાપિતાના
જીવતે હું દીક્ષા અહણ કરીશ તો તે મરણ પામશે, માટે એ
માતાપિતાના જીવંતપર્યત હું દીક્ષા અહણ કરીશ નહિ ”
એ બાલગર્ભે મનમાં નિશ્ચય કર્યો.

ગર્ભનો કાળ પૂર્ણ થતાં ઈ. સ. પદ્દ ના સમયમાં ચૈત્ર
શુદ્ધ ૧૩ ને દિવસે એ મહા બાલકનો જન્મ થયો. મોટો
જન્મેત્સવ થયો, જન્મને ઉદેશીને અનેક વિધિઓ થઈ. એ
મહા બાલકના જન્મ સમયે જે જે કામ કરવું ચોઝ્ય હતું
તે સર્વેંએ આવીને પોતાની કુરજ અન્નવી. સિદ્ધાર્થ રાજએ

પોતાને આંગણે જન્મોત્સવ ઉજોયો. દેવતાઓ અને એમના સ્વામી ઈદ્રોએ મેરુપર્વત ઉપર જઈ એ મહાબાળકનો જન્મ મહોત્સવ હર્યો. તે સમયે કયારે શહેર એના નાના બાળકને પોતાના ખોળામાં લઈ એઠા હતા ને ક્ષીરસસુદમાંથી નીરવાવી દેવતાઓએ કલશ ઉપર કલશ ભરી એ બાળકને નબરાપતા હતા ત્યારે સ્વાભાવિક ઈંક્રના મનમાં વિચાર ઉદ્ભાવ્યો હે “મહાસમર્થ દેવતાઓના કલશ ઉપર કલશોનાં નીર પડનાથી રહે આ બાળક સુઝાઈ જય.” ઈદ્રની આ શાંકા ખોળામાં રહેલા બાળકુમારે જ્ઞાનદિનથી બાણી. પોતાના ચરણનો અંગુઠો પર્વત સાથે ચાંચ્યો, ત્યાં તો આપોય મેરુ ડાલાયમાન થયો, વૃક્ષો પડવા લાગ્યાં, શિખરો ગણડી પડ્યાં, હાંડારવ મચી રહ્યો, દેવતાઓ પણ ગ્રાસ પામી ગયા “આહ ! અચાનક આ શું ? હર્યને સમયે આ શું ઉત્પાત ? ”

સૌધર્મયતિએ જ્ઞાનથી એ ઉત્પાતનું કારણ જોયું. “ઓહો ! આતો આ બાળકનું પરાક્રમ ! મને જે શાંકા ઉત્પાત થઈ, તેના સમાધાન માટે આ બાળક પ્રભુને આમ કરવું પડ્યું-હે ‘અરે શહેર ! તું શામાટે શાંકા કરે છે? આવા કંઈ કલશોનાં નીર અમારી ઉપર પડે છીતાં અમે જ્ઞાન પામવાના નથી; માટે તું એવો વહેમ રાખવો છોડી હે ! ’”

શહેર તરતાજ એ બાળકને ક્ષમાબ્યા, હે પ્રભુ ! અજ્ઞાનતાથી મારી એ ભૂલ તમે ક્ષમજો, તમારી શક્તિ, તમારું ધળ, તમારું, સૌલાગ્ય, ઔઝ્યાર્થ સ્વર્વ કંઈ અપરિભિત છે અમારી

અવધિથી તે આગોચર છે. આપની ઉપર ભક્તિને લઈ મને આ વિચાર આવ્યો તે હે હ્યાણુ ? કૃપાનિધે ? તમે ક્ષમજો ?

જન્મોત્સવની હિંયા એ રીતે પરિપૂર્ણ થઈ. બારમે દિવસે સાગાં સાંખ્યી જનોને આમંત્રણ કરી ભક્તિપૂર્વક જમાડાં, તેમની આગળ રાખીએ કહ્યું “ જ્યારથી આ પુત્રગર્ભમાં આવ્યો ત્યારથી અમારે આગણે, નગરીમાં અને માંગલિક પ્રસંગોમાં ધાન્યાદિકની વૃદ્ધિ થયેલી છે તેથા મારે એ બાલકનું ” વર્ધમાન નામ રાખવાની દર્શા છે. ”

“ તેમજ થાએ ” બાંધવ તથા સંખ્યીવર્ગે અનુભતિ આપી, એવી રીતે એ બાલકુમાર જગતમાં વર્ધમાન એ નામથી પ્રસિદ્ધ થયા. વર્ધમાન કુમાર અનુફરે આઠ વરસના થયા. ચૌદ ચૈદ સ્વમથી સૂચન કરાયેલ વર્ધમાન કુમારને ચક્કવત્તો થવાના ધારીને દરેક રાજાએઓ પોતા-પોતાના કુમારોને એમની સેવા કરવા મોકલ્યા હતા. એ દરેક રાજકુમારો સાથે બાલકને ચોગ્ય કીડા કરતા તે વધવા લાગ્યા. આઠ વરસના થયા. એ અરસામાં સ્વમાનવયના રાજ-પુત્રો સાથે નગરની બહાર કીડા કરવાને ગયા.

એ બાલકુમાર વર્ધમાનના ધીરપણુંની સૌધર્મણતિએ પોતાની સભામાં દેવતાએની આગળ પ્રશંસા કરી. એ પ્રશંસાને સહન નહિ કરતો. એક દેવતા વર્ધમાન કુમારને ભય પમાડવાને ત્યાં આવ્યો. બાલકનું ઇપ ધરીને તેમની સાથે રમવા લાગ્યો. જે વૃક્ષ પાસે વર્ધમાન કુમાર રાજપુત્રોની

સાથે રમતા હતા, તે વૃક્ષને સર્પનું રૂપ ધારણું કરી દેવતા વીટાઈ ગયો. એ લયંકર હોરંગમણિને નિહાળતાં જ બધા રાજુનો તો ત્યાંથી પલાયન કરી ગયા. તેમને પલાયન કરતાં લેઈ વર્ધમાનકુમાર જોવ્યા “અરે ! નાસો ના ! નાસો ના ! એ સર્પને હું લીલામાત્રમાં હૂર કરી દઉછું.” એમ કહેતાંની સાથે વર્ધમાનકુમારે હોરીની જેમ ઉંચો કરી હૂર પૂર્ખી ઉપર પટકી દીધો. રાજકુમારે લજણ પામી પાછા આવીને એમની સાથે રમવા લાગ્યા.

સર્પના સ્વરૂપમાં ન ફૂપવાથી દેવતા રાજકુમારનું રૂપ ધારણું કરી એમની લેગો રમવા લાગી ગયો. હવે બધાએ લેગા થઈને શરત કરી કે—“આપણે બધા આ વૃક્ષ ઉપર ચઢીયે. એમાં જે સર્વથી પહેલો અથભાગે પહોંચી જાય તેને થીજાએ પોતાની પૂર્ષ ઉપર ચઢાવીને વહન કરે.” એમ કહી તેઓ બધા વૃક્ષ ઉપર ચઢવા લાગ્યા. એમાં વર્ધમાન કુમાર સર્પની પહેલાં વૃક્ષના અથભાગ ઉપર પહોંચી ગયા. શરતમાં વર્ધમાનકુમાર જીત્યા હોવાથી બધા રાજકુમારે એમના અશ્વરૂપે થઈ પોતાની પૂર્ષ પર એસાડી વહન કરવા લાગ્યા. અનુકૂમે પેલા દેવરૂપ રાજકુમારનો વારો આવ્યો જાયારે વર્ધમાનકુમાર એની પીઠ ઉપર અસીર થયા, એટલે તે રાજકુમારરૂપ દેવતા માયાથી ધીરેધીર વધવા લાગ્યો, પર્વતોને પણ નીચે કરે તેથું વિકરણ સ્વરૂપ કર્યું. એની જીહવા તક્ષકનાગના જેવી દેખાવા લાગી મસ્તક પરના કેશ દાવાનદ સ્વરૂપ કાસવા લાગ્યા, એની દાઢો કરવતના જેવી

થઈ ગઈ, લોચન અંગારની સગડીએ બની ગઈ અને નસ-કોરાં પર્વતની શુક્રાર્દ્ર થર્ડ ગયાં, એક રાજકુમારમાંથી આવું જયંકર વિકરાળ સ્વરૂપ બની ગયું, તેમજ એનું શરીર અનુકૂળે વધતું વધતું પર્વતથી પણ ઉથ થયું.

હેવતાની આવી ચેષ્ટા જોઈને ખીળ રાજકુમારો તો જયના માર્યો પદાયન કરી ગયા ને વર્ધમાનના માતાપિતાને કહેવા લાગ્યા કે— ‘કોઈ પીશાચ હેવતા તમારા વર્ધમાનને ચતાવી રહ્યો છે. કોણ જાણે કે એ હેવતા શું કરશે? એ બાપ રે! શું એ હૃષ્ટતું વિકરાળ-ધીહામણું સ્વરૂપ !’

રાજકુમારોની આવી વાણી સાંભળી માતાપિતા વગેરે પરિવાર ત્યાં દોડી આવ્યો. અહીંથા તો વર્ધમાન-કુમારે જ્ઞાનથી આ હેવતાનું સ્વરૂપ જાણીને એના પૃષ્ઠ ભાગ ઉપર એક સુષ્પિત્રહાર કરીને એને વધતો અટકાવીને વામનરૂપ કરી નાઈયો.

વર્ધમાનકુમારની સુષ્પિત્રહારથી જરૂરિત થયેલો હેવતા વર્ધમાનકુમારને નમી, એમની આગળ પોતાનું સ્વરૂપ પ્રગટ કરી, રહુતિ કરી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. વર્ધમાનકુમાર પોતાના વૃહ તરફ જતા હતા ત્યાં માતા-પિતા એમને સામે ભળ્યા. માતાએ એમને સ્નેહથી આ-દિંગ્યા. અક્ષત અંગવાળા વર્ધમાનકુમારને જોઈ માતાપિતા-હિક પરિવાર ખુશી થયો.

કીડા કરવા ચોગ્ય બાલવયનું ઉદ્ઘાંબન કરી વર્ધ્માનકુમારને પ્રિય એવા યૈવનને આંગળે આવ્યા. એ બાલ્યકીડા કરતા વર્ધ્માનકુમારની બાલ્યકીડા પણ પણ નિર્દેખ હતી હવે રમણી જનને વદ્ધમ યૈવનવયમાં વર્ધ્માનકુમાર આવ્યા છતાં જગતના જનોથી એ જૂદી પ્રકૃતિના હતા. સ્વાભાવિક રીતે યૈવન વયમાં પુરુષનું કો પ્રત્યે અને રમણીયોનું પુરુષ પ્રત્યે આકર્ષણું થાય છે, એથું મોહનું ચેષ્ટિત છે. મોહ પોતાની સત્તા જગતના જીવે ઉપર તે સમયે અસખલિતપણે ચલાવે છે. એકથીલા સાથે અઙ્ગળાવી અનેક કુચેણ્ટાઓ કરાવી પોતાની ધ્રંઢા પ્રમાણે નાચ નચાવે છે. જગતનો શૂદ્ર પ્રાણી પણી બલે તે માનવ હોય કે હેવ, એ મોહને વરા થઈ મોહની અનેક ચેષ્ટા-એને આચરતો એમાં જ માનવજીવનની સાર્થકતા સમજી જીવિતવ્ય પૂર્ણ કરે છે. એ મોહને આધીન જની જીવનની મહુરા તે ભૂલી જાય છે.

એ મોહ ચેષ્ટાથી રહિત વર્ધ્માનકુમારનું જીવન હતું. એની સુંદર કાંતિ જોઈને, એનું સુંદર સ્વરૂપ લાલિત્ય નિહાળીને રમણીજન હાવલાવથી એ સૌંદર્યનો ઉપલોગ કરવાનો લાલસા રાખી એમને યોદાવવા આવતી, પણ એ વિકાર રહિત અને વૈરાગી વર્ધ્માનને એની શું અસ્તર થાય ? દિવસે દિવસે એમનો વૈરાગ્ય વૃદ્ધિ પામતો હતો. સંસારના સ્વરૂપના એ જાણનાર હોવાથી એ સંસારનો લોગ કરવા આવેલ નહોતા. સંસાર કેમ છોડવો? કયારે છોડવો?

અને શું કરવા છોડવો? બગેરે એ ત્યાગના પાડો શિખભાવનાનો તો સંસારમાં વર્ધમાનકુમારના આગમનનો હેતુ હતો, એમના જીવનની મહત્ત્વા કોઈ નિરાણી જ હતી. એમના જીવનનું ધ્યેય અન્ય અલ્પપણ જનો શું જાણી શકે ? અનંત કાળની સંસારની યાત્રા એમની હવે પૂરી થવાની હતી. એ જીવનના બાધ્ય વિલાસો, બાપકાંચો, આડંબરો, ઉધાનો કે બાગખગીયાઓની સુંદરતામાં કે રમણીજનના સમાગમમાં એમને સુખ લાગતું નહોતું. એ વસ્તુઓની એમને ઈચ્છા જરણી પણ નહોતી. જે વસ્તુઓ અન્યને હુર્લાય હતી તે એ વર્ધમાનકુમારના ચરણુમાં અથડાતી હતી; છતાં એને મન એ નિરસ હતી. જરા પણ લોંગ લેવાની એને ઈચ્છા થતી નહીં. બીજાઓને જે પ્રિય અને ગમતી વાત હોય છે તે એને મન તુચ્છ હતી. સંસારના લોગ-વિલાસોની એને ઈચ્છા નહોતી. એ જીવનની સ્થિતિ કોઈ અનુપમ હતી. ત્યાગને માટે તો સંસારમાં એનું આગમન હતું. એ ત્યાગના માર્ગે જતાં એમને શું મેળવવાનું હતું તેની બીજાને કલ્પના પણ શી હોય ? જે માણુસની શક્તિ, ઐશ્વર્ય કે સમૃદ્ધિ અનુપમ છે એના જીવનનું ધ્યેય પણ કોઈ અનેરું જ હોય.

જગતમાં પ્રાણીઓની સ્થિતિ કેવી વિચિત્ર હોય છે ! એક રંક, બાધારી કે ગરિય માણુસનું ધ્યેય હરખાને દ્રોય સંપાદન કરવા સિવાય બીજું શું હોય ? વિષયના લાલચું પ્રાણીને ઝી મેળવવા સિવાય બીજું શી અભિદાષ્ટ હોય ?

એમા જીવનની મહત્તમા કે ધ્યેય સારી રમણીઓના સમાં ગમનમાં જ સમાચેલું છે. સ્વી હોય, લક્ષ્મી હોય, બાગળ ગદા સર્વ કંઈ હોય પણ પુત્ર ન હોય તો એના જીવનનું ધ્યેય એક પુત્ર પ્રાપ્તિમાં જ સમાચેલું છે, અને તે માટે મનુષ્ય અનેક પ્રયત્નો કરે છે. દોણી ભાણુસના જીવનનું ધ્યેય શું હોય ? કે હું કયારે નિરોગી થાઉં, અને તે માટે તે અનેક પ્રકારે દવા વળેરેના પ્રભાયો કરી કષ સહન કરી, લક્ષ્મીનો અથાગ વ્યય કરે છે. જન-પ્રકૃતિને અનુસરીને મનુષ્યોનાં ધ્યેય સર્વનાં અનેરાં,- નોખાં નોખાં જ હોય છે. જીવનનાં એ બાધ્ય સુખ-સાધનોમાં જ્યારે જનપ્રકૃતિ લુણ્ય થયેલ છે ત્યારે વર્ધમાનકુમાર આગળ એમાંનું સર્વ કંઈ હતું. સમૃદ્ધિ, સત્તા, વૈભવ, ઠકુરાઈ, અનુપમ લોગવિલાસ એના ચરણ આગળ આગેટાતાં હતાં. એવી કઈ વસ્તુ હતી કે જે મેળવવાની એને અભિ-લાઘા હોય ? એના જીવનનું ધ્યેય, એના જીવનની મહત્તમા એ તો એ પોતે જ નાણી શકે. એને શું કરવાનું છે અને શું મેળવવાનું છે એ તો એને જ અખર, આપણે અદ્વિતીય ભાણુસને એની કલ્પના પણ કયાંથી કે એ કથે રહ્યે રહ્યે જઈને શું મેળવવાના છે ? કયાં આપણે ને કયાં એ ?

સંસાર ઉપર એમનું હિલ નહોટું છતાં સંસારમાં તો રહેલા જ હતા; વૈભવ, ઠકુરાઈ એમને અણુગમતાં હતાં છતાં એ વૈભવથી જ એ પોખાતા હતા; માતાપિતા, સગર્ણસંધીનું એમને જરાય અંધન નહોટું છતાં એમની વચ્ચે તે વૃદ્ધિ પામતા હતા; લોગો એમને મન દોગ સમાન હતા છતાં એ

બોણોનો ઉપલોગ કરી રહ્યા હતા. એમના સુખની અચીત થીજને દૂર્ઘા આવે, તપ-જપ કરી એમના જેવા બાદ્ય સુખે મેળવવાની અન્ય કોઈ અભિવાપા કરે, એવું અનુપમ સુખ મળેલું હતાં વર્ધમાનકુમારનું। દદ કંઈ જૂદા જ વિચારમાં હતું.

એ સૌંહર્યથી અળહળી રહેલા વર્ધમાનકુમારને જેવનને આંગણે આવેલા જોઈ એમના માતાપિતાને ચિત્તા થઈ, જે ચિત્તા સંસારમાં દરેકને થયા જ કરે છે. “ અરે હું તો વર્ધમાનકુમારને પરણાવવા જોઈએ, એમને લાયક કોઈ કન્યાની તપાસ કરવી જોઈએ ”

અને એવી બાધરોમાં પુરુષો કરતાં ખીચોના મનમાં અધીરતા વધારે હોય છે કે જેટલી અધીરાઇ ખૂદ પરણુનારને પણ કદાચ નહિ હોય. ધરમાં કથારે વહી પહેરોઓઢીને ઝરતી હોય, એ જેવાનો ઉમળકો કથા પુત્રની માતાને નહિ હોય ? તો પછી વર્ધમાનકુમારની માતાને ઉમળકો શા માટે ન હોય ? ત્રિશલાહેવી એ પણ એક મનુષ્ય હુતાં અને પુત્રની વધુ ધરમાં રમતીઝરતી હોય, એ દશ્ય જેવામાં કથી પુત્રવતી માતાએ જીવનની મહત્ત્વાની નહિ માની હોય ? કેટલીક માતાઓએ તો પુત્રવધૂનું સુખ જેવાને ગાંડીયેવી થઈ જાય છે, કેમકે મોટું લાગ્ય હોય તો જ પુત્રવધૂનાં દર્શન થઈ શકે; અને એથાય વળી મોટું લાગ્ય હોય ત્યારે એ પહેરોઓઢીને ઝરાલતી પુત્રવધૂઓ પાસેથી સુખ મેળવી શકે. કેમકે આ દોજખ-મય સંસારમાં કંઈ મનુષ્યો ખી ખી કરતા ચાલ્યા જાય છે ત્યાં એમની માતાઓને પુત્રવધૂ જેવાનો ઉમળકો કથાંથીજ આવે ?

પ્રકરણ ૧૬ મું.

સ્નેહીચોનો સ્નેહળણ.

એ વર્ધમાનકુમારનું બીજું નામ મહાવીરકુમાર હતું અણમાં, પરાક્રમમાં એમની જરખામણી ડેઢિ કરી શકે તેમ નહિ હોવાથી મહાવીર એવું એમતું નામ રાખવામાં આયુ હતું. જગતમાં અદ્વિતીય સ્વરૂપવાળા વર્ધમાનકુમારને સમરવીર નામના રાજને પોતાની પુત્રો યશોહા આપવાને પોતાના મંત્રીઓ સિદ્ધાર્થ રાજનાસે મોકલ્યા. સિદ્ધાર્થ રાજને સમરવીરના મંત્રીઓએ પ્રાર્થના કરી. “ મહારાજ ? અમારા રાજ પોતાની પુત્રી યશોહા આપના કુમાર વર્ધમાનને આપવા માગે છે તો એ પ્રાર્થના સ્વીકારવા વડે કરીને આપનો સંબંધ ફટ થાએ ? ”

સમરવીર રાજના કારબાઈની ભાગણી સાંકળીને સિદ્ધાર્થ રાજ ખુશી થયા. “ એ દિવસ સિદ્ધનતા કરો, અમારી એમાનગતી સ્વીકારો. એ અરસામાં અમે તમને જવાણ આપશું. ” સિદ્ધાર્થ રાજને પોતાના મંત્રીઓ ભારકૃતે એના ઉતારાની ગોઠવણું કરાવી.

વર્ધમાનકુમારના ભિત્રોને એ વાતની અખર પડવાથી રેખો વર્ધમાનકુમાર પાસે પહોંચ્યો ગયા, “ હો હું તમે સપ્હાદ ગયા. તમારે માટે એડી તૈયાર થઇ ગઇ. ”

“ એ બેડીનાં બંધન સ્વીકારવાની અમારી ભરણ નથી. બેડીના બંધનથી ડોષુ ફૂલ્યો છે કે એ બેડી અમે સ્વીકારીએ ? એ તો બેડી તે બેડી જ ! ”

આવી મનોહર બેડી પણ શું તમને નથી ગમતી વર્ધમાનકુમાર ? શું સુંદર રાજકુમારિકા છે એ ! તમે જોઈ નથી તેથી જ આમ ઓલો છો. જોયા પણી નહિ : ”

રાજકુમારોનાં વચન સાંભળી વર્ધમાનકુમાર હુસ્ત્યા. “ અરે ! તમે મોહવશ થયેલા હોવાથી આમ ઓલો છો. નિર્મિંહીને એ તમારી સુંદર રમણીએ પણ શું કરી શકે ? અમે તેવી સુંદર તો પણ બેડી જ ને ? એ બેડીનાં બંધન તે કંદિ રળીયામણાં હોય ? ”

“ પરણું એ સિવાય સંસારમાં બીજુ રળીયામણી ઘડી કંદ વાર્દ ? અને પરણ્યાની પહેલી રત એ તો વળી એથી ય શ્રેષ્ઠ વર્ધમાનકુમાર એવી અનુપમ ઘડીએ માનવસવમાં મનુષ્યોને કાંદ વારંવાર આવતી નથી. મોહું ક્ષાળ્ય હોય તો જ એવી અનુપમ ઘડીએ પ્રાસ થાય છે. ધણ્યાય બિચારી લીના નામની ભાગા જપતા મરી જાય છે શતાંય નથી મહતી. ”

“ એ અધીય સંસારની વિચિત્રતા છે. એ બાધ્ય વસ્તુએ કુર્માધીન છે. એ પરવરતુએમાં આઠલો જથો મોહ શો ? એવી પરવરતુએના મોહથી જ મનુષ્ય અધોગતિમાં

જાથ છે. અરે ! મતુષ્ય ભવસાં આવ્યા છતાં એટલુંચ ન
સમેકયો કે પોતાની વરસ્તુ કઈ ને પરવસ્તુ કઈ ? ”

“ પરવસ્તુ શાની બળી ? ચાલીયતાવીને કન્યાનો બાપ
લગ્ન કરાવી આપી કન્યાનો હાથ આપણા હાથમાં સોંપી
આપણુને એના માલેક બનાવે, પછી એ પરવસ્તુ કેમ કહેવાય ?
એ તો આપણી જ થઈ. ગમે તે સમયે આપણે એનો ઉપ-
લોગ કરી શકીએ—આનંદ મેળવી શકીએ.”

“ સવસ્તુ કઈ અને પરવસ્તુ કઈ એ સમજવાને
હજુ તમને વાર છે. તમે તો અત્યારે મોહચ્ચસ્ત છો તેથી
એનું તાત્પર્ય નહિ સમજાય. અરે ! આ આપણું શરીર લે
જ્યારે આપણું નથી, તે પણ મરણ પછી એક દિવસ આ-
ગમાં બળી ભર્સ થવાનું છે—તો પછી સ્વી પુત્રાહિક વરસ્તુ
ઓને પોતાની સમજવી એના જેવી અરૂપનતા ફીજુ કઈ વાર ? ”

“ વર્ધમાનકુમાર ! એ તમારી વાતો તમે સમજો. ત્યારે
તમે શું આ સુંદર રાજયાળાને નહિ જ પરણો ? શું તમને
પરણવાનું મન નથી થતું ? ”

“ જરાપણ નહિ. મને સ્વીની અલિલાખા જ થતી નથી.
ધૂંધા જ નથી.”

“ ત્યારે તમે શું કુંવારા રહેશો ? આટલો બધો વૈભવ,
ઐવર્ધ, ઠકુરાઈ છતાં તમે કુંવારા રહેશો ? લંદગી કુંવારી
શી રીતે પસાર કરશો ? અમને સ્વી વગર તો એ બધું સુનુ
શુનુ લાગે. એ વૈભવ, ઐવર્ધમાં જરાય ચિત્ત ન લાગે.

“ એ તમારો વૈભવ, અને ઐવય્યનો આડંબર પણ
મારે નહિ લોઇએ સમજ્યા ? ” વર્ધમાનનાં વચ્ચેન સાંભળી
એના મિત્રો ચમક્યા. “ હે.... શું વૈભવ, ઐવય્ય પણ તમને
ગમતા નથી ? ત્યારે તમે શું કરશો ? ગરોળીમાં લુવન કષ
ચીતે પસાર કરશો ? ”

“ સાધુ-સંન્યાસી થઈને. ત્યાગી થઈને. ”

“ ત્યારે શું તમે સાધુ થશો ? ”

“ હા, શું સાધુ થવું-દીક્ષા લેવી એ જોડું છે ? ”
વર્ધમાનકુમાર હસ્યા. “ દીક્ષાનું નામ સાંભળી આટલા બધા
બડકો છે. કેમ ? દીક્ષા એ તો માનવ લુવનની ઉંચ્યમાં ઉંચ્ય
વસ્તુ છે. લુવનતો એ મહા મંત્ર છે. ”

“ અરે વર્ધમાનકુમાર ! શા માટે દીક્ષા લેવી ? દીક્ષા લઈ
તપ કરીને પણ એના ઇણ તરીકે આવી સમૃદ્ધિ પામવી એ જ
ને ? તે તો તમને અહીયાં જ મળી છે પૂર્વે તપ જપ કર્યો હશે
ત્યારે જ આવી મહાન સમૃદ્ધિ મળી છે તે લોણવો તો
ખરા ! પછી વૃધ્ધાવસ્થાએ ચાંસિત્ર લેજો. ”

“ અરે મિત્રો ! તમારી ને મારી સ્થિતિ નિરાળી જ છે.
ઓ, લક્ષ્મી, વૈભવ તો લવોભવ આપણુને મહ્યાં અને છોઝ્યાં
ઇતાં કાર્યસિદ્ધ તો ન. જ થઈ. એ અભિલાષા હજુ ન
ગઈ. જેમાં તમને સંપૂર્ણ સુખ હેખાય છે તેને જ હું હું અ
માતું છું. મને એમાં હુંઅ હેખાય છે, માટે હું હું તો ત્યાગી
થવાને આવ્યો શું-દીક્ષા લેવાને આવ્યો શું. ”

“ એ તમારો નિશ્ચય માતાપિતા આગળ કેવી રીતે કાયમ રાખશો ? શું માતાપિતાની આજા તમે નહિ માનો ? વર્ધમાનકુમાર ? તમે જે વડીલોની આજા ઉલ્લંઘન કરશો તો તમારું જેઠને અમે પણ માતાપિતાની આજાનું ઉલ્લંઘન કરતાં શિખશું, એટલું જ નહિ પણ જગતમાંય એવો વ્યવહાર પ્રવર્તણે કે લોકો વડીલોની આજા ઉલ્લંઘન કરતાં શીખશો ને ઉપરથી તમારું ઓહું આપશે સમજયા ? ”

“ માતાપિતાની આજા એ એક જૂદી વાત છે. પોતાની ઈચ્છાથી પરણું ને ફૂકેત માતાપિતાની ઈચ્છાને માન આપવા ખાતર લગ્ન કરવા એ જૂદી વાત છે. માતાપિતાની આજા માનવી એ પુત્રોની ફરજ છે. હું માતાપિતાને સમજાવીશ, તેમ છતાં એમનો અતિ આથરુ થશે તો જેઠશ; પરંતુ મને પોતાને તો જરાય એમાં મોહ નથી. ” વર્ધમાનકુમારે કહ્યું.

એ વાત ચાલતી હતી એટલામાં વર્ધમાનકુમારને લગ્નની વાત કણુલ કરાવવા માટે ત્રિશલાહેવી ત્યાં આવી પહોંચ્યા. માતાને આવતા જેઠ ત્રિશલાનં દન ઉલા થયા, એમની સાથે બીજા પણ રાજકુમાર ભિત્રો ઉલા થયા. વર્ધમાન માતાના ચરણુમાં નથ્યા. માતાએ શુભ આશિષ આપી. ઉચ્ચ આસન ઉપર માતાને બેસાડી વર્ધમાનકુમાર એમના આગળ આવી એલયા “માતા ! કયા કાર્યપ્રસંગે આપનું પધારવું થયું ? મને જે ખોલાંયો હોતો હું આપની પાસે આવી હાજર થાત.”

“ વત્સ ! ફૂકા એક જ કાર્ય માટે હું તમારી પાસે

આવી છું. અમારી તમારી પાસે એક વસ્તુની માગણી છે તે તમારે કણુલ છે કે નહિં ? ”

“માતાપિતાની આજા પાળવી એ પુત્રનો ધર્મ છે. ”

“તો તમે એક જ માગણી સ્વીકારો ને આ સમર્વેર રાજની કન્યા યશોહા આવેદી છે એની સાથે પોંચિશહંદું કરો. અમારી એ અલિલાખા પૂર્ણ કરો. ”

“માતા ! લગ્ન કરી સંસારના બાધનમાં પડવું, એમાં જીવનની મહત્ત્વા શી ? પરછું અને સંસારની વાસનાઓમાં રક્ત થવું, અનેક પ્રકારના ખાનપાનમાં પ્રીતિવાળા થવું, એટલેથી જ જીવનની પરિસમાઝિ છે શું ? અનેક પ્રકારની આદૃતોથી વીટાયેલાં એ સુખોથી શું તમે મને સુખી કરવા છું છો છે. ? ”

“એમાં આદૃતો શી દીકરા ! સુખ એ તો સુખ જ કહેવાય. યૌવનવયમાં પુરુષ ગમે તેવા સૌભાગ્યવાળો વૈભવનાલો અને સર્વર્થ છતાં એકલો, અહુલો ઓવગર શોભતો નથી, એ તમે કયાં નથી જાણુતા ? ”

“પણ માતા ! એ સૌભાગ્ય, વૈભવ, ભારે શા કામના છે ? સંસારનાં એ મોહુંધનો મને શું કરનાર છે ? ”

“તમે જન્મથી જ વૈરાગ્યથી ભરેલા અને હીક્ષા લેવાને આતુસ્વંત છો. અમારા મોટા પુષ્યયોગે તમે અમારે ઘેર

આવ્યા છો છતાં પણ તમે અમારી આટલી છંછા પૂર્ખું
કરો તો કીડ. ”

“ એના કરતાં તમારો પુત્ર દીક્ષા લઈ મહાન् ત્યાગી—
તપસ્વી જને એ શું તમને નથી ગમતું માતા ! સંસારના મોહ-
બંધનમાં બંધાઈ વાસનાના કીડા થવું એના કરતાં એ બધાંથ
મોહબ્બંધનનો ત્યાગ કરવાં એ શું જોડું છે ? ”

“તમારે દીક્ષા લેવી હોય તો ભલે, પણ એક વખત ત-
મારે પરણવું તો પડશે જ. ધરમાં પહેલીઓદીને ફરતી તમારી
વહુને જોવાને હું ઘણી છન્નેજાર છું. સંસારમાં સંસારીયોને
કોથી વિશેષ થીલુ કદ્ય અભિલાષા હોય ? ”

“ માતા ! એ અભિલાષા તો તમારી પૂર્ખ થઈ ગઈ છે.
મારા મોટાભાઈની વહુને જોઈ શું તમારી હોંશ પૂરી નથી થઈ ? ”

“ પણ હણ વર્ધમાનકુમારની વહુ નથી આવી ને ?
અમારા જીવનમાં માત્ર એ જ અભિલાષા બાકી છે. તમે હા
લણો. બાકી બધી વાતની તૈયારી છે.” માતાએ કહ્યું.

“માતા ! પણ આવી જોટી બાખતામાં આવો મોહ શે? હુનિયામાં દરેકના જીવનમાર્ગે જૂદા જૂદા હોય છે. કોઈ
સંસારના પ્રવાહમાં જંપલાવે છે, કોઈ દીક્ષા થહણું કરો સંસાર
તરીને બહાર આવે છે. એ સંસારથી પાર ઉત્તરવા તો અમારું
અહીંથા આગમન થયું છે.”

“ ગમે તેમ હોય, તમે અમારા અકિતમાન પુત્ર છો. ”

અમારાં લુખતાં તો અમે તમને દીક્ષા કેવા હેશુ' નહિ. આવા સુડીમળ શરીરવાળા તમે દીક્ષા પ્રહૃષ્ટ કરી અમેક પ્રકારનાં કષ્ટ સહન કરો કે અમે કેવી રીતે જોઈ શકીએ ? માટે અમે જીવીએ ત્યાં લગી તમે સંસારમાં શહે. પરણીને અમારી છંચા પૂર્ણ કરો. ”

માતાનો એક જ વાતનો આશ્રમ સાંભળી વર્ધમાનકુમાર મૈન રહ્યા. “પુત્ર ! શા માટે દિવગીર થાવ છો? તમે વીતરાગ છો, તીર્થ'કર છો, તે અમે જાણીએ છીએ, પણ તીર્થ'કરો શું લગ્ન કરતાં નથી? તમારી પહેલાંના તીર્થ'કરો પણ પરણેલા છે. પરણી સંસારસુખ લોગવ્યા પણી જ એમણે દીક્ષા પ્રહૃષ્ટ કરી છે; છતાં તમે પરણુવાની શા સારુ ના પાડો છો? ”

માતાના આવા આશ્રમથી વર્ધમાનકુમાર વિચારમાં પડ્યા. અચીત, હું નહિ પરણીશ તો મારી માતાને અપસ્થિ હુઃઅ થશે. જે કે સંસારના લોગવિલાસે ઉપર સુહુલે મને

પ્રીતિ નથી, એ મોહનાં બંધનો મને બાંધી શકે તેમ નથી; છતાં માતાના આશ્રમને વશ થઈ મારે એમતું વચન માન્ય કરતું પડશે. મારી માતાને હુઃઅ ન થાય એની આતર તો ગર્ભમાં પણ હું નિશ્ચલ-સ્થિર રદ્ધો હતો. વળી એમના સુખના ખાતર તો મેં નિશ્ચય કર્યો હતા. કે—“ એ માતાપિતાના લુખતાં હું દીક્ષા પ્રહૃષ્ટ કરીશ નહિ તો ભલે તેટલા સમય પર્યાત માતાપિતાની અભિવાધા પૂર્ણ થાઓ ! ”

“ તેમ શું વિવાર કરો છો વર્ધમાન ! અમારી તો એ જ આજા છે. હું અને તમારો પિતા તમારો વિવાહ જેવાને અખીરાં છીએ, તમે હા ભણો એટલે તરતજ બધી તૈયારોએ થઈ જાય. અધ્યાય તીર્થંકરોએ જેમ પરણી સંસારસુખ લોગવી દીક્ષા અહણું કરી છે તેમ તમે પણ પરણીને પણી સમય આવે દીક્ષા અહણું કરજો. ” માતાએ પોતાનો આચહ ચાહુ રાજ્યે.

“ ઠીક છે માતા ! તમારો આવો આચહ છે તો તમારી અભિવાધા પણ પૂર્ણ થાએ. ” વર્ધમાનકુમારે કહ્યું. કંઈ માતાપિતાને હુંઘ ન થાય, એમની આજાનો લોપ ન થાય, તેમજ પોતાને પણ લોગકર્મ થોડું ક અવશેષ હતું કેથી માતાની વિનાંતિ વર્ધમાને સ્વીકારી લીધી.

વર્ધમાનકુમારે લગ્નની વાત કણૂલ કરવાથી સર્વત્ર આનંદ આનંદ છનાએ ગયો. વિવાહની તૈયારોએ થવા લાગી. સૌભાગ્યવંતી સ્વીએ માંગલિક ગીતો ગાવા લાગી. માતાના હર્ષની તો વાત જ શી ?

ચોળ્ય સમયે વર્ધમાનકુમારના વિવાહ યશોદા સાથે થઈ ગયા. એમના મિત્રો, માતાપિતા વગેરે સ્વજનવર્ગમાં આનંદ આનંદ વત્તાયો. ધૂચછા નહિ છતાં વર્ધમાનકુમારે યશોદા સાથે સંસારસુખ લોગવતાં કેટલાય વર્ષ વ્યતીત કર્યાં.



પરમસુખને માટે.

વર્ધમાનકુમારને યથોદા સાથે ગૃહવાસપણામાં ફેટ-
લાંક વખતે પાણીના પ્રવાહની માઝેક વહી ગયા, છતાં એ આ-
ત્મા સંસારથી નિર્બેંધ હતો. માયાના બંધનોમાં રહેવા
છતાં એ બંધનસુક્ત આત્મા હતો. માર્ગ શું ને પારકું
શું એ વસ્તુસ્વરૂપનો જીતા હતો. જીનવાનું આત્મા ગમે
તેવી સ્થિતિમાં પણ જે સમયેક જીન ઢાય તો તે નિર્બેંધ
૫૮ રહે છે. ચોતાને છાંછા નહિ છતાં ઇજી માતાપિતાની
આજાથીજ જેમને અહૃસ્થાશ્રમના બંધનમાં બંધાવું પડ્યું
હતું. જગતમાં એ માયાબંધન માટે મનુષ્યો અનેક ગડ-
મથદો કરે છે, ક્રાંકાં મારે છે, એને માટે અનેક કણ્ઠો સહન
કરે છે; છતાંચ સર્વત્ર એવો કાંઈ નિયમ નથી. ત્યારે આ
મહાપુરુષ અનિદ્ધારે વળગેલા બંધનને સમય આવે છોડ-
વાને આતુર હતા. એનો ત્યાગ કરવાને અતુકૂવ સમયની
રાહ જેતા હતા. યૌવન છતાં એ વર્ધમાનકુમાર નિર્વિકારી
હતા. રાગ, દ્રેષ્ટ, માયા, મત્સર તેમજ વિષયની તૃષ્ણા રહિત
હતા. માયાની મધ્યમાં છતાં એમની દ્રષ્ટિ માત્ર એક જ હતી:
'ક્યારે આ માયાનાં બંધનનો ત્યાગ કરીને હું ત્યાગી અનું?'

અતુકે વર્ધ્માનકુમારની વચ્ચે અહૃતીશ વર્ષાની થઈ. એ અરસામાં એમનાં માતાપિતા આ સંસારમાંથી હું મેંશને માટે વિહાય થઈ ગયાં. વર્ધ્માનના મોટા ભાઇ નંદિ-વર્ધન હતા. માતાપિતાના મૃત્યુથી ભાઇ નંદિવર્ધનને બહુ એદ થયો. એ સંસાર-સ્વરૂપના દ્રષ્ટા વર્ધ્માનકુમારને તો જીવિષ્યમાં વીતરાગ થવાનું નિર્માયું હતું. એવા વીતરાગ થવાને જન્મેલા પુરુષોને રાગ-દ્રેષ્ટ ડે મોહનાં બંધનો શું કરી શકે ?

એ શોકાકૂલ થયેલા મોહન્દ્રસ્ત નંદિવર્ધનને વર્ધ્મના-કુમારે હિલાસો આપ્યો : “ બંધુ ! પ્રાણીઓને મૃત્યુનો પાછળ જ લાગેલું છે. જે જન્મે છે તે અવસ્થા એક હિસ્સ મૃત્યુ પામવાના છે. દરેકને માટે એ નિયમ તો સ્વાક્ષાવિક જ છે તે એવી બાબતોમાં એદ કરવાથી શું ? ”

“ હા ! બંધવ ! જન્મ્યા છે એ ભરવાના જ એમ સર્વ ડોઈ સમજે છે, છતાંય જ્યારે સમય આવે છે ત્યારે એવી આકૃતોમાં ધીરપુરુષો પણ શોકથી વ્યાકૂલ ચિત્તવાળા નથી થતા શું ? ”

“ બંધ્યો ! એ બધા મોહના વિલાસો છે. સમજુ જનોએ પણ મોહની એ ચેષ્ટાઓમાં ફ્રસાવું શું ? ”

“ છતાંય ધીરજ તે શી રીતે રહે ? એ માતાપિતાનાં દર્શન હવે અપણુને ક્યારે થશે ? શું થશે ? ”

“ ભવોક્ષણ માતાપિતા તો અવશ્ય ભળે છે. એક ઓંના ઋણાનું થિયે સંચોગ અને વિચોગ થાય છે. હુંખને સમયે આર્ત્થાન કરવાથી તો માત્ર કલેશની જ વૃદ્ધિ થાય છે. ”

“ બંધવ ! તમારું કહેવું તો હીક છે. આકૃતના સમયમાં ધીરજ ધારણ કરવી એ ઘણી સારી વાત છે. આપણા છત્રસ્વરૂપ પિતાજી તો આ ઝ્રાની હુનિયા તજ ચાલ્યા ગયા. આ રાજ્ય રાજી વગરનું રહે એ હીક ન કહેવાય; માટે બંધવ ! પિતાજીનું રાજ્ય તમે શોભાવો-અદ્વિતીય કરો. અમે સર્વે તમારો રાજ્યાભિષેક કરીયે. ” નંદિપર્બને વર્ધમાનકુમારને કહ્યું.

“ અરે બાંધવ ! તમારા એ રાજ્યને હું શું કરું ? તમે પાઠવી છો, મોટા છો. મોટાબાઈ હુયાત છતાં મારાથી રાજ્ય કેમ અહણું થઈ શકે ? માટે રાજ્ય ઉપર તો તમારો જ હુક્ક છે. ”

“ છતાં એ મારો હુક્ક હું તમને સમર્પું છું. તમે પ્રજાને પ્રિય છો, મારાં કરતાં રાજ્ય તમે ઘણી સારી રીતે કરી શકો તેવા છો, [પિતાજીની કીર્તિમાં તમે વધારો કરી શકો તેવા છો?] ”

“ પિતાજીની કીર્તિ હું ઓળ રીતે વધારીશ. હું તો સમય આવે હીક્ષા અહણું કરી મુક્તિનું સામ્રાજ્ય મેળવીશ, માટે એ રાજ્ય તો તમને જ શોભે. ”

“ બલે અનુકૂલ સમયે દીક્ષા અહંકૃત કરને પણ અત્યારે આ રાજ્ય અહંકૃત કરવામાં શું હરકત છે? રાજી થયા પણી પણ સમય આવે તમે દીક્ષા તો લઈ શકો છો ? ”

“ છતાં રાજ્ય અહંકૃત કરવાની મારી લેશ પણ ધૂમળા નથી, માટે એ સંબંધી વિશેષ આશ્રણ હું જવા દો. અને રાજ્યનો ભાર તમે જ અહંકૃત કરો. ”

સિદ્ધાર્થ રાજીના મરણ પણી વર્ધમાનકુમારે રાજ્ય અહંકૃત કરવાની સાક્ષીના પાડવાથી મંત્રી વગેરે પ્રધાન પુરુષોએ નાદવર્ધનનો રાજ્યાભિપેક કર્યો.

નાદવર્ધનનો રાજ્યાભિપેક થયા પણી વચ્ચેમાં કેટલાક દિવસો પસાર થઈ ગયો એટલે વર્ધમાનકુમારે દીક્ષા અહંકૃત કરવાને મોટાલાઈ નાદવર્ધનની રજા માગી. “ અંધો ! હું નો તમારી રજા હોય તો હું દીક્ષા અહંકૃત કરી પરમ સુખની પ્રાપ્તિને માટે પ્રયાસ કરું. ”

વર્ધમાનકુમારની દીક્ષાની વાત સાંસળી નાદવર્ધન બ્યાકૂલ ચિત્તવાળા થયા. “ બાંધવ ! માતાપિતાનો મૃત્યુનો શોક તો હજુ તાને છે. એ શોકના ધા હજુ તો વિસરાયા નથી ત્યાં તમે એ ક્ષતિ ઉપર ક્ષાર શા માટે નાખો છો ? હમણાં તો સંસારમાં રહેા. સમય આવે વળી દીક્ષા અહંકૃત કરને. ”

“ બાંધવ ! મૃત્યુ એ કાંઈ કોઈની રાહ નોતું નથી. વળી આ ચૌચનવચ્ચમાં દીક્ષા અહંકૃત કરી આત્માના શૈયઃ માટે કેટલું કરવું હોય તેટલું કરી રાકાય. કોણું જાણું કે વૃદ્ધાવસ્ત્રા

કેવી આવશે ? સંયમનો નિર્વાહ કરવાને તો યોગનનો સમય જ ઉપયોગી છે.”

“ હા ! બંધુ ! માતાપિતાના શોકમાં તમારો દીક્ષાનો વિચાર મને અધિક વિહુવલ કરે છે—ચિત્તને આકૃતિબ્યાકૃત કરે છે. અરે ! આ સંસારની તે કેવી વિચિત્રતા ? જ્યાં એક ગમ વિસરાયો નથી ત્યાં થીને તૈયાર જ છે. હુઃખ ઉપર શું વિધાતાએ હુઃખ જ ઉત્પન્ન કર્યું છે ? ”

“ બંધુ ! એવો જોટો શોક શા માટે ? માતાપિતાના સ્નેહથી હું આજસુધી ગૃહવાસમાં રહ્યો, માતાપિતા હૃથાત હોય ત્યાં લગી મારે સંયમ ન અહણુ કરવું એ મારો નિશ્ચય પણ હુવે પૂર્ણ થયો, માટે હુવે તો તમારે રજ આપવી જ નોંધયો. મારા લુલનમાં ફૂકતા એ એક જ ચીજ આકી છે અને તે દીક્ષા. તમારું કર્તાબ્ય તમે બળવો, મારું કર્તાબ્યપાલન મને કરવા ધો. આ સંસારમાં એક ક્ષણુ માત્ર લુલવું એને ભડસો નથી તો ગઠી થીજી વાત તે શી ? ”

” તમે વીતરાગી છો, સમર્થ છતાં ક્ષમાવાળા છો, અમેય સમજળુએ તે. થીએ કે તમે નિશ્ચય દીક્ષા અહણુ કરવાના છો; કારણુ કે સંસારમાં અમારો માર્ગ જ્યૂહો છે તમારો માર્ગ પણ જુહો છે. નેવી ગતિ હોય છે તેવી જ મતિ થાય છે; છતાં અમારા વચનથી તમે યોડો સમય ગૃહવાસમાં રહો. માતાપિતાનો શોક વિસરાય એટલે તમે ખુશીથી દીક્ષા અહણુ કરનો. ”

“ ડીક છે, તમારો આટલો આખેહ છે તો હું એ વર્ષં
પર્યંત સંસારમાં રહીશ. તે પછી અવશ્ય સંયમ અહણું કરીશ.”

“ જેવી તમારી ઈચ્છા.” નાંદિવર્ધને અતુમોહન આપ્યું.

તે પછી એ એ વર્ષનો સમય ગૃહનાસમાં વસવા છતાં
ત્યાળીની માઝક પસાર કર્યો. સનાન, અંગ, રંગ રાગ, એમણે
તણ દીધા. પ્રાસુક અને એપણીય આહારથી જ પ્રાણુવૃત્તિ
અલાવતા હતા. અદ્ભુતને ધારણ કરી હમેશાં વિશુદ્ધ
ધ્યાનમાં જ તત્પર રહેતા હતા. ગૃહસ્થ છતાં ભાવ યતિ થઈને
એમણે પોતાનો સમય વ્યતીત કરવા માંજ્યો.

વર્ધમાનકુમાર તો દીક્ષા લેવાના છે. એમની દીક્ષાની
ભાવનાની જાણ થતાં ચક્વતી ધારીને એમનો સેવા કરનારા
અન્ય રાજપુત્રો એમને દીક્ષાના ઉત્સુક જાણી પોતપોતાના
રાજયમાં ચાલ્યા ગયા. ભાવ યતિ થયેલા વર્ધમાનકુમાર હવે
દીક્ષા લેવાને તૈયાર થયા.

સમયને જતાં કાંઈ વાર લાગે છે ? કાળ પોતાનું કામ
કર્યો જ જય છે. એ કાળના સપાટામાં મૂર્ખ માનવી તો
છક્કડ ખાઈ ગોથાં ખાય છે. એ એ વરસની અવધિ પણ પુરી
થઇ ને વર્ધમાનકુમારની વય ત્રીશ વર્ષની થઇ. એ દરમિયાન
નાંદિવર્ધનને ભાતાપિતાનો શોક પણ વિસારે પછ્યો. ગમે
તેવી તાણ બાણતો પણ કાળે કરીને બૂકી જવાય છે. એ
હૈયાના માર્મિક વા પણ સમયના વહેવા સાથે ઘસાતા જય

છે. માનવનાં જાય કર હર્ષો પણ સમયને બણે ભુંસાઈ જાય છે :
અનેક પરિવર્તન થઈ જાય છે.

ગ્રીશ વર્ષની ઉમરે મહાવીર કુમાર હુવે દીક્ષાને ભાઈને
તૈયાર થઈ ગયા. નંહિવર્ધન કે કોઈ પણ વ્યક્તિ હુવે એમને
અટકાવી શકે તેમ નહોતું. માગશર માસની કૃષ્ણ દુશ્મિને
દિવસે એમણે સર્વની અતુજાપૂર્વક તેમજ નંહિવર્ધને
જેમનો દીક્ષા મહોત્સવ કર્યો છે એવા જો દીક્ષા મહોત્સવમાં
દેવતાઓ અને મનુષ્યો સહિત તેમના રાજીએઓ ભાગ લીધે.
એવા ધામધૂમપૂર્વક વર્ધમાન કુમારે દીક્ષા અહિષ્ણ કરી.
સર્વે અલંકારો, આભૂષણો, વસ્તો, ખાનપાન વગેરે મોજ-
શાખનો ત્યાગ કરી ત્યાગી, સંન્યાસી થઈ ગયા. વર્ધમાન-
કુમાર હુવે વર્ધમાનસ્વામી કે મહાવીરસ્વામી ત્રણે જગતને
પૂજ્ય એવા થયા. મોહ, મમતા અને પરિશ્રહ રહિત એકલા
અદુલા વર્ધમાનને જોઈ સ્નેહીજનોની આંખમાંથી અશ્રુઓ
ખરી પડ્યાં. ભાઈ નંહિવર્ધનને શું બોલવું ને શું નહિ ?
એમનો કંઠ ઝાંધાઈ ગયો, અશ્રુએથી આંખો ભરાઈ ગઢ.
“હા ! બાંધવ ! તમારા વિના હુવે અમે શું કરશું ? માતા ગમ,
પિતા ગયા, એક નાનો ભાઈ હતો તે પણ અમારો સાથ
તળુને અમને છોડીને ત્યાગી થઈ જયો. હા બાંધવ ! તમે
એકાડી કયાં જશો ? અરે હૃષ વિધિ ? તે આ શું કર્યું ? ”
સુક્તા કર્ણે એકલા અદુલા વર્ધમાનને જગતને માર્ગ પાદચારી
ગમન કરતા જોઈ નંહિવર્ધન રડી પડ્યા. સર્વસંબંધી વર્ગ
પણ રડી રહ્યો, વિલાપ કરવા લાગ્યો. વર્ધમાન તો વિતસંગ

પુરુષ. એ સંસારનું માયાવી નાટક એમને શું અસર કરે ? એ તો લોકોત્તર પુરુષ, પ્રાણીઓનાં એવાં કંઈ મોાંડ નાટકોનો નાશ કરવા માટે તે એમનો અવતાર હતો. એ અવતારી પુરુષ, જગતના જનોને પોતાની ખરી વસ્તુનું ભાન કરાવવા માટે તો એનો આ પ્રયાસ હતો, એની દીક્ષા પણ ભીજના ઉપકારને માટે હતી. એ નરશ્રેષ્ઠનું જીવન ધોય તો જુહુજ હતું, મહાનું કાર્યો કરવાને વર્ધમાન નિર્માણ થયેલા હતા. મતુષ્ય જન્મનો ઉદ્દેશ અને એની સાર્થકતા તેઓ સમજતા હતા, મોહ, માયા, રાગદ્રેષ વગેરે પાપજન્મ બંધનોથી તે રહિત હતા. આવા સમર્થ પુરુષને એ માયાવી બંધનો શું અસર કરે ?

એ નરશ્રેષ્ઠ વર્ધમાન સર્વની અનુજ્ઞા મેળવી, વિહાર કરવાના ઉદ્દેશથી ત્યાંથી આગળ ચાલ્યા, એકાકી, વચ્ચે પાત્ર રહિત આ ઉત્તમ પુરુષને જંગલને માર્ગ જતા જોઈ કેના હૃદયમાં ધીરજ રહે. વર્ધમાનની પતની યશોદા, એ નંદિવર્ધન એન સુદર્શના, પુત્રી પ્રિયદર્શના સર્વ કોઈ સ્નેહી આપતજન અશુલીની આંખે વર્ધમાનને જેતું રહેન કરવા લાગ્યું, સર્વના રૂદ્ધન, વિલાપ, એ દશ્ય કરણું રસિક હતું. ગમે તેવું વજી હુદ્ધું પણ ક્ષાણુકર સ્તંભિત થઈ જાય, તે પછી આપત સ્નેહી જનની વિયોગ સમયે શ્રી સ્થિતિ થાય એતો આપ અનુભવેજ સુમજાય ?

સગાં સ્નેહી ઉપરાંત વર્ધમાનની દીક્ષા જોવાને અનેક લોક લાં નગરની બહાર ઉપવનમાં એકત્ર થયું હતું. નંદિ-

વર્ધન રાજી હતા, વર્ધમાન એમના નાના ભાઈ યુવરાજ હતા. એ યુવરાજ સંસારના લોગવિલાસો, વૈભવવિલાસો તળ સાધુ થાય છે એ દક્ષય જેવાની કેને ઉત્કંઠા ન થાય ? દીક્ષા, દીક્ષા પણીની વર્ધમાનની સ્થિતિ ગમે તેવા સંસારી જીવને પીગળાવવાને ખસ પુરતી હતી. અરે એ તો વર્ધમાન ! એ મહાપુરુષ ! આટલી ત્રીસ વર્ષની નાની વચે બધા વૈભવવિલાસો છોડી એમણે ત્યાગીપણું સર્વીકાર્યું. કયાં આપણે અને કયાં એ ? કયાં કીડી અને કયાં કુંજર ?

છતાંય એ સર્વમાં એમના બાંધવ નંદિવર્ધનને અને એમની પત્નીને આ સમયે અસહ્ય હુઃખ થતું હતું. સુરીલા સુંદરી બશોદા ! મહાસમર્થ વર્ધમાન એ તો વીતરાગ. એ વીતરાગને પોતે શી રીતે રીજવી શકે ? સભળવી શકે ? અને નંદિવર્ધન તો વિલાપ કરીને પણ પોતાને ઉલરો ખાલી કરે. આંખમાંથી અશ્વ પાડતાં અને નાના પણ શુણે કરીને ગરિષ્ઠ બાંધવને ખમાવતા, વંદન કરતાં નંદિવર્ધન વિનંતિ કરવા લાયા. “ હા ! બાંધવ ! હું તમે બાંધવ મટી મહા-વીરસ્વામી થથા. અમારે પૂજય થથા. અમને સર્વને છોડી તમે ત્યાગી થથા. અરે ! આ હુઃખમય સંસારમાં અમને તમારું દર્શન હું કયારે થશે ? અરે લગ્નનું ! તમે તો નિઃસ્નેહી ! વીતરાગ છતાં કોઈ કોઈ સમયે હે બાંધવ ! દર્શન આપવા કુપા કરજો. આ તમારા સંબંધીવર્ગને ચાદ કરજો. અરે ! તમે તો નિઃસંગ થથા. તમારા સંસારીપણુંમાં અજ્ઞાન-તાના વશથી તમારી અમે કંઈ પણ આશાતના કરી હોય. તો

હે ઉત્તમ પુરુષ ! તમે અમનો. અમારો અપરાધ ક્ષમા કરનો. હે વિશ્વવત્તસલ ! જંસારના કોડા જેવા અમારી ઉપર કૃપા નજર રાખનો. જગત પૂજય ! તમારી અમે શું શું સ્તુતિ કરીયે ? તમારી ઉત્તમતાનાં અમે શું વખાણુ કરીયે ? હે જગતવત્તસલ ! તમારા વિના હવે અમારું શું થશે ? આ રાજ્ય-મંદિર તમારા વગરનાં શૂન્ય પડેલાં અમને કેમ ગમશે ? ”

મન્ત્રીઓએ વિવાપ કરતા નંદિવર્ધન રાજને સમજાવી શાંત કર્યો. જ્યાંસુધી દ્રષ્ટિ પડી ત્યાં લગ્ની સર્વેએ લાંબી નજરે એ વિશ્વવત્તસલ પુરુષના દર્શન કર્યાં. છેવટે રડતાં અને જગતને રડાવતાં એ નંદિવર્ધન આદિ પરિવાર ગામ તરફ પાછે વહુયો. બંધવ વગર એ રાજમહેલ, ભાગભગિયાઓ, એ શયનગૃહો સર્વે કંઈ આજે તો શૂન્યકારમય હતું. એ થશો-દાને, એ નંદિવર્ધનને હૃદયમાં શું થતું હશે ? વર્ધમાનના અલંકારા, વર્ધમાનનાં વસ્ત્રો, વર્ધમાનની સુવા-ઐસવાની જગ્યાઓ વગેરે જેઈ એમને શું થતું હશે ? એ તો એ વખતના એમનાં હૈયાં જ જાણો. પણ એ અસહ્ય જખમો મોહીજનોને સહન કર્યો [સવાય ધીને કાંઈ હવે ઉપાય ? કારણુ કે રાગદ્રેષાદિક શત્રુઓને ઓળખણી વર્ધમાને તો જીતેલા, ત્યારે એ શત્રુઓને ઠડાલસોયા, હિતસ્વી મિત્રો માનીને આપણે તો એમને સંબંધી ગણેલા, જીવનતું નાવ એમને સ્વાધીન કરી આપણે તો પરવશ પડેલા. આ પણુમાં ને એ વર્ધમાનમાં એટલો જ માત્ર તક્ષાવત !



પ્રકરણ ૧૮ મું.

દીક્ષાવરસ્થામાં.

હીક્ષા અહણુ કરી એ મહાપુરુષ વર્ધમાનસ્વામી નંહિ વર્ધનાદિક કુદુંખિજનોની અતુર્જા મેળવી એકાકી, વાઙ-પાત્ર રહિત, લિક્ષુ જેવા જણ્યાતા ત્યાંથી આગળ ચાલ્યા. બાદ્ય સમૃદ્ધ તો એમને ધણીય હુતી, પણ એમાં વાસ્તવિક સુખ એમને દેખાયું નહીં. એ ભાઈ સમૃદ્ધિ ભવેષણમાં મળી અને ગઈ. જે સમૃદ્ધિ મળ્યા પછી નિશ્ચિતપણે નાશ પામનારી છે. એવી સમૃદ્ધિ પાછળ જીવન વ્યતીત કરવું, એમાં જ રચ્યાપચ્યા રહેવું, એ વર્ધમાન જેવા દોકોતર પુરુષને કેમ ગમે? એવી કંધી સમૃદ્ધિ છે કે જે એક વખત પ્રાપ્ત થયા પછી જતી જ નથી. એવી સમૃદ્ધિ મેળવવા એક જ વાર પણ પ્રયત્ન કર્યો હોય તો તે પ્રાપ્ત થયા પછી મુદ્દવે જતી નથી. એ પરિશ્રમ કરેલો પણ વ્યર્થ જતો નથી. એવી સમૃદ્ધિ તે આત્મસમૃદ્ધિ.

એ આત્મસમૃદ્ધિ ગમે તે લોગે પણ આ ભવમાં પ્રાપ્ત કરવી એ તેમનું લક્ષ્યબિંદુ હતું. એને માટે ગમે તે પ્રયત્ન કરવો પડે, ગમે તેટલા લોગ આપવા પડે, દેહનું બલિદાન દેવું પડે કે અનેક પ્રકારનાં તપ કરવાં પડે, અનેક ઉપસ્થે—કષ્ટો સહન કરવાં પડે, પણ એ લક્ષ્ય પ્રાપ્ત કરવાની એમની તીવ્ચ અભિવાધા હતી. અને એ લક્ષ્ય મેળવવી હોય

તો આ બાધ્ય લક્ષમીને અવશ્ય ત્યાગ કરવો જોઈએ, કેમકે બાધ્ય લક્ષમી તજણા વગર આંતરિક લક્ષમી શું સહજ મળી શકે છે ?

એ વસ્તુને છોડીને જગત તો અસત્ય વસ્તુ તરફ દોડધામ કરી રહ્યું છે એ અસત્ય વસ્તુ, ધન-દોલત, ચૌવન, દંકુશાહ, ખી, પુત્રાદિકને પ્રાપ્ત કરવાને અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે છે—અનેક લોગો આપીને પણ એ વસ્તુએ કાળજીથી સંભાળી રાખે છે કે રહેને પલટાઈ ન જય ? જગતનું લક્ષ્ય જ્યારે આ બાધ્ય પરવસ્તુમાં આગળ ને આગળ ઝુકેલું હતું ત્યારે આ સમર્થ વર્ધમાનકુમારે બાધ્ય વસ્તુએ અસાર જાણીને છોડી દીધી. કોઈકાળે નાશ નહિ પામનારી આત્મિક વસ્તુએ પ્રાપ્ત કરવા માટે દીક્ષા અહૃત્ય કરી અને નિર્મમત્વપણું અંગીકાર કર્યું.

એ બિન્દુ જેવા જણ્યાતા વર્ધમાનમાં અનેક શક્તિએ હતી, અનેક લખિધેએ હતી, અંતરંગ લક્ષમી અપૂર્વ હતી, એમનામાં પરાક્રમ હતું, એ તો એમના જીવનનો પરિચય થતાં સહજ જણ્યાઈ આવે, અપૂર્વ અને જગતમાં એમનું અદ્વિતીય પરાક્રમ છતાં એ શક્તિનો ઉપયોગ વર્ધમાને કર્ણો સહન કરવામાં જ કરેલો. કર્ણાના એ સસુદ્ર ! ચાહે તો શત્રુ હો કે મિત્ર, જે કોઈ એમની પાસે આવે તે લાલ પ્રામ કરીને જય એવી એમની ઉદાર અને દ્વારા ભાવના હતી. એમની પ્રબળ-દઢ ભાવના કર્ણાને પણ નિષ્કળ ન જતી. કેમકે મહાવીર એ તો ચોવીશમા તીર્થ્યકર !

તીર્થંકર એ પદવી જગતમાં સર્વોત્કૃષ્ટ પદવી ગણ્યાય છે, જ્યારે સામાન્ય રીતે એક દેવતાનું દર્શન પણ નિષ્કળ જતું નથી, તેનાથી અવસ્થય કુળ પ્રાપ્ત થાય છે તો પણી વર્ધમાન એ તો તીર્થંકર. એનું દર્શન નિષ્કળ ન થઈ શકે, એના દર્શનથી પ્રાણી અવસ્થય લાભ મેળવી શકે ન.

એ વસ્તુ-પાત્ર કે શોભારહિત વર્ધમાનને દીક્ષા સમયે એક વસ્તુ દેવપતિએ આપેલું, તે એમની પાસે હતું. તે ય ક્યાં સુધી રહે ? એક સોમ નામનો દરિદ્રી પ્રાણશુ, વર્ધમાન પાસે ચાચના કરવા લાગ્યો. અને બાધ્યલક્ષ્મીની આવશ્યકતા હતી. એ બાધ્યલક્ષ્મીના ત્યાગીએ પેલા વસ્તુમાંથી અર્ધ વસ્તુ આપા હીથું. એ હયા કાંઈ જેવી તેવી નથી. રૂપીયામાંથી અડધો રૂપીયો. અને પૈસામાંથી અડધો પૈસો દાન કરવું એ કેટલી કરુણાભાવના હોય ત્યારે જ અની શકે છે.

દીક્ષા લીધા પછી એ ઘણોખરો સમય કાઉસરગ સુદ્રામાં જ પસાર કરતા, તેમજ તપક્ષીર્યા એ એમનો સુધ્ય ઉદ્દેશ હતો. દીક્ષાના પ્રથમ હિવસે એમને ગોવાળીયાથી કણની શરૂઆત થઈ, અને આખરે છેલ્દો ઉપસર્ગ પણ ગોવાળનો થયો. દીક્ષા લીધા પછીના સાડાભાર વર્ષમાં એ વર્ધમાને અનેક કણો ક્ષમાપૂર્વક સહન કર્યો. ઉપસર્ગ કરનારને શિક્ષા કરવાની એમનામાં શક્તિ હતી છતાં એ શક્તિનો ઉપયોગ ઉપસર્ગ સહન કરવામાં કર્યો.

સાડાભાર વર્ષ હરમિયાન વર્ધમાને એક છમાસી તપ,

નવ ચાતુર્માસ, છ દ્વિમાસિક, બાર આસખમણુ, એંતેર અર્ધોમાસખમણુ, એ ત્રિમાસિક, એ હોઠમાસિક, એ અઢી-માસિક, ત્રણુ લદ્ર, મહાલદ્ર, સર્વતોલદ્ર, પ્રતિમાચો. એ, ચાર અને દશ હિવસની તેમજ કૌશાંખીમાં પાંચ હિવસે ન્યૂન છ માસનો અભિથહુ ઉપવાસ સહિત, બાર અહુમ, અસો ને ઓગણુત્રીસ છૃદુ, આટલી તો એમની તપક્ષયાંચો થઈ ને ઝક્કત ત્રણુસો ને ઓગણુપચ્ચાસ તો એમને પારણું થયાં. એ તપક્ષયાંચોમાં એમણે અચિતજળનો પણ ઉપયોગ કર્યો નહેતો.

એમની અપૂર્વ શક્તિ હતી તેવી જ રીતે એમનું શાન પણ હતું. એમની જાનરૂપી લક્ષમી અદ્વિતીય હતી છતાં એમણે હીક્ષા લીધા પણી બહુધા માનનું જ અવલંખન ધારણું કરેલું હતું. એક જ સ્થાનકે સ્થિરવાસ કરવાથી રખેને પોતાનો પૂજા-સતકાર થાય તેથી ચાતુર્માસ સિવાય કોણ સ્થાનકે તે અધિક સમય વાસ કરતા નહિ. પોતે જાની છતાં હું જાની છું, સર્વજ છું, એવો દેખાવ કયારે પણ કર્યો નથી. અનુપમ શક્તિસંપત્ત છતાં એ બળનું અભિ-માન કર્યું નથી, તેમજ વચનસિદ્ધાંચો, અનેક લખિધવાળી શક્તિઓ. છતાં એ સાગરની જેવા ગંભીર હતા. એ ગંભીર અને ધૈર્યતાવાળા હૃદયનો પાર અલ્પજ મનુષ્ય શી રીતે પામી શકે ?

જગતમાં પ્રાણીઓને સુખમાં અનેક સુખો ગ્રામ થાય છે.

તેમ કષ્ટમાં પણ અનેક કષ્ટની પરંપરા પ્રગટ થાય છે. છિદ્રો-
માંથી અનેક પ્રકારના અનર્થી ઉત્પન્ન થાય છે. પાપકર્મો પણ
છિદ્રને જ શોધનારા હોય છે. તીર્થંકરે જ્યારે ગૃહવાસમાં હોય
છે ત્યારે પાપકર્મો એમને હેરાન કરતા નથી, પણ દીક્ષા લીધા
પછી તીર્થંકરે જ્યારે શરીરથી પણ નિઃસ્પૃહ થઈ જાય છે, એ
સમયનો લાલ લઈ કર્મો પોતાની તક સાધી લે છે. એ
હુંકર્મોને યોગે દીક્ષા લીધા પછી મહાવીરસ્વામીને પણ સાડા-
બાર વર્ષપર્યંત અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવા પડ્યા
હતા. કુદરમાં કુદર ગણ્યાતા અજાની લુચે. પણ એમને હેરાન
કરવાનું ચુક્યા નથી અને જ્યાં સુધી એ હુંકર્મો નાશ ન પામે
ત્યાં લગી આત્મલક્ષ્મી પણ પ્રગટ થઈ શકે તેમ નહોતું.
આત્મલક્ષ્મી ને ડેવળજ્ઞાન, ડેવલદર્શાન જ્યારે આત્મા ધાતી-
કર્માથી સુકૃત થાય છે ત્યારે જ ઉત્પન્ન થાય છે. એવાં ચાર
ધાતીકર્મોને નાશ કરવા માટે જ મહાપુરુષોને દીક્ષાનું અવ-
લંઘન લેવું પડે છે; કારણું કે ભવાંતરોમાં પોતાની જાતે ઉત્પન્ન
કરેલાં કર્મો ભવાંતરે પણ કર્તાની પાછળ જઈ ઉદ્ય આવે છે.
કરેલાં કર્મો ડોધને છોડતાં નથી, જેથી મહાનપુરુષો અધ્યાયેલાં
હુંકર્મોને ક્ષમાપૂર્વક લોગવી લે છે.

દીક્ષા લીધા પછી પણ એ મહાપુરુષને જ્ઞાન મેળવવા
ખુદ્ધની માઝેક શુરૂ શોધવાની જરૂર ન હોતી, તેમજ સંસારી-
પણ્યામાં પણ એમને અણુવાની જરૂર હોતી નથી. એ અવતારી
ખુરુષોનો જીન જ જ્ઞાન સહિત થાય છે. જીનની સાથે જ

એમને ભતિ, શુત ને અવધિ એ ત્રણ જાન હોય છે. અર્થાતું એ ત્રણ જાને સહિત માતાના ગર્ભમાં આવે છે, ને દીક્ષા લે છે ત્યારે ચોથું જાન ઉત્પજ્ઞ થાય છે; પણ પંચમ જાન તે એ ઘાતીકર્મનો નાશ થયે જ ઉત્પજ્ઞ થાય છે.

એમની દ્વાય, એમની ધૈર્યતા, શૂરવીરતા, ઉદારતા, ગંભીરતા, સર્વકંઈ અફ્ઝૂત હતાં. બુદ્ધના વિચારોમાં જ્યારે પરિવર્તન થતું હતું ત્યારે આ પુરુષનો નિશ્ચય એક જ હતો. બુદ્ધને વારંવાર નવા શુરૂ કરીને એમની પાસેથી જાન મેળવી જાની જનઃપું હતું ત્યારે મહાવીરને કર્મનો નાશ કરી સ્વભાવિક આત્માની અનંત શક્તિએ પ્રગટ કરવી હતી. આ નરશ્રેષ્ઠનું સર્વથા આંતરિક લક્ષ્ય હતું, બુદ્ધને બાહ્યથી જ સંપાદન કરવાનું લક્ષ્ય હતું. બુદ્ધને અનેક શુરૂઆતના પરિચયથી જ્યારે કાર્યોસ્થિતિ ન થઈ ત્યારે તપ્ય કરવા માંડયું, તપથી કંટાળો આંદ્યો એટલે ખાવા માંડયું. ધ્યાન કરવા માંડયું વગેરે એક નહિ તો બીજી એવા અનેક પ્રયત્નો સેવન કરવા પડ્યા.

આ મહાપુરુષનું તો જન્મથી જ એવું જાન હોય છે કે એમના કેટલું જાન હુનિયાના કોઈ પણ મનુષ્યમાં ન હોઈ શકે. એટલું જાન છતાં સંપૂર્ણ જાનની પ્રાપ્તિ એ જ એમનું કેવળ લક્ષણિંદું હોય છે. દીક્ષા લીધા પછી કેટલાંક કર્મો તપથી નાશ પામે છે, કેટલાક ધ્યાનથી અને કેટલાંક ઉપસર્ગો સહન કરવાથી નાશ પામી જાય છે.

તપ કરતાં અને ઉપસર્ગો સહન કરતાં બારબાર વર્ષો

પસાર થઈ ગયાં ને વિહાર કરતા કરતા ભગવાન કોઈ ગામની બહાર આવીને કાઉસર્ગંધ્યાને રહ્યા. તે સમયે એમને કોઈ મહાન્ ફુલ્કર્મ ઉદ્ઘ આવ્યું. એમને કાચોત્સર્ગપણું ઉલેલા એક ગોવાળીઓએ જોયા. તેમની પાસે પોતાના બળદો છોડિને ગોવાળ ગયો હોવા ગયો. ગોવાળ ગયો એટલે બળદો તો ચરતા ચરતા ધણે હૂર નિકળી ગયા. ગાયો હોઢીને ગોવાળ બળદો પાસે આવ્યો, પણ બળદો ત્યાં જોવામાં આવ્યા નહિ કેથી એણે પેલા મહાપુરુષને પૂછ્યું. “ અરે સાધુ ! મારા બળદો કયાં ગયા ? ”

દ્વાનપરાયણ એ મહાપુરુષે આ ગોવાળીયાને જવાબ આપ્યો. નહિ ત્યારે એને શુસ્તો ચઠ્યો. “કેમ જવાબ આપતો નથી ? શું મારું વચન સાંસળતો નથી કે ? ”

ગોવાળનાં વચન સાંસળી ભગવાન તો મૈન રહ્યા. અતિ શુસ્તાથી ગોવાળ બધાયો, “એ....મ ! જવાબ નહિ આપવાનું કૃણ જો. હમણું જ તને બતાવું છું.”

તરતજ એ ખીલા લાવીને ભગવાનના કાનમાં ડેકવા માંડયા કે જેની બન્ને ખીલાની અણીએ. એકણીન સાથે મળી ગઈ. હવે એ ખીલાને કોઈ કાઢી શકે નહિ તે માટે ગોવાળે બહાર હેખાતો બધી ભાગ છેદી નાખ્યો. પોતાનું કાર્ય બરાબર કરી ગોવાળ ભગવાનની તાડના કરતો અને પોતાની ખુશાલી પ્રગટ કરતો એવ્યો: “તારા ઢેંગીપણુંનું કૃણ તું હવે બરાબર લોગવ. મારા ખીલા એવા તો સજજડ છે કે

કોઈ કાઢી શકે તેમ નથી. જન્મારાપર્યંત લાડં હુઃખ હુર થઈ શકે તેમ નથી.” એમ બોલતો ગોવાળ ત્યાંથી આવ્યો ગયો.

કાનમાં આવી ખીલાઓની વેદના છતાં વર્ધમાન જરા પણ જ્વાનિ કે ખેડ પામ્યા નહિ તેમજ પોતાના ધ્યાનથી પણ ચલાયમાન થયા નહિ. ત્યાંથી પ્રભુ ઝરતા ઝરતા એક નગરીમાં પદ્ધાર્યો. એ અપાપાપુરી નગરીમાં ગોચરીને માટે વર્ધમાન સિદ્ધાર્થ નામના વણિકને ઘર પદ્ધાર્યો. સિદ્ધાર્થ વણિકે લગવાનને અહિતપૂર્વક પ્રતિલાભિત કર્યો. એ સિદ્ધાર્થને ત્યાં ખરક નામે વૈદ અવેલો તે એઠો હતો. એ ચિકિત્સા નિપુણ વૈદ સિદ્ધાર્થને પ્રિય સ્નેહી હતો. એની ચંચળ નજર આ નરશ્રેષ્ઠ ઉપર પડતાં જ એને જણાયું કે આ મહાપુર્ખ સર્વ લક્ષણું ચુક્તા હોવા છતાં જરા જ્વાન કેમ જણાય છે ? ” જેથી તરતજ એણે પોતાના મિત્રને કહ્યું “મિત્ર ! નથી સમજતું કે આ લગવાનનું વહન કેમ જ્વાનિયુક્ત જણાય છે ? ”

પોતાના મિત્રનું આવું કહોર વચ્ચન સાંભળી સિદ્ધાર્થ બોલ્યો. અરે ભાઈ ! એ તું શું બોલે છે. તું જરા તપાસ કરીને કહે કે શાથી એમ જણાય છે ? ”

તે જ સમયે ખરક વૈદે લગવાનનાં સર્વે અંગો તપાસ્યાં તો અન્ને કાનમાં ખીલા જોયા. તે એવી સંક્રાંતિની નાભેલા હતા કે મહાસુષ્પ્રકેલીએ જ નિકળી શકે. તે ખીલા એણે

પોતાના ભિત્ર સિદ્ધાર્થને બતાવ્યા. દાર્શણ કૃત્યથી સિદ્ધાર્થ કુમકુમ્યો. “અરે ! આવું ભયંકર દ્યાર કૃત્ય કયા પાપીએ કર્યું હશે ? હા ! ખીલા તો પ્રલુના ઠાનમાં છે ને વેદના તો જણે મને થાય છે. હે મહામતો ! માર્દ સર્વસ્વ અહૃણુ કરીને પણ કોઈ શીતે આ ખીલા તું બહાર કાઢ.”

“ અરે ! આયુતિએ જોતાં તો આ નરશ્રેષ્ઠ અધા વિશ્વનું રક્ષણ અને નાશ કરવાને સંમર્થ છે, છતાં કર્મના ક્ષયના માટે એમણે આવા અપકારીની પણ ઉપેક્ષા કરી છે.” વૈદે કહ્યું: “આ પ્રલુ પોતાના શરીરની પણ આકાંક્ષા રહિત છે તો તેમની ચિકિત્સા મારાથી કેમ થાય ?”

“ અરે ભિત્ર ! તારી એ વચ્ચનની કુદુક્તિ જવા હે. મારી ખાતર પણ તું ભગવાનને શાલ્યરહિત કર. નકામો વાતોમાં સમય વ્યતીત ન કર.”

એમની વાતચિત દરમિયાન આ મહાપુરુષ ત્યાંથી બહાર ચાલ્યા ગયા, અને શુલ્ક ધ્યાનમાં તત્પર એવા નગરની બહાર પ્રતિમા ધારણુ કરીને રહ્યા.

સિદ્ધાર્થ અને ખરક વૈદે ઔષધ વગેરે લઇને ત્વરાથી ઉધાનમાં આવ્યા, લ્યાં ભગવાનને મૌનયણે કાઉસગગધ્યાને ઉલેલા જેયા. વર્ધમાનને એક તેલની કુંડીમાં એસાર્યા. સર્વ શરીરે તેલનું મર્દન કરાવી બળવાન પુરુષો પાસે શરીરના તમામ સાંધા શિથિલ કરાવી નાખ્યા. પછી એ સાણુસીએ લઇ એક:

સામટા બનને ઘીલા એંચા એટલે દૃધિર સહિત તે ઘીલા અહાર નીકળી પડ્યા. ઘીલા કાઢતી વખતની એ તીવ્ર વેદનાને ચોગે એ મહાપુરુષથી બધાંકર ચીસ પડાઈ ગઈ.

સરેઠાણી ઔષધીવડે પ્રભુના કાનને તરત જ ઝાડવી, ખ-માવી અને નમીને સિદ્ધાર્થ અને ખરક વૈદ પોતાને વેર ગયા. એ શુભાશયવાળા પુરુષોએ ઘીલાનો ઉદ્ધાર કરતાં ભગવાનને તીવ્ર વેદના કરી છતાં તેઓ દેવાયુનો બધ કરી સ્વર્ગલક્ષ્મીની લોગવનાર થયા. પેદો હુષ ગોપાળ એવા તીવ્ર પાપને ચોગે સાત રાજલોક નીચે ઉતરી ગયા અર્થાતું સાતમી નરક-પૃથ્વીને મેમાન થયો.

એ ઘીલાના ઉદ્ધાર સાથે એમનાં હુષ કર્મો પણ સંપૂર્ણ-પણે નાશ પામ્યાં. ત્યાંથી વિહાર કરતા પ્રભુ જૃંભક ગામની બહાર નજીવાલિકા નહીના તટ ઉપર આવ્યા. ત્યાં ક્ષપકશ્રેણી પર આડણ થયેલા ભગવાન દ્યાનમાં એકાશપણે રહ્યા.



પ્રકરણ ૧૯ મું.

આત્મલક્ષ્મીની પ્રાર્થિત.

ક્ષપકશ્રેણી આડમા શુશુસ્થાનકથી આરંભાય છે. આડમા શુશુસ્થાનકથી આગળ જનારા પ્રાણીઓમાં કોઈ તો ક્ષપક-શ્રેણુ આરંભે છે તો કોઈ ઉપશમશ્રેણુ ! તેમજ આડમા

ગુણુસ્થાનકે જનારને અથવા તો તેથી આગળ જનારને આયુ-
ષ્યકર્મ સિવાય સાત કર્મોના બાંધનો નાશ કરવાનો હોય છે.
ઉપશમશ્રેણીએ ચડનાર અગીયારમા ગુણુસ્થાનકે જઈ ત્યાંથી
પાછા પડે છે તો કોઈ છુટે જઈ અટકે છે, તો કોઈ પાંચમે તો
કોઈ ચોથે, એમ પ્રથમ ગુણુસ્થાનક સુધી પણ તે જરો રહે છે.
છુટેથી આગળ વધી આઠમે આવે. પાછા ક્ષપકશ્રેણી આરંભે
તો ધારેલું કામ સત્ત્વર સિદ્ધ કરે. ઉપશમશ્રેણીવાળો કથાયો
વળેરેની પ્રકૃતિએનો નાશ કર્યો વગર ઉપશમાવીને આગળ
વધતો હોવાથી એ પ્રકૃતિએ સર્વથા નાશ નહિ પામતાં
સત્તામાં રહે છે અને તે અગીયારમે ગુણુસ્થાનકે જરાતરા
કારણે પણ ઉદ્યમાં આવી આત્માને ત્યાંથી પાછા ધકેલી મૂકે
છે. અવશ્ય ઉપશમવાળાને અગીયારમા ગુણુસ્થાનકેથી પડલું
જ પડે છે, અગર જો અગીયારમે આયુક્ષયે કાળ કરે તો
સર્વાર્થસિદ્ધ નામના અતુલરવિમાનમાં જય ને ત્રીજે ભવે
સિદ્ધિપદને વરે.

આઠમે ગુણુસ્થાનકે ક્ષપકશ્રેણી આરંભે તો તે દરેક
પ્રકૃતિએને ક્ષય કરતો આત્મા આગળ વધે છે. તેને
અગીયારમે ગુણુસ્થાનકે જવું પડતું નથી. દશમેથી જ તે
આરમે ચાલ્યો જય છે. જ્યાં જ્ઞાનવરણીય, દર્શનવરણીય
અને અંતરાય એ ત્રણું કર્મની ચૌહ પ્રકૃતિનો ક્ષય કરી
આત્મા ફેલગ્નાન મેળવે છે ને તેરમું ગુણુસ્થાનક પણ
પ્રાસ થાય છે. તેરમે ગુણુસ્થાનકે આત્મા પોતાનું શૈવ

આયુષ્ય પૂર્ણ કરી શિવવધુને વરે છે લ્યાં અનંત સુખનો ધણી, અજર અને અમર અને છે. કૃલ્યકૃત્ય હોવાથી, અશરીરી હોવાથી, કર્મ રહિત હોવાથી એ અદ્વિતીય બને છે; કારણું કે કર્મેનું આકર્ષણું કરનારા પેલા મિથ્યાત્મ, અ વરતિ, કષાય અને જોગ એ ચાર હેતુનો સર્વથા અભાવ હોવાથી તેમજ આત્મા પોતાની લક્ષ્મી-અનંતશાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય, આવા બધા સુખ એટલે અનંત સુખાદિક પ્રાપ્ત કરી પોતાના જ સ્વસુખમાં પૂર્ણ રહે છે. સંસારમાં રખડાવનાર એ ચાર હેતુઓમાં મિથ્યાત્મ પ્રથમ ગ્રણું ગુણુસ્થાનક સુધી રહે છે. ચાંદે આવ્યો એટલે મિથ્યાત્મ ગર્યું; છુટે આવ્યો એટલે અવિરતિપળું ગર્યું, આગળ વધતાં વધતાં દરશે ગુણુસ્થાનકે સર્વથા કષાયનો નાશ થાય છે અને તેરમાને અંતે મન વચન અને કાયાના લોગો પણ જતા રહે છે. પછી આત્મા હંમેશને માટે અશરીરી બને છે.

સામાન્ય રીતે આયુષ્યકર્મનો બંધ પહેલે ગુણુસ્થાનકે, ચાંદે, પાંચમે અને છુટે ગુણુસ્થાનકે પડે છે. પ્રથમ ગુણુસ્થાન-કવાળો ચારે ગતિમાં ગમે તે ગતિના આયુષ્યનો બંધ પોતાના કર્તાંય પ્રમાણે કરી શકે છે. બીજા ગુણુસ્થાનકવાળો નરકગતિને છોડીને ગ્રણું ગતિમાં ગમે તે એક ગતિનું આયુષ્ય બાંધે છે. ચાંદા ગુણુસ્થાનકવાળો દેવ અને મનુષ્ય એ એ ગતિનાં આયુષ્યમાત્રનો બંધ પાડે છે એટલે ચાંદે ગુણુસ્થાનકે રહેલો મનુષ્ય કે તિર્યંચ દેવગતિનું આયુષ્ય જ બાંધે તેમજ ચતુર્થ

ગુણુસ્થાનકે રહેલો દેવતા કે નારકી : એક મનુષ્યનું જ આયુષ્ય બાંધે, તેથી આગળ પાંચમે અને છઠે ગુણુસ્થાનકે દેવગતિનું એક જ આયુ જ જીવ બાંધે છે તેથી આગળને ગુણુસ્થાનકે આયુષ્યનો બંધ નથી છતાં અમુક અપેક્ષાએ છઠે ગુણુસ્થાનકે આયુષ્ય બાંધતા ને સાતમે ચડી જાય તો ડવચિત સાતમે ગુણુસ્થાનકે પણ દેવગતિના આયુષ્યનો બંધ કદ્દો છે.

આઠમેથી શ્રેણિ શરૂ કરતા હોવાથી તેમજ એ ગુણુસ્થાનકોનો કાલ પણ અદ્વિતીય આઠમેથી આગળ વધતાં તેરમે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જ અટકે છે અર્થાત् કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરનારા કેવળજ્ઞાની તીર્થી કરો. તેમજ સામાન્ય કેવળજ્ઞાનીએ સર્વે તેરમે ગુણુસ્થાનકે હોય છે. તેરમે ગુણુસ્થાનકે રહેલા સર્વ જીવો સમાન કોઈના છતાં તીર્થી-કરોનું જગતમાં માન-સન્માન, પૂજા-આતિથ્ય વગેરે વિશેષ પ્રમાણુમાં થતું જોવાય છે એ નિઃસંદેહ વાત છે.

તેરમે ગુણુસ્થાનકે પણ ચાર કર્મ તો અવશ્ય હોય છે. એ ચાર કર્મ અને તેની પ્રકૃતિએ પંચાશી હોય છે જ. છેક ચૈહમાને અંતે તેનો ક્ષય કરી અશરીરી થઈ આત્મા મોક્ષ જાય છે. સાધારણ રીતે પ્રાણીને આયુષ્ય કર્મ તો છઠેથી ઉપર ગયો એટલે બંધાતું નથી. દર્શને ગુણુસ્થાનકે મોહનીયકર્મ નાશ પામી જાય છે ત્યારે ભારમાને અંતે જાનાવરણીય, દર્શનાવણીય અને અંતરાયકર્મ સર્વથા નાશ પામી જાય છે. તેરમે ગુણુસ્થાનકે નામકર્મ, આયુષ્યકર્મ, જોગકર્મ અને

વેહનીયકર્મ એ ચાર કર્મો હોથ છે તે ચૈહમાને અંતે નાશ પામી જાય છે.

હવે ચોથે શુણુસ્થાનકે લુલ સમકિત પ્રાપ્ત કરે છે પ્રથમ આત્મા યથાપ્રવૃત્તિકરણુ કર્યો પછી રાગ-દ્રેષ્ટદ્વારી કર્મની ગાંઠને છેદી બીજું અપૂર્વકરણુ કરે છે, અને જ્યારે સમ્યકૃત્વ સન્મુખ થાય છે ત્યારે અનિવૃત્તિકરણુ કરેલાય છે. લુલ શરૂઆતમાં ઉપશામ સમ્યકૃત્વ પામે છે. ઉપશામ સમકિતનો કાળ અન્તાસુંધર્તપ્રમાણુ છે, તે પછી તુરત તે પડે છે ને લુલ ક્ષાયોપશમિક અથવા તો ક્ષાયિક સમ્યકૃત્વ પામે છે. ક્ષાયોપશમિક સમ્યકૃત્વનો કાળ “છાસઠ સાગરોપમથી કંઈક અધિક છે ત્યારે ક્ષાયિક સમ્યકૃત્વ તેવીસ સાગરોપમથી અધિક સંસારમાં રહે છે. ને આયુષ્યનો બંધ ન પડ્યો હોય તો ક્ષાયિક સમકિતના ધર્ષી તો તેજ ભવે સુકિતમાં જાય છે. આયુષ્યનો બંધ પડી ગયો હોય તો ત્રીજે ભવે મોક્ષ જાય છે. ક્ષાયોપશામ સમકિત તો લુલને અસંખ્ય વાર આવે છે ને જાય છે. એ સમકિતવાળાની સુકિત તો એની જીવિતવ્યતા ઉપર આધાર રાખે છે. અર્ધપુણ્યાલપરાવર્તની અંદર ગમે ત્યારે ને ગમે તેટલા ભવમાં તે મોક્ષ જઈ શકે છે. તીર્થીકર ભગવંતો ક્ષાયક સમકિતના ધર્ષી હોવાથી તેઓ આઠમેથી નિશ્ચય ક્ષપકશેણી શરૂ કરે છે. ત્યારે ક્ષાયોપશામ સમ્યકૃત્વવાળા ડોઈ ક્ષપકશેણુ માંડે તો ડોઈ ઉપશામ શેણુ માંડે.

સામાન્ય રીતે નારકી અને દેવતાઓને પ્રથમનાં ચાર

ગુણુસ્થાનક હોય છે. તિર્યંચને પાંચ ગુણુસ્થાનક હોય છે લારે અહિને ગુણુસ્થાનક મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે. તેમાંચ વર્તમાન કાળે તો સામાન્યતાઃ વ્યવહારથી છ ગુણુસ્થાનક આ જરત-ક્ષેત્રમાં હોય છે, છતાં આંતરિક પરિણામની અપેક્ષાએ ગુણુસ્થાનકનો ફરજ તો જાની જ જાણી શકે.

વર્ધમાનસ્વામીએ ઋજુવાલુકા નદી આગળ પ્રતિમાધારણ કરી ક્ષપકશ્રેષ્ઠી આરંભી. એમને વિદ્ધ કરનારં કોઈ પણ કર્માવરણ નહોતું. આઠમે ગુણુસ્થાનકે આવ્યા એટલે આચુષ્યનો બંધ તો હતો જ નહિં, ઇકત ઉદ્ઘયમાં રહેલું આચુષ્ય લોગવીને ક્ષય ઇરવાનું હતું, જેથી સાત કર્મની પ્રકૃતિએ। બંધમાં, ઉદ્ઘયમાં, ઉદ્ઘયામાં ને સત્તામાં રહેલી હતી તે દરેક પ્રકૃતિએ। ક્ષય કરતા કરતા તે આગળ વધે છે. દશમે કૃષાયનો નાશ કર્યો ને બારમે મોહનીયને! સર્વથા નાશ કરતાં જાનાવરણુ, દર્શનાવરણુ અને અંતરાય પણ ત્યાં અગવાનનું નાશ પામી ગયું ને ત્રણ લોકમાં રહેલા, ચૌદ રાજલોકમાં રહેલા, સમસ્ત અખાંડમાં રહેલા ઇથી અને અદ્યા પદાર્થીને જણાવનારં કેવળજાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું અર્થાત્ આત્માની જે અનંતરજાન-દર્શનની શક્તિ પ્રચ્છન્નપણે હતી તે આવિભાવે પ્રગટ થઇ. એ પ્રચ્છન્ન કરનારી પ્રકૃતિએનો સર્વથા નાશ થઇ ગયો. અનંત કાળને માટે-સહાને માટે આત્માની શક્તિએ પ્રગટ થઇ.

લોક અને અલોક સંખ્યી ભૂત, ભવણ અને વર્તમાન એ ત્રિકાલિક વિષયતું સંપૂર્ણ જ્ઞાન એમને પ્રગટ થયું. લોકમાં રહેલી વસ્તુઓ અને અલોકને પ્રત્યક્ષપણે તે જોવા લાગ્યા. એવું કોઈપણ સ્થાન કે દૃશ્ય ગુણ, સ્વભાવ અને બદ્ધાતા પર્યાયો એમને પ્રત્યક્ષ લાસવા લાગ્યા. જેમ હાથમાં રહેલી વસ્તુ સ્પષ્ટપણે દેખાય છે તેવી જ રીતે તે લોક અને અલોક ને તેમાં રહેલી વસ્તુઓ અને તેના ગુણપર્યાયોને, સમયે સમયે બદ્ધાતા લાવેને જોવા લાગ્યા. રૂપી અને અરૂપી દરેક વસ્તુઓ જેવા જેવા સ્વભાવમાં હોય છે તે પ્રમાણે તે જોવા લાગ્યા. સંસારમાં એવો કોઈ વિષય નથી, એવો કોઈ પહાર્થ નથી કે એવું કોઈ સ્વરૂપ નથી કે જે એમના જ્ઞાન-દર્શનથી બહાર હોય. એવાં સંપૂર્ણ જ્ઞાનદર્શન એમને પ્રગટ થયાં-ને જગતમાં જ્યજ્ય વતી રહ્યો. ચૌદ રાજલોકના દરેક પ્રાણીને એ સમયે સુખાતુલ્લઘ થયો. દેવતાઓ અને તેમના સ્વામી ઈદ્રો ડેવલજ્ઞાન મહોત્સવ કરવાને આવ્યા. ચોત્રીશો અતિ-શર્યોની સિદ્ધિએ પ્રભુ પરિપૂર્ણ થયા. ચાર તો મૂળથી-એંગણીશ દેવતાના અને કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા અગીઆર એવી રીતે ચોત્રીશો અતિશય યુક્ત ને અરિહંતના ઝાર ગુણ્યુક્ત તીર્થંકરની સર્વ જડિં એમને પ્રગટ થઈ.



પ્રકરણ ૨૦ મું.

ચાલબાળ.

મગધરાજ શ્રેષ્ઠિક નરપતિની શ્રદ્ધા બૌદ્ધો તરફ અચળ ભક્તિવાળી હોવાથી પદૃરાણી વિલલાદેવીએ બૌદ્ધ સાધુઓનાં સર્વજપણાનાં ધર્તીંગ રાજને પ્રગટ કરી બતાવ્યાં છતાં એની શ્રદ્ધા કરી થઈ નહિં. જેવી નજરથી બાદ્ધ સાધુઓને તે જેતો હતો એમાં રતિમાત્ર પણ કુરક પડ્યો નહિં, પણ એના મનમાં ઉલટો દ્રેષ્ટાવ ઉત્પન્ન થયો કે પટરાણીએ જેમ મારા શુરુએની અવગણુના કરી છે રોમ હું પણ જૈન સુનિએનાં પોગળ પ્રગટ કરી બતાવું કે જેથી એની પણ આંખો ઉધડે કે એ તો ઘેર ઘેર માટીના ચુલ્લા હોય છે. અમારા સાધુઓ આવા હોય છે એવું કંઈ નહિં પણ જૈન સાધુએની પોત પણ કંઈ એછી નથી; માટે હું પણ એને કંઈક એવો અમતકાર બતાવું કે જૈન ધર્મ ઉપરથી એનું મન અવશ્ય સખાદિત થઈ જાય !

પોતાના શુરુએના લોજનના આમંત્રણાંપણી મગધપતિએ આવો નિશ્ચય કરેલો તે પછી વચ્ચમાં ડેટલાક હિવસો પસાર થઈ ગયાં અને જાણે પોતાના શુરુની અવગણુનાની વાત વિસારે પડી હોય એમ તે ભૂલી ગયો. વળી વચ્ચમાં ડેટલાક હિવસો પસાર થયા, પછી એક દિવસે રાજને એક સ્વર્ગંગ સુંદર વાસંગનાને જોલાવી ખાનગીમાં તેની સાથે કંઈક વાતચીત કરી, અને એ પોતાનું કાર્ય સારી રીતે પાર ઉતાર્યે તો એને

સારી રીતે ઈનામ આપવાનું રાજીએ કખુલ કર્યું. રાજી સાથે વાતચીત કરી વારાંગના લાંથી પોતાને આવાસે ચાલી ગઈ.

તે જ દિવસે તે વારાંગના સાંજના અનીઠણી નગરની બાંદ્રાના ઉધાનમાં આવેલા કેંદ્રિક શૂન્ય મંહિરમાં ગઈ. મંહિરની અંદરના ભૂમિગૃહમાં તે ભરાઈ ગઈ. તે પછી અદ્ય સમયમાં રાજીના સિપાઈએ ડોઝ નેન સાધુને લાવી એ શૂન્ય મંહિરમાં તેડી લાવ્યા. કપટથી એ સાધુને એ મંહિરમાં સપડાવી તેએ મંહિર બંધ કરીને ચાલ્યા ગયા. સાધુ મંહિરમાં સપડાઈ ગયા. પોતાને આવી રીતે સપડાવવાનું શું કારણ હુશે એ આ સાધુ કાંઈ સમલુ શક્યા નહિ. એ મુનિ તો વિચારમાં જ હતા, કઈ નહિ, સંદ્યા સમય થઈ ગયો છે. રાત્રીનો સમય અને આવી એકાંત જગ્યા ક્યાન કરવાને માટે ઢીક અનુકૂળતાવાળી થશે.

સાધુ એ વિચારમાં લીન હતા. એવા મોક્ષાથી પુરુષોને બીજો વિચાર હોય પણ શાને? એ જ્યારે આવી એકાંત જગ્યાનો લાભ લઈ ક્યાન કરવાનો ધરાદો રાખતા હતા ત્યારે વિધિએ એમને માટે નુહ નિર્માણ કર્યું હતું. પેલી ભૂગર્ભમાં રહેલી નદ્યેવના તરતજ મંદ મંદ ડગલાં લરતી એમની સામે આવીને ઉલ્લી રહી. સાધુ યુવાન વયમાં હતા, ચુંબતી પણ સર્વાંગ સુંદર અને લોગ લોગવવાને આકુળંયાકુળ થયેલી. લેમાંય આવી એકાંત જગ્યાએ કયા પુરુષનું યૌવન અસ્થાલિત રહી શકે?

શુદ્ધતીને તો કોઈ રીતે એ સાધુને પોતાનો આશક બનાવી રાત્રી એની સાથે પસાર કરવી હતી—એ સાધુને પોતાનો પ્રિયતમ બનાવવો હતો. જેથી વિના સંક્રાંતે જાણે મહાદેવનું તપ લાગ કરવાને ડ્રપ પરાવર્તન કરી જૈપરીજ મંદ મંદ ડગલા ભરીને આવતાં હોય એમ આ વારાંગના એમની સામે આવી ને ઉલ્લી રહી એને જેતાં જ મુનિ આશ્રમ્ય પામ્યા. “ અહો ! આ શું ! ” આવા ઉજ્જડ મંહિરમાં આ રમણી કયાંથી ? ” સાધુ બધી વસ્તુસ્થિતિ સમજી ગયા.

નક્કી આ ખાળા માર્દ બ્રત મહિન કરશે, એ મને પોતાનો શિકાર બનાવી પ્રાતઃકાળે જગતની સન્મુખ મારી અવગણણના કરાવશે; એટલું જ નહિ પણ જૈન ધર્મની પણ નિંદા કરાવશે અરે મારે નિમિત્તે જૈન શાસનની મહિનતા થશે. લુંડી થશે. અસ્તુ ! હું એ જ ધ્યાનું છું મારે માટે આવા ઉત્તમ ધર્મની મહિનતા ન થાઓ. ”

એ સન્મુખ આવેલી નવયોવનાના વખતું પણ ડેકાણું ક્રાંતિનું હતું ? આવી જગ્યાએ ને આવી સિથિતિમાં કામવિહૂપદ ક્ર્યા જીવ્યોના વખોતું ને મર્યાદાનું ડેકાણું હોય છે તે એનું પણ હોય ! અખળા છતાં જી એક એવી ભયંકર વ્યક્તિ છે કે જે એનું મન ન કણૂલ કરતું હોય એવી ચીજ કરવવાને સમર્થ પુરુષ પણ શક્તિવાન થતો નથી. જ્યારે એનું મન કણૂલ કરતું હોય તો ગમે તેવાની ઉપર પણ તે પોતાનો જાહૂરી ચભતકાર ચલાવી શકે છે. આ વારાંગના પણ એવી એક ભયંકર વ્યક્તિ

હતી, આવી એકાંત જગ્યાનો લાખ લઈ આ મુનિને પોતાના વ્રતથી સ્ફદ્રિત કરવા એ રેનો સુખ્ય ઉદ્દેશ હતો.

એના હૃષાલાવ, એના ઠંગરંગ જોઈ મુનિ બધો લેદ સ્વમળ ગયા અને પદ્માસન લગાવી પરમાત્માના ધ્યાનમાં આર્દ્ધ થયા, પણ આ સુંદરી કયાં એમને છોડે એમ હતી. ? “ અરે મુનિરાજ ! હું ચાલીયલાવી આજની રાત તમારી સાથે રંગે રમવા આવી ત્યારે તમે આ શું ઢાંગ આદર્યો ? અરે રસિક ! આ તમારી ચુવાની મારી સાથે સફુલ કરો ! માનવ જન્મ સફુલ કરો ! ”

એ અભિનયોની નવનવી દીલાઓ કરતાં સુંદરીના મસ્તક ઉપરથી છેડો સરકી ગયો. એના અંગની શિથિલતાથી અને અંભાડો પણ છુટી ગયો. “ મહારાજ ! આવા તપનું ફૂલ પણ સ્વર્ગ પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ હોય તો કહો ! સ્વર્ગમાં જશો તો દેવબાળાઓ સાથે તમારે રમણું પડશો. જ્યારે આંગણે આવી અમે તમારી પ્રાર્થના કરીએ છીએ તો હે મુનિપર ? એ પ્રાર્થનાનો લંગ ન કરશો, ન કરશો. ” એ રમણી એલી. “ હે સ્વામી ! અત્યારે હું કોને શરણે જાઉ ? કોને એલાવું ? તમારા સિવાય આ ઉર્મિઓ હું કોની આગળ ઠલવું ? આ હુષ્ટ કામદેવથી રક્ષણું કરવા કોને એલાવું ? ”

રમણીના અભિનયો, કટાશો, લલચાવવાના અનેક પ્રયત્નો છતાં મુનિરાજ શાંત હતા. આત્મધ્યાનમાં એકાશતાવાળા હતા. એ મંદિરમાં રહેલા હિપકનો પ્રકાશ બન્ને ઉપર

સરણો પડી રહ્યો હતો. “અરે મુનિ ! આવી એકાંત જગ્યામાં તમે મારી સાથે રમણો તો કોણું જાણુવાનું છે ? ને કોણું જોવાનું છે. આવી એકાંત, આવો જોગ, મારા જેવી તરણું તરણ્યી. આવા ચે.ગો મોટું બાળ્ય હોય તો જ મલી શકે છે. તમારા અખંડ તપને ચે.ગો જ આવો ચોગ મદ્દ્યો છે. તેને નિષ્કળ કરવો એ શું તમને ઉચ્ચિત છે ? હું તમને હૃથ જોડી કાલાવાલા કરુંછું. નહાલાઅાવો ! આવો ! મારી પાસે આવો ! મારી પ્રાર્થના સ્વીકારો ! હુષ કામદેવનું. મર્દન કરી મને શાંત કરો.” કોયલથી પણ અધિક માધુર્યતાવળા શબ્દો, એ અંગે અંગના અલિનયેવકે સુંદરીએ એક પઢી એક શ્રૂંગારના પાડો સુનિવર આગળ પ્રગટ કરવા માંજ્યા છતાં એ સુનિરાજનું નિષ્કુર હૈયું દોષાવવાને નિષ્કળ નિવહ્યા. રમણ્યીએ પાછ્ય કરેલી. ઉચ્ચયમાં ઉચ્ચયી પ્રદોષન કળાઓનો એક પઢી એક ઉપયોગ કરવા માંજ્યો.

એણે મર્યાદાનું ઉદ્ઘૂંધન કરી પોતાની ચુવાની એને અતાવથ માંડી. એ ચુવાનીનાં ચિન્ડો સુનિરાજ આગળ ચુવ-તીએ પ્રગટ કરવા માંજ્યાં. એનાં વચ્ચનો એક પઢી એક નમૃતા-ભર્યા, મૃદુ, મીડાશ અને ગ્રેમરસના પ્રવાહથી આર્ડ થયેલાં હતાં. “અરે ! મારી આટાટાટલી આળુલુ-વિનવણી છતાં તમે મારો ગ્રેમલરો સત્કાર નહિ કરો ? અરે સુનિવર ! આવા નિર્દ્ય કાં બનો ? અમારામાં એવી શું ખામી છે કે જેથી તમે સામુય જોતાં નથી. પ્રાણુપ્રિય ! લુવનલરના હું તમને મારા

વદ્વલસ બનાવીશ. અંતરના ઉમળકાથી પ્રતિહિન પ્રેમવડે
તમારો સત્કાર કરીશ. આપણે રેખ નવાં નવાં સંસારનાં સુધે
બોગવશું, માનવજનમ સકૃણ કરીશું.”

સુંદરી કાકલુદીની છતાં મુનિનો મોન જ હતા. એ મુદ્દિત
રમણીના રસીયા ને આ લોકની રમણીમાં તે શી હેંશ હોય ?
માનવભાગા કે દેવભાગાના ઉત્સંગમાં રમી રમીને એ
હવે કંટાળી ગયા હતા. એ તો મુદ્દિતરમણીના ઉત્સંગમાં
રમવા આતુર હતા. આ સંસારમાં મુદ્દિતની વરમાગા, એ
એક જ ચીજ લેવાને તે જંખી રહ્યા હતા.

પોતાના ડોમળ અંગોપાંગથી તે મુનિને સ્પર્શ કરવા લાગી.
એ કામના મહથી ન્યાકુલ અનેલી ભાગાએ આવી સ્થિતિમાં
પુરુષને ચલાવવા નેટલી ચેષ્ટા કરવી જોઈએ, એ સર્વે કરી
લીધી. પોતાના ડોમલ કરકમલ એના શરીર ઉપર ફેરવતી
મુનિને કામજવર ઉમજ થાય એવી ચેષ્ટા કરતી અને વિન-
વતી લોલાવવા લાગી. “ અરે નહાલા ! હું તારા ચરણમાં
પડેલીની કાં ઉપેક્ષા કરે છે ? શું હું પુરુષાર્થ વગરનો છે
કે નેથી મારી ઉપેક્ષા કરી રહ્યો છે ? આવી સ્થિતિમાં તો
કોઈ પણ રહી શકે જ નહિ. હાથમાં આવેલો કોળીયો કોણું
જતો કરે ? લક્ષમી ચાલીચલાની આંગણે આવે તો મોં
ધીબા કોણું જાય ? સમજ, સમજ, મારા હૃદાના હાર ! મારા
હૃદાની તાલાવેલો જરી તો સમજ.”

આખરે એ રસવિહીન સુનિને ક્ષાસ પમાડવાની એની અધી કળાંગો વ્યર્થ ગઢ છતાંય હજ એ ઉત્સાહદેલી હતી. એના ટોડ હજ હૈયામાં ઉલરાતા હતા. “ અરે રચિક ! જે તું રસ વગરનો હો તો ભલે, ઇક્ઝ પરોપકાર કરીને મારા આત્માને શાંત કર. આજની રાત પરોપકાર કરી મારા અંગને પીડી રહેલા મન્મથનું તું નિવારણ કર. એગુણે પરોપકાર કરીશ તો તને મોદું પુણ્ય થશે. એ કેંભી શાંતિ પામેલો મારો આત્મા તારી ઉપર આશીર્વાદ વરસાવશે. પરોપકારને માટે તો તું આઠલું કામ માર્દ અવસ્થ કર. પરોપકાર એતો સંજજન અને સાધુ જનોનું સુખ્ય કર્તાવ્ય છે.” છતાં સુનિને તે વાત ગણુકારી નહિ.

“ અરે પરોપકાર કરવા જેટલી પણ તમારામાં ઉદારતા નથી ? એક પરોપકારને માટે સાધુપુરિષે પોતાની લક્ષ્મી અને ગ્રાણું સર્વ કંઈ અર્પણું કરે છે. મારે તો નથી જોઇતા તમારા ગ્રાણું કે નથી જોઇતી તમારી લક્ષ્મી; ઇક્ઝ જોઇએ એક તમાર્દ મન. એટલુંચ મને નથી આપી શકતા ? વાહરે સુનિરાજ શી તમારી ઉદારતા ! હું જ્યારે માર્દ સર્વસ્વ તમારે ચરણે અર્પણું કરી રહી છું ત્યારે તમે એક તમાર્દ મન પણ મને ન આપી શકો એ તો નવાઈ ! આ સોહામણું પ્રેમના દોર હોરને હવે બહુ ના તાણીયે. એ તુટેલા પ્રેમના દ્વાર ઇરીથી પાછા સંધાવા સુશકેલ, એ યાદ રાખજો. સુમજુને વારવાર શું સમજાવીએ ? ”

એ આખીય રાત સુનિની કદર્થના કરવામાં ચુવતીએ પસાર કરી પણ ન તો ઈંછા સંક્રાંતિ થઈ ન તો એ સુનિને ચલાયમાન કરી શકી. ચુથ બ્રહ્મ મૃગલીની માર્કિક તે ઉભય બ્રહ્મ થઈ. ચતુર્થ પ્રહર શરૂ થયો એટલે ચુવતી એ પરિશ્રમથી કંટાળી જરા આડેપડાએ થઈ એ ભારે થયેલી આંખ સાથે મળી જઈ નિદ્રાને જોળે પડી. એ શાંત પડેલી ચુવતી પછી ઘસઘસાટ નિદ્રાને આધિન થઈ ગઈ.

ચુવતીને નિદ્રાને જોળે પડેલી જેઈ સુનિએ છ્યાન છોડયું. વસ્તુસ્થિતિનો કંઈક લેહ એણે કદમ્પેલો હોવાથી પ્રાતઃકાળે રણે જૈનધર્મની અવહેલના થાય, જેથી એક લંગોટી રાખી બાકીના વસ્તુ વગેરે કાઢી નાખી એક ટગલો કરી પોતાની તેજેલેશયાની શક્તિથી અભિન ઉત્પજ્ઞ કરી સુનિનાં સર્વે ઉપકરણો સળગાવી મૂક્યાં. એની રાખોડી બધા શરીરે ચોળી એક અભ્યૂતના સ્વરૂપમાં પોતે ફેરવાઇ ગયા.

સુનિને મંદિરમાં પુરી સીપાઈએ શ્રેણિક મહારાજને એમની આજા પાછી આપી હીધી. પોતે જે કાર્ય અજાવેલું હતું તે મહારાજને કહી સંભળાયું. પોતાની મનોવૃત્તિ પ્રમાણે કાર્ય સંક્રાંતિ થયેલું જેઈ શ્રેણિક મનમાં પ્રસ્તુત થયા. પ્રાતઃકાળે ચેલ્લાણે સાથે લઈને ત્યાં આગળ જવું ને એના શુરૂનું કાર્ય એને પ્રત્યક્ષ બતાવવું કે—“તારા શુરૂની માર્કિક અમારા શુરૂ બ્યાલિયારી તો નથીને ?”

પ્રાતઃકાળ થયો ને થાડો હિવસ ચઢ્યો એટલે મગધ-
પતિએ ચૈલણુંને કહું—“ચાલો આપણે જરા ઝરવા જઈએ.
એક અનોપમ દૃષ્ય આપણે નિહાળીએ.”

“ અને તે કણું દર્શય ? ” ચૈલણુંએ પૂછ્યું.

“ એ દૃષ્ય ત્યાં તમે જુઓ ને પછી વિચારી લેને કે
એ કેવું છે ? ”

રાજા-રાણી એ નગરની બહાર ઉજાડ મંહિર તરફ
આવ્યા. રાજના સંકેતથી બીજા અમલદાર, સુલટો, નાગરિકો
વગેરે પણ એમની પાછળ પાછળ ગયા. સર્વે પેલા ઉજાડ
મંહિર પાસે આવ્યા. શેખુંદના મનમાં અવનવા વિચારો રમતા
હતા. ચૈલણુંદેવીનું મન અધીરં થઈ રહ્યું હતું કે અત્યારમાં
આજે અહીં આવવાનો મહારાજનો શો હેતુ હુશે ? આ જ્યાં
શું જોવાને અહીંયા એકઠા મહ્યા હુશે ? નહીં કાંઈ દાળમાં
કાળું અવસ્થય હુશે જ.”

એ શૂન્ય મંહિર પાસે આવી મગધપતિએ એક સુલટને
એ મંહિર ખોલવાની આજા કરી. એ હુકમ અનુસાર એક
સુલટો મંહિરના દ્વાર ઉધાડી નાખ્યા તો અંદરથી ‘અહુલેખ’
કરતો. એક અખધૂત, જેના શરીરે રાખોડી ચોળેલી છે એવો
બહાર નીકળ્યો. એની પછિવાડે એક સુંદર રમણી મંહમંહ
પગલે ચાલતી બહાર નીકળી. અહુલેખ જગાવતો એ અખધૂત.

સર્વો માલુસોની વચ્ચમાં થઈને ચાલ્યો ગયો, ત્યારે પેલી ચુવતી અહાર નીકળી શ્યામ સુખવાળી એક બાળું ઉલ્લી રહી ગઇ.

એ બધામાં વિશેષ આશ્ર્યો તો ભગવાપ્તિને થયું : ‘આહ ! મેં તો જૈન સાધુ જોવાની આકાંક્ષા રાખી હતી ને આ તો કોઈ અભધૂત ખાખી બાવો નીકળી પડ્યો. જાણુંદેહ સિવાય એનો ખરો મર્મ કોણું સમજે ? બધાથ એટલું સમજ્યા કે કોઈ અભધૂત ખાવાએ આ વીરાંગનાને અંદર પુરી હશે અથવા તો અન્ને હૃષ્કર્મ કરતાં અહીં સપદાઈ ગયા હશે. ”

પોતાની ધારણ્યામાં નિષ્કળ નીવડેલો રાજ રાણી સાથે પાછો ફર્યો. એટલે ખીજાએ પણ પોતપોતાને સ્થાનકે ગયા. રાણીએ એનો મર્મ સમજ્યા રાજને પૂછ્યું, પણ હાલમાં તો રાજએ કંઈ વાત કરી નહિ. રાજએ પોતાના સિપાઈએને ખાતાવી ખાતરી કરી તો માલુમ પડ્યું કે એક જૈન સાધુને અંદર પુર્યો હતો, છતાં પડ્યો એકદમ કેવી રીતે પલટાઈ ગયો. તેની એને અખર પડી નહિ. અરે ! એનાં વસ્તુ વળેરે ક્યાં ? શું પોતાની શક્તિથી એ જૈન સાધુ અભધૂત બની ગયો ! અને એવી રીતે એણે પોતાના ધર્મનું રક્ષણ કર્યું ? ત્યારે આ કેમ અન્યું, પણ પ્રીકર નહિ ખીજુ વખત વાત.



પ્રકરણ ર૧ મું.

એક વાર ઝેરીને.

જૈન સાધુમાંથી અખધૂતના સ્વરૂપમાં બહાર નીકળેલાં
આ ચોગીની સત્ય હડીકિત જાણવા માટે ભગવાનિએ પેલી
વારાંગનાને બાલાવીને પૂછ્યું. “સુંદરી ! સત્ય કહે. આ
અધું શી રીતે બન્યું ? તને મેં જૈન સાધુને ભષ કરવાને મે-
કલેલી; આ અખધૂતને નહિં. તે આ અખધૂતને ભષ કર્યો કે ?”

“મહારાજ ! એ અખધૂત અખધૂત નથી; પણ જ્યારે
સીપાઠિઓ એને પકડી લાવ્યા લારે તો જૈન યતિના સ્વરૂપમાં
હતો. એ સાધુ મનુષ્ય નહિં પણ સાક્ષાત દેવ સ્વરૂપ હતો.”

“એમ કહેવાનું કરણું કાંઈ ?” સાલાએ પૂછ્યું.

“શું કહું મહારાજ ? મારી બધીય સૌ-કળા, અભિ-
નયો સર્વો વ્યથો ગયા. આવી એકાંત જગ્યા, મારા જેવી
પ્રાર્થના કરતી સ્વી, એ ચુવાન સાધુ છતાં એણે મારી પ્રાર્થના
ન જ સ્વીકારી-એણે મારી સામે જેવાની પરવા પણ ન જ
કરી. જ્યારે પરોઢીએ હું શ્રમીત થયેલી ત્યાં નિદ્રાવશ થઈ ગઈ.
તે અરસામાં એ સાધુ અખધૂતના સ્વરૂપમાં પલટાઈ ગયો.
પ્રાતઃકાણે ઉડીને જોડ તો જૈન સાધુને બદલે એક અખધૂત !
આશ્રી !”

“તમારે એનાં વસ્તુ વગેરે તો કાંઈ જોખામાં ત્યાં આન્યા
નહિં એખ કેમ ?”

“ અમે તે રીતે અમિ પ્રગટ કરી એ વસ્તુ એણે કુંદી હીધાં અને આએ શરીરે એ લસ્તમ ચોળી અખધૂતના સ્વરૂપમાં એ સાધુ કરવાઈ ગયો ! ”

“ એમ કરવાનું કારણ તું શું કહે છે ? ”

“ કારણ ? મને લાગે છે કે એનું કારણ એના ધર્મની રક્ષા કરવાનું હુશે. પ્રાતઃકાળે એક જૈન સાધુ સાથે સુંદરીની આખી રાત્રિ એકાંતમાં ગઈ એમ લોકો જાણે તો એના ધર્મની નિંદા થાય. આ તો આપે જેયું ને ? લોકોએ મને ને એ અખધૂતને મંહિરમાંથી જેયાં. ”

“ તારું અનુમાન સત્ય છે. અખધૂત થવાનું એનું ૨-હસ્ત એ જ હેઠું જોઈએ, અવશ્ય એના ધર્મની પ્રભાતમાં સર્વ લોક સમજ્ઞ હાંસી થાત. એમ કરવાની મારી ધર્યા અત્યારે તો નિષ્ઠળ થઈ મનની મનમાં જ રહી ગઈ. ”

“ પ્રલો ! એ જૈન સાધુઓનો કેડા લેવો આપ રહેવાધો ? બીજા સાધુ સંન્યાસી જેવા નથી હોતા, એ સાધુઓ તો પોતાના પત-નિયમમાં ઘણ્યા જ ચુસ્ત અને મજૂમ હોય છે.”

“ શું તું એ પણ ધર્મની-એના સાધુઓની પ્રશંસા કરી રહી છે ? ત્યારે તું એ ધર્મ કેમ પાલતી નથી ? ”

“ એ પત-નિયમો ૬૬ પાલન કરવાની મારી શક્તિ નથી. મારું એનું મનોભળ નથી. મનને એમની માઝુક હું કાયૂમાં રાખી શકું તેમ નથી. એ ઘણ્યી ઉચ્ચ વસ્તુઓ છે.

મોટા ભાગથી ને પૂર્વના શુભ પુષ્ટયના ચેંગે એવી સ્થિતિ મેળવી શકાય છે. ”

“ હુન્યાના બધા ધર્મો કરતાં, અરે ! ઉત્તમ બોદ્ધ ધર્મ કરતાં શું એટલું બધું સત્ત્ય છે ? ”

“ આપને હું એ બધું શી રીતે સમજાવી શકું ? હું કંઈ જાની નથી કે આપને સમજાવું ? પણ એ સાધુ મારાથી ચલાય-માન તો ન જ થયો. એના વ્રત, નિયમ અને ચારિત્રધર્મથી જરાય સખાલિત ન થયો એ તો નિઃસંદેહ. આખરે જે વર્તુ સત્ત્ય છે એ તો સત્ત્ય જ છે.”

“ ડીક છે, કોઈ બીજુ વખત વાત. ” વાતને દુંકાવી વારાંગનાને રાજાએ રજ આપી દીક્ષા, થોડાએક દિવસો વહી ગયા પછીના એક દિવસે રાજાએ પોતાના સેવકો પાસે તરતના સુઅલાં બાળકનું શબ મંગાવ્યું. તે રસોયાને આપી તેના માંસાદિકથી ચુક્ત ક્ષીરાદિક લોજન સામગ્રી તૈયાર કરાવી. રાજના હુકમથી રસોયાએ માંસાદિકથી ચુક્ત ઉત્તમ રસોઈ સ્વાદ પરિપૂર્ણ બનાવી કે જેથી માંસાદિક દોષ સહેલાઈથી ચતુર પુરુષ પણ જાણી શકે નહીં. રસોઈ તૈયાર થધું એટલે રાજાએ જૈન સાધુએને આમંત્રણ કરવાને મોકલ્યા.

આજે રાજની ચંચળતા જોઈ ચેત્તાણાએ પૂછ્યું.
“ કૃત્યા ! આજ આપનું ચિત્ત વ્યથ કેમ જણ્યાય છે ? ”

“ રાજ્યાદિકના કારણથી, બીજું કંઈ નથી. ” એથ

જણાવી રાજ લોજનશાળમાં જઈ એડો અને જૈન સાધુઓ આવે તો એમને વહોરાવવાની તૈયારી કરવા લાગ્યો.

રાજની આવી ચેષ્ટાથી રાણી પામી જઈ. નક્કે આજે પણ કાંઈક દાળમાં કાળું છે જેથી રાણી સાધુને આવવાના માર્ગે ગોપનમાં એઠી.

રાજના સેવકો જૈન સુનિઓની તપાસ કરવા માટે ગયેલા તેમણે શહેરમાં તપાસ કરતાં એક સુનિને ગોચરી માટે ફરતા જેથા. રાજના પુરુષો વિનંતિ કરીને તેમને રાજમહેલ તરફ તેડી લાવ્યા. રાજમહેલ તરફ સુનિને આવતા જેઈ રાણીએ વિચાર કર્યો. “ અચીત, આ નિસ્પત્ત સુનિ મારી સામે પણ જેશે નહિ, માટે કાંઈક યુક્તિ કર્દું ”

ચેલલખુંચે એમ વિચારી બારીનાં બારણું એકદમ ખખડાવ્યાં. એ બારણુંના અવાજથી સુનિએ ઉંચે નજર કરી. સુનિની પોતાના ઉપર નજર પડતાં જ રાણીએ એ હાથ જોડી ફેટાવ હન કર્યું. નમન કરીને ચેલલખુંચે પ્રથમ^૧ એ આંગળી ને પછી પ્રથમ^૨ આંગળી બતાવી.

ચેલલખુના કહેવાનો લાવાર્થ સુનિ જ્ઞાની ડેવાથી સમજી ગયા જેથી એમણે એક આંગળી બતાવી રાણીએ હું^૩ પામી કરીને ફેટાવંહન કર્યું.

૧ એ આંગળથી પૂછ્યું કે આપને એ ગાન છે કે ૨ તથુ ગાન
૩ સુનિએ એક આંગળી બતાવી જણાવ્યું કે નાણથી પણ એક વધારે
બેટને બાર ગાન છે.

રાજુદ્દશો સાથે મુનિ રાજની લોજનશાળામાં ગયા. મુનિને આવતા જોઈ રાજ ઉલો થયો. એમનું બહુમાન સત્કાર કરી માંસાહિકથી ચુક્ત પેલું ક્ષીરાદિક ઉત્તમ લોજન વહેરાવવા લાગ્યો. શાનદારિથી લોજનને અભક્ષય અને માંસાહિક દોષેથી ચુક્ત જાણી મુનિએ રાજને કહ્યું. “ હે રાજનુ ! આ લોજન અમારે ચોણ્ય નથી.”

“ પ્રસો ! ક્ષીરાદિક જેલું પરમાન્ત લોજન પણ આપ અચોણ્ય કહે છો એ તો નવાઢ ! ” રાજને સાધુની કસોઠી કરવા માંડી.

“ રાજનુ ! અમે તો નિર્દેખ આહારને અહુણ કરનરા છીએ; જ્યારે આ તમારું લોજન તો દોષચુક્ત છો.”

“ મુનિવર ! અમારું લોજન આપને દોષચાળું લાગતું હોય તો એના દોષ પ્રગટ કરો? રાજને ઘેર નીપજેલું અનુન તો શુદ્ધજ હોય?

“ રાજન ! તમોએ કરાવેલું કૃત્ય તમે પોતે જાણો છો છતાં શા માટે કપટ કરો છો ? : તમને એ ચોણ્ય નથી.” સાધુએ કહ્યું.

“ મેં કરાવેલું છે. મહારાજ ! કહો સ્પષ્ટ કહો ! તો મેં શું કરાવેલું છે ? આ લોજનમાં શું દોષ છે ? ” રાજને મુનિનું સૌન જાણુવાને પૂછિયું.

“આ લોજન માંસાદિક હોષથી યુક્ત હોવાથી અમારે માટે એ અભક્ષય અધોગ્ય છે. મુનિઓ તો અચિત આહારના અક્ષણું કરનારા હોય છે.”

“આપે શાથી જાહુયું કે આ માંસાદિકથી યુક્ત લોજન મેં જ કરાવેલું છે.”

“જાનથી જેમ અધારામાં રહેલી વસ્તુઓ હીખકથી હેખી શકાય છે તેમ પરોક્ષપણે થતી કિયાઓ પણ જાનથી જાણું શકાય છે.”

“માંસાદિકથી યુક્ત આ લોજનમાં શેનુ માંસ કે તે કહે મુનિરાજ?”

“તરતના સુચેલા બાળકનું.”

મુનિનું જાન જોઈને રાજ આશ્વર્ય પાડ્યો. “હે મુનિ વર? તમારું જાન, તમારો ધર્મ અને તમારી કિયા સર્વે સત્ય છે.” મુનિરાજની પ્રશંસા કરતો રાજ એમને નિર્દોષ આહાર વહેરાવતો એમની સ્તુતિ કરવા લાગ્યો.

એ નિઃસ્પૃહ મુનિ આહારપાણી અહુણું કરીને ત્યાંથી ચાહ્યા ગયા.

જૈન ધર્મની પ્રશંસા કરતો અભિજન ચેદ્વલણું પાસે આવી કહેવા લાગ્યો. “રાણી તારા શુરૂએની મેં પરીક્ષા કરી જોઈ. તેઓ પરમજાની ને ઉત્કૃષ્ટ કિયાવાળા છે. સાધુપણું”

પાળવામાં નિરંતર ઉધમવણા છે.” લે પછી શ્રેષ્ઠિકે પોતે જે કર્યું હતું તે રાણીને સ્પષ્ટપદ્યે કહી દીધું.

“ ત્યારે પેદા અભધૂતની ચેષ્ટા પણ આપની સાથે કંઈક સંખ્યા ધરાવે છે ખરું કે ? ” ચેતવણાએ આગલી વાત યાડ કરાવી.

“ હા, તે પણ એક જૈન સાધુની મેં પરીક્ષા કરી હતી. એ પરીક્ષામાં સાધુ સર્વથા ફૂલેહુમંદ થયા છે. તમારા શુરુ શુદ્ધ રહ્યા છે.”

“ તે કેવી રીતે ? ”

“ પેદા અભધૂત તે અભધૂત નહિ પણ જૈન સાધુ હતા. ચેતાને નિમિત્તે ચેતાના ધર્મની નિંદા ન થાય તે માટે પોતે અભધૂત થઈ ગયા; ને ધર્મનું ને ચેતાના સંયમનું રક્ષણું કર્યું.” રાજાએ એ સર્વ ધૃતિહંતસ કહી જાંબળાંયો.

“સ્વામી ! એવાનિઃસ્પૃહ મુનિઓનો અંત લેવો એ સારું નથી. એ કાંઈ એદું સાધુએઓ જેવા નથી એદ્વાચાર્ય તો લોજ-નમાં આવેલા ચર્મના કકડાએઓ મુખાદિકના રૂપર્થીં પણ જાણી શક્યા નહિં.”

આ જનાવથી અને વારંવાર ચેતવણાહેવીના ઉપદેશથી રાજા જૈન ધર્મમાં પ્રીતિવાળો થયો ને ધીરે ધીરે ખોદું ધર્મ ઉપરથી એની શ્રદ્ધા એધી થતી ગઈ.



પ્રકરણ ૨૨ મું,

સત્યને ભાર્ગે.

મગધરાજ શેણુકને જૈન ધર્મ ઉપર આસ્તે આસ્તે પ્રેમ થવા લાગ્યો. ચોતાના શુદ્ધાની રીતબાત જૈન સાધુઓની રીતબાત, કિયા પ્રવૃત્તિ વળેદેની જ્યારે એકાંતે સરખામણી કરતા ત્યારે જૈન સાધુઓમાં એમને વિશેષ જાન હેખાવા માંડયું, એ આચારવિચારો, એમનું અપૂર્વ જાન, ધ્યાન, દોકાતર કરણી અદ્વિતીય હતાં. મગધરાજનું મન સંસ્કૃતમાં વહાણુંની જેમ ડોલાયમાન થવા લાગ્યું. “ અચીત, સત્ય શું હશે ? શું ત્યારે આજસુધી હું ભ્રમણું જ કુટાયો મેં જે વસ્તુઓ સત્ય માની હતી તે શું માત્ર સત્યના દંલ-ડેપે હતી? એ તો સત્ય જ કે ઘોઢ સાધુઓ કરતાં જૈન સુનિ-ઓમાં કંઈક વિશેષતા હતી. હોય છે. ગમે તેવો પણ આ બાદ્ધ ધર્મ તો નવીન ત્યારે આ જૈન ધર્મ પૂરાણો તે હવે મને યાદ આવે છે. મારા માતાપિતા પણ જૈનધર્મી હતા, પાદ્ધનાથનાં એ આવક હતાં; પણ જુદ્ધ દેવનાં સમાગમમાં આવી કુલપરંપરાએ આવતા ધર્મને મેં તિલાંજલી આપી, એ ટીક કણું નહિ. એ ધર્મની મહત્ત્વા, એમના સાધુઓમાં પણ મને તો કંઈક શીનાઓ કરતાં વિશેષ મહત્વ લાગે છે. માર્ગ ભૂલેલાને પણ અવિતબ્યતાને ચોણો શુલ્ષ માર્ગ જ કે છે, મને પણ જણે એમ જ થતું હોય ને શું ? ”

એક દિવસ છીડા કરવાને રાજા રયવાડીએ ગયેલો. અથવાને ખેલાવતાં રાજા એક ઉદ્ઘાનમાં જઈ ચડ્યો. અથ ઉપરથી ઉત્તરી ધરુણ્ય બાણુસહિત કૃત્યાધારી રાજા ઉદ્ઘાનની નૈસ્તર્યિક શોભા જેતો કરતો હતો, એટલામાં પ્રતિમા ધારણું કરીને ઉભા રહેલા એક સાધુ ઉપર એની નજર પડી. એ બિક્ષુકને જેઠ રાજ સ્થાનિત થઈ ગયો. આહા ! માનવ જીવના દુર્લભ લોગોને છોડી આવી તરણું વયમાં આ પુરુષ આવી કરોર તપશ્ચર્યા કેમ કરતો હશે ? શું એનું સૌંદર્ય ! કેવું એનું બાળ તારણ્ય ! આ તો બીજા બુદ્ધ દેવ : હજુ યુવાની તો બરાબર આવી નથી ત્યાં તો એણે સંસારની માયા છોડી દીધી. શું એ તો કોઈ પણ આપજન નહિ હોય ? ” વિચાર કરતો કરતો રાજા એ સાધુની પાસે આવી એના ચરણુમાં નસ્યો. સુનિ તો ધ્યાનમાં મચ હતા. ધ્યાનમાં-એકાશતાવાળા સુનિ બિક્ષુક છતાં અધિક સુંદર લાગતા હતા.

મગધપતિ સુનિના ચરણુકમલ આગળ બેઠો. થોડીવારે સુનિ ધ્યાનસુક્તા થયા એટલે શ્રેણ્યિક મહારાજે પૂછ્યું : “હે પૂજય ! જગતમાં યુવાની એ તો સુખને આપનારી કહેવાય. એ યુવાનીમાં જો સુખ ન લોગવાય તો આ જુંદગી શા કામની છે ? તો લોગોને છોડી આવી યુવાવસ્થામા આપે હૃદ્દર ત્રત, અહણું કર્યું, એનું કારણ આપ કૃપા કરીને કહો. ”

“ કારણ, એનું કારણ તમારે જાણવું હોય તો સાંક્ષેપી. હે મહારાજ ! મારે માથે કોઈ સ્વામી નથી. મારી ઉપર કોઈ દયા કરનાર નહિ હોવાથી આવી ચુવાબસ્થામાં પણ મેં ત્રત અહણ કર્યું ? શું કરું હું અનાથ છું.”

સુનિનો અનાથ શર્ણ સાંક્ષેપી રાજચમક્ષેપો. “ શું તમે અનાથ ? ”

“ હા, મહારાજ ! હું અનાથ ? મારે માથે કોઈ સ્વામી નથી—નાથ નથી, એમાં શું તમને નવાઈ લાગે છે, રાજનૂ ? ”

“ એશાંક, તમારું રૂપ, લાવણ્ય, ચતુરાઈ વળે જોતાં તો તમે અનાથ હો એ સત્ય જાણું નથી; છતાં તમે અનાથ છો એટલાની ખાતર જ ત્રત અહણ કર્યું હોય તો હું તમારો નાથ થવાને તૈયાર છું. આદો સંસારની સર્વ સુખસ્સામણીમાં તમને તરણોલ કરી તમારો નાથ અનું. તમને સુખી કરું ! ” રાજચે કહ્યું.

“ શું તમે મારા નાથ થઈ મને સુખી કરી શકશો ? ” એ અનાથી સુનિને પૂછ્યું.

“ હા, તમને પસંદ પડે એવી સુંદર ચુવતીઓ સાથે તમારાં લઘુ કરાવી આપું. તમોને રાજ આપું. રાજ્યતક્ષમી લોગવતાં ચુવતીઓની સાથે કીડા કરી મનુષ્ય જન્મ સાર્થક કરે. ”

“ અરે ભહારાજ ! એ તમારી શુવતીઓ, એ તમારું સાઓક્ય, એ ઠકુરાઈ, એ વૈભવ મને શું કામના ? તમે પોતે જ પ્રથમ તો અનાથ છો. ત્યાં મારા નાથ તે તમે ડેવી રીતે અની શકવાના હતા ? ”

એ અનાથી મુનિનાં વચન સાંભળી શેખુંક ચમક્યો.
 “ અરે મુનિ ! તમે આ શું બાલો છો ? શું હું અનાથ છું ? સેંકડો સીઓનો હું નાથ છું. અનેક હસ્તીઓ, અર્થે અને રથોનો હું માલેક હોવાથી સનાથ છું. લાખો માણસોનું રક્ષણ કરનાર હું પોતે હોવાથી હું તેમનો નાથ છું. આ મગધની સાઓક્ય લક્ષ્મીનો હું નાથ છું. કહો હું અનાથ ડેવી રીતે છું ? ”

“ છતાંય ભહારાજ ! તમે અનાથ છો. તમારે ત્યાં બલે મગધની લક્ષ્મી હોય કે બધી હુનિયાની લક્ષ્મી કાં ન હોય, છતાંય તમે અનાથ ! ”

“ અસંભવ ! અસંબંધ ! મુનિવર એ ડેવી રીતે ? ”

“ એ તમારી સમૃદ્ધિ, સત્તા, ઠકુરાઈ વગેરેના તમે નામના જ નાથ-માલેક છો. વસ્તુતઃ એ બધાના કાંઈ તમે ખરેખરા માલેક નથી સમજ્યા ? ”

“ હું જ એમનો ખરેખરો અને સાચો સાલેક છું. મારી સીઓનો હું શું નાથ નથી ? આપા મગધહેથનો શું હું નાથ નથી ? મુનિવર ! તે બધું શું તમને ધીરજાળ જેવું લાગે છે. ”

“ હા, એમજ છે. એ સર્વના તમે ભાડુતી નાથ-માલેક છો. એ બધી વસ્તુઓને તમે તમારી પોતાની માની બેઠા છે, પણ વખત આવે ત્યારે એમાંની ડોઈ પણ ચીજ તમારે કાંઈ કામ નથી. એ તમને જરાય સહાય કરે એમ નથી.”

“ શું સહાય કરે એમ નથી સુનિવર ? એ શું બોલ્યા. મારી કીએ રાતદિવસ મારી સેવામાં રહત રહે છે, મારા હુકમે હાજર ને હાજર રહે છે. મારી મરળ મુજબ એમની પાસેથી હું સેવા લઈ શકું છું, તેમજ મારા સૈન્ય, હાથી, ઘાડા, રથ વગેરે મારે જ ઉપરોક્તિ છે. મારા સિવાય બીજને એનો ઉપરોક્ત કરવાની જરાય સત્તા નથી. સમરાંગણુમાં એ મને અણુમોદી સહાય કરનારા છે. શત્રુના સૈન્યને લુતી તેઓ મને વિજય અપાવનારાં છે.”

“ છતાંય અણુને સમયે એ તમારે નકામાં છે.” સુનિ બોલ્યા. “ તેથી જ તમે અનાથ છો.”

“ આપને આટાઆટલો સ્પષ્ટ ખુલાસો કરવા છતાં આપ મને અનાથ કહો છો. તો એનો હેતુ શું છે? કયી બાબતમાં હું અનાથ છું એનો ખુલાસો તો આપજ કહો ત્યારે.”

“ રાજજુ! તમે તમારી કલ્યાના ગ્રમાણું તમારા અનાથ-પણુના બ્યાંખયા કરી અને મારા નાથ બની તમે કરણા બતાવી; છતાં વસ્તુતઃ તમે અનાથ અને સનાથનો લેદ સમજતા નથી તેથીજ તમને અકળામણું થાય છે. એ શુંચવણું ફર થતાં જ સહેલે સમજાઈ જશે.”

“ તેથી એનો ભર્મજ જાણવાને હું છન્ટેકાર છું.
આપ જ એનો ખુલાસો સત્તવર કરો કે સમજાય.”

“ અનેક પ્રકારની સમૃદ્ધિ, વૈશવ છતાં તમે, હું કે
જગતનો ગમે તે પ્રાણી અનાથ જ છે. એ દરેક વस્તુઓનો
નાથ છતાં એમનાં હુંખમાં નથી તો આપણે ભાગ લઈ શકતા
ચા તો આપણા હુંખમાં નથી તો એ વસ્તુઓ ભાગ લઈ
શકતી. હુંખને સમયે એ આપણુંને ટગટગ જોયા કરે છે;
આપણે એને જોયા કરીએ છીએ.”

“ એ અધું કેવી રીતે ? ” મંગધપતિએ આતુર-
તાથી પૂછ્યું.

“ સાંભળો. ” સુનિ બોલ્યા.



પ્રકરણ ૨૩ મું.

અનાથી સુનિ.

“ કોશાંથી નગરીના વિશાળ રાજમહેલમાં સુખમાં
ઉછરેલા રાજકુમારને એક દિવસ ભવિતવ્યતાને યોગે નેત્ર-
રોગનો પીડા થઈ. ભાવ્યાવસ્થામાંથી જ રાજકુમારની એ
નેત્રરોગની પીડાએ ઉચ્ચ ઇપ લીધું. જેથી નેત્રની પીડાથી
રાજકુમારના આખા શરીરે દાહ્યજ્વર થયો. એ અસહ્ય પીડાથી
રાજકુમાર અનેક પ્રકારની વ્યથા લોગવવા લાગ્યો. ”

કૌશાંભીપતિ મહીપાલનો એકનો એકજ એ કુમાર ! માતાપિતાને રાજકુમાર પ્રાણુસમાન હતો. એકના એક યુવ-રાજને જમના હાથમાં જતો. માતાપિતા કેમ સહન કરે ? એ વ્યાધિ દૂર કરવાને માટે અનેક ઉપાયો ચોલવા લાગ્યા. અનેક વૈદ્યો, અનેક મંત્રવાદીઓ અને જ્યોતિષીઓ વગેરેને આલાવી અનેક ઉપયારો કરાયા; છતાંય રાજકુમારની વ્યથા દૂર કરવાને કોઈ શક્તિવંત થયો નહિ. રાજીએ શહેરમાં ને રાજ્યમાં ડાંડી પીટાવી “જે કોઈ રાજકુમારની પીડાને દૂર કરશે તેને રાજ અર્થ રાજ્ય આપશે.” હેશ પરહેથમાં એ વાયકા પ્રસરી ગઈ અને અનેક વૈદ્યોના પ્રથત્ન છતાં રાજકુમારનું હુઃખ કોઈ રીતે દૂર થાય શક્યું નહિ. રોગથી પીડા પામતો રાજકુમાર મૃત્યુ અને જીવન વચ્ચે ઓલાં ખાવા લાગ્યો.

મૃત્યુને લેટવા તૈયાર થયેતા આ રાજકુમારને રાજ-કુમાર છતાં જરાય સુખ કે શાંતિ નહોંતી. રોગોની વ્યથાથી એને જરાય ગમતું નહોંતું. મનુષ્ય જીવનું અથુમોદું જીવન એને મન અકાઢિં હતું. એ મોતના મેમાનને રતિબાર પણ એન નહોંતું. કૌશાંભીપતિની ઋદ્ધિ, સમૃદ્ધ એના સુખને માટે, એની શાંતિને માટે અર્પણું હતી છતાંય એ ઋદ્ધિ, સમૃદ્ધિ, અખંડીત વાત્સલ્યવામાં એ માતાપિતા સેંકડો કુદું-અભજનો, એ હાથી, ઘોડા, રથ, પાયહલ, સુભટો એ મોતની પથારીએ આળોટતા રાજકુમારના થરણું આળોટતું હતું. માતાપિતાના વાત્સલ્યભર્યાં રૂહન, પત્રી, એન, ભાઈએ.

ખોદેનાં કર્ણાજનક રૂહન કઠોર હૃદય પીગળવાને ખણુ પુરતાં
હતાં. લોજનનો પણ ત્યાગ કરીને એ રાજકુમારની સારવાર
માટે હાજર રહેતાં હતા, ઐન, સ્વી, બાઈ, કુટુંબ પરિવાર
બધાં એ રાજકુમારના આરામ માટે રડી રહ્યાં હતાં. આપીય
રાજસમૃદ્ધિ કુરાન હતી. હજરો સુભટો, સૈનિકો, રાજ-
કુમારને ટગર ટગર લેયા કરતા હતા. વૈધો અને મંત્ર-
વાહીઓ એક પછી એક અનેક પ્રકારના ઉપચારો કર્યો
જતા હતા. એ બધાય રાજકુમારને આરામ પમાડવાને
આતુર હતા. એકાંત હિત કરનારા હતા, છતાંય રાજકુમારનો
આનંદ તો ઉડી ગયો હતો. આટાટલી વસ્તુઓ, સાહેભીનો
માલેક-નાથ હેવા છતાં સારા સંસારમાં અત્યારે તે એકલો
હતો. જગત એને મન શૂન્ય હતું. બહેણો પરિવાર છતાં
પોતાને તે એકલો જ માનતો હતો. પ્રતિક્ષણે મૃત્યુ એની
નળુક આવતું હતું. મોતનાં નગારાં વાગી રહ્યાં હતાં. આટ-
આટલી સાહેભીય એને મનતો અત્યારે નકામી હતી. એ
હજરો સુભટો, કુટુંબ પરિવાર એને તો કંઈ કામના નહોતા,
કોઈ એનો દોગ લઈ શકે તેમ ન હેતું. મોતથી બચાવી શકે
તેમ નહેતું. મગધરાજ ! કહો એ રાજકુમાર અનાથ છે કે
સનાથ ? ”

“ મુનિવર ! આપની વાત રહસ્યવાળી છે—શાન-
પશ્ચિમૂર્ખ છે. સંસારમાં જ મીઠાશ માનનારા અમારા વેવા
અદ્યતો સનાથ—અનાથનો મર્મ શું સમજુ શકે ? ખરે

મોટા ભાગ્યથોંગે જ આપ જેવાનો સમાગમ થઈ શકે ? કહેલા, “પછી એ રાજકુમારનું શું થશું ? ”

“ મગધરાજ ! આટાટલી સાહેણી વૈભવ છતાં ઘણ્ણાં દિવસોના હુંખને અંતે એ રાજકુમાર સમજયો. “ હા ! જગતમાં હું અનાથ છું, હું એકલો છું. મારું કોઈ નથી, હું કોઈનો નથી, અચીત પ્રાણીઓએ પૂર્વે જેવાં જેવાં કર્મ કરેલાં હોય છે એવાં અવસ્થય લોગવવાં પડે છે. લોગવવા સમયે કોઈ રક્ષણું કરવાને સમર્થ નથી. મેં પૂર્વે કંઈક હૃદ્દૃત કરેલું હશે તો આ લવમાં મારે લોગવવું પડશું. આટલા બધા ઉપયારો કરવા છતાં, અનેક પ્રકારની સારવાર છતાં લાંબા દિવસોની મારી વ્યથા હૂર થઈ શકતી નથી એનું કરણું શું ? અરે ! જન્મ, જરા અને મરણના લયંકર પ્રસંગો થકી મને કોણું બચાવનાર છે ? માટે અચીત હું અનાથ છું. અન્યે સર્વે જગતના માયાવાસી પ્રાણીઓ પણ અનાથ જ છે તો પછી કોણું કોનો નાથ થઈ શકે ? અસ્તુ. મૃત્યુથી કોણું બચાવી શકે તેમ છે ? ”

પોતાની અનાથ અવસ્થાનું જાન થતાં એ રાજકુમાર વિચારમાં પહ્યો. જ્યારે જગતમાં તો કોઈ પ્રાણી નાથ થઈ શકે તેમ નથી તો પછી હું નાથ કોને બનાવું ? બસ, આ સ્થિતિમાં તો મને કોઈનું શરણ નથી. સંસારની સર્વે વહુંથી હુંઅકર છે. શરણ કરવા યોગ્ય તો એક ધર્મ જ છે.

પૂર્વે જે મેં ધર્મનું શરણ અંગીકાર કર્યું હતે તો આજે મારે આ હુઃખ ન હતે. એરે, હવે ‘ભૂત્યા ત્યાંથી ઇચ્છીને બણું’ એ નિયમને અનુસરી ધર્મ એ એક જ મારું શરણ થાયો ।

આજે આટલી વેહના પણ હું સહન કરી શકતો નથી, તો પૂર્વે આ કરતાંથી ધણીય તીવ્ર વેહના મેં નરક, તર્યાદિક હુર્ગતિમાં સહન કરી હશે. વળી લબિષ્યમાં આના કરતાંથી અધિક વેહના મારે સહન કરવી પડશે એ અધું હું કેમ સહન કરી શકીય ? માટે સંસારના સર્વે અંધનોનો નાશ કરનાર સર્વવિરતિ ધર્મ તે જ મને તો હવે શરણ હો ! એ જ મારે નાથ હો. આ હુઃખમાંથી જે હું સુકત થાડું, ભાવીને ચોગે મારે રોગ નાશ થાય ને શરીરે હું નિરોગી થાડું તો એ સર્વવિરતિ દ્વય દીક્ષાને અંગીકાર કરું. મારા આત્માનું હું શ્રેય કરું. ” રાજકુમારને કોઈ પૂર્વના તથાપ્રકારના શુભ અધ્યવસાયથી તથાપ્રકારની શુભ લાવના જગૃત થઈ અને મન સાથે તે પ્રમાણે તેણે નિક્ષેપ કર્યો.

રાજકુમાર એ પ્રમાણે મન સાથે નિક્ષેપ કરી સૂર્ય ગયો. પેલા નિક્ષેપને પરિણામે ડેટલીક ઘડી વચ્ચમાં પસાર થઈ ગઈ: તે પણી જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ જેમ તેની ભાવના દફન થતી ગઈ અને એની વેહના ધીરે ધીરે ઝાંત થતી ગઈ. “ આહા ! આત્મા એ જ પોતે પોતાનો જનાથ થઈ શકે છે, પણ જે તે પોતાના સ્વરૂપ પ્રમાણે વર્ચે તો પોતે

પોતાને ઓળખી કે તો તે પોતેજ નાથ બની શકે. આ બધીય બાધ્ય વસ્તુઓનો હું નાથ છું એના કરતાં મારી પોતાનો વસ્તુઓનો જ હું નાથ થઈ શકું એ સત્ય છે; ને એ બાધ્ય વસ્તુઓનો ત્યાગ કરવાથી સર્વવિરતિ ઇપ સંયમવડે સનાભતા પ્રાસ થઈ શકે છે. બાધ્યવસ્તુઓનું નાથપણું તો અનંતીવાર થયું છતાં એનાથી કાર્યસિદ્ધ નજ થઈ.' એવા વિચારવાળો રાજકુમાર ચેડા દિવસમાં નિરોગી થઈ ગયો.

અનેક ઉપચારો કરવા છતાં રાજકુમારને કંધ્યપણું કાયદો ન પડવાથી એના માતપિતા બહુ હુંઘી થયેલાં, તે રાજકુમારને અદ્વય સમયમાં આમ તદ્દન નિરોગી જોઈ બેહદ ઝુશી થયા; કારણું કે આ બધું કેમ બન્યું તેની એમને ઓળી ખખર હતી ?

તદ્દન નિરોગી થયેલો રાજકુમાર હુવે માતપિતાના ચરણમાં નમસ્કાર કરી એલયો " પૂજય માતપિતા ! તમે રજા આપો તો હું સર્વવિરતિ ઇપ સંયમ થબણું કરું.

રાજકુમારનું વચ્ચે સંભળી માતપિતા હુલાયાં. કયા માતપિતા હીક્ષાને માટે ઝુશીથી રજા આગી શકે ?

"પૂજય પિતાજ ! આતી મોહચેષા શું કામની ? હું તો મૃત્યુના સુખમાં જ હતો, તમે સર્વેએ મારી આશા છોડી હતી. શું ચોતે પણ જીવવાની આશા છોડી હતી. તે વખતે તમે સર્વે કોઈ છતાં સંભારમાં હું અશરણ હતો—અનાથ હતો. "

“ પણ હવે તો તને સાર થઈ ગયું છે ને ? સંસારના પહાર્થી લોગવવાને તું શક્તિવાન થયો છે. પાપના હિવસો પૂર્ણ થઈ તારે હવે તો પુષ્ટયના હિવસો આંધ્યા છે. બાપુ ! “ માતાએ વચ્ચમાં કણું.

“ માતા ! એમ નથી. હું નિરોગી થયો એનું કારણ અભિનું છે અને તે માટે જ હું ઉધ્યત થયો છું. સમજાયાં ? ”

“ શું કારણ વાઝ ? ” માતાપિતાએ પૂછ્યું.

“ માં એ અશરણું-અનાથાવસ્થામાં નિશ્ચય કર્યો હતો કે મને સાર થશે તો જરૂર હું તત્કાલ દીક્ષા અહણું કરીશ. સર્વ-વિરતિદ્વિપ ધર્મવડે મારા આત્માને સનાથ કરીશ. એ નિશ્ચય કરવાથી જ મને જોતાજોતામાં સાર થઈ ગયું. હવે હું તમને કંઈ કામનો નથી ને ત્યારે પણ કંઈ કામનો નહોતો.”

“ તો જોતે તારે નિશ્ચય તું અમદદમાં મૂકુને. દીક્ષા તો તું ગમે ત્યારે પણ લધ શકે છે. ઉતાવળ શી ? હાલમાં તો સાંસારિક સુખ લોગવ, સમય આવે દીક્ષા અહણું કરજે.”

“ નહિ, હું તો સર્વવિરતિને અર્પણ થઈ ગયો છું. નિરોગી થયો એટલે ક્ષણું માત્ર હું રહ્યી શકું જ નહિ. માતા ! તમારો આશ્રમ અસ્થાને છે. એ લોગો મારે તો વિષ જરૂન છે. હું તો દીક્ષાનો જ ઉમેઠવાર છું. માતા ! ” રાજકુમારે પ્રાતાની હઠ કાઢું રહ્યી.

“તું અમારે એકનો એક પુત્ર. પાટવી, યુવરાજ, આ મોટા રાજ્યનો વાસુસ, તારે માટે અમને ડેટલો અભિલાષ વત્સ ! અમે તને રજા તે કથાંથી આપી શકીએ ? ”

“અચીત, સંસારીયોનો મોહ સ્વાર્થમય ને વિચિત્ર છે. તેણો યમને આપી શકે છે પણ યતિને આપતાં હું ખી થાય છે. લલાં થઈને મને રજા આપો, કોઈ રીતે હું હવે રહી શકું તેમ નથી. કલ્પાંત કથેં કંઈ વળનાર નથી.”

એ હુરાથી માત-પિતાને સમજલી રાજકુમારે સંસારનો ત્યાગ કરી સુનિપણું અંગીકાર કર્યું. અનાથ-અશરણપણું અનુભવેલું હોવાથી અનાથમુનિ પોતાનું નામ રાજ્ય.

“ધન્ય છે એ અનાથી મુનિને, જેમણે એવી બાદ્ય-વસ્થામાં રાજ્યલક્ષમીના વૈભવોનો ત્યાગ કરી દીક્ષા અહણું કરી, અનાથ અને સનાથનો મર્મ સમજુ આત્મકલ્યાણ સાધ્યુ” રાજશ્રેષ્ઠિક વચ્ચે કહું. “ભગવાન ! સનાથ છતાં પોતાને અનાથી તરીકે એણખાવનાર એ મહામુનિ અત્યારે કયાં હશે ? ”

“એ અનાથી મુનિ દીક્ષા અહણું કરી ગામેગામ વિ-હાર કરતાં આજે તમારા ગામની પાદરે આવીને રહેલા છે, જેની સામે તમે પ્રક્ષ કરી રહ્યા છો રજન્ય ? ”

“શું આપજ અનાથી મુનિ ! આહું ધન્ય છે આ-પને ! સંસારના લોગોને તજનાર એક આપને જ ધન્ય છે

કે આપ સુનાથ છતાં પોતાને અનાથી સુનિ તરીકે એળા-
ખાવો છો. આપના જેવા ત્યાગી સુનિબરને જ્ઞાનધ્યાનમાં
આંતરાયુક્તિ આપને સાંસારિક લોગો માટે રતિ પમાડવાનો
ચતું કર્યો, તે માટે હે મહાસુનિ ! આપ મારા અપ-
રાધને ક્ષમા કરજો. ”

અનાથી સુનિને વંદના કરી ખમાલી રજી પોતાની
નગરીમાં ગયો, અનાથી સુનિ ત્યાંથી વિહારુક્તિ અન્યત્ર ચા-
દ્યા ગયા. અનુક્તમે તેઓ કર્મનો ક્ષય કરીને શિવવધૂને વર્યો.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

પ્રકરણ ૨૪ સું.

મહાવીર ભગવાનની દેશના.

કેવળજ્ઞાનની લક્ષ્મી પ્રગટ થયા પછી ભગવાન મહાવીર
અસંખ્યકોટી દેવતાઓના પરિવાર સહિત વિહાર કરતા અ-
પાપાપુરી નગરીએ પદ્ધાર્યો. દેવતાઓએ સમવસરણુંની રચના
કરી, તેમાં એસીને ભગવાન દેશના દેવા લાગ્યા. ભગવાનની
દેશના સાંખળી સર્વ લોકો પરમ શાન્તિવાળા થયા.

અપાપાનગરીમાં સોમિલ નામનો પ્રાદ્યુથ જી કરાવતો હો-
લાથી ગૌતમાદિક અગ્યારે પ્રાદ્યુથ પંડિતો યજ કરવાને પોતાના
શિષ્યાદિક પરિવાર સહિત આવેલા હતા. એ અગ્યારે પંડિતો

૧૩

અતુકે ભગવાન મહાવીરના સમાગમમાં આવ્યા અને પરિવાર સહિત તેમના શિષ્ય થયા.

ત્યાંથી વિહાર કરતા પ્રલુ રાજગૃહનગરે ગુણુશીલચૈત્ય નામના ઉદ્ઘાનમાં સમવસર્યા. ભગવાન મહાવીરનું આગમન સાંભળી મગધપતિ શ્રેણીક ઋદ્રિ, સમૃદ્ધ અને પરિવાર સહિત ભગવાન મહાવીરને વંદન કરવાને આવ્યા. પ્રલુને પ્રદિક્ષણા કરી, નમી, વંદન કરીને યોગ્ય સ્થાનકે એઠા. ભગવાને હેશના આપી. આ દાર્શણ સંસારસસુદ્રમાં આણ્ણીએ. ૭૦મી માનવ-ભવની ખાદ્ય મોહુકતામાં રાચીમાચી ધર્મના મર્મને સમજન્યા-વગર આત્મા જય છે—માનવ ભવ હારી જય છે. પ્રાણીએને સંસારનું કારણું કર્મ છે. પોતાના જ કરેલા કર્મથી વિવેક રહિત પ્રાણી કુવો જોદનારની જેમ નીચે ઉત્તરી જય છે ત્યારે શુદ્ધ હૃદયવાળા પુરુષો મહેલ બાંધનારની જેમ ઉર્ધ્વર્ગતિને ભજનારા થાય છે. એ કર્મબંધનમાં જે જે કારણો છે તે બધાં દૂર કરવામાં આવે તો જ પ્રાણી ઈચ્છિત વસ્તુને મેળવી શકે છે. જીવહિંસા, અસત્ય, ચોરી, વ્યાલિયાર તેમજ ધન ધાન્યમાં મૂર્ચ્છા, તેને મેલવવાની મૂર્ચ્છા એ બધાં પ્રાણીને અધોગતિમાં એંચી જય છે.

સંસારમાં પ્રાણીને સંસારદ્ય વૃક્ષને નાશ કરનારું અને મોક્ષના યીજ સમાન સમ્યગુદર્શનની પ્રાસિ અતિ હુર્દા છે. જ્યાં સુધી સમકિતની પ્રાસિ નથી ત્યાં લગી કાર્યસિદ્ધ પણું નથી. જે ડેદર્શન શરૂઆથી આંખોએ કરીને જે જોવામાં

આવે તે દર્શાન કહેવાય છે; પણ જૈન શાસનમાં સત્ય હેવ, શુરૂ અને ધર્મની ઓળખાલું તેને સમ્બન્ધર્થાન કહેલું છે.

એ સમકિત સહિત કરેલી કિયાએ કૃળવતી થાય છે. મોદ્દ્ધમાર્ગને આપનારી થાય છે, જ્યારે સમકિત વગરની ગમે તેટલો બ્રત-જ્રાપ-તપાહિક કિયા કરવામાં આવે છતાં સાંસારિક કૃળ સિવાય તેતું બીજું કાંઈ ક્રદ નથી. સાંસારિક પણ અદ્ય કૃળ મળે છે. માટે સમકિત માણીને અતિ ઉપયોગી અને અતિ મહત્વની વસ્તુ છે. તીથે કરેલે કહેલા વચ્ચનો ઉપર જે ઇચ્છા જે શ્રદ્ધા તે જ સમકિત કહેવાય છે. એ સમકિત સ્વ-ભાવથી અથવા તો શુરૂના ઉપહેશથી પણ થાય છે.

સાંસારમાં અનાહિકાળથી જીવ જન્મ-મરણ કરે છે. એ જન્મ-મરણ કરતાં ભીયત્વપણુના સ્વભાવને લીધે પર્વત પરથી નહીંમાં પડેલા પાખાણુના ન્યાયે અનાસોગપણુથી યથા-પ્રવૃત્તિકરણ કરે છે. એ યથાપ્રવૃત્તિકરણ કરતાં અદ્યવસાય વિશેષ કરીને આયુષ્ય જીવાય સાતે કર્માની એક પદ્ધોપમના અસંગ્યાતમા ભાગે ન્યુન એક સાગરોપમ કોટાનકોટીની સ્થિતિ કરે છે. આ ગ્રથમ કરણ અસંગ્ય પણ અનંતીવાર કરી શકે છે; પણ એ અભિવ્ય ગ્રથમ કરણ પાસે આવીને પાછા આગળ ચાલ્યા જાય છે; જ્યારે ભવી જીવો અનથીનો લેદ કરી બીજું કરણ કરે છે. એ બીજું કરણ કરણને મિથ્યાત્વની સ્થિતિ અંતઃકોટી સાગરોપમની કરે છે. તેમાંથી અન્ત-

સુર્ખૂર્ત કાલ સુધી તેનાં દલીયાં પ્રહેશથી પણ ન વેહવા પડે
તેવું અન્તરકરણું કરે છે.

મિથ્યાત્વની અંતર્સુર્ખૂર્ત સ્થિતિ લોગવીને બીજુ ઉપ-
શમ કરેલી સ્થિતિમાં અંતરકરણના પ્રથમ સમયે જીવ
સમ્યકૃત્વ પામે છે. મધ્યના અંતર્સુર્ખૂર્તમાં જે સમકિત પ્રાપ્ત
થાય છે તે સમ્યકૃત્વ શર્દાવાળું નિસર્ગ સમકિત કહેવાય છે.
ગુરુના ઉપહેશથી સમ્યકૃત્વ થાય છે તે અધિગમ સમકિત
કહેવાય છે. એ સમ્યકૃત્વ આવકને બળાત્કારે પણ આપવાસં
આવે છે, કારણું કે સમ્યકૃત્વ પામેલો મુદ્ગલપરાવર્તની
અંદર મોક્ષ જરૂર શકે છે. જીબ અને ચારિત્ર વગરનું એકલું
સમકિત પ્રશંસાપાત્ર છે પણ સમકિત વગરનાં જીબ અને
ચારિત્ર તો વખાણુવા યોગ્ય નથી જ.

એ સમકિત ત્રણું મફારે છે. ઔપશમિક, ક્ષયોપશમિક
ક્ષાયિક, હર્ષન મોહનીયની ત્રણું પ્રકૃતિ અને ચારિત્રમોહની-
યની ચાર પ્રકૃતિ આ સાતે પ્રકતિનો ક્ષય ઉપશમ કે ક્ષયોપ-
શમ થાય ત્યારે તથાપ્રકારનું સમ્યકૃત્વ થાય છે. કસમથી
આંશુદ્ધાન કરેલા અગનની કેમ મિથ્યાત્વમોહની અને
અનંતાનુઅંધીની ચોકડીનો ઉપશમ કરવાથી થાય તે ઉપ-
શમ સમકિત કહેવાય છે. આ સમકિત અનાદી મિથ્યાદિષ્ટ
જીવને પૂર્વનાં ત્રણું કરણું કરવાપડે કરીને અન્તર્સુર્ખૂર્તની
સ્થિતિવાળું હોય છે અને તે ચારે ગતિના જીવો પામી શકે

છે. અથવા તો ઉપશમ શ્રેણિપર આરૂપ થયેલા મુનિને અગિયારમે ગુણુસ્થાનકે આ સમકિત હોય છે.

મિથ્યાત્મમોહનીય અને અનંતાતુખંધીની ચોકડી ઉદ્ઘયમાં આવેલી હોય તેનો નાશ કરે અને ઉદ્ઘયમાં નહિં આવેલીનો ઉપશમ કરે. એમ ક્ષય અને ઉપશમ બજેવડે કરીને યુક્ત કે સમકિત તે ક્ષયોપશમિક સમકિત કહેવાય છે. આ સમકિતની સ્થિતિ છાસઠ સાગરાપમ જાળેરી છે.

દર્શનમોહનીયની ગ્રણ અને અનંતાતુખંધીની ચાર એ સાતે પ્રકૃતિનો ક્ષય કરવાથી ક્ષયક સમ્યકૃત સાહિઅનંત સ્થિતિવાળું ઉત્પજ્ઞ થાય છે.

શુશ્રૂષા, ધર્મરાગતા અને સેવાભક્તિ આ ગ્રણ જેનામાં હોય તે સમકિત કહેવાય છે. જિનેશ્વરનાં વચનો, એમનો ઉપદેશ સાંભળવાની કે ઈચ્છા તે શુશ્રૂષા, જિનેશ્વરના ધર્મને વિષે કે રાગ-પ્રોત્િઓ બીજું લક્ષ્ય, તેમજ જિનેશ્વર અને સંધની વૈયાવચ્ચ-સેવાભક્તિ.

તીર્થંકરનો ઉપદેશ, એમનાં વચનો સાંભળવાની નિરંતર ઈચ્છા રાખવી કેમકે જિનવચનો શ્રવણ કર્યા વગર કોઈ ફળું જ્ઞાનાદિક ગુણું પ્રાપ્ત થતો નથી. જ્ઞાન સાંભળવાથી એવા ગુણો પ્રગટ થાય છે. શાસ્ત્ર સાંભળવાથી જ્ઞાન થાય, એ જ્ઞાનથી પરચખાણું થાય, પરચખાણુથી વિરતિપળું આવે, વિરાત-પળુથી દોષરહિત તપ થાય, તપથી અનુષ્ઠાને કિયારહિત થવાથી કિયારહિત થવાથી મર્વિષુમાર્ગ પ્રાપ્ત થાય. આરા જલના

ત્યાગથી અને ભીડા જલના ત્યોગથી થીજ અંકુરાને પામે છે તેમ તત્ત્વજ્ઞાનના શ્રવણથી મનુષ્ય જ્ઞાન પામે છે જ્ઞાનરૂપ અંકુર પ્રગટે છે.

જ્ઞાન પ્રગટ થયા પછી વસ્તુ સમજયા પછી જિનેશ્વરના ધર્મ ઉપર રાગ પ્રગટે છે. જ્યારે પ્રીતિ ઉત્પન્ન થાય ત્યારે જ ધર્મ ઉપર શ્રદ્ધા, અહિતા આહિ વૃદ્ધિ પામે છે અને તે પછી વૈયાવચ્ચ કરવી, તેમાં લીર્થંકરની દ્રવ્ય અને ભાવ પૂજાવડે વૈયાવચ્ચ કરવી, ગુરુની અશન પાનાહિકવડે વૈયાવચ્ચ કરવી તેમજ ચાર પ્રકારના ધર્મમાંથી યથાશક્તિ ધર્મનું આરાધન કરવું અથવા તો શ્રાવકધર્મ કે સાધુધર્મ એ અન્ને ધર્મમાંથી એક પણ ધર્મનું પાલન કરવું. મોખે જવું હોય તો રત્નત્રધીની પ્રાપ્તિ અવહૃત કરવી. એ રત્નત્રધીમાં સમકિત અવસ્થ મેળવવા લાયક છે, કારણ કે તેના સિવાય કાર્યની સિદ્ધિ થતી નથી.

એ પ્રમાણે દેશના શ્રવણું કરી ધણું જવો પ્રતિયોધ પામ્યા. શ્રેષ્ઠિક મહારાજે સમ્યકુત્વ અહૃતું કર્યું. અભયકુમાર પ્રસૂઅ શ્રાવકો આર પ્રતધારી શ્રાવકો થયા.

શ્રેષ્ઠિકના કુમાર મેધકુમારે ઘેર આવી માતાપિતાની દીક્ષા લેવા માટે અનુસા માગી. માતાપિતાએ સંસારમાં રહેવાને મેધકુમારને સમજન્યો છતાં પ્રત લેવાના એના દઢ પરિણ્ણામ જાહ્ણીને માતાપિતાએ રબ આપી. મોટા મહેતસવ-પૂર્વક મેધકુમારે દીક્ષા અહૃતું કરી.

નિશાસસભયે મેધ મુનિનો સંઘરે છેદવો આવવાથી

હરેક સાધુએના થરણું આધાતની પીડાથી પીડિત થયેલા મેઘમુનિ અગ્નપરિણામી થયા. પ્રાતઃકાળે પોતાને ધેર જવાને મેઘમુનિ મહાવીરસ્વામી પાસે રજી લેવાને આવ્યા. શાનથી મેઘમુનિને અગ્નપરિણામી જાહી ભગવંત મહાવીરે એમને ખાદ કર્યો. મેઘકુમારને પાસે આવેલા જાહી ભગવાન બોલ્યા: “ અરે મેઘ ! સંયમના પરિણામથી કાગચિત્વાદી થઈ તું તારા પૂર્વભવને કેમ સંભારતો નથી ? ”

“ ભગવાન ! આપજ કહો ? પૂર્વભવે હું કેણું હતો તે ? ” મેઘમુનિએ પૂછ્યું:

“ સાંભળ. આ લબથી ત્રીજે લવે તું વૈતાદ્યગિરિ ઉપર મેઢપ્રાબ નામે હુથી હતો. એક વર્ષતે વનમાં દાવાનળ લાગવાથી તૃપ્યાર્થ થયેલો તું પાણી પીવા સરોવરમાં ગયો. ત્યાં કાદવમાં ઝુંચી ગયો. નિર્ભળ થઈ ગયેલા તને તારા શત્રુ હુસ્તીએ આવીને દંતાદિકના બહુ પ્રહાર કર્યો, તેથી સાતમે દિવસે મૃત્યુ પામીને તે જ નામનો વિધ્યગિરિમાં તું હુથી થયો. એક દિવસ વનમાં દાવાનળ લાગેલો જોઈ જાતિસ્મરણુ જ્ઞાન થવાથી તૃશુલૃક્ષ વગેરેતું ઉન્મૂલન કરીને તેંબુથની રક્ષા ને માટે નથી ડિનારે ત્રણ સ્થંડિલ કર્યો.

અન્યદા દાવાનળ પ્રગટ થયેલો જોઈ તું પેલા સ્થંડિલ તરફ દોડ્યો. તો એ સ્થંડિલો તો મૃગ વગેરે જાનવરોથી પૂરાધ ગયા હતાં. તું ત્રીજા સ્થંડિલમાં ગયો. ત્યાં રહ્યાં થકાં શરીરને ખુજલી કરવાને તેં એક પગ ઉપાડ્યો. એ જગાએ એક

સસલો આવીને રહ્યો. તું જેવો પગ મૂકવા જય છે તેવામાં ત્યાં સસલો જોઈને તને હ્યા આવી, જેથી તેં પગ ઉચ્ચો રાજ્યો. અનુકૂળે ત્રણ પગે તું સ્થિત રહ્યો. એવી સ્થિતિમાં અઢી દિવસ વહી ગયા. અઢી દિવસ બાદ દાવાનથ શાંત થયો. ને સસલા વગેરે પ્રાણીઓ પોતપોતાને ડેકાણું ચાલ્યા ગયા તું પણ જવાની ધર્ભિયાવાળો જેવો ચોયો. પગ મૂકવા જય છે તેવો તું પડી ગયો. ચાલવાને અસર્મર્થ થડો ત્રણ દિવસ બાદ મૃત્યુ પામીને તું સસલા ઉપર કરેકી હ્યાને પ્રતાપે આ ભવમાં રાજ્યપુત્ર થયો છે. મહાનુભાવ ! માંડ માંડ પ્રાપ્ત થયેદો મનુષ્ય ક્ષમતાનું તું શાને શુભાવે છે ? એક સસલાની હ્યા કરવા જતાં આટલું ખંડું કષ્ટ તેં સહન કર્યું ને અત્યારે સાધુઅના ચરણ-સંઘર્ષથી ગવાનિ પામે છે? એક જ માત્ર સસલાને અભયદાન આપવાથી તને આટલું ક્ષેત્ર મળ્યું તો ક્ષર્વ જીવોને અભય આપનાર સુનિપણુંને પ્રાપ્ત કરવાના ક્ષેત્રની તો વાત શી ? માટે તેં જે પ્રત સ્વીકાર્યું છે તેનું સારીરીતે પાલન કર. આ ભવસાગર તરીઝ, કારણ કે સંભારથકી પાર ઉત્તાશવાને સર્મર્થ એવું મનુષ્યપણું આ લોકમાં ફરીને મલવું હુર્લાલ છે. ”

સગવાનની આવી વાણી સાંભળીને મેધમુનિ પ્રતમાં સ્થિર થયા. રત્નિંદ્રા થયેદા માડા વિચારનું મિથ્યાહૃષ્ટત કર્યું, ને વિવિધ પ્રકારે તપ કરવા માંડયું સારી રીતે પ્રત પાલન કરી મેધમુનિ વિજય વિમાને હેવ થયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મોક્ષે જરી.

મફકરણુ રૂપ મું.

વહેમ.

મગધરાજ શ્રેષ્ઠિકને ચેતલણુા, ધારણી પ્રમુખ ધણી સ્વીએં હતી છતાં રાજને ચેતલણુા અધિક પ્રિય હતી. ચેતલણુાની સાથે અનેક પ્રકારની પ્રેમચેષ્ટા કરતો રાજ પોતાનો કાળ દેવતાની માઝક સુખમાં વ્યતીત કરતો. એકદા શિશિર જતુ આવી. એક તો હંડીના દિવસો તેમાંચ વળી ઉત્તર હિશાનો પવન કુંકાવા લાગ્યો. જેથી શ્રીમંત લેણો તો સધીએં પાસે રાખીને તેમજ ડેશરનું વિલેપન કરી. ગર્વઘૃહમાં રહી કાબ નિર્ગમન કરવા લાગ્યા; જયારે બિચારા ગરીબ લેણોની આ સમયે કુમણઘટી હતી. અરીબ લેણોનાં બાળકો વચ્ચ વગર હાથીના દાંત જેવા ખુલ્લા હાથ રાખી મુજજ્તા મુજજ્તા ગૃહદ્રાર ઉપર દંતવીણુા વગાડતા હતા. એવા સમયમાં ભગવાન મહાવીર સુર-અસુરોથી સેવાતા રાજઘૃહી સમવસર્થી.

મહાવીરસ્વામીનું આગમન સાંભળી શ્રેષ્ઠિક ચેતલણુા સહિત વંદન કરવાને આવ્યો. ભગવાનને વાંદી, દેશના સાંભળી રાજહંપતી પાછા કૃથી. તે વારે માર્ગમાં કોઈ સરોવરની નીચે પ્રતિમા ધારણું કરીને સુનિ કાઉસસગધ્યાને ઉલેલા હતા. ઉત્તરીય વાંદન શીત પરીસહને સહન કરતાં તે સુનિને જોકુ તેઓએ તરતજ વાહન ઉપરથી ઉત્તરીને વંદન કર્યું. પછી ધર્મ સંબંધી વાતો કરતો શ્રેષ્ઠિક પ્રિયા સહિત પોતાના મહેલમાં આવ્યો.

નિશા સમયે ચેલ્લાણું હેવીની ભુજલતાનું ઓશીકું કરીને રાજ નિદ્રાવશ થયો. ગાઠ નિદ્રામાં પડેલા ચેલ્લાણું હેવીનો હુસ્ત બહાર નિકળી ગયો નેથી હુસ્તસહ શીતવેદના સહન કરતા ચેલ્લાણું જાગૃત થઈ ગઈ ટાઢાની પીડાને સહન કરતી ચેલ્લાણું એતાનો હાથ અંદર લઈ લીધો. તે સમયે પેલા મુનિનું રમરણ થયું નેથી તે બાબી “ અહો ! આવી ઠંડીમાં તેનું શું થયું હશે ? ” એમ એલાકી ચેલ્લાણું કરીને નિદ્રાવશ થઈ ગઈ.

ચેલ્લાણાનાં સિત્કારથી અદ્ય નિદ્રાવાળો રાજ જાગૃત થયો. કારણું કે મહાનૃ હૃદયવાળા પુરુષોને નિદ્રા પ્રાય: હાસીની જેમ વશ્ય હોય છે, તેથી ચેલ્લાણાના સિત્કારથી જાગૃત થયેલા રાજએ ચેલ્લાણનું વાક્ય સાંભળ્યું. સાંભળતાં જ એના હૃદયમાં ધર્ષાં ઉત્પન્ન થઈ ચેલ્લાણું માટે અનેક સંકલ્પ વિકલ્પ તેને થવા લાગ્યા..

“ આહા ! હું આને સતીશિરોમણિ ધારતો હતો ત્યારે આનાં હૃદયમાં વળી કોઈ ખીને પુરુષ જ રમતો લાગે છે કે જેને માટે તે અત્યારે શીતની પીડાથી તેની ચિંતા કરી રહી છે ? સ્વીઓના હૃદયના આવા જ જરૂરાંસા. ” રાજ શ્રેણિક ચેલ્લાણાં શઅદો સાંભળી તેની ઉપર મંદ રાગવાળો થઈ ગયો. પ્રાતઃકાળે ભગવાનને વંન કરવા જઈશ ત્યારે હું પૂર્ણીશ કે મારી સ્વી ચેલ્લાણું સતી છે કે કેમ ? પછી હું એને અવશ્ય શિક્ષા કરીશ.

વિચારમાં ને વિચારમાં શ્રેણિકને નિદ્રા આવી નહિ. બાકીની અંધી રાત્રિ એમજ પસાર થઈ ગઈ. પ્રાતઃકાળ થયો પણ અત્યારે રાજનું હુદય ધર્યાથી સણગતું હતું. પોતાની જીના શિયળ સંભંધી શાંકિત થયેલો પુરુષ કોણ ધીરજ ધરી રહે છે. શાંકા પડી કે તરત જ શિક્ષા કરવાને પુરુષો અધિરા થઈ જય છે. આવી બાબતો નિર્માલ્ય પુરુષો જ સહુન કરે છે. બાકી તો કેટલાક ઉતાવળીયા પુરુષો બોાડનું બોાડ કરી નાખે છે, પછી પાછળથી ભલે ને પઢ્યાતાપ કરે.

આવા જ ઉતાવળીયા સન્નભાવવાળો શ્રેણિક પણ ઝુદ્ધિ-માન છતાં અવિચારી કામ કરવાને તત્પર થઈ ગયો. એ સ્થિતિમાં પુરુષો પ્રિયાનો જરાપણ અપરાધ સહુન કરતા નથી. એ ઉપર પુરુષની ગમે તેટલી અને ગમે તેવી પ્રીતિ હોય તો પણ તત્કાલ તેનો નાશ થઈ પુરુષ ધર્યાનું બની જય છે.

પ્રાતઃકાળે રાજને ચેલાણુંને અન્તઃપુરમાં જવાની આજા કરી અને પોતે અલયકુમારને ઓલાવી કહેવા લાગ્યો “વત્સ ! માર્દ અન્તઃપુર અધું હુરાચારથી દુષ્ટ થઈ ગયું છે માટે તને હું હુકમ કરું છું કે તું તે અન્તઃપુરને બાળી નાખ.”

પિતાની આજા સંભળી પુત્ર વિચારમાં પડ્યો. પિતાની સામે જ જોઈ રહ્યો “પિતાજ ! આપ શું કહી રહ્યા છો ? શું કરી રહ્યા છો ?”

“ હું સત્ય કહું છું; તું જરાપણું માતા પરને મોહ રાખીશ નહિ ને મારી આજાને અમલ કર ? ”

“ આપની આજા મારે શિરસામાન્ય છે. પિતાના કથનને અભયકુમારે અતુમીધન આપ્યું. અભયકુમારને આજા કરીને મહાવિરસ્વામીને વંહન કરવાને ગયો;

પિતાની આજાંપામીને અભયકુમારંવિચારમાં પડ્યો. મારી માતાએ સ્વાભાવિક રીતે નિર્દેષ અને સહૃદયબુન્ધસંપત્ત છે છતાં પિતાળુએ જ્યારે આવી કઠોર આજા કરી તો મારે આ સમયે શું કરવું ? પિતાળની આજા માન્ય કરી શું મારી માતાનો મારે જ હાથે નાશ કરું ? ત્યારે પિતાળની આજા અમાન્ય કરું ? તે પણ ન બને; કારણ કે એ તો રાજન્ય. મોચીના કરવતની માફક બન્ને રીતે બયંકર હોય છે. પિતાની આજા પણ પાલવી જોઈએ ? તેમજ માતાએનું પણ રક્ષણ કરવું જોઈએ. એ બન્ને બાબતો સચવાય તે માટે કર્યો. માર્ગ મારે અહણ કરવો ? જેમે તેવું વિષમ અને બયંકર કાર્યે પણ વિચારપૂર્વક કરવામાં આવે તો પાછળથી એહ થતો નથી.

કેટલોએ વિચાર કર્યો પછી બુદ્ધિમાન અભયકુમાર મંત્રીએ અંતઃપુરની નણક હાથીખાનાની પર્ણકુરીએને સળગાવી દીધી અને માણુસો દ્વારા ઉદ્ઘોષણા કરાવી કે “ અન્તઃપુર દરખ થાધ ગયું. અન્તઃપુર દરખ થાધ ગયું. ”

હાથી ખાનાની પર્ણું કુટીએને આજોં લગ્યાની અભયકુમાર પણ શાંત કદમે ડગલાં ભરતો ભગવાનને વંદન કરવાને ચાલ્યો.

મગધપતિઃ વીર ભગવાનને વંદન નમસ્કાર કરીને હેશના આંબથવા એડો. હેશનાને અંતે સમય મળત્રાં મગધરાજ શ્રેણું કે ભગવાનને પૂછ્યું “ પ્રભુ ! ચેલલણું સંતી છે કે અસ્તી ? ”

‘ રાજુ ! તારી ધર્મપતની ચેલલણું મહાસતી છે, શીલ અદંકારથી સુશોભિત છે તેથી એ ખી ઉપર કાંઈ શાંકા લાવીશ નહિ. ’ ભગવાને કહ્યું.

“ ત્યારે રાતના ખી પેલા શષ્ઠો યોદી તેનો પરમાર્થ શું ! પ્રભુ ? ” રાજુએ શાંકાનું નિવારણ કરવા પૂછ્યું.

“ ગઈકાલે અહોથી જતાં શીત પરીસહને સહન કરતા ઉધાનમાં રહેલા પેલા મુનિને જોઈ તમે હંપતીએ વંદન કર્યું. નિશા સમયે નિદ્રામાં એવી ઠંડીને સમયે રાણીને તે મુનિ ચાહ આવ્યા, જેથી એને લાગ્યું કે આટલી સગવડતાં છતાં અમને આટલી ઠંડી લાગે છે ત્યારે વસ્તુ નગરના તે મુનિની અત્યારે શું સ્થિતિ હશે ? મુનિ સંબંધી વિગ્રહ આવતાં ચેલલણાના મુખમાંથી એ શષ્ઠો નીકળી પડ્યા. ” ભગવાનના ઉપર પ્રમાણેના શષ્ઠ સાંભળી શ્રેણું ભગવાનને નમસ્કાર કરીને નગરમાં જવાને હોડતો ચાલ્યો.

એના હૈયામાં ધ્રાસકો હતો “ અરદર ! ચેલલણું મહાસતી છે. એવી મહાસતી ઉપર નાહંક મેં અનિષ્ટની ચિંત-

પણું કરી. સમસ્ત અન્તઃપુરને બાળી નાખવાનો મેં હુકમ કર્યો. અભયકુમારે તે પ્રમાણે કર્યું હશે? તો શું થશે બારે થધ! ” મનુષ્યરાજ ઉતાવળે ઉતાવળે શાસકર આવતો હતો. ત્યાં અભયકુમારને જોઈ ઉત્સુકતાથી રાજને પૂછ્યું “ કેમ અભય! મારી આજા પ્રમાણે તેં કર્યું? ”

રાજનો સવાલ સાંભળી અભયકુમાર અંજલી જોઈને જોદ્યો “ તાત! આપની આજા બીજાને પણ પ્રમાણું છે તો મારે કેમ ન હોય? ”

અભયકુમારનાં વચન સાંભળી રાજને ચકરી આવવા મંડી “ અરે પાપી, પોતાની માતાઓને મારી તું અધારિ જીવે છે શું? તું એ અજિનમાં કેમ પડ્યો નહિ? ” રાજને રોપથી કહ્યું.

રાજનો કહિ કોઈના થયા છે કે તે પોતાના થધ શકે? હુકમ કરવા સમયે પોતાને ભાન હોતું નથી. સહસ્ર હુકમથી અવિચારી કાર્ય કરી પાછળથી પશ્ચાત્તાપ કરવા મંડી જાય છે. શ્રેષ્ઠિક રાજને એવો જ અવિચારી હુકમ કર્યો ને હવે અભયકુમારને હોષ હેવા લાગ્યો.

રાજનાં વચન સાંભળી અભયકુમાર જોદ્યો. “પિતાજી! મહાવીર ભગવાનનાં ભક્ત એવા મને પતંગની માઝક મરવું ચોગ્ય નથી. હું શા માટે અજિનમાં પડું? સમય આવુતાં હું તો દીક્ષા અહુણું કરીશ અને તે સમયે ભગવંતની એવી આજા

થશે તો પતંગની માર્ક અભિનમાં પડીને પણ મૃત્યુ પામીથ, એમાં કરાપણ સંશય રાખશો જણ્ણિ. ”

અભયકુમારનાં આવાં વચન સાંભળી શ્રેષ્ઠિક મૂઢ જેવો થઈ ગયો. “અરે હાથ મારું અન્તઃપુર ! બધું વિના કારણે મેં હંઘ કરાયું. મહાસતી ચેદ્વાણું ઉપર જોઈ શાંક લાલી સમસ્ત અન્તઃપુરનો મેં નાશ કરાયો. હા ! ચેદ્વાણું !! ચેદ્વાણું !!! કરતો રાજ વિલાપ કરવા લાગ્યો. ” અરે વત્સ ! મારા વચનથી પણ તેં આવું અકાર્ય કેમ કર્યું ? ”

વિષપાન કરેલો માણુસ ઊરની અસર લાગતાં જેમ મૂચ્છિત થઈ જાય તેમ રાજ “ ચેદ્વાણું ! ચેદ્વાણું ! ” કરતો મૂચ્છિત થઈ ગયો.

અભયકુમારે શિતળ જળ સિંચન કરી રાજને જગૃત કર્યો “ સ્વામિનું ! અન્તઃપુરમાં કુશળતા છે. કોઈ હુર્ભાગના યોગે મારી માતાઓ ઉપર આપે અવકૃપા કરી તેમનો નિશ્ચહ કરવાની મને આજા કરી; પણ મેં આપની આજાનો અમલ કર્યો નથી, એ આપનો અપરાધ થયો છે પિતાણ ! ”

અભયકુમારનાં વચન સાંભળી રાજ અધિક પ્રસન્ન થયો. “ વત્સ ! તેં બહું સારુ કર્યું છે. ત્યારે તેં મારી આજાનો શીરીતે અમલ કર્યો ? ”

“ પિતાણ ! અન્તઃપુરને બહલે અન્તઃપુરની નળુક રહેલી પર્બુ કુરીઓ મેં બાળી નાંખી છે, તમારી આજા પણ હું વિચાર કર્યા વગર અમલ કર્દે તેવો નથી. ”

“ અભય ! તું ખરેખર મારો પુત્ર છે. યુદ્ધિમાન છે. મારી ઉપર આમ ચેડેલું ઠળંક તેં યુદ્ધિવડે હુર કરી નાખ્યું છે.

પિતાપુત્ર વતો કરતા રાજમહેલમાં આવ્યા. રાજાએ પારિતોષિકિવડે અભયકુમારને સંતોષ્યો. અનતઃપુરમાં જવાની ત્વરત્વાળો અને ચેહ્સાખાના દર્શનની ઉંઠકંઠાવાળો તે ચેહ્સાખાના મંહિરમાં ચાહ્યો ગયો.



પ્રકરણ ૨૬ મું.

નંદિષેષુ.

મગધરાજ શ્રેણિકને નંદિષેષુ નામે પુત્ર હતો. મહાવીર અભયાનની દેશના સાંકણી નંદિષેષુને વૈરાગ્ય આપ્યો. જેથી એને હીક્ષાના પરિણામ થયા. માતાપિતાની અનુસા માગી. સંસારમાં રહેવાને માતાપિતાએ ધર્માય સમજાઓ. પ્રત વાહણ કરવામાં હુદ્દ નિક્ષેપવાળો. જાણી માતાપિતાએ નંદિષેષુને રજા આપી. પ્રત લેવાને જેવો તે ગૃહમાંથી બહાર નીકળ્યો. તેવામાં દેખતાએ અંતરિક્ષમાં રહીને કહ્યું કે—“ હે નંદિષેષુ ! તું કિસુક થઈ પ્રત લેવાને કૃયાં જાય છો ? હજી તારે ચાન્દિને આધુનારણુ કરનારું લોગકર્મ બાકી છે. તે કર્મનો ક્ષય થાય લાં લગ્ની. તું થાડો એક ઢાળ ગૃહવાસમાં રહે. ”

“ આહ ! એ કર્મ બિયારા જડ પદાર્થનો શું હિસાબ છે ? મારી આગળ તો તે રંક છે. ” નંદિષેષુ કહ્યું

“ વત્તે ! જ્યાં લગી લોગકર્મ પડેલું છે ત્યાં લગી તારી કિયા ઝૂળવાળી થવાની નથી. અકાલે કરેલી કિયા ક્યારે પણ ઝૂળવાળી થાય છે કે ? ”

“ સાધુપણુંમાં મગ્ન એવા મને એકર્મ શું કરી શકનાર છી ? ” દેવતાના વચનની અવગણુના કરીને ચારિત્ર લેવાની ઉત્કંઠાવાણો તે પ્રભુની સમીપે આવ્યો. પ્રભુ પાસે દીક્ષાની પ્રાર્થના કરી. પ્રભુએ પણ તેને સમજાવ્યો. છતાં ચારિત્ર લેવાની તીવ્ર આકંક્ષાવાળા નંદીષેષુ ઉતાવળથી દીક્ષા અહણુ કરી છઢુ, અહુમ વગેરે તપસ્યા કરતો નંદીષેષુ અગવાન સાથે વિહાર કરવા લાગ્યો. ગુરુની પાસે એસી સૂત્ર, સૂત્રાર્થ વિચારતા, એની સદહણુ કરતા, એના અર્થનું સમરણુ કરતા હતા, બાવીશ પ્રકારના પરીસહાને સહન કરતા હતા, આવા ત્યાળી, તપસ્વી છતાં એમના મનમાં લોગની પ્રખણ છંચ્છા ઉત્પત્ત થવા લાગી. એ લોગની છંચ્છાને રોકવાને તેઓ અધિક અધિક પ્રયત્ન કરવા લાગ્યા. તેઓ વિશેષપણે તપ કરવા લાગ્યા, આત્માપના લેવા લાગ્યા સવિશેષપણે કંચાને આવી રીતે દમન કરતાં પણ લોગકર્મના ઉદ્દ્યથી અધિક અધિક છંચ્છાએ થવા લાગી. આત્મા સમર્થ છતાં, જગૃત થયેદો હોવા છતાં, એમના મનમાં લોગોના વિચારો વારંવાર થવા લાગ્યા. લાલસાએ વધવા લાગી, વિષયો ઉપર એમને પ્રાતિ થવા લાગી. પૂર્વકર્મના ઉદ્દ્યથી એમનું મન વારંવાર વિષયોમાં લાટકવા લાગ્યું—પ્રીતિ ધરવા લાગ્યું.

વારંવાર વિષયોમાં, લોગમાં જતા મનને એંચ્યોને નંદીષેષુ સુનિ ક્ષયાનમાં એકાશ કરવા લાગ્યા. સમશાનભૂમિ ઉપર ઉલા રહીને દોર આતાપના કરવા લાગ્યા. અનેક રીતે કાયાને દમવા છતાં ઈદ્વિશેના વિકારો બલાત્કારે ઉઠતા ત્યારે પ્રતભંગથી કાથર થયેલા નંદીષેષુ સ્વયમેવ ઈદ્વિશેને બંધ કરવાને પ્રવર્ત્તા હતા; પણ પ્રત લેતાં રોકનાર દેવતા તેના બંધને છેઢી નાખતો હતો. પ્રતભંગના ડરથી શાખાવડે સૃત્યુ પામવાની તજવીજ કરતા હતા, પણ દેવતા તેના એ પરિશ્રમને વ્યર્થ કરી નાખતો હતો. મરવાની ઈચ્છાથી વિષસક્ષણ કરતા પણ એ વિષ તેમને અમૃતપણે પરિણુમતું હતું. અભિ-પ્રવેશ કરતા તો અજિન પણ શીતલ થઈ જતો હતો. પર્વત ઉદ્ધર્થી જંપાપાત કરતા તો દેવતા એમને વચ્ચમાંથી જ જીવી લઇને એક બાળુએ મૂકી દેતા હતા. “ અરે નંદીષેષુ ! મારું વચ્ચન કેમ સંભારતા નથી ? રે હુરાથહી ! તીર્થંકરો પણ લોગ્ય કુળકર્મને લોગ્યા વગર તેને ટાળવાને સમર્થ થતા નથી તો તમે પ્રતિદિવસ વૃથા પ્રયત્ન શા માટે કરો છો ? ”

દેવતા વારંવાર તેને આ પ્રમાણે કહેતા છતાં જત લંગના ભયથી ભય પામેલા નંદીષેષુ દેવતાનું કથન માન્ય કર્યું નિહિ. તેઓ બલાત્કારે પણ મનને કાણ્યુમાં રાખવા લાગ્યા.

છતાં એમનું લોગકર્મ કુળ તીવ્ર હતું. એ કુળ લોગ્યા વગર એમને છુટકો નહોતો. આખરે એક દિવસ તેમનો આવી પહોંચ્યો. જે દિવસના મધ્યાનહ સમયે આહાર

માટે પરિભ્રમણું કરતા નંદિષેણ મુનિ અવિતંયતા ચોગે એક વેશ્યાના ઘરમાં પેઠા. ત્યાં વેશ્યાની આગળ ધર્મલાભ કહીને ઉભા રહ્યા.

વેશ્યા મુનિને જોઈ ઉભી થઈ. એમની સામે જોઈ રહી. નંદિષેણ રાજકુમાર હતા. આટઆટલી તપશ્ચયોથી શરીર કુશ થયું છતાં એમનું સ્વભાવિક સૌંદર્ય હજ નાથ થયું નહોતું.

અવસ્થા પણ તરણ હતી. એ સુંદર સાધુપુરુષનો ધર્મલાભ જોઈ વેશ્યા હુસી. “સ્વામિન! અહીયાં તો અર્થલાભ જોઈએ, ધર્મલાભ નહિ.”

શુવાન, સુંદર સાધુને જોઈ વેશ્યા પણ રાગવાળી થઈ. એનું ચિત્ત સાધુમાં રાગયુક્ત થયું. રાગયુક્ત ચિત્તે વેશ્યા સાધુને જોઈ રહી. “અર્થલાભ છે તમારી પાસે? તમે તો સાધુ સંન્યાસી થયા છો. તમારી પાસે અર્થલાભ તે કયાંથી હોય !”

“શું તારે અર્થલાભ જોઈએ છે કે ? ”

“હા ! સ્વામિન ! ”

“તો કે તારે અર્થલાભ. ” મુનિએ એક તૃણ એંચીને કણિધવડેડું ધનનો ઠગલો કરી દીધો. મુનિ તેના ઘરમાંથી અહાર નિકળવા લાગ્યા.

મુનિની આવી અનુપમ શક્તિને જોઈ વેશ્યા એમની

પછવાડે હોડી આવી. એમની આગળ કરી વળી. મુનિને જવાને માર્ગ રોકીને બોલી. “ હે સ્વામી ! આપે યૌવન-વયમાં કેમ દીક્ષા અહુણું કરી છે ? હુધ્કર એવું વત તમે છોડી દો અને મારી સાથે લોગોને લોગવો . ”

“ એ તું શું બકે છે ? તારી એવી કાકદુદીથી હું માર્ગ વત તળ દઉં ? વત ભાંગ કરું ? ” નંદીબેણું કહ્યું.

“ હે પ્રાણુનાથ ! હે જીવિતેશ્વર ! મારી પ્રાર્થના સ્વીકારે. તમને જોઈ હું દિવાની બની છું. તમે જો મને તળને ચાલ્યા જરીએ તો અચીત માનજો કે હું મારા પ્રાણ છોડી દદ્ધશ . ”

વેશ્યાનું સૌંદર્ય અનુપમ હતું. ચાતુર્ય, તારણ્ય, લોગકળા નિપુણતા, એના હાવલાવ વગેરે સર્વાંગે લોગની સામચી પ્રત્યક્ષ થયેલી જોઈ નંદીબેણું વિચારમાં પડ્યા. “ શું કરવું મારે ? વતભાંગ કરું ? ત્યારે વતભાંગતું મહાન પાપ ઉપાજ્ઞન કરું ? આ તો મહાન્સ સંકટ: પ્રાર્થ થયું હેવતાનું અવિષ્ય-કથન આખરે સત્ય થયું. ”

મુનિના મનમાં પણ વિષયવિકારેની પ્રભળ ધ્યાચ્છાયો ઉમજ થવા લાગી. એ લાલસા, એ વાસનાઓ એમને હેરાન કરવા લાગી. સ્વી સાથે રમવાની એમની આતુરતા એટલી તો વધી ગઈ કે લોગ સિવાય તેમને ધીજું કાંઈ પણ ગમતું નહિં. છેલ્દો છેલ્દો એ વાસનાઓને દાખવાનો પ્રથતન કરતા મુનિ વેશ્યાને છોડી આગળ ચાલવા લાગ્યા. મુનિને જતા જોઈ વેશ્યા એમને વળગી પડી. કાલાવાલા કરતી બોલી: “ હા !

પ્રિયતમ ! મને તળુને કથાં જાઓ છો ? શું સાધુએ આવા નિષ્ઠુર હોય છે ? મારા ઉપર જરા તો હ્યા લાવો.”

પ્રમહાના ડોમલ વૃપર્શથી સુનિની વાસનાને અધિક ઉત્તોજન મળ્યું. એમની રોગે રોગે મહનની પીડા સંક્રમણ લાગી. રોમે રોમે વિષયતું વિષ પ્રસરવા લાગ્યું. વેશ્યાના હાવભાવ, પ્રીતિથી સુનિ શ્રોદ્ધ પામવા લાગ્યા. એ વિષની પીડાથી એમનું મન ડામાડોળ થયું. અરે ! શું ત્યારે આ અમૃતદ્વય રતન તળુ ફષ્ટ ચારિત્રની વિરાધના કરું ત્યારે ? હા ! આ તો ધર્મસંક્રટ આવ્યું. અરે પ્રશ્ન ! આ બલા મને કાં વળણી ! આ પાયમાંથી હુવે બચવાનો કોઈ માર્ગ ? કચા પાપના રોગે આ મકાનમાં મારો પ્રવેશ થયો ? ” સુનિ પદ્માત્તાપ કરવા લાગ્યા.

“સ્વામી ! કહો, જેમે તે કહો. મારા પૂર્વના ભાગ્ય-યોગે જ આપ મારે ત્યાં પદ્ધાર્યાંછો. હુવે હું તમને જવા દઉં ? આવા અણુમોદ રતનને હું જવા દઉં નહિ. આપ મને તળુને ન જશો.” વેશ્યાએ આજુજુ કરવા માંડી.

કુરીને એક વાર વધુ સાધુએ પ્રયત્ન કરવા માંડ્યો. અપથી વેશ્યાને છુટી કરી સુનિ આગળ ચાલવા લાગ્યા. “હા ! પ્રાણુનાથ ! પ્રાણુનાથ ! ” કરતી વેશ્યા ભૂમિ ઉપર તુટી પડી. પ્રીતિનો તાર તુટી જતો નેંધ સુનિષ્ઠત થઈ ગઈ.

સુનિએ પાછા કુરીને બેઘું તો વેશ્યાને તડક્કડતી

તડકડણી સુચિંછિત થતી જોઈ. “ અક્ષેસાસ આ તો મોટી આકૃત ઉલ્લી થાં. મને લાગે છે કે આ વેશ્યા હુમણું પોતાના પ્રાણ છોડી દેશે મને પણ લોગની હુમણા તો પ્રથમ રહ્યાં કરે છે ત્યારે શું વ્રતખંગ કરું ? અરે આપરે મારી આ સ્થિતિ ! ”

તાં પેઢો દેવતા પ્રગટ થઈ એલયો. “ અરે હુરાથણી ! ઉપાર્જન કરેલાં કર્મકુલ લોગવવાનો હુરાથણ શો ? તને સોગકર્મ અત્યારે ઉદ્ય આવેલું છે તે લોગંયા વગર તારે છુટકો થવાનો નથી. આ સીની પ્રથમ સારવાર કર, તારામાં એક પ્રીતિવાળી આ સી તારા રૂપશોંથી જ નવચેતના પામશે. અન્યથા એ પોતાના પ્રાણ તળુ દેશે. હવે તને ઠીક લાગે તેમ કર.” દેવતા અદૃશ્ય થઈ ગયો.

“ જેવી અવિતંધ્યતા. પ્રાણીએને જેવી અવિતંધ્યતા હોય છે તેવા જ સંયોગો. આવી મળે છે. અચીત મારા કોઈ હુંકર્મના ચોગો આ સંયોગ આવી મળ્યો. છે તો મારે નિરાશાસભાવે લોગવી હેવો. જેમ શરીર ઉપર કોઈ ભયંકર રોગ ઉત્પન્ન થાય છે તે મને કે કર્મને લોગવ્યા. વગર છુટકો થતો નથી. અંદીખાને પડેલા માણુસને એ અંદીખાનું સેવ્યા વગર છુટકો થતો નથી તેમ મારે પણ હવે આ સંઝેગોમાં સંઝેગને આધીન થયા વગર છુટકો નથી. અત્યારે તો વ્રતખંગ કરું શું પણ એક હિવસ એવો પણ આવો કે હું શુદ્ધ થઈ આ પાપરૂપ કાદવથી બહાર નીકળું. કરેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરું. આ લોભ્ય ફ્લકર્મ

લોગવાઈ ખલાસ થાય મન વિષયવિકારોથી રહ્ણીત થાય,
અને મારું ચારિત્ર નિર્મળ શુદ્ધ થાય એવો સમય મને
કરીને આપું થબો.”

એ પ્રમાણે વિચાર કરતા સુનિ ત્રતસંગના પાપને
બાધુતાં છતાં પણ લોગ્ય કર્મને વશ થઈ વેશ્યાની પાસે
આવ્યા. વેશ્યાનું મસ્તક ઓળામાં લઈ એની મુચ્છી
વાળવાના ઉપચારો કરવા લાગ્યા. એના ડોમલ શરીર ઉપર
પોતાના હૃસ્તથી રૂપર્શ કરવા લાગ્યા. મુનિના આવા સ્નેહ-
સિંચનથી વેશ્યામાં કરીને નવ ચૈતન્ય પ્રગટ થયું. જરા જરા
હાલતી પોતાની આંખ ઉધાડી વેશ્યા જોવા લાગ્યી તો પદંગ
ઉપર મુનિના ઓળામાં પોતે સુતેલી હતી. પદંગની
આસપાસ એની હાસીએ એના આરામ માટે રાહ જોતી
ઉલ્લિ હતી.

મુનિના ઓળામાં સુતેલી વેશ્યા મુનિના હૃસ્તરૂપર્શથી
સુખને અતુભવ કરતી હતી. રેણુ પોતાની આંખ મીંચી
દીધી—અંધ કરું.

વેશ્યાને સાવધ થયેલી જોઈ નંદિષેષ ભાવ્યા. મૃગાક્ષી!
ઉઠ! ઉઠ! હે ડોમલાંગી! જો હું તારી પાસે જ છું.”

વેશ્યાએ પોતાના લોચન ઉધાખ્યાં. આસપાસ નજર
કરી. આળસ મરડતી મહનના સમરણું ભાન કરાવતી તે
બેઠી થઈ. એની નેત્રસંજાથી હાસીએ ત્યાંથી પસાર થઈ
અછ. કાણુમાં સુનિ તરફ તો કાણુમાં નીચે નજર કરતી વેશ્યા

મુનિના જોગામાં એસી અનેક ચેનચાળા કરવા લાગી. લોગને માટે તે આકુળાંયાકુળ થવા લાગી.

લોગને માટે આતુર થયેલી રમણીને જેઈ મુનિઓલ્યા. “બાદે ! જે તારી આગળ હું એક પ્રતિશા કરું છું. તે જે તારે માન્ય હોય તો હું તારી સાથે પ્રીત બાંધું.”

“ અને તે પ્રતિશા ? ” રમણીએ આતુરતાથી પૂછ્યું.

“ પ્રતિદિવસ મારે દશ અથવા તેથી વધારે માણુસોને પ્રતિબોધવા, અને જે તેઠલા બોધ ન કરું તો મારે દીક્ષા અહેણું કરવી.”

“ આપણું વચન મારે માન્ય છે. ” નંદીબેણું વચન વેશ્યાએ માન્ય કર્યું.

મુનિનો વેશ ત્યાગ કરીને નંદીબેણું ગૃહસ્થપણે થઈ વેશ્યાના વ્યાકુલ હૃદયને પ્રેમવાત હઈ શાંત કરી. ત્યારથી વેશ્યાને ત્યાં પ્રતિદિવસ નવાં નવાં સુખ લોગવવા લાગ્યાં.

વેશ્યા સાથે સુખ લોગવતાં નંદીબેણુને બાર બાર વર્ષનાં નુહાણું વહી ગયાં. તે ફરરોજ દશ દશ જણુને પ્રતિબોધી વીર ભાગવાન પાસે દીક્ષાને માટે મોકલતા હતા. એ બાર વર્ષ ફરમીયાન એમણું લોગ કર્મ ક્ષીણું થઈ ગયું હતું. જેથી નંદીબેણું પણ દીક્ષાની ઉત્કંઠાવાળા થયા હતા. માત્ર સમયની જ તેએ રાહ જેતાં હતા. એક દિવસ એમને એ તક મદ્દી ગઈ.

એક દિવસે નંદીબેણું નવ જણુને બોધ કર્યો. પણ દશમો

સોની હતો તે ડોઢ રીતે બોધ પામ્યો નહિ. તેને બોધ કરવામાં બહુ વખત થઈ ગયો મધ્યાનહ સમય થવા આવ્યો હતો. રસોઈ તૈયાર થયેલી હોવાથી વેશ્યાએ દાસીને બોલવા મોકલી પણ પોતાને અભિથહ હોવાથી તે જમવાને ઉડયા નહિ. અનેક પ્રકારની વાણીની ચુક્કિલવડે તે સોનીને પ્રતિબોધ કરવા લાગ્યા.

દાસીએ કરીને આવીને કહ્યું : “ રસોઈ ઠરી જાય છે, બાઇસાડેબ આપની રાહ જુઓ છે માટે જમવા પદ્ધારો ? ”

દાસીની વાત નંદીખેણુ લક્ષ્યમાં લીધી નહિ. એણે તો સોનીને પ્રતિબોધ કરવાનું કામ ચાહુ જ રાખ્યું. રસોઈ ટાઈ પડી ગઈ. વાર્ષાર ગરમ કરવા છતાં પણ જ્યારે રસોઈ ઠંડી પડતી ગઈ ત્યારે વેશ્યા પોતે નંદીખેણુ પાસે આવી બોલવા લાગી “ સ્વામી ! ને રસોઈ મેં કરેલી તે તો ઠંડી પડી ગઈ છે તે પાણી કરીને ભીજુ વાર તૈયાર કરી છે તો હવે તો ચાલો. વિલંબ ના કરો. ”

વેશ્યાના જવાબમાં નંદીખેણુ બોલ્યા. “ મારી પ્રતિસા પ્રમાણે આજે આ દશબોધ માણ્યુસ બોધ પામતો નથી, માટે એ બોધાન પામે ત્યાં લગી હું આવીશ નહીં. ”

“ તથાસ્તુ. તારી ધર્યા પ્રમાણે હું જ દશબોધિશ ત્યારે ! નંદીખેણુ ઉભા થઈને મુનિવેશ ઘેરવા માંડયો. ”

“ તથાસ્તુ. તારી ધર્યા પ્રમાણે હું જ દશબોધિશ ત્યારે ! નંદીખેણુ ઉભા થઈને મુનિવેશ ઘેરવા માંડયો. ”

નંદીષેષું આવું આચરણ જેછ વેશ્યા વિવખી થઈ ગઈ, “ સ્વામી ! એ તો માત્ર મેં મશકરીમાં કહ્યું છે. ”

“ તો એ તારી મશકરી સત્ય કરવી એ મારું કામ છે. ”

વેશ્યાએ મુનિને અટકાવવાને ધણ્યાય પ્રયત્ન કર્યી પણ હવે કાંઈ વળે એમ નહોતું; પણ મુનિનું લોગકર્મ ક્ષય થઈ ગયું હતું જેથી મુનિ પણ શુદ્ધ થયા હતા.

વેશ્યાના અનેક પ્રયત્નો છતાં ત્યાગમાં જ પ્રીતિવાળા, વિદ્યાની જેમ ન છુટકે જ લોગોને લોગવનારા નંદીષેષું ત્યાંથી એ વેશ્યાના રનેહાગારમાંથી મુનિવેશ ધારણ કરીને વીર ભગવાન પાસે ચાહ્યા ગયા. હૃષ્ટત્યાની કિંદા અને પાપની આદોયના કરી પુનઃદીક્ષા અહુણું કરી ભગવાનની સાથે વિહાર કરતા, તીવ્ર તપશ્ચર્થી કરતા. વ્રતને ઢૂરી રીતે પાળીને દેવતા થયા. નમન હો એવા દદશક્તિવાળા મહાપુરુષ નંદીષેષુને !

પ્રકરણ ર૭ મું.

એક સ્થાનવાળો ગ્રાસાદ.

ચૈહ્નણાના શિયલ ઉપરથી શાંકા ટળી ગયા પંચી રાજી તેના ઉપર અધિક પ્રીતિ ધારણ કરવા લાગ્યો. જે થયું તે સારું થયું; નહીંતર પરિણામ કેવું બયંકર આવત. રાજીને મનમાં પશ્ચાત્તાપ થયો “ અરે વગરવિચાર્યું ને ઉતાવળે કામ કરવાથી પરિણામ કેવું બયંકર આવે છે ? સારું થયું કે અભય-

કુમાર જેવો બુદ્ધિમાન મારે મંત્રી છે. મારાં ભાગ્ય હુલુ જાગૃત છે; નહીંતર કોઈ એવફુર્ક મંત્રીએ મારા હુકમનો અમલ કરી દીધો હોત તો આજે પરિષ્વામ ઘણું ભયંકર આવત. એ તો જે થાય તે સારાને માટે. એટી રીતે લોળવાઈ ચેલ્લાણું ઉપર મેં શાંક આણ્ણી પણ ચેલ્લાણું તો માડાન્સતી છે. મારી જ અહૃપ-મતિ છે. એટી શાંક આણ્ણી મેં એને જે ગેરધન્સાક્ર આગચે છે તેને બદલો એને શી રીતે વણી આપું? વળી ફરેક રાણ્ણી-આમાં ચેલ્લાણું મને અધિક પ્રિય છે તો એને માટે હું શું કરું? તેને માટે હું એક સ્થંભવાળા પ્રાસાદ બંધાવું, જેમાં રહીને વિમાનમાં રહેલી ખેચરીની જેમ સ્વેચ્છાએ કીડા કરે.” એમ નિશ્ચય કરીને તેણું અભયકુમારને પોતાની પાસે બોલાવી આજા કરી કે—“ વત્સ! ચેલ્લાણુદેવીને માટે એક સ્થંભવાળા મહેલ બંધાવ.”

રાજાની આજા પામીને અભયકુમારે એક હેંથીયાર સુથારને બોલાવ્યો. અને તેને કહું કે—“ આપણે એક સ્થંભવાળા મહેલ બંધાવવો છે તેને માટે પાટીયાં વગેરે સારું કોઈ સારા વૃક્ષને છેહીને તેનાં લાકડાં લાવવાના છે.”

મંત્રીશરની આજા પામીને સારાં લાકડાંને માટે કોઈ સારું વૃક્ષ લાપાસવાને તે વનમાં નોકણો. વનમાં પરિષ્વમણું કરતાં સુથારે એક મોટી શાખા-પ્રશાખાવાળું ઉત્તમ વૃક્ષ જોયું. ગાડી છાયાવાળું, આકાશ સુધી ઊંચું, ઘણું પુણ્યવાળું અને મોટા થડ અને શાખાવાળું તે વૃક્ષને જોઈ એણે વિચાર કર્યો કે—“ આ વૃક્ષ કોઈ સામાન્ય કોઈનું જણાતું નથી. ગમે તેવું

વૃક્ષ પણ દેવતાવગરનું હોતું નથી તો આ વૃક્ષરાજ તો તેની શોભાવડે મોટા દેવતવાળું માલુમ પડે છે, માટે પ્રથમ આ વૃક્ષના અધિકાર્યકને ગંધ, ધૂપ, દીપાદિક પૂજા, તપસ્યાથી આરાધી એની ઉપાસના કરું કે જેથી મને કે મારા સ્વામીને વિક્ષાય નહિ. ”

એ પ્રમાણે વિચારી અહિતપૂર્વક ઉપવાસ કરી ગંધ, ધૂપ વગેરેથી સુથારે વૃક્ષનું પૂજન કર્યું. એ સમયે વૃક્ષને આશ્રીને રહેલો તેનો અધિકાર્યક વ્યંતર પોતાના આશ્રયની રક્ષાને માટે અને તેમના અર્થની સિદ્ધિને માટે અભયકુમાર પાસે આવ્યો. “હે મહાતુલાવ ! તું મારા આશ્રયદ્વારા વૃક્ષને નહિ છેદાવતાં તારા માણુસને પાછો બોલાવી લે. હું તને એક સ્થંભવાળો પ્રાસાદ કરાવી આપીશ ને વધારામાં મહેલને ફરતું ચારે કોર સર્વ વનસ્પતિઓથી સુશોભિત અને સર્વ ઋતુઓથી મહિત એક ઉદ્ઘાન કરી આપીશ.” વ્યંતર એમ કહીને અહૃદય શ્રદ્ધ ગયો.

દેવતાના વચનથી અભયકુમારે સુથારને વનમાંથી પાછો બોલાવી દીધો. તેને લાકડાં છેદવાની ના પાડી દીધો. અભયકુમારનાં વચન સાંભળી સુથાર પોતાને ઘેર ગયો. તેજ રાત્રિને વિષે દેવતાએ એક સ્થંભવાળો મહેલ અને એને ફરતું ઉદ્ઘાન કરી આપ્યું; કારણું કે વચનથી બંધાયેલા દેવતાએ સેવકથી પણ અધિક તરાથી કાર્ય કરનારા હોય છે.

પ્રાતઃકાળે એ પ્રાસાદ અભયકુમારે શ્રેણિક મહારાજને

અતાંયો. એ હેવકૃત પ્રાસાદ જોઈ શૈખિક મહારાજ ઘણા ખુશી થયા છતાં અમયકુમારને કહેવા લાગ્યા. “ વત્સ ! મને તો ભાગ એક સ્થાનવાળા પ્રાસાદની જરૂર હતી. તેમાં સર્વ ઋતુ-વારું વન થયું એતો દ્વારા હતું પાન કરતાં એમાં સાકરના પડવા જેવું થયું. ”

શૈખિક મહારાજે ચેલણું ને પ્રાસાદમાં રાખી તેથી પદ્મહૃદમાં રહેલી લક્ષ્મી જેમ પોતાના પરિવાર સહિત શોકાતી હતી તેમ ચેલણું આ પ્રાસાદમાં શોકના લાગી. એકસ્થાંભી પ્રાસાદમાં રહેલી ચેલણું રોજ નવનવા પુણ્યોથી પુણ્યમાળાઓ શુંથી સર્વ જ પ્રભુને પૂલ ધર્મસાધના કરવા લાગી તેમજ એ પુણ્યમાળાઓથી પતિની લક્ષ્મિ કરી પતિના ઉશપાશને પૂરવા લાગી. તે રમણી આ ઉદ્ઘાનનાં પુણ્યોને ધર્મ અને કામમાં સ્કુલ કરતી સહા પુણ્યમાળા અને સહા ઇલવાળા તે ઉપવનમાં ચાક્ષાત વનદેવીની માર્ક પતિ સાથે કીડા કરતી હતી.

તે નગરમાં રહેનારી માતંગીને અકાળે આઅર્કલ ખા-વાની અગ્નિલાઘા થવાથી પોતાના પતિને તેણું પોતાની ધર્ઢા જણ્ણાવી. તેના જવાબમાં તેણીના ધાર્યીએ કહું—“ અરે મુહુ સ્વી ! આને અકાલે આઅર્કલ કયાંથી ? ”

“ સ્વામી ! આને અકાલે પણ ચેલણું રાણીના ઉદ્ઘાનમાં આઅર્કલો છે, માટે મને લાવી આપી મારો હોહદ ખૂરો કરો. ”

“ ત્યાં ભરવાને માટે મને મોકલે છે કેમ ? રાજ જાણું તો મારી શી સ્થિતિ કરે તે તને અખર છે કે ? ”

“ રાજ તો જાણું ત્યારે શિક્ષા કરશે પણ હું તો જો તમે નહિ લાવી આપો તો તેના વગર મારી દેહ છોડી દઈશ.”

“ તું કાલે ભરતી હો તો આજ મરી જને, પણ તારા માટે હું મારા પ્રાણુને સંકટમાં નાખીશ નહિ, સમજુ ? ”

“ આહા ! તમારી જેવા પતિને પામેલી સીએસ અરેખર નિર્બાળીણી હોય છે. એક ખીના ખાતર પુરુષો કેટલું બધું કરી છૂટે છે, તે તમે કાં નથી જાણુતા ? સીતાલુને મેળવવાની ખાતર રામે કેટલું બધું કર્યું જયારે તમારા જેવા નિર્માલ્ય પતિ પોતાની પ્રિયાને સંતોષવા કાંઈ પણ કરવાને સમર્થ નથી. ”

“ હીક છે રાતના વાત. પ્રાતઃકાળે તારો હોઢું હું પૂર્ખું કરીશ. શર્દીત રાખ. ” માતંગપતિ એ દિલાસો આપ્યો.

મધ્યરાતના માતંગપતિ ઉધાનની સમીપે આવ્યો. ત્યાં આપ્રવૃક્ષા સદ્ય ફુલવાળાં ને ઉચ્ચે રહેલાં એના જેવામાં આવ્યાં. ભૂમિ ઉપર રહેકો તે પાકાં એવાં આપ્રફુલને જેવા લાગ્યો. ક્ષણુમાત્રમાં અવનામિની વિદ્યાથી એ આપ્રફુલવાળી શાખાને ચાંડાદે નીચે નમાવી, આપ્રફુલની હુંબ તોડી લીધી ને તે ચોતાને સ્થળે ચાવ્યો ગયો.

પ્રાતઃકાળે ચેલથણું તોડેલાં ફુલવાળી આપ્રવૃક્ષની

તે શાખા જોઈ એના મનમાં એહ ઉમજ થયો. તરતજ રાજને ઓદાવીને હડીકત જણાવીને બતાયું.

રાજને અભયકુમારને ઓદાવી આજા કરી કે—“ વત્સ ! જ્યાં પંખીએ પણ પ્રવેશ કરવાને અસર્મર્થ છે ત્યાં મનુષ્યે પ્રવેશ કર્યો તો તે મનુષ્ય કોઈ સર્મર્થ હાવો જોઈએ. જેની આવી અતિશય અમાતુધી શક્તિ છે તે કોઈ વખતે અન્તઃપુરમાં પ્રવેશ પણ કરે; માટે એને તો અરાધર શિક્ષા કરવી જોઈએ.”

રાજનાં વચન સાંલળી અભયકુમાર ગોદ્યો—“ ઢેવ થોડા દિવસમાં હું તે ચોરને પછી આપને આખીન કરીશ.” એમ કહીને તે દિવસથી ચોરને શોધવાને રાત્રિ-દિવસ નગરમાં કામવા લાગ્યો.

પોતાની ઝુદ્ધિના પ્રભાવથી અભયકુમારે તે ચોરને પછીને રાજદરખારમાં મહારાજને હવાલે કર્યો. પોતાની સમક્ષ ઉલેલા ચોરને જોઈ રાજને કહ્યું. એક સામાન્ય ચોર હોય તેની પણ જયારે ઉપેક્ષા કરવામાં આવતી નથી તો પછી આ ચોર તો શક્તિમાન છે. તો તેનો તો અવશ્ય નિયંત્ર કરવો જોઈએ.”

રાજને ચોરને પૂછ્યું. “ આમ્રવનમાંથી તેં કેરીએ. શીરીતે તોડી લીધી વાર્દું ? !

” વિદ્યાના બળથી.” રાજના જવામાં ચોર જણાયું.

” આવો ચોર કોઈ વખતે ભયંકર છે માટે એને શુણીએ
અડાવો ? ” રાજને હુકમ કર્યો.

રાજનો હુકમ સાંભળી અભયકુમારે રાજને વિનંતિ
કરી.” હેવ ? પ્રથમ આપ એની પાસેથી વિદ્યા શીખીલ્યો.
પછી જે યુક્ત હોય તે કરજ્યો !

અભયકુમારની વિનંતિ સાંભળી રાજને ચોરને કહ્યું. “
ચાલ સામે આવીજને તારી વિદ્યા આપ, હું શીખી લઉં.”

સિહાસન ઉપર બેઠેલા રાજની સામે બેસીને ચોરે વિદ્યા
અણુવા માંડી. ફરન્તુ રાજ સિહાસન ઉપર બેઠેલો હોવાથી
અને ચોર નીચે બેઠેલો હોવાના અવિનયીપણુથી રાજને એ
વિદ્યા આવડી નહિ. કારણુકે વિનય વગર વિદ્યા આવડતી નથી.
હુચ્ચાધિથી કે ઠગાધિથી અથવા ખળજેરથી વિદ્યાએ સક્રલ
થતી નથી. વિદ્યા મેળવવાનો સર્વથી ઉત્તમ ઉપાય તો વિનય
છે. વિનયથી મેળવેલી વિદ્યાએ જટ પરિણુમ્ભી જય છે. જેની
પાસેથી વિદ્યા મેળવવી હોય તે વિદ્યાશુર્દું વિદ્યાતું બહુ માન
કરતું જોઈએ, એ બહુમાનથી, વિનય થકી મેળવેલી વિદ્યા-
આજ જગતમાં ઈચ્છિત ફૂલને આપનારી થાય છે.

રાજને વિદ્યા નહિ આવડવાથી તેણે ચોરને તિરસ્કાર
કરીને કહ્યું કે. “ તારા હૈયામાં કુડ કપટ છે તેથી તારી વિદ્યા મને
આવડતી નથી.”

આ સમયે અભયકુમારે ઠહ્યું. “ હે હેવ ! અત્યારે એ

તારો વિદ્યાગુરુ છે જેઓ ગુરુનો બહુ વિનય કરે છે તેમને જ વિદ્યાઓ આવડે છે. અન્યथા સ્કુરતી નથી તેથી આ માતંગ-પતિને આપ સિંહાસન ઉપર એસાડો અને તમે અંજલી જોડીને એની સામે એસો તો વિદ્યા આવડશે.”

વિદ્યાના અર્થી રાજ માતંગને સિંહાસન ઉપર એસાડી ચાતે સામે હાથ જોડીને પૃથ્વી ઉપર એઠો, કારણ કે નીચ પાસેથી પણ ઉત્તમ વિદ્યા હોય તો અહણું કરવી એવી નિતિ છે.

રાજએ ચોરના સુખથી ઉજામિનિ ને અવનામિની એમ એ વિદ્યાઓ સાંભળી એટલે હર્ષથુમાં પ્રતિભિંબની જેમ રાજના હૃદયમાં તે વિદ્યાઓ પરિણયી ગઈ. વિદ્યાઓ પરિણયી પણી રાજએ એને શિક્ષા કરવા માટે જલ્દાને સ્વાધિન કરવાં માંડયો. એટલે અભયકુમારે કહ્યું.“ હેવ ! આપનો એ વિદ્યાહાતા ગુરુ થયો. ગુરુનું તો બહુમાન સન્માન કરવું જોઈએ. આપને એના તરફથી વિદ્યાની પ્રાપ્તિ થઈ એના બહુમાં આપ એને શૂળીની દક્ષિણા આપો એ ટીક ન કહેવાય ?”

અભયકુમારનાં વચન સાંભળી રાજએ ચોરને લેણ સોગાડ આપી બહુમાન કરવા પૂર્વક છોડી સુક્યો. અભયકુમારનો ઉપકાર માનતો ચોર પોતાને ઘેર ગયો.



પ્રકરણ २८ મું.

હુર્ગંધારાણી.

એક દિવસ મહાવીરસ્વામી રાજગૃહનગરે સમવસયો, તે સમયે પૃથ્વી ઉપર બીજે ઈદ્વ હોય તેમ મોટા આડંભરથી શ્રેષ્ઠિક મહારાજ પ્રલુને વાંદવાને ચાલ્યો, ગણેંદ્રોનીહાર, અસ્વેના હણુહણુાટ અને સેનાથી ભૂમિતલને ઇંધતો તે શોખતો હતો. આગળ ભાટ ચારણ્ણો સ્તુતિ કરી રહ્યા હતા ગંગા અને યમુના જેવા ચામરો વારાંગનાઓ વીંઝતો હતી. એવા મોટા આડંભર પૂર્વક ભગવધપતિ પ્રલુને વંદના કરવાને ચાલ્યો.

માર્ગમાં ચાલ્યા જતાં જન્મયા પછી તરતજ છોડી દીધેલી એક બાળિકા સૈનિકોના જેવામાં આવી, જાણે નરકનો અવશેષ હોય નહિ શું? તેમ એ બાળિકાના શરીરમાંથી અત્યંત હુર્ગંધ નિકળતી હતી. એ હુર્ગંધીને અંગે એની આસપાસ કોઈ ચાલી શકતું પણ નહિ. શ્રેષ્ઠિક મહારાજ આ માર્ગથી ભગવાનને વાંદવા જતા હોવાથી તેના સૈનિકોને પ્રથમ આ હુર્ગંધ આવી. એ તીવ્ર હુર્ગંધીને સહન નહિ કરી શકવાથી સૈનિકોએ પોતપોતાની નાસ્કિા બંધ કરી દીધી. પોતાના સૈનિકોની આવી ચેષ્ટા જોઈ રાજને પોતાના પરિજનને એનું કારણું પૂછ્યું, “આ શું છે?”

પ્રતિહારીએ ખુલાસો કર્યો: “જન્મયા પછી તરત જ

છોડી હીધેલી બાલિકાના શરીરમાંથી આ દુગંધી નિકળે છે નેથી અધારે નાસ્તિકા બંધ કરી હીધી છે. ”

સેવકના મુખેથી આવી વાર્તા સાંકળીને શ્રેષ્ઠિક મહારાજ એ દુગંધીને જોવાને આગળ ચાલ્યો. પ્રતિદ્વિસ અરિહૃતં પ્રલુના મુખેથી બાર પ્રકારની દેશના સાંકળનાર હોવાથી તેને જરા પણ જુગુંસા આવી નહિ, કારણ કે સમકિતતું એ લક્ષણ છે. સમકિત પામેલો લુલ વસ્તુસ્વરૂપ સારી રીતે જાણી શકે છે. વસ્તુ જોવા સ્વભાવમાં હોય તેનો સંપૂર્ણ સમજનાર હોવાથી અથવા તો તીર્થ કર ભગવાનના વચ્ચનમાં શ્રદ્ધાવાળો હોવાથી એનાં વિવેક ચક્ષુ ખુલ્લી જાય છે. વિવેક ચક્ષુ પ્રગટ થતાં સમકિતાને પ્રભાવે. વસ્તુના જાણવાપણુથી સંસારમાં આસક્ત છતાં બહુધા એનાં પાપ બંધનો એઓછાં થઈ જાય છે. કારણ કે આજ સુધી એની સંસાર તરફ દિલ્લિ હતી. પરન્તુ સમકિત પામ્યા પણી એની દિલ્લિ મોક્ષ તરફ ઢળે છે. સંસારમાં આસક્ત હોય છતાં પણ સંસારથી છુટવાને તે અનુકૂળ સમયમની રાહ જુઓ છે.

દુગંધાને જોઇ મગધપતિ ત્યાંથી આગળ ચાલ્યો, ભગવાનને વાંદી એમની દેશના સાંકળ્યા બાદ ચોગ્ય અવસર પામીને પૂછ્યું “ભગવન્ ? કયા કર્મને યોગે એ હુર્જથા થઈ.”

શ્રેષ્ઠિકના જવાબમાં ભગવાને કહું. “ પૂર્વ ભવે એણે સુનિની જુગુંસા કરી હતી. એ જુગુપ્સાનું આ ફૂલ છે. ”

“ ભગવાન્ ? જરા સ્પષ્ટતાથી કહો, એણે કેવી રીતે

કણું અને ડેવી રીતે લોગંચું.” ભગવધપતિએ સ્પષ્ટતા કરવાને કર્યું.

“તમારા શહેરની નજીક શાળી નામે ગામમાં ધનમિત્ર નામે શ્રેષ્ઠ રહેતો હતો, તેને ધનશ્રી નામે પુત્રી હતી. અન્યદી એ શ્રેષ્ઠી પુત્રીને વિવાહ ઉત્સવ આપ્યો, તેવામાં શીખમાં જરૂરુમાં વિહાર કરતા ડેટલાક સાધુએ ત્યાં આવ્યા. શ્રેષ્ઠીએ સાધુએને વહેરાવવાને ધનશ્રીને આજા કરી, પિતાની આજાથી સાધુએને વહેરાવતાં ધનશ્રીએ પરસેવાથી જેમનાં અંગ મદ્દીન થયાં છે એવા સાધુએને જેદ્ધ મનમાં વિચાર કરવા લાગી.” અહીંત ભગવાને જે ધર્મ કદ્યો છે તે બધી રીતે નિર્દેષ છે. પણ પ્રાસુકતાથી સનાન કરવાની સુનિષ્ઠાને આજા આપી હોત તો શું હોષ હતો?

મનના એ વિચાર વડે કરીને બાળાએ તીવ્ર હૃદકર્મ આપ્યું. તેની આદ્વાચના કર્યા વગર અન્યદી મૃત્યુ પામીને તે બાળા વેશયાના ગર્ભમાં આવી. ગર્ભમાં રહેલી પણ તે બાળા માતાને ધાણીજ અરતિ આપવા લાગી. વેશયાએ ગર્ભપાતનાં ધણ્યાં ઔષધ ખાયાં પણ એ ગર્ભ ઘડગ્યો નહિં, કર્મની શક્તિ આગળ ઔષધ કોણું માત્ર છે?

વેશયાએ એ પુત્રીને જન્મ આપ્યો. પૂર્વ કર્મના યોગથી જન્મતાં તેના શરીરમાંથી અત્યંત હુર્ગિધા નિકળવા માંડી એ હુર્ગિધાને વેશયા પણ ન સહુન કરી શકવાથી પોતાના ઉદ્ધરમાંથી ઉત્પજ્ઞ થયા છતાં તેને વિષાની જેમ તજી હીધી. એ બધો પૂર્વ કબે કરેલી સુનિની જુશુસાનો હોષ હતો.

સ્નાન એ તો શૃંગારનું અંગ ગણ્યાય છે. જથારે શરીર ઉપરથી પણ મમતા રહિત એવા : સાધુઓને પછી સ્નાનની શી જરૂર ? શૃંગારનું એક અંગ સેવન કરવાથી અનુકૂળ ખીજા અંગોનો પણ સેવનનો દોષ ન લાગે તે માટે જ્ઞાનીઓએ સાધુઓને માટે સ્નાન નિષિદ્ધ કર્યું છે.

હુર્ગધાનું પૂર્વભવનું ચરિત્ર સાંભળી મગધપતિએ કરી લગવાનને પુછ્યું, “લગવાન એ હુર્ગધાનું ભવિષ્યમાં શું થશે ? ”

“રાજન ! એ હુર્ગધાએ પોતાનું દુષ્કર્મ ઘણુંખડું બોગવી લીધેલું હોવાથી હવે નામ શેષ આકી રહ્યું છે તે બોગવી લેશો. ભવિષ્યમાં એ તારી પદૃરાણી થશે.”

“પ્રભુ ! આપનું વચન સત્ય છે છતાં મને એની ખબર પડે તેવી કંઈક નિશાની આપો જેણી હું જાણી શકું ? ”

તેની ખાતરીને માટે તને એક નિશાની આપું છું કે અન્તાઃપુરમાં કીડા કરતા તારી પીઠ ઉપર ચડીને જે હંસની માઝક લીલા કરે તે આ હુર્ગધા છે એમ જાણી લેવું .”

પ્રભુની વાણી સાંભળી શેષિંદુક આશ્વર્ય પામ્યો “આહો ! આ તો નવાઈની વાત કહેવાય ! આ ભાગા મારી યત્ની શી રીતે થશો ? ” ધૃત્યાદિ વિવાર કરતો રાજ લગવાનને નમીને પોતાને સ્થાનકે ગયો.

દુષ્કર્મ પૂર્ણ થવાથી હુર્ગધાનો હુર્ગધ ચાલ્યો ગયો,

એવામાં કોઈ ગોવાલથું ત્યાંથી નીકળી, તેણે આ બાજિકાને જેઠ પોતાને પુત્ર પુત્રી ક્રાંદી ન હોવાથી આ કન્યાને પોતાની પુત્રી તરીકે માની લઈ લીધી. પોતાની પુત્રીની જેમ તેનું પાલન કર્યું. વર્ષેના વિતવા સાથે એ બાળ યૌવનવતી થઈ. કામી પુરદ્ધેણા મનને હરનારી એ ભૂગલોચના યૌવનને આંગણે આવી.

અન્યદી કૌમુદી ઉત્સવ આવ્યો, શૃંગારરસના નાટકમાં સુત્રધાર સમે એ કૌમુદી ઉત્સવ ઉજવવાને નગરના યુવાન પુરદ્ધે અને યુવતીઓ વનવિહાર કરવાને એક ઉદ્ઘાનમાં આવ્યાં. પેદી ગોપાલ કન્યા પણ પોતાની ગોવાલથું માતાની સાથે ઉત્સવ જોવાને આવી. રાજ શ્રેષ્ઠિક પણ અભયકુમારની સાથે એ ઉત્સવમાં ભાગ લેવાને આવ્યો.

એ મોટા ઉત્સવમાં એકથીલના સંસર્ગથી પેદી મનો-હર કાંતિવાળી ગોવાળ કન્યાના સ્તન ઉપર ભગધપતિને હુથ પછ્યો. એ ઉંચા કઠીથું સ્તનોના ડેંબત સ્પર્શથી એ આલીર કન્યા ઉપર રાજને રાગ ઉત્પજી થયો. રાજએ તત્કાળ પોતાની સુદ્ધિકા એ આલીર બાળાના વખને છેડે તે ન બણે તેમ બાંધી લીધી. બાળાને મેળવવાનો કેવો સ્તરસ ઉપાય ?

“થોડીબાર પછી શ્રેષ્ઠિકે અભયકુમારને કહ્યું,” મારું ચિત્ત વ્યાચ થતાં મારી સુદ્ધિકા કોઈ હરી ગણું છે. માટે મારી સુદ્ધિકાના ચૈરને તું સત્ત્વર શોધી ક્રાંદ ? ”

ને ઉદ્ઘાન વનવિહાર માટે નિયત કરવામાં આવ્યું હતું, તેના દરવાજા બાળુના અભયકુમારે બાંધ કરાવી દીધા. ને એક એક માણુસને તપાસીને બહાર કાઢવા માંડયા. અદ્વિના શાંદાર અભયકુમારને સર્વનાં વસ્ત્ર, કેશ, સુખ વગેરે તપાસવા માયાં. અનુકૂમે પેલી આલીરકુમારી આવી. તેના વસ્ત્રોની તપાસ કરતાં વસ્ત્રને છેડે બાંધેલી રાજની મુદ્રિકા અભયના જોવામાં આવી. તેના વસ્ત્રને છેડે એ મુદ્રિકા જોઈ અભયે પૂછ્યું, “હે બાળે ! આ મુદ્રિકા તેં શા માટે લીધી હતી ?”

અભયના જવાબમાં બાળ પોતાના કાને એ હુથ મુકૃતી બોલી. “મહારાજ ! હું કંઈ એમાં જાણુતી નથી.”

“ તું કંઈ જાણુતી નથી ? સત્ય કહે છે કે તું કઈ જાણુતી નથી ? તો તારા છેડામાંથી મુદ્રિકા કયાંથી નીકળી ?” ફરિને પૂછ્યું.

“ મને એની કંઈ પલુ ગમ પડતી નથી. કે મારા વસ્ત્રને છેડે કોણું બાંધી અથવા તો કેવી રીતે આવી. હું એમાં નિર્દોષ છું.”

અભયકુમારે એ બાળાની સામે જોયું એને લાગ્યું કે આલીર કન્યા નિર્દોષ છે ત્યારે આ બન્યું કેમારી જરૂર આ જુંદર આલીર કન્યા ઉપર પિતા રક્તા થયા હશે. એને અહુણુ કરવાને માટે સનેહવશ થયેલા રાજને પ્રેમની નિશાની તરીકે આ મુદ્રિકા બાંધાણી સારું બાંધી હશે “ એમ વિચારી તેણે આલીર કન્યાને કહ્યું ”, બાળ ! કહાચ તું નિર્દોષ હશે

પણ અત્યારે તો તારી પાસે સુદ્ધામાલ મળી આવવાથી તું શુન્હેગાર છે. માટે રાજની આગળ તને હાજર કરવી પડ્યો. મહારાજ આગળ તું તારી નિર્દેખતા પુરવાર કરજે.”

આભિર કન્યાને લઈને અભયકુમાર રાજની પાસે આવ્યો. આભિર બાળાને એક બાળુના અંડમાં છેસાડી અભય રાજ પાસે આવ્યો. અભય છોલે તે પહેલાં તો રાજાને જ પૂછ્યું. “કેમ અભય વીંઠીને ચોર મળ્યો ? ”

“સ્વામી ! ચોર મળ્યો તો છે, પણ સુદ્ધિકાને ચોરનાર એક બાળ છે !” અભયે જવાબ આપ્યો.

“બાળ ચોર ! આશ્વર્ય ! ” રાજ હુસ્યે.

“હા ! હેલ ! એ ચોરનાર કોઈ અજાય છે. વીંઠીની સાથે એણે એક મોટી વસ્તુ પણ ચોરી જણ્યાય છે.”

“અને તે વસ્તુ ? ”

“તે વસ્તુ મગધપતિનું મન ! ” અભયકુમારનો પ્રત્યુત્તર સાંભળી મગધરાજ હુસ્યા.

“બરાબર ? એ કુમારીનું હું પાણી અહુણું કરીશ. કારણ કે હું કુલમાંથી પણ સ્વીરત્ન અહુણું કરવું એ તે નથી સાંભળ્યું.”


રાજએ એ આભિર કન્યા સાથે લગ્ન કરી ઘણ્યા શામથી એને પદૃસાણીને પઢે સ્થાપન કરી.

એક દિવસ રાજ રાણીએ સાથે પાસા વડે રમત રમતો
હતો. તેમાં એવું પણ કર્યું કે જે જુતે તે હારેલાની પીડ
ઉપર ચડે.”

એ રમતમાં બીજુ કુળવાન રાણીએ રાજને જીતની
ત્યારે પોતાનો જ્ય જખુલવવાને ટે માત્ર રાજની પીડ ઉપર
પોતાનું વખતનાખતી હતી. પણ જ્યારે પેલી વેશયા પુત્રી હુર્ગં-
ધાનો વારો આવ્યો. અને તેણું રાજને જીતી લીધો ત્યારે તે
કઠીણું હુલ્યવાળી થઈને રાજની પીડ ઉપર અરી ગઈ. તે વખતે
ભગવાનનું વચન સાંભળવાથી રાજ ઘડઘડાટ હસી પડ્યો.

રાજના અકસ્માતું હસવાથી પીડ ઉપર ચડેલી હુર્ગંધા
ખસીયાણી પડી ગઈ. તે અટ નીચે ઉતરી ગઈ અને હાસ્યનું
કારણું તેણું રાજને પૂછ્યું.

રાજએ તેના જવાબમાં ભગવાને કહ્યું હતું તે પ્રમાણે
પૂર્વભવથી માંડીને અત્યાર પર્યંતનું તેનું સર્વ વૃતાંત કહી
સાંભળાયું પોતાનું અરિત્ર સાંભળી હુર્ગંધાને વૈરાય આવ-
વાથી વિનયપૂર્વંક સ્વામીની અનુમતી મેળવી ભગવાન મહાવીર
પાસે દીક્ષામંહુણું કરી પોતાનું આત્મકલ્યાણ સાચ્યું



પ્રકરણ ૨૯ મું.

હસ્તી તાપસોના આશ્રમમાં

હસ્તિ તાપસોના આશ્રમમાં પાંચસે શિષ્યોથી પરિવરેદા એક મહાસુની પધાર્યો. એ હસ્તિ તાપસોના આશ્રમનાં વિધિ વિધાન વળી જુહા પ્રકારનાં હતાં. એમની દ્વાયા, એમનો ધર્મ પણ વિચિત્ર હતો તેમોનો માન્યતા એવી હતી કે નાના નાના અનેક જીવને મારવા કરતાં મોટા એક જીવને મારી તેના માંસથી ઉદ્દરની પૂર્તિ કરવી સારી. એક હાથી જેવા પ્રાણીને મારી નાખ્યો હોય તો એના માંસથી ધંધુા હિસ્સ ચાલે. પણ મૃગ, તિચર કે ભત્સ્ય જેવા અનેક જીવોને મારી તેનાથી ઉદ્દર પૂર્તિ કરવી અથવા તો ધાન્યના કણોનો આહાર કરવાથી ધંધુાં જીવોના ડિંસા થાય છે ને તેથી મોટું પાપ લાગે છે. આવી તેમની માન્યતાથી તેમની પર્યાદુરીઓમાં હાથીઓનું માંસ તહેક સુકવવા નાખેલું હતું. અને જીવતો જગતો એક હાથી ત્યાં આંધેલો નજરે પડતો હતો. પાંચસે શિષ્યોના પરિવારવાળા આ સુનિ હસ્તિ તાપસ આશ્રમમાંથી નિકળ્યા તેમના જેવામાં આ માંસ વગેરે આવ્યું તેમની દ્વાયા-બાસ્તવાને. એ સુનિવરને ખ્યાત આવ્યો.

જે માર્ગે ચેલો મોટી કાયાવાળો હાથી બાંધ્યો. હતો ત્યાંથી આ મહર્ષિની કલ્યાણ, મોટા પરિવારવાળા આ સુનિવરને અનેક લોકો મસ્તક નમોલીને વંદન કરતા હતા તે જેઇને લધુ-કર્મ હાથી પણ મનમાં વિચારવા લાગ્યો.” હું પણ જે છુટો

હેત તે જરૂર આ મહિંદ્રને વંદન કરી ભારા આત્માને
પવીત્ર કરત. પણ આવા સાંકળના ગાઠ બંધનથી બંધાયેલો હું
શું કર્યા? એ પ્રમાણે વિચાર કરતા હાથીની પાસેથી સુનિ
નીકળ્યા, એટલે ગરૂદના દર્શનથી જેમ નાગપાશ તુટી જાય
તેમ હાથીની લોહ શ્રુંખલા પણ સુનિવરના દર્શનથી તુટી ગઈ.
જેથી હાથી સુનિવરને વંદવાને ચાહ્યો.

હાથી સુનિવરને વંદના કરવા માટે તેમની તરફ જોતો
નેઇ લોડોઅએ વિચાર્યું કે નક્કી આ હાથી સુનીવરને ભારી
નાખશે. આ સાધુના દિવસો હવે ભરાઈ ગયા છે. એમની
આયુષ્યની દોરી હવે પૂરી થઈ ગઈ છે. એમ બોલતા જેને
જ્યાં ક્ષાળ્ય ત્યાં હાથીના ભયથી પલાયન કરી ગયા. પણ
પોતાના પાંચસે શિષ્યોની આગળ મોખ્યે એ સુનિવર તો
સ્થિર અડગ ઉભા રહ્યા. ગનેંદ્ર તેમની પાસે આવીને તેમને
નમ્યો. પોતાનું કુંભસ્થળ નમાવી સુનિવરને પ્રણામ કર્યો.
સુનિવરના અરણ્યને પોતાની સુંઠ પ્રસારી સ્પર્શ કરી પોતાનો
આત્મા પવિત્ર કર્યો. પરમ શાન્તિને પામેલો હાથી ઉલ્લો થઈ
ભક્તિથી ભરપુર દૃષ્ટિએ સુનિવરને જોતો ને ઉલ્લાસ પામતો
અરણ્યને માર્ગ ચાલ્યો ગયો. સુનિવરના આવા મહાન
પ્રભાવથી અને હાથીના ભાગી જવાથી તાપસો સુનિવર
ઉપર ગુસ્સે થયા ને તેમની સાથે કોથથી ધમધમીત થયેલા
દઠવાને આવ્યા.

એ શાંત રસના નિધાન અને દ્વયાના સાગર સુનિવરે

હ્યાલાસ ધર્મવાળા હસ્તિ તાપસોને પ્રતિભોધ પમાડીને
વીર લગવાનના સમવસરથુમાં મોકલ્યા. એ હસ્તિ તાપ-
સોએ લગવાન પાસે જઈને દીક્ષા અહૃણુ કરી.

હસ્તિ તાપસોનો આશ્રમ રાજગૃહી નગરીની સમીપમાં
હોવાથી ગનેંદ્રમોક્ષ અને હસ્તિ તાપસોના પ્રતિભોધની
હકીકત શ્રેષ્ઠું મહારાજાપાસે પહેંચી ગઈ. તેમ પોતાના પુત્ર
અભયકુમાર સાથે રાજગૃહપતિ આ મુનિવરને વંદના
કરવાને આગે.

ભક્તિથી વંદન કરતા મગધપતિ અને અભયકુમારને
મુનિવર ધર્મલાભ દ્વીપી આશિષ આપી. શુદ્ધ જૂમિતલ
ઉપર નિરાબાધ પણુ મુનિવરને બેઠેલા જેઠ રાજાએ પૂછ્યું.
“ લગવાન ! આપે કરેલા ગનેંદ્રમોક્ષથી મને આશ્રીય
થાય છે. ”

રાજના જવાખમાં મુનિવર ઐદ્યા. “ રાજન ! ગનેંદ્ર-
મોક્ષ એ કાંઈ ફર્લંબ નથી, પણ મને તો ત્રાકસૂત્રના
બંધનમાંથી મુક્તિ મેળવવી એજ અતિ હુંકર જણ્યાય છે. ”

“ લગવાન ? તે કેવી રીતે ! ” રાજાએ પૂછ્યું
મુનિવરે તેના જવાખમાં એ ત્રાકસૂત્રના બંધનનો
પોતાનો વૃત્તાંત કહી સંભળાવવા માંડ્યો એ સાંભળવાને
ખીજા દ્વોડી પણ એકચીત થઈ ગયા.

સમુદ્રની મધ્યમો પાતાલ જુવન જેવા આર્ડીક દેશના

આર્દ્રક નગરમાં આર્દ્રક નામે રાજ એક હિવસ રાજહરથારમાં સિંહાસન ઉપર બેઠેલો હતો એનો પાટવી કુમાર અને યુવરાજ આર્દ્રકુમાર રાજની સમીપમાં બેઠેલા હતા તે સ્વિવાય મંત્રીઓ, સામંતો વગેરે અધિકારીઓ પોતાની ચોભ્યતા પ્રમાણે સભામાં બેઠેલા હતા. તે સમયે એક પુરુષે પોતાના પરિવાર સહિત રાજહરથારમાં આવી આર્દ્રક નૃપતિ સન્મુખ અતિ ઉત્તમ જાતિની લેટો વગેરે સુકી પોતાના સ્વામી વતી કુશળ સમાચાર પૂછ્યા, પોતાના સ્વામીના કુશળ સમાચાર કહ્યા.

આર્દ્રક નૃપતિએ પણ એ પુરુષની બંધુની જેમ સંભાવના કરી અતિ સત્કાર અને સન્માનથી નવાજતાં મગધરાજના કુશળ સમાચાર પૂછ્યા.

વચનાં આર્દ્રકુમારે પિતાને પૂછ્યું. “ પિતાજ ! આ કોણ છે ! મગધેશ્વર કોણ છે ! કે તેમની સાથે વસંતકાંતુને કામદેવની જેમ તમારે પ્રીતિ છે. ”

આર્દ્રકુમારના જવાબમાં આર્દ્રક રાજએ કહ્યું. “ હુ વત્સ ! શ્રેણિષ્ઠ નામે મગધ દેશનો રાજ છે. તેના અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. ”

પિતાનાં વચન સંભળીને યુવરાજ આર્દ્રકુમારે ચેતા પુરુષને પૂછ્યું, “ તમારા સ્વામીને ડોઈ પૂર્ણ શુણુંતો પુત્ર છે ! જેની સાથે હું પણ મૈત્રી કરવા દર્શાવું છું. ”

“ હે કુમાર ! યુદ્ધનો નિધાન એવો, અને પાંચથે મંત્રીઓનો સ્વામી, દાતાર, કુરુણારસનો લાડાર, દૃષ્ટ, કૃતજ્ઞ, સર્વ કણામાં પારંગત એવો અભયકુમાર નામે ગ્રેણિક નરપતિને પુત્ર છે. અરે કુમાર ! યુદ્ધ અને પરાક્રમથી સંપત્તિ, લયરહિત, વિશ્વમાં વિખ્યાત એવા અભયકુમારને શું તમે નથી જાણ્યતા કે ? ”

આર્દ્રકુમારને અભયકુમાર સ્થાયે મૈત્રીનો અર્થ જાણીને આર્દ્રકનૃપતિએ કહ્યું કે “ હે વત્સ ! સાધુ ! સાધુ ! તું મારો કુલીન પુત્ર છે, કેળેશી મારા ચાલેતા મર્ણને અનુસારે તું પણ ચાલવાને ધૂક્યે છે, સમાન શુદ્ધિવાળા અને સમાન પુત્ર, સંપત્તિવાળા તમારા બન્નેને મૈત્રીપણું ચુક્તા છે. ”

પિતાની અનુમતિ મલવાથી યુવરાજ આર્દ્રકુમારે કહ્યું. હે મંત્રી ! તમે સ્વહેશ તરફ જાણો ત્વારે મને પૂછ્યા વગર તમારે જવું નહિ. મારે પણ મારા મિત્ર અભયકુમારને એક સહેશ મોકલવાનો છે. ”

મગધરાજના મંત્રીએ મારું વચન સ્વીકૃત્યું આર્દ્રક નૃપતિએ આપેલા ઉતારામાં કેટલાક દિવસ નિર્ગમન કર્યા.

એક દિવસ આર્દ્રક નૃપાતની રણ બંધ તે મંત્રી પોતાને સ્વહેશ જવાને તૈયાર થયો. જતાં પહેલાં તે આર્દ્રકુમારને મળ્યા આછ્યો. આર્દ્રકુમારે અભયકુમારને આપવા માટે મંત્રીના હાથમાં પરવાળાં સુકૃતાકુલ વૃગેરે ઉત્તમ

વસ્તુએ આપી અનુકૂળે તે મંત્રી રાજગૃહે પહોંચ્યો. શ્રેષ્ઠિકરાણને ને અભયકુમારને લેટો આપી તેમનો સંદેશો કહી સંભળાયો. અભયકુમારને પણ કહું કે ‘આર્ડ્-કુમાર પણ આપની મિત્રતા આહે છે.’

જૈનશાસનમાં કુશળ અભયકુમારે વિચાર કર્યો કે આર્ડ્-કુમાર જરૂર પૂર્વભવે સાધુપણાની વિરાધના કરેલી હોવાથી અનાર્થ દેશમાં ઉત્પન્ન થયો છે, છતાં એ આસક્ત લભ્ય હોવો જોઈએ; કારણું કે અભય અને હુર્ભાયને મારી સાથે મિત્રતા કરવાની દુદ્ધા થાય જ નહિ. જગતમાં પ્રાય: સમાન પુણ્ય-પાપવાળા પ્રાણીઓને જ પ્રીતિ થાય છે, તો કોઈપણ ઉપાયે અને જૈનધર્મમાં સ્થિર કરી હું એનો આસુજન થાઉં, કેમકે જે ધર્મમાર્ગમાં જોડે તે જ ખરો હિતસ્વી કહેવાય છે. તે આર્ડ્-કુમારને હું તીર્થાંકરતું બિંભ દર્શાવું, જેના પ્રભાવથી કહાય એને જાતિસમરણ જ્ઞાન થાય તો પાછો ફરીને પણ જૈન ધર્મમાં સ્થિર થાય, માટે લેટમાં અહિથી મહાન આચાર્યે પ્રતિષ્ઠિત કરેલી એક રત્નમયી ઉત્તમ અર્હત પ્રતિમા તેની ઉપર મોકલાવું.”

ઇત્યાદિ વિચાર કરી અભયકુમારે એક પેટીમાં રત્નમય આદિનાથની અપ્રતિમ પ્રતિમા મૂકી તેના આગળ ધૂસ, દીપ ઘંટા વગેરે દેવપૂજનનાં ઉપકરણો મૂકી, પેટીને તાળું દક્ષ, એની ઉપર મહેરા છાપકરી મગધપતિ શ્રેષ્ઠિકે આર્ડ્-કરાણના માણ્યસને સંમાન કરી લેટો આપી વળાયો તેની સાથે

અભયકુમારે આ લેટ પણ મોકલાવી. અને કહ્યું કે. “ હે ભાડ ? આ પેરી આર્દ્રકુમારને આપણે, અને ખાનગીમાં કહેલો કે તમારે ખાનગીમાં આ પેરી ઉધાડવી અને એની અંદર રહેલી વસ્તુ વિચારપૂર્વક તમારે જોવી; પણ થીજા કોઈને તમારે આ વસ્તુ બતાવવી નહિ. ”

આર્દ્રક રાજના માણસે અભયકુમારનું કથન માન્ય કર્યું ને તે પોતાને નગરે આવ્યો. આર્દ્રક રાજને લેટ વગેરે આપી તેમના કુશળ વર્તમાન કથાં અને પેલી અભયકુમારે આપેવી લેટ આર્દ્રકુમારને પણ આપી અભયકુમારનો સંદેશો કહી સંભળાવ્યો.

આર્દ્રકુમારે પોતાના દિવાનખાનામાં આવી એકાન્તમાં તે પેરી ઉધાડી તો અંધકારમાં ઉધોત કરનારી જાણે તેજના જ પુંજથી ઘડેલી હોય તેમ આહિનાથની મનોહર પ્રતિસા જોઈ. નવીન પ્રકારની આ વસ્તુથી આર્દ્રકુમાર અનાયધ પાંચ્યો, એણે ધણી વસ્તુએ, અંતારો જોયા હતા પણ આવી વસ્તુ આજપર્યાંત એન્ફોજેવામાં આવી ન હતી, તેથી આ નવીન જાતના આભરણુથી તે અત્યાંત ઝુશી થયો. આ આ આભરણને એને મસ્તકે ભૂક્યો, ગળે પહેલી જોયો, કમરે ભૂકી જોયો, પણ અંધેસતો થયો નહિ. “ આ શું હશે ! આ તે કયી જાતનું આભરણું ? ” પોતાની દૃષ્ટિ સંસુધ રાખીને અરાખર ધારીને ચુવરાજ આ નવીન વસ્તુને જોવા વાયો.

“ અચીત આ કોઈ નવીન વસ્તુ છે, પણ આભૂષણું હોય એમ તો લાગતું નથી. આ કોઈ અજબ વસ્તુ છે. અભયકુમારે શું કહેવડાંયું છે કે વિચાર પૂર્વક એ વસ્તુને જોવી. માટે આ વસ્તુ પહેરવાની તો ન હોય, ત્યારે આ વસ્તુ કંધી. શું? આ વસ્તુ ક્યારે પણ મારા જોવામાં નથી આવી! ” ચૂવરાજ વિચારનાં ઉડાણું ઉતરી ગયો, આ નવીન વસ્તુની સંમુખ એની ફાળ હતી. અત્યારે તે એકાશચિતવાળો હતો, ધ્યાનમળ હતો, બાદ્ય બંધનોથી વિમુખ થઇ તે અત્યારે વિચારમાંજ એકચિતવાળો હતો.

“ મને લાગે છે કે: આ વસ્તુ મેં જોઈ છે; પણ ક્યાં જોઈ છે અને કુયારે જોઈ છે તે યાદ આવતું નથી. આ વસ્તુ અતિ મહત્વની વસ્તુ છે. અભયકુમાર યુદ્ધિનો નિધાન છે. એ મહા યુદ્ધિધ્વાન પુરુષે જે વસ્તુ મોકલાવી હશે તે ખચિત અતિ આવશ્યક વસ્તુ હશે. ત્યારે આ વસ્તુ કંધી? ” વિચારની પરંપરામાં પૂર્વભવને સૂચન કરેનારં ચૂવરાજ આદકુમારને જાતિસ્મરણુજ્ઞાન થયું. એ જ્ઞાનથી એણું ચોતાનો પૂર્વભવ રૂપી રીતે જોયો. “ હું કોણું? અહીં ક્યાંથી આવ્યો છું! આ દેશ કયો! આ તો અનાર્યદેશ, એના લોકો પણ અનાર્ય પૂર્વભવે મેં સંયમ પાલન કર્યું છતાં પ્રાંતે જરા માત્ર પણ મેં જનથી ચાર્ચિત્રની વિરાધના કરી તો તેથી આ ભવે હું

આનાર્યમાં ઉત્પજ્ઞ થયો કે જ્યાં ધર્મ સામગ્રી જ મલી શકે નહિ. હા ! હવે મારું શું થશે ? ”

“ ત્રીજે ભવે મગધદેશના વસ્તુંતપુર નગરમાં હું એક ડણ્ણખી હતો, બંધુમતી નાંસે મારી જી હતી. અન્યદ્વા સુદિયત નામે આચાર્ય પાસેથી આર્હતધર્મ પામી અમે બન્ને જણાંએ દીક્ષા અનુષ્ટુ કરી. શુરૂની સાથે વિહાર કરતો હું અન્યદ્વા એક શહેરમાં આવ્યો. ત્યાં મારી જી બંધુમતી પણ ધીણ સ્ત્રીઓ સાથે વિહાર કરતી કરતી સાધ્વીઓ સાથે તે શહેરમાં આવી. એક દીવસે તેને જેવાથી મને એની સાથે બોાગવેલી વિષય કિંડા ચાદ આવી. તેથી હું સાધુ છતાં તેણીનામાં અતુરાગી થયો. અને બીજા સાધુને તે વાત મેં કહી સાધુએ પ્રવત્તિનીને કહું, એ પ્રવત્તિનીએ બંધુમતીને કહું. શુરૂણીનું વચ્ચેન જાંખળી બંધુમતી એહ પામતી જોઈ. “ હે સ્વામિની ! એ ગીતાર્થ થયેલ સાધુ પણ મર્યાદાનું ઉત્ત્વધન કરશો, તો મારું શું થશે ? સંસારમાં તો મર્યાદા એજ મોટી ચીજ છે, મર્યાદાથી જસુદ્ર પૃથ્વીને કુલાડતો નથી. હું કેવી દેશાંતરે જધશ તો તે મહાનુભાવ મને પરદેશ ગયેલી જાણી મારી પાછળ આવશો, પણ રાગને છોડશે નહિ. માટે જગપતી મને અણુસણુ કરાવો, કે જેથી મારું અને એમતું શીલવત અખંડ રહે. ”

શુરૂણી પાસેથી અનશનત્રત અનુષ્ટુ કરી મારી જી

બાંધુમતીએ શુંકની જેમ પોતાન્સાર પ્રાણોને લીલામાત્રમાં
તળ હીધા, અને તે દેવપથાને મુાઝેત થઈ.

બાંધુમતીને ભૂત્ય પામેલી સાંભળી મને પચ્છાતાપ
થયો “ કારે ! ખચીત મેં આ હૃકર્મ કર્યું. એ મહાતુભાવા
તો વ્રતલંગના જયથી ભૂત્ય પામી ને હું તો હજુ વ્રતલંગ
થયા છતાં પણ જીવું છું. હા ! ધિક્કાર છે ! મેં પણ
તરત જ અનશન વ્રત અહથું કર્યું. ”

અનશનવ્રતથી ભૂત્ય પામીને દેવલોકમાં હું દેવતા
થયો ત્યાંથી ચચીને હું અહીં અનાર્થદેશમાં ધર્મવર્જીત-
પણે ઉત્પજ્ઞ થયો છું. અહીંયાં ધર્મતું નામ પણ હુર્બણ
તો પણી “ ધર્મની બીજી વાતો તથા કૃત્યો તે કચાંથી હોય ?
અહા ! એ મહાનું બુદ્ધિવંત ઉપકારી અભયકુમાર ન મળ્યો
હોત તો મારું શું થાત ? અહીંથી હું કથી હૃતિમાં જાત ?
આવા અનાર્થદેશમાં ઉત્પજ્ઞ થયા છતાં મારું ભાગ્ય હજુ
બાયત છે કેમકે આતું આલંબન મળે છે. હવે હાલમાં તો
આ આહિદ્વર ભગવાનની પ્રતિમાં ઓજ મારે આલંબન
તે સિવાય ધર્મવર્જીત આવા અનાર્થદેશમાં હું વિશેષ શું
કરી શકું ? ”



પ્રકરણ. ૩૦ મુ.

આર્ડ્ર્ટ કુમાર.

આહિનાથની પ્રતિમાની પૂજા કરતાં કેવાં દિલ્લો વહી ગયા પછી આદ્ર્ટકુમાર આર્ડ્ર્ટદેશમાં જવાને, મગધની ભૂમિ ઉપર પગ મૂકી પોતાના શુરૂ અસયકુમારનાં હર્ષન કરવાને અતિ ઉત્સુક થઈ રહેલો ને એક દિવસ સમય મેળવી પિતાની આજા મારી. “પિતાલુ ? હું અસયકુમારનાં હર્ષન કરવાને ઉત્સુક છું માટે જેને જવાની રણ આપો ? ”

પણ પિતાચે અને રણ આપી નહિ. અને કહું વત્તસ ! તારે ત્યાં જવાની જરૂર નથી મારી શ્રેષ્ઠીકરને જેમ ફૂરથી જ પ્રીતિ તેમ તારી અને અસયકુમારની મેત્રી ફૂરથી જ વૃદ્ધિ પામે.

આદ્ર્ટકુમારની અતિ ઉત્કંડા છતાં પિતાના બંધનના કારણે તે જરૂર શક્યો નંહિ, છતાં મગધદેશ તરફું જવાની એની ઉત્કંડા તો અતિ વધી પડી. જેથી તે જેને તેને પૂછવા લાગ્યો કે “ મગધદેશ કેવો છે ? રાજયહ નગર કેવું છે ? ત્યાં જવાનો કયો માર્ગ છે ? ” ખાતાં, પીતાં, હરતાં, ઝરતાં, સંસારની ફાયેક કીયા કરતાં મગધ મગધતું જ રટણું કરતો હતો.

આદ્ર્ટકુમાર આવી ઘેલચાથી આર્ડ્ર્ટકુરાલને ચિંતા થઈ. જરૂર ચુવરાજ મને કહ્યા વગર જતો રહેશે માટે પાણી આવે તે પહેલાં પાણ બાંધી હેવી જોઇએ. “ રાજાચે આર્ડ્ર્ટકુમારના રક્ષણું સાર્દ પોતાના પાંચસો સામંતોને આજા કરી કે

તમે આર્દ્રકુમારનું રક્ષણું કરો ! તમારે હેઠળની છાયાની જેમ એની સાથે રહી યુવરાજને પરહેઠ ન કબા હેવો.

ત્યારથી હરરોજ પાંચસે સામંતો યુવરાજની સાથે રહેવા લાગ્યા. બાંધનમાં પડેલા આર્દ્રકુમાર જેમ જને તેમ જ લદીથી છુટાય તે માટે સામંતોને વિશ્વાસ પમાડવા લાગ્યો. અંચ ઉપર બેસી હૂર જતો વળી એમની પાસે આવતો, એમ વિશ્વાસ પમાડી એક દિવસ આર્દ્રકુમાર પોતાના માણુસો દ્વારા વહાણું તૈયાર કરાવી તેમાં બેસીને આર્યદેશમાં આવતો રહ્યો. આર્યદેશમાં આંધ્રા પણી આદિનાથની પ્રતિમા અભય કુમાર ઉપર મોકલાવી વહાણુમાં આણેલું ધન સાત ક્ષેત્રમાં વાપરી પોતાનો મેળે આર્યકુમારે પતિલિંગ અહણું કરો સામાયિક ઉચ્ચારવા માંડયું.

તે સમયે આકાશમાં રહેલા દેવતાએ ઉચ્ચય સ્વરે કહેવા મંડયું. “ હે મહાસત્પ ? હાવમાં તું દીક્ષા અહણું કરીશ નહિ. તું દીક્ષા અહણું કરીશ નહિ. ”

આકાશવાણી સાંભળી આર્દ્રકુમારે આકાશ તરફ નજર કરી તો દેવતાએને જોયા, તેથી તે જોખ્યો, “ શા માટે મેં અટકાવો છો ? ”

“ હજુ તારે બોગકર્મ અવશોષ (બાકી) રહેલું છે. તે બોગવ તે પણી દીક્ષા અહણું કરજે. અન્યથા તો જગતમાં તારું ઉપહાસ્ય થશો. ” દેવવાણી સાંભળી.

“ આહ ! એ જડકર્મ આત્માને શું કરનાર છે. ”

“ અરે કદાથહી ! તીર્થંકરે પણ લોગકર્મને ટાળવાને સમર્થ થયા નથી, થતા નથી, તેઓ પણ લોગોને લોગવીને પછી દીક્ષા અહંકૃત કરે છે; તો તું કાં હઠ કરે છે. ”

દેવતાનાં એવા વચ્ચેનોનો અનાદર કરીને આર્દ્રકુમારે પોતાના પરાક્રમ વડે પોતાની મેળે દીક્ષા અહંકૃત કરી. એ આર્દ્ર-મુનિ પ્રત્યેક ખુદ્ધ થઈ તીવ્ર પણે તપસ્યા કરતા, ધ્યાનમાં મર્જન રહેતા. ત્રતને પણતા, વિહાર કરવા લાગ્યા.

વિહાર કરતાં કરતાં આર્દ્રમુનિ વસ્તંતપુર નામના નગરે આવ્યા, નગરની અહાર કોઈ દેવાલયમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા.

આ નગરમાં ભણ કુળવાન દેવહસ નામે શાહુકાર રહેતો હતો, તેને ધનવતી નામે સ્વીની કુલિથી ચેલો બંધુમતીનો જીવ પુત્રીપણે ઉત્પજ્ઞ થયો હતો. શ્રીમતી એવું બાલાનું નામ હતું. ખાત્રીએથી લાલનપાલન કરતી બાલા ધુલીકોડાઅવસ્થાને પ્રાપ્ત થઈ. સમાનવયની બાલાએ. સાથે રમત રમવાને આલા શ્રીમતી ચેલો દેવાલયમાં આવી. રમત રમતાં રમતાં પતિની રમત રમવા માંડી. જેથી પોત પોતાની રૂચી પ્રમાણે જીવેં બાલાએ વર વરી લીધો. કોઈ થાંભવાને તો કોઈ પત્થરના પુતલાને તો કોઈ વૃક્ષના થડને તો કોઈ ણીલ વસ્તુ-ઓને એમ સર્વે બાલાએ વરને વરી ગઢી.

પેઢી બાલા શ્રીમતી વર પસંદ કરવાના વિચારમાં હતી.

તેવામાં તેની નજર કાચેપસર્ગ મુદ્રાએ રહેલા આર્ડ્રુમાર મુનિ ઉપર પડી. બાલા શ્રીમતી એ મુનિની પાસે જઇ બોલી. “સખી-ઓ ! હું તો આ સાધુને વરી ચુકી. ”

શ્રીમતીના આ કૃત્યથી આકાશમાં રહેલા દેવતાઓએ કહું, “ બાલા ? શાણાસ છે તને, તું ચોગ્ય વરને વરી છો ? ” એમ કહીને મોટી ગર્જના કરી રતનેની વૃદ્ધી કરી, ગર્જનાથી અથ પાસેલી બાલા એકદમ ચીસ પાડતી મુનીના ચરણુને વળગી પડી.

અનુકૂળ ઉપસર્ગ થવાથી મુની વિચારમાં પડ્યા. “ અહીંથાં રહેવાથી મને આવો અનુકૂળ ઉપસર્ગ થયો, માટે વિશેષ વખત રહેવું તે મને ચોગ્ય નથી. ” એમ વિચારી મુની ત્યાંથી ઝીંકે ચાલ્યા ગયા, શ્રીમતી સખીએ સાથે પોતાને દેર ગાઈ.

નગરનો રાણ પેલું નધાણીયાતું ધન લેવાને તે દેવાલયમાં આવ્યો. ત્યાં તેના જોવામાં સર્પી આવ્યા. જેથી તે વીલએ થયો તે સંમયે તે દેવતાએ અદ્રશ્ય પણે કહું. “ આ ધન મેં કન્યાના વરને નિમિત્તે આપેલું છે માટે તમારે લેવાનો પ્રયત્ન કરવો નહિ. ” રાણ પાછો ગયો ને શ્રીમતીના પિતાએ તે ધન વરકન્યાના ઉપલોદ્ધ માટે ઈલાયહ રાખ્યું. એ વાતને વચ્ચમાં કેટલાંક વર્ષો પાણીના પ્રવાહની જેમ વહી અથાં ને શ્રીમતી યોવનને આંગણે આવી. બાલા શ્રીમતી એકતો સુંદર હતી જ, તેમાંથી વળીએ સૌંદર્યનો વધારો.

કરનારી ચુવાન્ની આવી. જેથી એને વરવાને એના સ્વરૂપથી આકૃષ્યાયોજા ઘણ્યા ચુવાનો આવ્યા.

શ્રીમતીના પિતાએ શ્રીમતીને આજા કરી. “ મુગ્રી ! આ ચુવાનો માંથી તને ચોંચ લાગે તેને તું અંગીકાર કર ?

પિતાનાં વચન સાંભળી શ્રીમતી બોલી. “ ભાપુ ! કાનને અપ્રિય એવું તમે આ શું બોલો છો ? હું તો તે વખતે જે મુનીને વરી છું તે જ મારો વર છે ! ”

“ એગા ! એતો સાધુ પુરુષ, મુનિઓ શું લગ્ન કરે છે ? એમણે તો સંસારનો ત્યાગ કરેલો છે. સંસારના ત્યાગીઓને સંસારીવાસના ન હોય. ”

“ હોય, કે ન હોય. પણ આ ભવે તો તેજ મારા વર છે. તે સિવાય બીજા બધા મારે ભાઈ-આપ સમાન છે. પિતાલુ ! આપને હું એ સત્ય વાત કહું છું. ”

“ એ સાધુ પુરુષ ! એમનું નતો ગામ, કે નતો ઠામ કે ઠેકાણ, તું એમને કથાંથી મેળવીશ. એ મુનિને આજ કેટલાંક વર્ષો થઈ ગયાં, તેમને તું ઓળખશે પણ કેવી રીતે ?

“ પિતાલુ ? કે વખતે મેધાર્જના થઈ, તે વખતે હું તેમના અરણુમાં વળગી પડી હતી. ત્યારે તેમના અરણુમાં એક ચિનહી મારા જોવામાં આવ્યું હતું, તે ચિનહીનું હું તેમને ઓળખી કાઢીશ. ” શ્રીમતીએ પિતાને કણી સંશોધું.

“ પણ એ મુનિ આહીયાં આવશે ત્યારે ને, અને આવશે તો તને ખબર પણ શી રીતે પડશે કે તું ઓળખશો.”

“ પિતાજ ! તે માટે એક રસ્તો છે, અને તે રસ્તો એજ કે સર્વ મુનિઓને હું જોઈ શકું તેવી તમે ગોઠવણુ કરો.

પિતાએ પુત્રીના કથનને અતુમોદન આપ્યું અને કહ્યું કે આજથી આ શહેરમાં જે મુનીઓએ આવે તેમને તારે સવય મેળ લીક્ષા આપવી.” એમ કહીને તે પ્રમાણે ગોઠવણુ પણ કરી, કારણું કે દેવકા મોટો શાહુકાર હતો. શ્રીમંત માણ્સને મહાનુ કાર્ય કરવું પણ હુફ્કર નથી હોતું તો આવું સામાન્ય કાર્ય કરતાં તે શી વાર ?

પિતાની અતુમતિથી શ્રીમતી પ્રતિદિનસ સાધુઓને ભિક્ષા આપવા લાગી, અને વંદના કરતી હતી, વંદના કરતી વખતે મુનિના ચરણુ ઉપર રહેલું ચિનહ્ન જોવાને તે ચુક્તી નહિ. બાદા શ્રીમતીનો દરરોજનો આ કાર્યક્રમ હતો.

પૂરા બાર વર્ષે પાછા આર્દ્રમુનિ દિગમૂઠ થઈને લાવિ-તાવ્યતાને અંગે વસંતપુર નગરે આવ્યા. શ્રીમતીને ત્યાં વહેરવાને એ મુનિ આવ્યા, વંદના કરતાં તેણીએ પેલું ચિનહ્ન જોઈ મુનિને તત્કાલ ઓળખી લીધા. “ આહા સ્વામી ! આપરે તમે મને મલ્યા. તે દિવસે દેવાલયમાં હું તમને વરી હતી તે તમને યાદ છે. તે દિવસે તો તમે હું બાલક હોવાથી પસીનાના બિંહની જેમ તળુને ચાલ્યા ગયા હતા, પણ આવે ખણા જરૂરાચા છો. ” શ્રીમતીએ ફર્જેવા માંદયું.

શ્રીમતીનાં વચન સાંકળી આર્ડ્રુમાર મુનિ પાછા વળવાની ત્વરા કરતા એલયા. “ બાલે આ તું શું એલે છે ? તમે ગુહસ્થ ને અમે સાધુ, ત્યાગી, સ્વામી શું ને વાત શી ? જરા વિચારને એલ ? આવું ગાંડુ વેલું ન એલ ?

“ તે દીવસે હું તમને વરી હતી ત્યારથી તમે જ મારા ખતિ છો. ધી તો ઝીચડીમાં પડી ગયું દુધમાં સાકર પડી ગધ, ને થવાનું હતું તે તો થઈ ગયું પ્રિયતમ ? હવે શું વિચાર કરીને એલાવો છો. ચાતક જેમ મેઘની વાટ જુઓ તેમ હું નિરંતર તમારી વાટ જોઈ રહી છું. “ શ્રીમતીએ કહું.

“ મારી વાટ જોઈને તું શું કરશો હું તો એક મુનિ છું, વિક્ષુંક છું. મારી પાસે પૈસો નથી, લિક્ષા માગીને પેટ ભરૂ છું. ધર વગર જાં ત્યાં રહીને ભારે સમય હું વ્યતીત કરું છું. મારી સાથે પરણીને તું નાહક હુઃખી થશો ડેરાન-થશો.”

“ બસ એટલું જ કહેવાનું કે ઝીજું કાંઈ, તમને પરણીને હું હુઃખી થઈશ કે સુખી એ તો મારે વિચારવાનું છે અને માનો કે કદાચ હું હુઃખી થાડું તો પણ શું. કારણું મનથી, વચનથી અને કાયાથી પણ તે દીવસે તમને હું વરી ચુકી છું. એટલે હવે તો નિર્પાય ? તમારે કે મારે હવે ધીને કોઈ રસ્તો નથી.”

“ શ્રીમતી ? તે નહી ધની શકે. મેં સંયમ સ્વિકારેલું

છે. એ વતની વિરાધના પુર્વે મેં મન વડે કરેલી અના ફ્રેન્ડ
તરીકે ધર્મરહિત અનાર્થદેશમાં હું ઉત્પજ્ઞ થયો. આજે
સર્વથા સંયમથી ભ્રષ્ટ કરીને મને તું કયાં મોકલવા ધારે છે.”

આ બન્નેનો દ્વાવિવાહ સાંકળવાને આડોસી પાડોસી
લેમાં થઈ ગયાં. શ્રીમતીનાં માતા પિતા દ્વારી આંધ્યાં, વાત
ફેલાતાં રાણ પણ ત્યાં આવી ચડગે.

“ પ્રાણોશ ! એ તત્વજ્ઞાનનો વિચાર અત્યારે ન હોય,
અત્યારે તો મને પરણોા, તે સિવાય તમારો ખીને કોઈ રસ્તો
નથી. તમે મને વરીને ચાલ્યા ગયા છો ત્યારથી આજપર્યંત
મારો કાલ પ્રાણરહિતની જેમ પસાર થયો છે. માટે મને
અંગીકાર કરો ! અનાથને સનાથ કરો ! ”

“ શ્રીમતી તે કહિ નહિ બની શકે ! ” આર્દ્રકુમારે
આવવા માંડયું.

“ ત્યારે તમે શું મારી અવજ્ઞા કરીને જશો ? ભલે
કુરતાથી મારી અવજ્ઞા કરશો તો અનિમાં પડી તમને જી
હૃત્યાનું પાપ આપીશ. ” શ્રીમતીની જોલવાની છટા, એનું
તેજ, ગૌરવ બધાં અદ્ભૂત હતાં. એની નિશ્ચિતતા અડગ હતી.
“ આપ શું એમ સમજો છો કે આપને વર્યા પણી હું હવે
અન્યને વરીશ. આપને હજુ ખબર નથી. સતીસીએ એક
વખત પણ મનથી વર્યા પણી અન્યને જીવનપર્યંત છાંછતી
નથી. જગતમાં પણ જેવાય છે કે ‘ રાજાએ એકજ વાર

એલે છે. મુનિઓ એકજ વાર બોલે, ને કન્યા પણ એકજ વાર અપાય છે.' એક ભ્યાનમાં જેમ એકજ તત્તવાર હોય છે તેમ જ સતીસ્થિને પણ એક જ પતિ હોય છે. માટે આપ કે મારો ત્યાગ કરશો તો જરૂર હું મૃત્યુ પામીશ."'

શ્રીમતીનાં આવા વચ્ચેનો સાંભળી મુનિને દિગમ્બાર થઈ ગયા. આબુભાળુ લોકોની ઠું જામેલી હતી. એક બાળુએ શ્રીમતીને પડ્યે એના માતા પિતા તથા સગાં સંબંધી ઉલેલાં હતાં. રાજ વળે બીજુ બાળુએ ઉલા રહી આ દ્વિત્ય જેયા કરતા હતા. આવા સંચેગોની અનુકૂળતા અને શ્રીમતી નેવી સુંદર બાલાની પ્રીતિ-ભક્તિ છતાં મુનિની અડગતા ઉપર લોકો બેહદ પ્રસંગ હતા. છતાં પણ બધાંના મનમાં હતું. "આ મુનિ બાળાની પ્રાર્થનાસ્વીકારી એની સાથે લંબ કરે તો હીક?"

સ્વભાવ, જીવિતભૂતા શું કામ કરે છે? અહીં સાધુના પ્રતનો કાંગ થતો હતો, સાધુપણું છોડી ગૃહસ્થપદ્ધામાં આવી ઊચોના પરિચયમાં રહેવાનું હતું, ધર્મમાગ મુક્તી પાપને પંથે ડગલાં ભરવાનું હતું છતાં આજે જગત અનુકૂલ હતું. શ્રીમતી અનુકૂલ હતી, સર્વ સ્નેહી સંબંધી અનુકૂલ હતાં. કુદરત પોતે પણ અનુકૂલ હતી, અરે હેવતાચ્ચોની પણ એમાં અનુમતી હતી. શ્રીમતીના બાપે વિનાંતિ કરી. "મહા પુરુષ! આપ મારી પુત્રીને સ્વીકારી સંસારમાં રહો ને સ્વભાવાંથી પાછા ફરીને દીક્ષા અહેણું કરજો."

એના કથનને સર્વ લોકોએ અનુમતિ આપી. "અરે

સુનિવર ? શા માટે આ બાલાનો તિશ્શકાર કરો છે. ? તમારા ભાગ્યમાં આ બધું લખાયેલું છે. તેથી જ આજે તમને મળે છે. પૂર્વલાવે તમે લઇને અહીંથાં આવ્યા છો માટે એ તમારે લોગ્યા વગર ખુટકો નથી. તમે આવા જાની પુરુષ થઈને શા માટે કદાચં રાખો છો. તમારા વિયોગે આ બાલા બિચારી નિશ્ચય અકાલે મરી જશે. પણ ભીજાને તો નહીં જ વરે. વિધિએ એને તમારે માટે જ નિર્માણ કરી છે. જુઓને તમારી ઉપર ડેવી એની અખંડ ભક્તિ-પ્રોત્િ છે. ”

“ સત્ય છે સુનિવર ! અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે આ બાલાનો તમેણે વિકાર કરો ને અવસરે હીક્ષા લેનો.”
નગરના રાજાએ પણ એ સુનિવરને કહ્યું.

આ બધું સંસારનું નાટક જોઇ આર્દ્રકુમાર તો તાજુખ થઈ ગયા. એક પણી એક જર્વેની સામે જેવા લાગ્યા. પેલા દેવતાનું કથન યાદ કરવા લાગ્યા. “ નક્કી દેવવાણી આજે સત્ય થઈ. અવિતંયતાં કયારે પણ અન્યથા થતી નથી. છચ્છા નહિ છતાં એ મહામુનિ અવિતંયતાને વશ થઈ શ્રીમતીને પરણ્યા, પોતાનો મુનિવેશ તજી ગૃહસ્થ થયા. તેમની આવી પ્રવૃત્તિથી સર્વ લૈક પ્રસન્ન થયા. એ રીતે આર્દ્રકુમારમુનિ મુનિ મરીને પાછા ગૃહસ્થ બન્યા.



પ્રકરણ ૩૧ મું.

ત્રાક્ષુત્રનું બંધન અને સુક્રિયા

“ દંસણમઢો મઢો, દંસણમઢુસુસ નાનિથ નિષ્વાયાં ।
સિજાંતિ ચરણરહિઆ, દંસણરહિઆ ન સિજાન્તિ ॥ ”

ભાવાર્થ—જે આત્મા સંભ્રંશુનથી પતિત થયો છે તે જ સંસારમાં પડેલો છે, કારણું કે હર્ષનથી બ્રહ્મ થયેલાને મોક્ષ નથી. ચારિત્રથી બ્રહ્મ થયેલા મોક્ષપદ પામે છે પણ હર્ષનરહિત જીવો મોક્ષ નથી જતાં; માટે સંભ્રંશુદર્શનમાં એટલી સુસિશેષતા છે.

ચારિત્રથી પતિત ભલેને પ્રાણીએ કહાચ કર્મવશાત અવિત્યતાને યોગે થઈ જાય છતાં શુદ્ધ સંભ્રંશુદર્શનધારી હોય તો પાછા રહ્યે આવી જાય છે. ગમે તેવી સ્થિતિમાં પણ આત્મા પોતાના સંભ્રંશુવનું રક્ષણું કરે તો તેને ડેકાણે આવતાં વાર લાગતી નથી; માટે યન્ન થકી પણ સંભ્રંશુવનું રક્ષણું નથી. વસ્તુતવનું જેને ભાન થાય છે, પ્રભુના માર્ગમાં જેને અવિયળ શ્રદ્ધા છે, જેની પ્રભુની સન્મુખ દૃષ્ટિ છે જમે તેવી સ્થિતિમાં પણ તે દૃષ્ટિ તેની ઠાયમ રહે છે અને તેથી સંસારના પંચેંદ્રિયના સુખમાં ભગ્ન રહેના છતાં પણ તેની દૃષ્ટિ મોક્ષ તરફ હોય છે, પ્રભુનો માર્ગ પામવાની આતુરતાવાળા હોય છે તેમની શુદ્ધવાની ભાવના

હોવાથી સમય ભળતાં તેઓ સંસારમાંથી સતત ખાડુર નીકળી જાય છે. તેઓ સંસારમાં પડે છે તે પણ ન ઝુટકે ને અનિચ્છાઓ.

એવી જ રીતે આર્દ્રકુમાર પણ સ્નેહલગ્નથી લોડાઈ શ્રીમતીના પતિ બન્યા. શ્રીમતી સાથે અનેક પ્રકારે સંસારના સુખ લોગવતાં આર્દ્રકુમારને બાર વર્ષ વ્યતીત થયાં. તે દરમિયાન તેમના સંસારસુખની પ્રતીતિરૂપ તેમને એક પુત્ર થયો.

કાલુકાલુ બોલતો પુત્ર માતાપિતાના આનંદનું સ્થાન થયો તે અરસામાં આર્દ્રકુમારે દીક્ષા લેવા માટે પત્નીની રજા માગી. “ શ્રીમતી ! તારે હવે આ પુત્રનો આધાર છે. આ પુત્ર મોટો થશે એટલે તારું પાતન કરશે, માટે હવે દીક્ષા લેવાની તું મને રજા આપ ! ”

આર્દ્રકુમારની દીક્ષાની વાત સાંભળી શ્રીમતી ગભરાણી. “ અરે સ્વામી ? તમને થયું છે શું ? રાતદિવસ દીક્ષા દીક્ષા જ અંખ્યા કરો છો. હજુ તો કાલ અત્યારે આપણે પરણીએ છીએ, ત્યાં તમે આ દીક્ષાની વાત કયાં કરો છો ? ”

“ અરે લોણી ! કાલ અત્યારની તારી વાતને આજ ખાર વધાણું વહી ગયાં. મૃત્યુનાં નગારાં કંઈ કોઈની ઓછી રાહ જુઓ છે ? અચીત મનુષ્યનો મોહ હુદ્દયાજ્ય છે જમને સોંપે છે પણ પતિને સોંપતાં જીવ કપાઈ જાય છે. આ તે તારો કેવી જાતનો સ્વાર્થ શ્રીમતી ? ”

“ આ તમારા પુત્ર સામે તો જુઓ. તમને મારી ઉપર

સ્નેહ ન હોય તો ભલે પણ આ તમારા પુત્ર ઉપર પણ શું
સ્નેહ નથી ? શું મુર્દૂથાનાં હૃદ્ય આટલાં જધાં નિઃખુર હોય
છે ? કે તમને સી કે પુત્ર ઉપર જરાતરા પણ સ્નેહ આવતો
નથી ? ”

“ શ્રીમતી ! સાંસારનો એ સ્નેહ ઓટો છે. સ્નેહ એ તો
હુઃખું મૂળ છે. એ સ્નેહથી ડોને સુખ મળ્યું છે ? તું તારે
જો સ્નેહથી પુત્રનું પાલન કર ! શ્રીમતી ! ભલી થઈને તું તારું
કામ કર મને ભારે ભારે ભારે જવા હે ? ”

પોતાના નિશ્ચયથી એહ પામતી શ્રીમતી રેંગીયો કાંતવા
લાગી. શ્રીમતીને રેંગીયો કાંતતી જેઠ પેઢો નાનો ભાલક એની
પાસે દોડી આવ્યો, અને એના કંઈ વળગી પડી કાલી ભાધામાં
ઢોંઘ્યો. “ માતા ! આ ગરીબ લોકોના જેલું તું શું કરે છે ? ”

“ બાપુ ! તારા પિતા હુવે દીક્ષા લેવાના છે—જતા રહે-
વાના છે. દીક્ષા લેશો—એ જતા રહેશો પછી આપણુંને ડોનો
આધાર છે ? આ રંકનો એલી, અનાથનો નાથ અને અથળાનો
તારણુહાર આ એક રેંગીયો જ આપણું રક્ષણ કરનાર છે.”
માતાએ ભાલકને સમજાવ્યો.

“ આહુણ ! મારા બાપુ શા માટે જતા રહે છે ? ”
ભાલકે પૂછ્યું.

“ એ આપણી ઉપરથી સ્નેહ વળરના થઈ ગયા છે,
તેથી જ દીક્ષા લેવાને ઉતાવળા થયા છે. માતાએ કહું.

“ તો હું મારા બાપુને બાંધી રાખીશ. ”

એમ કહીને એની માતાએ કાંતેલું વ્રાક ઉપર સુતર હતું તે ત્રાક લઈને તે આર્દ્રકુમાર પાસે આવ્યો અને કાલી-કાલી ભાષામાં બોલ્યો “ બાપુ ! મારી બા કહે છે કે તમે અમને તળુને જતા રહેા છો. શામાટે જતા રહેા છો ? અમે તમને નહી જવા દઈએ. જુચો હું તમને બાંધું છું.” એમ બોલતાં ત્રાકના સુતરથી એ નાના ભાગકે આર્દ્રકુમારના એ પરે આંટા હેવા માંડ્યાં, થોડાક આંટા હઈ ભાગક બોલ્યો. “ મેં તમને બાંધ્યા છે. હવે તમે કેવી રીતે જઈ શકશો ? ” મૃદુ હસ્તો તે આર્દ્રકુમારને લેઇને બોલ્યો. ને પછી શ્રીમતી સામે લેઇને કહ્યું. “ માતા ! હવે રડીશ નહિ. મારા બાપુને મેં બાંધી લીધા છે.” બંને જણ્ણા ત્યાં હસી પડ્યાં.

આર્દ્રકુમાર આ નાના ભાગકની ચૈષાથી તાળુખ થયો. “ શું સંસારનો મોહ ! પ્રાણીઓને આવો મોહ ખરીત હુસ્ત્યાજ્ય છે. મારા જેવાને પણ તેઓ બંધનકર્તા છે. જે કે સંસારના પાશને તોડવાને હું ઉદધત થયો હતો છતાં હવે આ પુત્રનો સનેહ તોડવાને હું અશક્ત છું, માટે જેટલા આંટા પુત્રે લીધા હશે તેટલા વર્ષ હું ફરીને ગૃહભાસમાં રહીશ.” એમ વિચારી આંટા ગણી જોયા તો પુરા બાર થયા.

“ શ્રીમતી ! આ નાનકડા બાલકે ખરેખર મને બાંધી લીધો છે. તેના સનેહથી હવે હું હાલમાં નીકળવાને અશક્ત છું, માટે ઝુશી થા ! તારા સનેહથી આજ લગી બાર વર્ષ

પર્યાંત સંસારમાં રહ્યો, હવે પુત્રના સ્નેહથી ધીળ ભાર વર્ષ હું સંસારમાં રહીશ; કારણ કે આ સુત્રના ભાર આંટા એણે મને દીધા છે તેથી ભાર વર્ષ સુધી રહીશ. ” આર્દ્રકુમારે ખીને આધાસન આપ્યું.

એ ભાર વર્ષ પણ વ્યતીત થઈ ગયા. આર્દ્રકુમારનું લોગકર્મ પણ ખલાસ થઈ ગયું. પૂરાં ચોવીશ વર્ષને અંતે એક દિવસ રત્નિના પાછલા પ્રહરને અંતે તે બુદ્ધિમાન પુરુષ મનમાં ચિંતવન કરવા લાગ્યો કે—“ અહો ! આ સંસારનું નાટક વિચિત્ર છે. આ સંસારદૂરી કુવામાં પડેલા જીવો એ કુવામાંથી બહાર લાગ્યેજ નીકળે છે. આવા અગાધ કુવામાંથી મેં વ્રતરૂપી હોરીવડે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ પાછું એ વ્રત છોડી દઈ સંસારમા નિમન્ન થયો. પૂર્વે મેં એમ મનથી ભાગ વિરાધના કરી હતી તો એથી મને અનાર્થપણું પ્રાસ થયું. જ્યારે અત્યારે તો મન, વચન અને કાયાથી મેં વ્રત લાંઘ્યું છે તો માઝે શું થશે ? માટે હજી પણ દીક્ષા અહુણું કરી પાપતું પ્રાયશ્ક્રિત કરી મારા આત્માને શુદ્ધ કરે ” ધર્મધ્યાને ચઢેલા એ આર્દ્રકુમારે પ્રાતઃકાળે શ્રીમતીને, સભળવી એનું મન મનાવી, રજ લઈ પોતાનો સુનિ વેશ ધારણ કરીને ધરમાથી બહાર નીકળ્યા.

વસ્તંતપુરથી રાજગૃહ તરફ જતાં માર્ગમાં પોતાના પાંચસો સુભાટોને ચોરીનો ધંધે કરતા જોયા. એ સામંતોએ પણ આર્દ્રકુમારને ઓળખીને લક્ષિતથી વંદના કરી.

તેમની આવી વૃત્તિ જોઈ આર્દ્રકુમાર મુનિઓ પૂછ્યું.
“ અરે ! તમારી આવી સ્થિતિ કેમ થઈ ? ”

“ સ્વામી ! તમે અમને હણીને પલાયન કરી ગયા ત્યારે અમે લનજાથી તમારા પિતાને મુખ બતાવી શક્યા નહિ, જેથી તમને શોધતા પૂર્વી ઉપર ભામવા લાગ્યા ને આળુવિકાને માટે ચોરીના ધંધે અમે શરૂ કર્યો. ”

ચોતાના સામંતોની આવી સ્થિતિ સંબળી મુનિ બોલ્યા. “ ભદ્ર ! કદાચ કષ આવી પડે તો પણ પાપકૃત્ય તો નહિ જ કરવું હા, ધર્મનું કાર્ય હોય તો કષ આવી પડે તો પણ કરવું ; કારણ કે ઊભય લોકોમાં હિતકારક છે. કોઈ મહા-પુણ્યને ચોગે મનુષ્યભરત પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય ભવ પણ ત્યારે જ સફ્રલ થાય કે સ્વર્ગ કે મોક્ષને આપનાર એક સદ્ધર્મ જો પ્રાપ્ત થાય. ”

“ એ સદ્ધર્મ કચો વારુ ? ” સામંતોએ પૂછ્યું.

“ જુવો ઉપર હયા કરવી, જુહું નાહ બોલવું, ચોરી ન કરવી, મૈથુન સેવવું નહિ તેમજ ધન ધાન્યરૂપ પરિશ્રહનો ત્યાગ એ ધર્મ કહેવાય છે.” દુંકમાં મુનિએ ધર્મનું સ્વરૂપ કહ્યું.

“ ત્યારે હવે અમારે શું કરવું ? ” ચોરીએ પૂછ્યું.

“ હે ભદ્ર ! તમે બધા સ્વામીમાટા છો. રાજની જેમ હું પણ તમને માનવા ચોગ્ય છું. તમારો સ્વામી છું, માટે મારા અંગીકાર કરેલા માર્ગને તમે પણ સદ્ધુદ્વિષઠ અંગી-કાર કરો. ”

“ હે સ્વામી ! તમે પ્રથમ પણું અમારા સ્વામી હતા ને ધર્મ પમાડવાથી અમારા શુરૂ છો. તમારો કલેક્ટર ધર્મ-માર્ગ અમને રૂચ્યો છે નેથી દીક્ષા આપીને અમારો ઉદ્ઘાર કરેલા. ” સામંતોએ પોતાનો અભિપ્રાય કર્યો.

આર્દ્રકુમાર મુનિએ પાંચસેને દીક્ષા આપીને વીર ભગવાનને વાંદવાને રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગમાં વળી ગો-આળો મહ્યો. નિયતિ (ભાવીભાવ) ને માનનારો ગોશાળે આર્દ્રમુનિ સાથે વાદ કરવા લાગ્યો. યુક્તિથી વાદમાં ગોશાળને નિર્દ્દિશ કરી આર્દ્રમુનિ આહસ્તિ તાપસેના આશ્રમમાં ચાલ્યા. અહીંથાનો ગણેંદ્ર મોક્ષ અને હુસ્તી તાપસેનો પ્રતિષ્ઠાધ એ તો તમે જણો છો રાજનુ ! ” આર્દ્રકુમારે એ પ્રમાણે કહ્યું.

“ મુનિવર ! ધન્ય છે. તમોને ત્રાક્ષુત્રના બંધનો મોક્ષ કર્યો એ આપે અહ્લૂતકાર્ય કરેલું છે. એવું લોકોત્તર કાર્ય આપ સમાન સમર્થ પુરુષો જ કરી શકે. અનાર્થેશમાં ઉમજ થવા છતાં આપે આ હુંકર કાર્ય કરેલું છે. ” રાજ શ્રીલિંગ અનુમોદના કરી.

“ એ બધુંય કરવામાં ઉપકાર અભયકુમારનો છે. અલયકુમારે પ્રતિમાન મોકલી હોત તો હું બોધ ન પામત, આ સાધુપણું પણ ઉદ્ય ન આવત. આ ભવમાં તો ધર્મ પમાડનાર મને અભયકુમાર છે, એ જ મારા ધર્મશુરૂ છે. ” આ-

દ્રોકુમારે કહ્યું. તે પછી રાજકુમારને ઉદેશીને કહ્યું, “ હે રાજ-
કુમાર ! પ્રતિમા મોકલવાવડે કરીને તમે મને શું નથી આ-
ખું ? અનાર્થેશમાં જન્મેલા મને તમે આર્ધત ધર્મ પમા-
ખો. ધર્મરહિત મહાકાદવમાં પડેલા મારો તમે ઉદ્ધાર કર્યો.
તમારી બુદ્ધિથી યોધ પામી હું આર્થેશમાં આવ્યો ને
પ્રતિયોધ પામીને દીક્ષા અહણુ કરી. હે રાજકુમાર ! તમને
ધર્મના લાલ થાયો. ”

“ છતાં પણ આપની શક્તિને ધન્ય છે, આપનો ધર્મ
રાગ તીવ્ર છે કે એવો સખ્ત બંદોબસ્ત છતાં આપ ત્યાંથી
આર્થ દેશમાં આવ્યા ને ચરિત્ર અહણુ કર્યું. સોગાલલી કર્મ
છતાં પણ આપે શૂરવીર બનીને દીક્ષા લીધી. ન છુટકે સંચોગ-
વશ થયા, ને એતાક્ષુત્રનું બંધન પણ આપે તોડયું, એ
શું એછી મહત્વની વાત છે ? મોહર્ય કાદવમાં ઝુંચેલા
અમે બહાર પણ નીકળવાને સમર્થ નથી. શું કરીએ ? કયાં
આપની શક્તિને કયાં અમારી શક્તિ ? ” અલયકુમારે
આદ્રોમુનિનો આભાર માનતાં કહ્યું.

મગધરાજ શ્રેષ્ઠીક અને અલયકુમાર આર્દ્રમુનિને વંદન
કરી મનમાં તેમની પ્રશાંસા કરતા એમને સ્થાનકે ગયા. આર્દ્ર-
કુમારમુનિ પેતાના પાંચસો શિષ્યોના પરિવાર સહિત રાજ-
ગૃહ નગરે સમવસરેલા વીર ભગવાનને વંદના કરી, શુદ્ધ
ચરિત્ર અહણુ કર્યું. નિરતિચારપણે ચારિત્ર પાલન કરતાં અને
વીર ભગવાનની સેવાભક્તિ કરતાં પ્રાંતે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી
મિશે ગયા.

પ્રકરણ ત૨ મું.

પ્રસભચંદ્ર રાજ્યિં.

પોતનખુરના રાજી પ્રસભચંદ્રે મહાવીરસ્વામીના ઉપ-
દેશથી બોધ પામીને હીક્ષા અહણુ કરી. મહાવીર ભગવાન
સાથે વિહાર કરતાં કરતાં એકલા રાજગૃહ નગરના ઉદાનમાં
પથાર્યા. પ્રસભચંદ્ર રાજ્યિં માર્ગની એક આઙ્ગુઝે કાંચો-
ત્સર્ગપળે આત્મધ્યાનમાં મર્જન રહી ધર્મધ્યાનમાં લીન
થયા. ભગવાનનું આગમન સાંકણી રાજ શૈલિક-હાથી ઘોડા-
દિક ઋદ્ધ સાથે અરિહુંતને વંદન કરવાને ચાલ્યો. એના
સૈન્યની આગળ સુસુખ અને હુર્મુખ નામે મિથ્યાદ્રષ્ટિ એ
સેનાનીઓ ચાલતા હતા. એ સેનાનીઓએ ભગવાન પાસે
જતાં માર્ગની એક આઙ્ગુ ઉપર પ્રતિમા ધારણુ કરીને ઉભા
રહેલા પ્રસભચંદ્ર રાજ્યિંને જોયા. હુદ્ધર તપને તપતા એ મહા-
સુનિ એક પળે ઉભા રહી, ઉંચા બાહુ કરીને. આતાપના
કરતા હતા. સમસ્ત રાજઋદ્ધ છાડીને ડેવલ મોાસ્થને જ માટે
પ્રયત્ન કરતા એ સુનિને જોઇ સુસુખ નામે સેનાની બોલ્યો.
“ અહો ! આવી આતાપના કરનાર, હુદ્ધર તપ, હિયા અને
વિધિ કરનાર આ સુનિને રવર્ગ કે મોાસ જરાયે હુર્દાન નથી.”

સુસુખનું વચન સાંકળીને કર્મથી અને સુખથી તેમજ
નામથી હુદ્ધ એવો હુર્મુખ બોલ્યો. “ અરે ! એતું નામ લાંઠા
નહિ. એ તો પોતનનગરનો રાજ પ્રસભચંદ્ર છે. મોટા ગાડામાં

જેમ નાના વાછરડાને જોડે તેમ એણે પોતાના નાના ભાલકને
માથે મોટા રાખ્યનો બોલે મૂક્યો છે. એ તે કેવી જતનો
ધર્મ ! એના મંત્રીએ અંપાવતી દાખવાહુન સાથે મટી જઈ
એ ભાલરાજાને રાજભાઈ કર્યો. આણે તો રાજ્ય ઉપર ઉલટો
અધર્મ પ્રવર્ત્તાઈયો છે. નથી એની પત્નીએનું ડેકાણું, નથી
એના રાજનું ડેકાણું. આવા માણુસનું તો મેં પણ જેવા
ચોંગ નથી.”

એ સુસુખ અને હુમુંખની વાતચીત પ્રસન્નભાગદરાજાએ
સાંખળી. ધર્મદ્યાનમાં મળન રહેલા પ્રસન્નભાગ સુનિની ધર્મ-
ભાવનાએ પલટો આધ્યા. એ વાણીથી, કર્મથી અને નામથી
પણ હુમુંખ સેનાનીના વચ્ચની અસર સુનિ ઉપર પણ હુષ્ટ-
પણે થઈ. “ અહો ! મારા હુષ્ટ મંત્રીએ એટલી વારમાં જ
એવજ્ઞા થઈ ગયા. આજ સુધી, ભાલકની પેઠે મેં એમને રમા-
ડી, જમાડી, કુલરાંયા છે, સતકાર્યા છે, તેનો શું આ બદલો ?
મારા પુત્ર સાથે શું એમણે હળે કર્યો ? મારા પુત્રની જગાએ
હું હોત તો ધાણી જ આડકરી શિક્ષા તેમને કરત ? ”
પેલા હુમુંખની વાણીથી જેમની વિચારશૈલી લપ-
ટાઈ ગઈ છે એવા પ્રસન્નભાગ રાજધિ આર્તોરાં-
ધ્યાનમાં પડી ને પોતાનું પ્રત પણ ભૂલી ગયા. પોતાને
રાજતરીકે માનતા પ્રસન્નભાગ રાજધિ પ્રતને ભૂલી મનથી
સ્વયમેવ ચુદ્ધ કરવાને પ્રવર્ત્યા. તે મંત્રીએ સાથે ચુદ્ધ કરવાને
લાગ્યા. તેવામાં શૈલિકરાજ તેમની પાસે આવ્યો. પ્રસન્નભાગ

રાજધિને ઓળખી એ મહામુનિને વંદતા, વતની અતુમોહના કરતા. તેમના ધ્યાનની મશાંસા કરતા શ્રેણીક ભગવાન મહાતીર પાસે આવ્યા.

ભગવાન મહાતીરને નમી, વંદન કરી, હાથ લેડી સ્તુતિ કર્યા બાદ ભગવધપતિ આવ્યા. “પ્રલુ ! જ્યારે મેં પ્રસન્નચંદ્રા-જર્દિને વાંદા લારે પૂર્ણ ધ્યાનમાં મર્જન હતા. ભવિતવ્યતા ચોંગે તે સમયે જો તેઓ કાલ કરે તો કયાં જાય ? ”

શ્રેણીકના જવાબમાં ભગવાન આવ્યા “શ્રેણીક ? સાતમી નરકે જાય ? ”

ભગવાનનાં વચન સાંભળી શ્રેણીક વિચારમાં પડ્યા. “સાધુ નરકે તેં જાય નહિ છતાં પ્રલુ આમ કેમ કહે છે ? શું મારા સાંભળવામાં કંઈક ભૂલતો નથી થતી કે મારા સાંભળવામાં ઘરાખર આંદ્રું નથી. ઇરી પૂર્ણિને ખાતરી કરી વૈવાહે ? ”

વિચાર કરી ફરીને પૂર્ણયું. “ભગવાન ! પ્રસન્નચંદ્રમુનિ આ સમયે કાલ કરે તો મૃત્યુ પામીને કયાં જાય ? ”

“સર્વાર્થસિદ્ધ વિમાને જાય.” ભગવાને કહું

“પ્રલુ ? આપે એ જુદી જુદી વાત કેમ જણ્ણાવી ? ” શ્રેણીકે પૂર્ણયું.

“ધ્યાનના લેદથી. શ્રેણીક ”

“ભગવાન ! જરા સ્પષ્ટતાથી કહો કે એમ કેમ વાર્ઝ ? ”

“ પ્રથમ તારા હુર્માખ સેનાનીની વાણીથી મુનિ કોપ પાઢ્યા હતા. એ કોપને વશ થઈ તેના ભંગી સામંત વગેરેની સાથે કોધથી જ મનમાં યુદ્ધ કરતા હતા. જે વખતે પૂર્વું કોધમાં હતા તે સમયે તમે એમને વંદના કરી હતી, અને નરકના દળીયાં પણ પૂર્વું રીતે તેમણે મેળગ્યાં હતાં. ત્યારપછી મનમાં યુદ્ધ કરતાં કરતાં એમનાં આયુધો ખુટી ગયાં. રણ્ણસંશ્રામમાં પોતે શાખ રહિત થયા ત્યારે માથાનો મુગટ ઉપાડા શરૂ ઉપર મારવાને ધરયા. એવા વિચારથી માથા ઉપરથી જેવા તે મુગટ લેવા ગયા ત્યાં તો માથે કંઈ ના મલે. એ કેશ કવચ અને મુગટ રહિત મસ્તક તેમજ શરીર નિષ્ઠાળતાં તેમને બ્રતનું ભાન થયું.

એ માનસિક યુદ્ધ થકી નિવતી^१ પક્ષીનાપ કરવા લાગ્યા “આહા ! અને ધિક્કાર છે. મેં આ શું ચિત્તગ્યું ? આખું રોક્કધ્યાન ચિત્તવી મેં મારા આત્માને દુખાંયો છે. હવે મારું શું થશે ? ” પાપની આલોચના કરતા, અને ધર્મધ્યાનમાં લીન બનેલા પ્રસંગચંદ્ર રાજ્યિ પોતાના આત્માની નિંદા કરતા પાછા પ્રશસ્ત ધ્યાનમાં ભગ્ન થયા. પાપની આલોચના, પ્રતિ-કુમણું વગેરે કરવા લાગ્યા. એમ કરતાં કરતાં તમારા ધીજા પ્રક્ષ વખતે એ સર્વાર્થસિદ્ધ યોગ્ય થઈ ગયા હતા. “ ભગવાન મહાવીર શ્રેણિક ભૂપતિને સમજાવતા હતા. એટલામાં હેવ હુંકંબિ એમના સાંભળવામાં આવ્યો અને ધીજા પણ એવા

કેલકુલ શરૂદો સાંભળવામાં આવ્યા. જેથી શ્રેષ્ઠું કાગવાનને પૂછ્યું: “ ભગવાન् ! આ શું થયું ? ”

“ ક્યાનમાં સ્તિર રહેલા અને સ્વાર્થસિદ્ધ વિમાનને ચોઅય કરેલા પ્રસન્નાંદુનિને હાલમાં કેવલજાન ઉત્પન્ન થયું-છે. એ કેવલજાનને મહીમા કરવાને હેવતાઓ આવ્યા છે. તેમનો આ હુંદુંબિમિશ્રિત હર્ષનાદ થાય છે. ”

“ ભગવાન ! આપની પછી કેવલજાન કયારે ઉચ્છેદ પામશે. ” શ્રેષ્ઠ નરપતિએ ભગવાનને પૂછ્યું.

શ્રેષ્ઠ ભૂપતિએ ભગવાનને જયારે એ વાત પૂછી તે સમયે અણુ હેવલોકના ઈન્દ્રનો સામાનિક હેવતા પોતાની ચાર હેવીઓ સાથે ભગવાનને નમવાને આવ્યો, તેની તરફ આંગલી ચીંધીને ભગવાન છોલ્યા. “ આ પુરૂષ થકી કેવલજાન ઉચ્છેદ પામશે. ”

ભગવાનની વાણી સાંભળી શ્રેષ્ઠ વિચારમાં પડ્યા. “ શું હેવતાઓને કેવલજાન થઈ શકે છે કે ભગવાને આ હેવતાને ખતાવીને કહ્યું. ” પ્રગટપણે શ્રેષ્ઠું ભગવાનને પૂછ્યું: “ ભગવાન ! શું હેવતાઓને કેવલજાન થાય છે કે ? ”

“ હેવતાઓને કેવલજાન થતું નથી પણ આ હેવતાજથી સાતમે દ્વિસે બ્યાવી તમારા નગરમાં દૃષ્ટબદ્ધ બ્યવહારીયાનો પુત્ર થયો. તે મારા શિષ્ય સુધર્માનો જંયુ નામે શિષ્ય થશે.

તેને કેવળજ્ઞાન થયા પછી એનું કોઈ કેવળજ્ઞાન ઉપાડ્યાન કરી શકશે નહિએ. ”

શ્રેષ્ઠિક મહારાજ એ હેવના તેજ તરફ નિહાળી રદ્ધો. “ વ્યવનકાલ સમીપમાં આવે ત્યારે હેવતાઓની કાંતિ જ્ઞાનિ પામે છે, તેમ તેઓ મોહથી સુંઅયેતા હોય છે ત્યારે આ હેવતાનું તેજ તો અપરિમિત જણ્ણાય છે. ” શ્રેષ્ઠિકે ભગવાનને પૂછ્યું. “ પ્રભુ ! સાત દિવસમાં આ હેવ વ્યવી જવાનો છતાં તેનું તેજ તો મંદ પડેલું જણ્ણાતું નથી. ”

“ હાલ તો આ હેવનું તેજ મંદ જ છે. પૂર્વના પુણ્યથી પ્રથમ આતું તેજ આથી પણ ઉત્કૃષ્ટપણે હતું. ”

અસ્મેંદનો સામાનિક હેવ ભગવાનને વાંદીને પોતાને સ્થાનકે ચાલ્યો ગયો.



પ્રકરણ ૩૩ મું.

સમાચિત પરીક્ષા.

એક દિવસે શકેંદ્રની સલામાં સુધરમાર્પણિએ પ્રશાંસા કરતાં કહ્યું કે “શ્રેષ્ઠિક જેવો કોઈ શ્રદ્ધાળું નથી. ” તે વચનમાં અશ્રદ્ધાળું એવો હુર્દાંક નામે હેવ શ્રેષ્ઠિકની શર્દ્ધાની પરીક્ષા કરવાને આવ્યો. એણે કોઈયાનું સવરૂપ ધારણું કરીને ભગવાન પાસે આવી, પ્રણામ કરી હડકાયા ખાનની નેમ પ્રભુ પાસે

એઠો. ચંદ્રનની કેમ પોતાના પડ્થી પ્રલુના ચરણુને નિઃશાંક-પણે ચર્ચિત કરવા માંડ્યા. એ પુરુષની આવી અચોળ્ય વર્ત-શુદ્ધથી શ્રેષ્ઠિક કોધાયમાન થયો. “ અરે આ પાપી જગત સ્વામી પ્રલુની આશાતના કેમ કરે છે ? અહીંથી બહાર નીકળે કે જરૂર તેને શિક્ષા કરવી જોઈએ. ” એમ ચિંતવી એના સુભટોને એને પકડવાનો શ્રેષ્ઠિકે હુકમ આપ્યો.

એ અરસામાં પ્રલુને છીંક આવી એટલે કુષા ખોલ્યો. “મૃત્યુ પામો. ” રાજ શ્રેષ્ઠિકને છીંક આવી ત્યારે “ ધણું જીવો. ” એમ કહ્યું. અભયકુમારને છીંક આવી ત્યારે “ જીવો કે મરો. ” કાલસૌકર્યિકને છીંક આવી ત્યારે. “ જીવ પણ નહિ ને મર પણ નહિ. ” એ પ્રમાણે બિજીબાજી એ કુષીના કથનથી શ્રેષ્ઠિક અધિક શુદ્ધસે થયો. અને સમવસરણુથી તેના બહાર નીકળવાની રાહ જોવા લાગ્યો,

પ્રલુની દેશના સાંભળ્યા પછી દેશના સમાસ થતાં કુષી જેવો સમવસરણુમાંથી બહાર નીકળ્યો કે શ્રેષ્ઠિકના સુભટો તેને પકડવાને ધસ્યા. કુષીને ચારે બાળુઓથી ઘેરી દીધો, પણ એ સર્વના દેખતાં કુષી ક્ષણુવારમાં દિંય સ્વરૂપ ધારણ કરીને બાહ્યાશમાર્ગે ઉડી ગયો. સુભટોએ શ્રેષ્ઠિકને એ વાર્તા કહી સંભળાવી. વિસ્તમય પામતા શ્રેષ્ઠિકે એનો પરા-મર્શ ભગવાનને પૂછ્યો. “ ભગવાન ! એ કુષા કોણ હતો ? ”

“ એ કુષી એક દેવ હતો. ” ભગવાને કહ્યું.

“ ત્યારે એ કુદ્ધી શા માટે થયો હતું ? ભગવાન ! ”

“ તમારી પરીક્ષા લેવાને તે આવ્યે હતો . ”

“ તેણે પડ્ઢી આપની આશાતનો કરી , જો કે કેવાં અછને એણે એમ કર્યું . ”

“ વસ્તુતાઃ તો એ પડુ નહિ પણ ગોશીખ ચંદ્ર વડે તેણે મારા ચરણે અર્ચિત કર્યા હતા. પણ દાખિ મોહથી તમને તે પડુ દેખાતું હતું . ” ભગવાને કહ્યું .

“ ત્યારે પ્રભુ ! છીંકના સંબંધમાં જુહું જુહું રહસ્ય શું વારુ ? આપ છીંક્યા તો અપમાંગલિક બોલ્યો તે શું ? ”

“ મારી છીંકના સમયે તેણે કહ્યું કે મુત્યુ પામો એટલે તમે હજુ સુધી સંસારમાં કેમ રહ્યા છો ? શીઘ્ર મોઝે જાઓ. અનંત સુખના સ્વામી થાઓ એ તેના કહેવાનો આશય હતો. કુમાર માટે જીવો કે મર્દો. એટલે જો તે જીવશો તો ધર્મસાધન કરે ને મરી ગયા બાદ સર્વાર્થસિદ્ધ નામે અતુતર વિમાને જશે તેથી એણે એ પ્રમાણે કહ્યું હતું. કાલસૌકર્યિક માટે તે જીવશો તો પાપ કરશો ને મરશો તો સાતમી તરીકે જશે તેથી જીવ પણ નહિ અને મર પણ નહિ એમ કહ્યું હતું . ” ભગવાને ખુલાસો કર્યો.

“ ત્યારે મને એણે એમ કહ્યું કે ધણું જીવો ? ” રાજાએ પૂછ્યું.

“ તેનું કારણ તમે અહીં જીવો છો ત્યાં લગી જ સુખ છો . ”

“ એમ કેમ પ્રણુ ? ” રાજને પૂછ્યું.

“ કારણુ કે અહીંથી તમે મૃત્યુ પામી પ્રથમ નરક-
પૃથ્વીમાં ઉત્પન્ન થશો. ”

ભગવાનની વાણી સાંભળી શ્રેષ્ઠિકના હૈયામાં પ્રાસહે
પડ્યે. “ ભગવાન ! શું મારી નરકગતિ ! આપ સમાન
મારે માથે શુરૂ છતાં મારી નરકગતિ ! ”

“ રાજન ! પૂર્વે તે નરકનું આયધ્ય વલેજાપપણે બાંધેલું
છે, તેથી તું અવશ્ય નરકમાં જઈશ. ”

“ આ ભવમાં એવું તેં મેં કયું પાપકર્મ કરેલું છે કે
જેને ચોંગે મારી નરકગતિ દ્વારા ન થઈ શકે ? ”

“ નહિં, કદાપિ પણ નહિં. ચાદ છે પેલી ગર્ભવંતી
મૃગદીની કરેલી સત્યાનાશી ? એ નિરાધાર તરફકી રહેલી
મૃગદી ઉપર તને જરી પણ દયા આવી હતી કે ? તે સમયે
રૌદ્ર ધ્યાનમાં તું એટલો તો આગળ વધેલો હતો કે તારું ન-
રકગતન તેં વજાલેપ કર્યું હતું. હવે તો નિરૂપાય ! એ અર્ભ-
વંતી હરણી, એ મૃગદીનો ગર્ભ કેવાં કેવાં તરફકડતાં હતાં તે
જરી ચાદ કર. તારા સેવકો પણ તે સમયે તારા ખલનાં
વખાણું કરી તને રૌદ્રધ્યાનમાં આગળ ચઢાની રદ્દ્યા હતા. તે
સમયે તું ચુકી ગયો, મનુષ્યભવનની હાથમાં આવેલી બીજ
તું આણીને સમયે ભૂલી ગયો. ”

“ હા ભગવાનુ ! અચાવો ! મને નરકમાં જતાં કોઈ પણ રીતે અચાવો. મારું રક્ષણુ કરો. ”

“તારું નરકગમન એ તારે હાથે કરેલી શુદ્ધિસાનું ફળ છે. એનિકાચિત કર્મ લોગવ્યા વગર તારો છુટકો નથી. ચક્રવર્તીં, વાસુદેવો અરે ! અમારા સરખા તીર્થું કરો. પણ નિકાચિત કર્મો લોગવ્યા વગર છુટી શકતા નથી. પાપ કરતી વખતે શોંક ન થયો ને હવે શા માટે જોઈ કરે છે ? ” ભગવાને કહ્યું.

“અરે પ્રભુ ! નરકમાં જવાનું તે કોઈ પણ મન કરે છે ? કોઈ પણ અચાવનો માર્ગ બતાવો, કોઈ એવો ઉપાય બતાવો કે જેથી મારી નરકગતિ તુટી જાય. ”

“એ મારાથી કેવી રીતે બની શકે ? કર્મો તો જેવાં કર્યાં હોય તેવાં ફળ પણ લોગવવાં જેણાએ. શ્રી નેમનાથના શિષ્ય ભક્તા અવિરતિ શ્રાવક કૃષ્ણુ પણ ત્રીજુ નરક પૂર્ણીમાં ગયા; માટે જેવાં કર્મ કરેલાં હોય તેવાં અવસ્થય લોગવવાં પડે છે. ”

“ હા હતાશ ! પ્રભુ ! કંઈક તો માર્ગ બતાવો.” શ્રેષ્ઠિકે આખ્યાનું ચાલુ રાખ્યો.

“શા માટે આટલો અધ્યો શોંક કરે છે ? એવાં નિકાચિત કર્મોને અન્યથા કરવાને અમે પણ સમર્થ નથી, છતાં પણ તીર્થું કરની જહિતાના પ્રલાયે તું આવતી ચોનીસીમાં આ જ ભારતદેશેત્રમાં નરકમાંથી નીકળી મારા સરખી સ્થિતિવાયો. પણ નામ નામે પ્રથમ તીર્થું કર થઈશ. તીર્થું કરપણુંની લક્ષ્મી લોગવી શિવલક્ષ્મીને વરીશ. ”

“હા ! લગવાનું ! નરકનું નામ સાંબળીને હું કંપુછું તો ત્યાં તો મારી શું સ્થિતિ થશે ? કંઈ પણ ઉપાય બતાવો કે જેથી મારી રક્ષા થાય . ”

“ રાજજી ! એમાંથી બચવાને માટે કોઈ ઉપાય તો નથીજ, છતાં તારી શાંતિને માટે કહું છું કે તારી કપિલા ખાંધાણી પાસે તું હર્ષથી સાધુને દાન અપાવ, અથવા તો કાલ સાકશિક પાસે કસાઈનું કામ મૂક્ખાવ, તો નરકથી તારો મોક્ષ થાય . ”

પ્રલુનો ઉપદેશ હૃદયમાં ધારણું કરી શ્રેષ્ઠિક લગવાનને નમીને પોતાના સ્થાનકે આવ્યો. લગવાનને નમીને શ્રેષ્ઠિક પોતાના સ્થાનકે આવ્યો હતો. તે સમયે માર્ગમાં પેલા હર્દિરાંક દૂવે એની પરીક્ષા કરવાને ઢીમરનું કામ કરતા એક સાધુ બતાવ્યા. સાધુને ઢીમરનું કામ કરતા જોઈ રાજને પૂછ્યું, “ અરે સાધુ ! લગવાન મહાવીરનો ધર્મ પામીને તમે આ પાપ કાર્ય કેમ કરી રહ્યા છો ? ”

“ અરે ! મહાવીરના બધા સાધુઓ જ આવા મારા જેવા છે, તમે શું જાણ્યો ? ” પેલા સાધુએ કહ્યું.

“ મહાવીર લગવાનના સાધુએ તો ધર્મની નિશ્ચાયોત્તાનારા છે. તમારા જ હૃષકર્મનો ઉદ્દ્ય થયો છે, જેથી તમને આવી કુમતિ સુણ છે; માટે આવું હૃષકાર્ય, કરતા અટકો. ” સાધુને નિવારીને શ્રેષ્ઠિક ત્યાંથી આગળ ચાલ્યો તો

એક સગર્ણી સાધીની તેના જેવામાં આવી. જૈન શાસનની નિંદા થાય તે માટે સાધીને સમજાવી ગુંગ રાપ્યી.

શ્રેષ્ઠિકનું આવું શ્રદ્ધાયુક્ત કાર્ય જોઇ હુર્રાંડ હેવ પ્રસન્ન થયો. તેની આગળ પ્રગટ થઈ એલયો. “ રાજ્ઞી ! સુધર્માપતિએ જેવા તમને વખાણ્યા તેવા જ તમે છો. તમારું સમકિત ડોધનાથી ચળાવી શકાય તેમ નથી. ” એમ કહીને એક સુંદર હાર અને એ ગોળા શ્રેષ્ઠિક રાબને આપ્યા, અને કહું કે “ આ હાર તુરી જાય ત્યારે જે એને સાંધી આપશો તે ખૃત્યુ પામી જશો. ” હેવતા તરતજ અદૃશ્ય થઈ ગયો.

ગોવાને રથાનકે આવી શ્રેષ્ઠિકે તે હાર ચેલલણુંદેવીને આપ્યો. અથવા તો પસંદ કરીને ચેલલણુંદેવીએ એ હીન્ય અને મનોહર હાર લઈ લીધ્યા. પછી પેલા એ ગોળા નંદાદેવીને આપ્યા. એ તુચ્છ દાન મળવાથી નંદાદેવી ગુસ્સે થઈ. આહ ! હાર તો પણ રાણી ચેલલણુને, ને મને આ એ ગોળા રમવાને. શું હું તે નાની કીકલી છું કે આ ગોળા સાથે રમું ? ” એમ બોલતી નંદાએ પેલા એ ગોળા સ્થંભ સાથે અકૃળાવીને ઝોડી. નાખ્યા, તો એક ગોળામાંથી અંદ્રમા જેવાં એ કુંડલ નીકળ્યાં, અને બીજામાંથી દેશમી દેહીઓ માન એ વસ્તો નીકળી પડ્યાં. ખુશી થતી નંદાએ તે એ વસ્તુએ અહણું કરી, કેમકે જગતમાં મહાન જનોને અષુચિંતન્યા લાગ પણ મલી જાય છે.

નંદાદેવીને કુંડલ અને રેશમી વસ્ત્ર મહ્યાની વાત સાંલળી ચેલણ્ણાએ સભા પાસે તે વસ્તુની માગણી કરી. “ હે સ્વામિનું ? તે વસ્તુએ મને આપાવો ? ”

ચેલણ્ણાનાં વચ્ચન સાંસળી રાજ બોલ્યો. “ એ હવે ન બને, તેં જ પ્રથમથી હાર પસંદ કરીને લીધો છે. એ ગોળા તને ગમ્યા નહિ ત્યારે નંદાને આપ્યા. હવે એના કાળ્યથોળે અને એ વસ્તુ પ્રાપ્ત થઈ તે હું પાછી લઈ એ નહિ બને. એવી અનીતિ મારાથી કેમ થઈ શકે ? ”

“ મારી ખાતર એટલું કામ તમારે કરવું પડશે. શું તમારી મારા ઉપર આવી શુષ્ઠ જ પ્રીત છે કે આવું નાલવું કામ પણ તમે કરી શકતા નથી ? ”

“ એ કામ નાલવું નથી, પણ વિરોધ ઉત્પન્ન કરનારું છે— પરસ્પર કલેશ કરનારું છે. એક ચીજ બીજને આપ્યા પણી શુદ્ધ માણ્ણસ પણ પાછી માગતો નથી તો હું રાજ થઈને પાછી માણું ? વાહ શી તારી શિખામણું ! ”

“ શું ત્યારે તમારો મારી ઉપર આવો જ કૃત્રિમ સ્નેહ છે. વાહ ખુસ સારો સ્નેહ છે. એના વગર હું અંચીત મરી જઈશ. સમજયા ? ”

“ તારે ઝાંચે તે—ગમે તે તું કર, પણ તારી એવી શિખામણું હું કાંઈ અંગીકાર કરીશ નહીં. ” રાજને ચોકાણું પરખાવી દીધું. “ તારી ઉપર મારો સ્નેહ છે કે નહિ તે. કાંઈ

એ વસ્તુઓ તને લાવી આપવાથી જણુશો નહિ. તારી ઉપર મારે અખંડ સ્નેહ છે, છતાં તારી શિખવણીથી એવું અચ્યુત પગલું તો હું ન જ કારી શકું. ”

“ ત્યારે તમે મને સુઅલી જોવા છાંછો છો કેમ ? એ વસ્તુઓ વિના મારા પ્રાણ જતા રહેશે સમજ્યા. ”

“ તારી જીદુ ખોટી છે. એટા આથરુને વશથી અવિચારી પગલું ભરી તારે હાથે તું તારું અગાડે એમાં હું શું કરે ? ”

રાજના આવા જવાબથી ચેલવણ્ણા ગુસ્સે થઈને ચાલી ગઈ.

રાજએ તે પછી કપિતા પ્રાક્ષણીને બોલાવી આજા કરી કે—“ હે અદ્રે ! તું અભિનાની સાધુઓને બિક્ષા આપ. હું તને ધનથી ન્યાલ કરી દઈશ. ”

“ મને સુવર્ણમય કરો કે ચાહે તો મારી નાખો પણ એ મુનિઓને હું બિક્ષા આપીશ નહિ. ” કપિતાએ સાઝેસાઝે વાત કરી દીધી.

તે પછી કાલસૌકર્યિકને બોલાવીને રાજએ કહું. “ તું તારો જીવહિસાનો ધંધો છોડી હો. હું તને ઘર્ણું દ્રોય આપીશ. ”

“ તે કહિ નહિ અને. મારા ધંધામાં શું પાપ છે કે હું એનેછોડી દઉ ? ઉલદું એથી તો ઘણું મનુષ્યોનું પોષણ થાય છે. ”

“ એમ છે તો હું જોઉ કું કે તું કેવી રીતે પાંચસો પાડા-

નો રાજ વંધ કરે છે ? ” એમ કહીને રાજને સેવકો મારદ્દેતે અને અંધ કુવામાં લટકાયો.

રાજ શ્રેષ્ઠિકે પછી ભગવાન પાસે આવીને ફણું કે—“ હે સ્વામી ! મેં કાલસોકરિકને એક અડોરાત્રિ હિંસા કરતાં અટકાયો છે. ”

શ્રેષ્ઠિકનાં વચ્ચન સાંભળી ભગવાન ઓદ્યા. “ રાજ ! જેણું અંધારા કુવામાં પણ માટીના પાંચસે પાડા બનાવીને હણ્યા છે. ”

શ્રેષ્ઠિકે ત્યાં જઈને જેથું તો તે પ્રમાણે તેના જેવામાં આંધું, જેથી ખિજી ચિત્તવાળો થયો ને પદ્ધ્યાત્તાપ કરવા લાગ્યો. “ આહ ! મારાં એ પૂર્વકૃત કર્મને ધક્કાર છે ! હા ! અનાંદુથી અજ્ઞાનપણે મારા મૂર્ખ પાશવાનોની સોણતથી મેં કેણું હૃદકર્મ કરેલું છે કે જેનું ફ્રલ મારે ઘણ્ણો હાલ પર્યાત નરકમાં જઈને લોગવનું પડશે. મારા પાપમાં ભાગ લેનારા એ પાશવાનો મારી સાથે કાંઈ પાપનાં ઝળ લોગવા આપશે નહિ. એ પાપના ઝળ તો મારે એકલાએ જ પરલોકમાં જઈને લોગવાં પડશે. એ ભગવાનની વાણી કદાપિ પણ હવે અન્યથા થશે નહિ. ” અતિ પદ્ધ્યાત્તાપથી શ્રેષ્ઠિકને એહ તો ઘણ્ણો થયો પણ શું કરે ? હવે કોઈપણ ઉપાય નહોતો કે જે ઉપાયથી કરેલું અન્યથા થઈ શકે.

ઉદાસ થઈ ગયેલા શ્રેષ્ઠિકના મનમાં અનેક વિચારો ઉત્પન્ન થયા. “ ખ્યાત હું બારેકર્મી છું તેથી જ મને વિરતપણું

ઉદ્ઘયમાં આવતું નથી. ગમે તેવો તોય હું ભગવાનનો અવિરતિ શ્રાવક. અરાય પરચાખાણુ મને ઉદ્ઘ આવતું નથી. લેવાતું મન થતું નથી. શું કરે ? મારી નજર આગળ મારા ડેટલાય પુત્રોએ દીક્ષા અછણુ કરી, અભયકુમાર દીક્ષા લેવાને ઉત્સુક થઈ રહ્યો છે. પણ કાંઈક મારી સાથેના ઋણાતુંધનથી જ સંસારમાં રહ્યો છે; છતાં સમય અનુકૂલ થતાં એ ક્ષણમાત્ર સંસારમાં રહેશે નહિ. તે સિવાય મારી નજર આગળ ડેટલાય ઋદ્ધિ-સ્વરૂપું છોડી ચાલી નીકળે છે. આવા મહાત્મીર ભગવાનનો યેંગ છતાં વસ્તુને સમજયા છતાં મને દીક્ષાના મનોરથ થતા નથી, એ મારી મનોવૃત્તિને ધિક્ક છે. નરકમાં જવાતું હોવાથી જ મને વિરતિપણું ઉદ્ઘ આવતું નથી. પૂર્વે પણ કુણું મહારાજ નેમનાર્થ નેવા છત્ર છતાં દીક્ષા ન લઈ શક્યા. અને અવિરતપણે ત્રીજી નરક પૃથ્વીમાં ગયા. સુમર્થ છતાં એવા પુરુષની આવી ગતિ ! હા ! એ હુંકરને ધિક્કાર છે—એ આધ્યાત્મિકને ધીક્કાર છે !!!

પ્રકરણ ત૪ મુ'.

ચેલણું હેવીનો ગુરુસ્યો.

ગુરુસ્યે થયેદી ચેલણું હેવીનું મન અત્યારે કોધથી ધમધમી રહેલું હતું. “ આહા ! શું પુરુષોની સ્વાર્થતા ? આટલી આટલી એમની ઉપર મારી પ્રીતિ છતાં મારું આવું

નજું કામ પણ તે ન કરી શક્યા. એવા સંસારના કૃતિમ સંબંધથી જરૂરી. હવે તો હું મરીજ જાઉં. પણ શી રીતે મરી જરૂર ? ગણે ફાંસો ખાઈ મર્દું કે આપધાત કરું ? અથવા તો કુચે પડું કે જંપાપાત કરું. અથવા તો નીચે પત્થરની શિલા ઉપર પડતું મેલું કે જેર ખાઉ કે શું કરું ? ” વિચાર કરતી ચેલણ્ણા અંતઃપુરની નજુક હાથીશાળામાં આવી. હાથીશાળામાં આવી ઓળે ગણે ફાંસો ખાઈ પ્રાણોને કાઢી નાણવાની તૈયારી કરી. એટલામાં કંઈક ગરખડાટ એના કાન ઉપર આવ્યો. એક-તો ઝી જાત, તેની વૃત્તિએની ચંચળતા, કંઈક નવીન જોવામાં ઉત્સુકતા એમની તીવ્ર હોય છે. “શી ગરખડ છે ? ” એ જાણવાની એની ઉંડંડા વધવાથી તે આસ્તેથી તપાસ કરવા લાગી તો તેને ખખર પડી કે હાથીએનો ઉપરી મહાવત પોતાની માશુક સાથે વાતાવાપ કરી રહ્યો હતો. તેમની અન્યો-અન્યની વાતચીત સંભળવાની ચેલણ્ણાની ઉંડંડા વધવાથી શુંતપણે ઉભા રહી મનમાં વિચાર કરવા લાગી. “ હમણું તો આ લોકોની વાત સંભળવા હે, પછી અવસરને ચોગ્ય જણાશે તે કરવામાં આવશે. ”

આહીંચા મહાવત અને પેલી ઝી પ્રેમકલહ કરી રહ્યા હતાં. પેલી ઝી હુઠથી એની પાસે કંઈક વસ્તુ માર્ગી રહી હતી. મહાવત એને એનો આથડ છોડાવવા સમજની રહ્યો હતો, પણ ઝી-હુઠ હમેશાં ખૂરી હોય છે. એ પોતાની હુઠ સહેલાધીથી છાડી શકતી નથી. “ નહાલા ! શા માટે મારું કહેવું તમે

ગણુકારતા નથી ? હું કહું છું કે આટલું કામ તમારે કરવું જ પડશે. તમે નહિ કરો તો બીજું કોણું કરશે ? મારી આશા કહો, જીવન કહો કે મારું સર્વસ્વત્ત કહો. તે બધું તમારા વિના આજે કોણું છે ? તમારી સાથે મેં પ્રીતિ બાંધી હતી તે મોટી આશાએ સમજયા ? ” પેલી વેશ્યાએ કહ્યું.

“ મોટી આશા એટલે મને પુરો કરવાની એ જ તારી મોટી આશા કે બીજું કોઈ પ્રિયા ? એ મારાથી નહિ બની શકે સમજુ ? ” મહાવતે કહ્યું.

“ શા માટે નહિ બની શકે ? આવું નળવું કાર્ય પણ તમારાથી ન અની શકે તો બીજું કોઈ મહાન કાર્ય તો તમે શી રીતે કરી શકવાના હતા ? જોઈ જોઈ એ તો તમારી મતદાખી પ્રીત ”

“ તારું આવું કાર્ય તારે મન નળવું છે કેમ ? એ તો જાતે કરવાનો પ્રસંગ આવે ત્યારે જ ખખર પડે કે એ નળવું છે કે ગહુન કાર્ય છે. સ્વાર્થિધ માણુસોને વસ્તુની અવસ્તા કે વિશેષતાનો ઘ્યાલ રહેતો નથી. ”

“ નળવું નહિ તો બીજું શું ? ચેષ્ટાણદેવીના હારતું અપહરણ કરવું છે તે શું મહાન કાર્ય છે ? અને રાત્રીને સમયે તે કાર્ય તો તમે સહેલાધથી કરી શકો છો. કાણી રાત્રીએ આવું કાળું મૃત્ય તો ધણી જ સહેલાધથી થઈ શકે છે ? ”

“તા જરી તું જ આજે રાતના તૈયાર થઈ જાની ? જેણં તો અરે તારી મહીનગી કેવીક છે વારુ ? ”

“તો અને જે તમારા જેવા પુરુષ હોય તેઠા જીઓના મનોરથ પૂર્વામાં અમે શું પણત પડત કે ? પણ શું કરીએ અમે અખળા જાત, અમારાં હૈયાં નખળાં, અમારું કાવત અહૃપ, અમારી શક્તિ શી ? નહિતર તમને કહેત જ શું કરવા ? ”

“તો તારે માટે એવી ચોરી કરવા હું જનાર નથી. તું જણે છે એ હાર ચેલલણુંદેવીને ડેટલો બધો પ્રિય છે તે ? રાતના પણ એ પોતાની પાસેથી હુર નથી કરતી. એવા હીંય હારને ઉપાડી લેવો એ તો મોતને લેટવા જેવું છે.”

“શી રીતે મોતને લેટવા જવું પડે ? જે સંક્રાંતથી કામ કરશો તો એધી કોઈને ખખર પડવાની છે અને હું તો કોઈને કહેવા જવાની નથી. પણી ભય કોનો ? ”

“આખરે પાપ છાપરે ચઢીને પોકારે છે એ તને સ્વાધીને ખખર ન હોય. ચેલલણુંને પ્રિય એ હીંય હારની હું ચોરી કરું તો શ્રેષ્ઠિક મહારાજ પાતાલમાંથી પણ ચોરને શ્રેષ્ઠી કાઠયા વગર રહે ખરા ? ”

“શી રીતે એ શ્રેષ્ઠી કાઠ વારુ ? ”

“શી રીતે શું ? અભયકુમારની બુદ્ધિની હજુ તને ખખર નથી. એ બુદ્ધિએ આજ સુધીમાં અતિ મહાન કામો કરેલાં છે.

શું ચેત્વાણેલાં રાજનીતિનો કોકડાં એણે ઉકેદ્યાં છે. એની યુદ્ધિ-
એ કંઈ કંઈ ગુમ કેઢો ખુલ્લા કર્યા છે. પેલા આમૃહલના
ચોરને કેવી સફ્રાઇથી પકડ્યો, તે શું એટલી જ વારમાં ભૂલી
મધ્ય. તો પછી હારની ચોરી પકડવી એ એની યુદ્ધિને કંઈ
હુંકર વાત નથી. ”

પ્રચ્છન્નપણે ઉકેલી ચેત્વાણું દેવી આ બજેની વાતચીત
સાંભળતી હતી. પોતાના દીવ્ય હારને લગતી આ વાતચીત
હોવાથી ધ્યાનપૂર્વેક તે સાંભળતી હતી. એમની વાતમાં એને
રસ પડતો હતો. એ વાર્તાના રસમાં ક્ષાણકર ચેત્વાણું પોતાનું
હુંઘ પણ ભૂલી ગઈ. “ આહા ! શું ત્યારે વેરવેર સી-પુરુષોને
આવા જ અધડા છે. સીએ પુરુષોને પ્રેમથી વશ કરી એમની
પાસે કેવું ન કરવાનું કરાવે છે! જેમ હું કરવી રહી છું; પણ
ખરેખર સમનું પુરુષો જ સીએની અયોજ્ય માગણીને આધી-
ન થતા નથી. આ મહાવત જે કદાચ સીએ માગણી સ્વીકારે
તો નકળો પરીથ્યામે એનું મોત જ થાય; પણ જોવા તો હે.
એમની વાતનીત પૂરેપૂરી સાંભળવા તો હે. એ વાતચીતનું
પરિણામ શું આવે છે તે. ”

એ મહાવતના જવાણમાં વેશ્યા બોલી. “ તમે તો મારી
અધી દલીલો તોડી નાખો છો, ત્યારે શું તમે મને એ હાર
નહિ લાવી આપો ત્યારે ? ”

“ એ ના ! ના ! ના ! સો વખત ના ! તારે માટે હું
મરવા જઈશ નહિ. ભલી થઈને સમજ. આપણે ગરીબ

માણુસોને વળી એવા મોહ થા ? આપણી સ્થિતિમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. તને ખબર નથી મોટાની સાથે નાનો જય તો મરી જય નહિતો માંદો તો અવશ્ય થાય. હું તને હાથ જોડીને કહું છું કે તારો આશ્રણ તું છોડી હે.”

“ અરે ! એ હારમાં મારો એટલો બધો મોહ છે, તે તમને કેવી રીતે સમજાવું. ટીક કહું છું કે તમે મને લાવી આપો નહિતર જેના વગર મારું શું થશો ? એ તમે કયાંથી સમને ? ”

“ એના વગર તારું શું થશો ? શું તારું ભૂત્યુ થશો. અરે ભૂત્યુ કયાં રૈહું પડેલું છે કે તે તને અટ જોડી પડશે. બાબી થઈને તારીએ ફુરાશા તું છોડી હે.”

“ હાઃ ! અચીત મારું ભૂત્યુ થશો. તમે તો મશકરીમાં કહો છો પણ જ્યારે “મારું ભૂત્યુ થયેલું” જોશો ત્યારે જ તમને આત્રી થશો સમજન્યા ? ”

“ એમ, શું તેના વગર તું મરી જઈશ ત્યારે.”

“ અવશ્ય. તમે તો મરવાના હશો ત્યારે મરશો પણ હું તો એના વગર મારો પ્રાણ ત્યાગ કરીશ, એ નિઃસંદેહ છે.”

“ મારી આટલી ‘બધી આળજી છતાં, સમજાવટ છતાં, જો પુરે મરવું’ હોય તો હું નિરૂપાય છું. તું મરીશ તો મને શું જોયું જવાની છે. તું જઈશ તો મને વરવાને તારી એન બીજી જાવશે. એક જશો તો બીજી આવશે. તારી વગર મારું

ચાલ્યું જશો ? બધા ભલ ભલા વગર ચાલે છે તો તું મરી જતાં મારાં શાં રાજ રંડાઈ જવાનાં છે ? મરવું હોય તો તારે ખુશીથી મર. નિરાંતે મર ! એધડક મરી જો. ”

મહાવતનો જવાબ સાંભળી વેશ્યા ખસીયાણી પડી ગઈ. ‘મહાવત તો એનો જવાબ સાંભળ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. પેલી સી વિચારમાં પડી. “ શું ત્યારે મરી જઈ. અરે હું મરી જઈ તો એના બાપનું શું જાય ? ગમે તેવો તોચ એ પરાયે પુરુષ, મારી પાછળ એ આંસુય ન પાડે. અરે પરણેલો ધાણી પણ કી મરી ગઈ તો એમ સમજે છે કે જુતિ જુની હતી તે ગઈ ને નવી આવશે. પરણેલો પણ એક કી ગઈ કે થીજી લાવીને ખડી કરે છે તો આ તો ભાડૃતી પુરુષ. એની ગ્રીત તો વાદળની છાયા જેમ કથાં લગી રહેવાની, માટે હું મરીશ તો એને કાંઈ પોટ જવાની નથી. હું તો કાંઈ મરતી નથી, પણ હુને એ હારની ઈચ્છાને જેમ બને તેમ રોકવાનો પ્રયત્ન કરીશ.” પેલી સી પોતાની ધારણામાં નિષ્ઠળ જવા છતાં પણ એણે મરવાનો વિચાર મુલ્લતવી રાખ્યો. મહાવત જેવાએ પણ પોતાની પ્રયત્નમાનું અચોગ્ય વચન એની.

મહાવત અને તેની માશુકની એ પ્રમાણેની વાતચીત સાંભળીને ચેત્તણાના મનમાં પણ પરિવર્તન થવા માંડયું. મરી જવું કે કેમ ? મરવામાં લાભ છે કે જુવવામાં. આ મહાવત જેવાએ પણ પોતાની પ્રયત્નમાનું અચોગ્ય વચન એની.

ઉપર ગ્રીતિ છતાં અંગીકાર ન કર્યું, તો પણી મારો સ્વામી તો રાજ, એ મારું વચ્ચન કેમ અંગીકાર કરે ? હું મરણનો બય બતાવું તેથી શું એ કણુલ થઈ જાય. હવે અહીંથા હું મરી જાઉ તો એનું શું જાય. એને તો અંતઃપુરમાં મારા જેવી ધાર્યી રાખ્યીએ છે. એમના વિદાસોમાં મને તો એ સહેજ ભૂલી જાય, અને હું તો મારા જીવની જાઉ; માટે હાલમાં તો આ કીને વિચાર એ જ મારો પણ. આહ ! આજે જે આ મહાવત અને તેની માશુકનો ફલહ મારા જોવામાં ન આવ્યો હોત તો ખરીત હું કોધની મારી આપદાત કરી એસત ! કારણ કે અવિચારી કી વગરવિચારે આડુઅવળું કરી એકે છે ને પણી પદ્ધતાવે કરે છે, અને મારી પણ એ સ્થિતિ થાત; પણ જે થાય તે સારા જ માટે. ” ચેલણું હેવી મનમાં વિચાર કરતી ત્યાંથી પાછી કરી ને પોતાના સ્થાને ગઈ. એના હૃદયમાં હુંઘ તો ધણું ચ હતું પણ શું કરે. મરવાથી પણ લાભ નહોતો અને જીવતા રહેવાશે તો રાજની ગ્રીતિ પણ પાછી મેળવી શકાશે. વળી શુક્ષ્મામાં અકાળ મરણ કરવાથી જીવોની કેવી માઠી ગતિ થાય છે. એવા અકાળ મરણો કરીને સારા જીવો પણ અવગતિમાં ઉત્તરી જાય છે.

પ્રકરણ ઉપ મું.

રત્નકંબલ.

અન્યદા રાજગૃહ નગરમાં કોઈ પરદેશી વ્યાપારીએ. રત્નકંબલ લઈને વેચવાને આવ્યા. તેએ શ્રેણીક નરપતિ પાસે આવ્યા, પણ તેની કિંમત અધિક હોવાથી શ્રેણીક મહારાજ ખરીદી નહિ. તેએ ક્રતા ક્રતા શાલિભદ્ર શેડને ઘેર ગયા. ત્યાં ભદ્રા શેઠાણીએ એમની પાસેથી સોણે રત્નકંબલો મેં માગ્યા હામ આપીને ખરીદી લીધી. એકેક રત્નકંબલના એ એ દુકડા કરી શાલિભદ્રની જગ્યાસે વહુએને આપી લીધી. એ વહુએ તે રત્નકંબલો શરીરે ઝુંચવાથી પગ દુંધીને નિર્મિત્ય કરી લીધી.

શ્રેણીક મહારાજ પાસેથી રત્નકંબલવાળો પાછો ક્રવાની અભર ચેલલણું રાણીને પડતાં તેણે તરત જ શ્રેણીકને કહ્યું કે: “ મારે માટે એક રત્નકંબલ લાવી આપો.”

મગધપતિએ રત્નકંબલના વ્યાપારીએને યોલાવ્યા અને તેમની પાસે એક રત્નકંબલની માગળી કરી. તે વારે વ્યાપારીએ જવાબ આપ્યો. કે—“ હેવ ! રત્નકંબલો તો ખરી વેચાઈ ગઈ.”

વ્યાપારીએની વાણી સાંભળી શ્રેણીક આશ્ર્ય પામ્યો. “ ઓહા ! એટલી વારમાં ખરી વેચાઈ ગઈ. એકાદી ખરી-ફાનો પણ હું વિચાર કરતો હતો, ત્યારે એટલી વારમાં

સંઘળી રત્નકંખલોનો કોણું થાહક થયો ? ” શ્રેષ્ઠિકે વ્યાપા-
રીઓને પૂછ્યું.

“ મહારાજ ! આપના નગરમાં શાલિશક્ર નામે શેડ છે
તેની માતા ભદ્રા શેઠાણીએ બધી કંબલીએ અરીદી લીધી.”

વ્યાપારીનાં વચન સાંભળી શ્રેષ્ઠિકના આશ્ર્યમાં વધારે
થયો. “ શું શાલિશક્રની માતાએ બધી કંબલો અરીદી
લીધી ? ”

“ હા, મહારાજ ! મૈં માગ્યા લાખ લાખ સુવર્ણ
મહોરોના દામ આપીને તેમણે ખરીદી લીધી, ધન્ય છે આપની
નગરીને કે જ્યાં આવા શાહુકારો વસે છે. ”

“ આહા ! ધન્ય છે મને કે મારા રાજ્યમાં આવા
વ્યવહારીયાએ વસે છે. ” વ્યાપારીએ વિહાય કરી રાખ્યો
એક ચતુર માણુસને ભદ્રા શેઠાણી પાસે કંબલ લેવાને મોકલ્યો.
તે માણુસે ભદ્રા શેઠાણી પાસે આવીને એક રત્નકંખલની
માગણી કરી. “ મહારાજ શ્રેષ્ઠિક આપે ખરીદ કરેલી રત્ન-
કંખલોમાંથી એક રત્નકંખલ મંગાવે છે. આપને જે દામ એડા
ઢાય તે દ્યો અને એમાંથી એક રત્નકંખલ આપો ! ”

રાજપુરધના જવાખમાં ભદ્રા શેઠાણીએ કહ્યું “ રાજાને
જઈને કહો કે એ કંખળોના દુકડા શાલિશક્રની સીએને પગ
લુચ્છવા આપી દીધા છે, માટે જે એવા લર્ણ દુકડાનું આપને
કામ હોય તો લઈ કાવ. ”

ભદ્ર શેડાણીની વાણી સાંભળીને રાજપુરુષ ત્યાંથી રાજની પાસે આવ્યો અને રાજલુને તે ભદ્ર શેડાણીને સંદેશ કહી સંભળાવ્યો. રાજપુરુષનું વચન સાંભળીને વચમાં ચેહેરાણું બોલી “ જેયું ! તારામાં ને તેમનામાં કેટલું અંતર છે તે ? તમે એક કાંબલ ખરીદવા માટે વિચાર કરતા હતા, ત્યારે ત્યાં બધી ખરીદાઈ ગઈ અને એનો ઉપયોગ ગણું કર્યાં કરવામાં આવ્યો. પગ લુચ્છવામાં, શી તેની દોલત ? ”

રાજન્ય તે જ પુરુષને મોકલીને કૌતુકથી જેવાને શાલિકદ્રને પોતાની પાસે બોલાવ્યો. તે પુરુષે રાજનો સંદેશ ભદ્ર શેડાણીને કહી સંભળાવ્યો. તેના જવાબમાં ભદ્ર શેડાણી રાજ પાસે આવીને કહેવા લાગી. “ હેવ ! મારો પુત્ર ધરમાંથી બહાર પણ નીકળતો નથી, માટે આપ જ પોતે મારું ધર પાવન કરવાની કૃપા કરો. ”

શાલિકદ્ર સંખાંધી એક એકથી અધિક વાતો સાંભળતો શ્રેષ્ઠિક આશ્રીયં પામતો ગયો. ભદ્ર શેડાણીની તે વાત શ્રેષ્ઠી કે કણુલ કરી. અસુક સમય મહારાજને આવવા માટે નિયત કરવામાં આવ્યો. તે દરમિયાન ભદ્ર શેડાણી ઘેર જઈને રાજના આગમન માટે તૈયારી કરવા લાગી. એના સત્કાર માટે બધી બ્યલસ્થા કરી. શ્રેષ્ઠીકને આવવાના માર્ગ રાજદરભારથી તે પોતાના મકાન સુધી રાજમાર્ગની શોશા કરાવી. અનેક પ્રકારના તોરણો મણિ માણિક જડયાં, લટકાવ્યાં, અગર, તગર, અંદન અને હ્રૂર આદિકથી માર્ગો સુગંધી યુક્ત કરવામાં

આવ્યા, નિયત કરેલા સમયે રાજ પોતાના પરિવાર સાથે માર્ગની રચના જેતો જેતો શાલિબદ્ધને વેર આવ્યો.

શાલિબદ્ધના મહાનની અલૌકિક શોભાથી શ્રોણિક પણ મંત્રમુખ જેવો થઈ ગયો, જ્યાં સુપર્ણાના રથંથ ઉપર ઈરનીલ મણિનાં તોરણો ઝુલતાં હતાં, દૂર ભૂમિ ઉપર મોતીના સાથીઓની શ્રેણિઓ કરેલી હતી, સ્થાને સ્થાને દિવ્ય વસ્તુના ચંદ્રવાચો બાંધેલા હતા. એવી અનેક રચનાઓ જેતાં રાજને શાલિબદ્ધના ઘરમાં પ્રવેશ કર્યો.

મહાનની અલૌકિક રચનાઓ નિહાળતો શ્રેણિક ચાથી ભૂમિકાએ આવ્યો. ત્યાં એક દિવ્ય સિહાસન ઉપર બેસાડી ભદ્ર શેઠાણી શાર્વિલિને પોલાવવાને સાતમી ભૂમિકાએ ગયાં. ત્યાં સાતમી ભૂમિકાએ જઈ ભદ્ર શેઠાણીએ પોતાના પુત્રને કહ્યું. “ વત્સ ! શ્રોણિક આવ્યા છે તો તું જોવાને ચાલ ? ”

“ માતા ! એમાં આરું શું કામ છે ? જે મૂહ્ય આપવા ચીજ્ય હોય તે આપીને એને ખરીદી વ્યો. ” શાલિબદ્ધને જવાબ આપ્યો.

શાલિબદ્ધનો જવાબ સાંભળી માતાએ હસીને કહ્યું. “ વત્સ ! એ કાંઈ ખરીદવાનો પદાર્થ નથી કે મૂહ્ય આપીને અરીદ કરીયે; પણ જેતો આ રાજશૃઙ્હિનો તારો ને આપાં અગ્રા દેશનો માલેક છે. આપણે તેની પ્રણ છીએ. ”

ભદ્ર શોઠાણીનું વચન સાંભળી શાલિભદ્ર મનમાં હુભાયો.
 “ અરે મારા આ એક્ષયને ધિકડાર છે કે હજ મારે માથે
 પણ સ્વામી છે ! મારા પૂણ્યમાં હજ ખામી છે તો અહૃપ
 પુણ્ય વાળા આ સર્વના ફ્રણા જેવા લોગોથી હવે સર્વું હવે
 હું સત્ત્વર વીર અગવાન પાસે સંસારનો ત્યાગ કરી દીક્ષાને
 અથણ કરીશ.” હુભાયેલા શાલિભદ્રને ઉલ્કટ વૈરાગ્ય
 પ્રાણી થયો.

માતાના આશ્રહથી શાલીભદ્ર પ્રિયાઓની સાથે ચોથી
 ભૂમિકાએ આંદ્યો, વિનયથી શ્રેણિક મહારાજને પ્રષ્ટુત કર્યા.
 શ્રેણિક મહારાજે એને પુત્રની માદ્રક ઘોળામાં એસાડી આદિન-
 ગન દીધું. થાડીલારે ભદ્ર શોઠાણીએ કહ્યું. “ દેવ ! એને છાડી
 દ્યો, એ મનુષ્ય છતાં મનુષ્યના ગંધથી બાધા પામે છે.”

શાલિભદ્રને રજા આપતાં શ્રેણિકે કહ્યું. “ એનું કારણ?”

“ એના પિતા દેવલોકમાંથી પ્રતિ દિવસ એના લોગ માટે
 નવાળું નવાળું પેરી મોકલાવે છે. તેત્રીસ લોજન માટેની પછ
 વાજ વગેરેની, તેત્રીસ વસ્તુની ને તેત્રીસ આભૂષણુની. એ દેવ-
 લોગને લોગવવાથી-એનું શરીર પણ સુકુમાલ થઈ ગયું છે.”

શાલિભદ્રના ભાગ્યની વાત સાંભળી શ્રેણિક અધિકાધિક
 પ્રસન્ન થયો. શાલિભદ્ર તો પાછો સાતમી ભૂમિકાએ ગયો.

ભદ્ર શોઠાણીએ રાજને વિનતિ કરી કે “ આજે તો

આપે અહીં ચાજ લોજન લેવાની કૃપા કરવી. ” રાજને તે વાત સ્વીકારી.

ભદ્ર શેડાણીએ તરતજ રસોઈની તૈયારી કરાવી. રાજને સ્નાન કરવા માટે સુગંધ યુક્ત જલ તૈયાર કરાયું. તે જગથી રાજને સ્નાન કર્યું. સ્નાન કરતાં રાજના હાથની અંગુલી નિકળી પડી. રાજ તેને આમતેમ શોધવા લાગ્યો.

ભદ્ર શેડાણીએ દાસીને આજા કરી કે “ વાવમાંથી જલ બીજુ તરફ કાઢી નાખ એટલે મહારાજની વીંઠી અટ મળશો. ”

તે પ્રમાણે કરતાં આભરણોમાં પોતાની પ્રીકી જણ્ણતી વીંઠી રાજના જેવામાં આવી, તેથી આક્ષર્ય પામી રાજને પૂછ્યું:

જવાબમાં દાસીએ શાલીકદ્રનાં આ રોજનાં નિર્માલ્ય આભૂષણો સંબંધી હકીકત કહી સંભળાવી, “ હેવ ! શાલિકદ્ર રોજ નવાં નવાં આભૂષણો પહેરે છે. તેને બીજે દિવસે નિર્માલ્ય ગણ્ણી આ વાપિકામાં હેંકી દેવામાં આવે છે. એવાં કેગા થયેલાં આ શાલીકદ્રનાં નિર્માલ્ય આભૂષણો છે. ”

શાલીકદ્રની દાસીની વાત સંભળી રાજ વિચાર કરવા લાગ્યો. “ સર્વથા આ શાલીકદ્રને ધન્ય છે, ને મને પણ ધન્ય છે કે મારા રાજ્યમાં—જેના રાજ્યમાં આવા ધનાઠ્ય અને ભાગ્યશાળી પુરુષો વસે છે ”

શાલિભદ્રની ઓગણમૃદ્ધિથી વિસ્મય પામેલા એણિકે પરિવાર સહિત લોજન કર્યું. એ ઉત્તમ પ્રકારની રસવતી આરોગતાં પણ જમનારાચો પ્રસન્ન થયા.

જમીને ચખાસ્થાનમાં આવ્યા. તે ભદ્રા શોઠાણીએ રત્ન જડેલી સુવર્ણની રકાણીમાં પાંચ સુગંધીવાળાં તાંધુલનાં ઝીડાં લાણી રાણને આપ્યાં. દિવ્ય અત્તરાદિક વડે સત્કાર કરાણી વિવિધ પ્રકારના આભરણોવડે સર્વેનો સત્કાર કરવામાં આવ્યો. આવા વૈભવ ઠકુરાઈમાં પણ ગર્વરહિત ભદ્રા શોઠાણીનો વિનય વિવેક જોઇ રાણ મનમાં ઝુશી થયો. જતી વેળાએ રાણએ પણ ઉચિત થળ્હેમાં વિવેક કર્યો. “ હે ભદ્રે ! ? મારાથી તમે કાંઈ જુહાઈ જાણુશો નહિ. મારું રાજ્ય, સંપદા સંવેં કાંઈ શાલિભદ્રાનું છે એમજ જાણુને ને મારા લાયક કામ હોય તે અવશ્ય ફરમાવશો. તમારા આત્મીય માર્કેક મને પણ ગણુનો. ” એમ કહી શ્રેષ્ઠિક મહારાજ પોતાને સ્થાનકે ગયા.

જગતમાં પુણ્ય પણ કેવા પ્રકારનું હોય છે ? પુણ્ય તો શ્રેષ્ઠિક મહારાજનું પણ હતું ને શાલિભદ્રનું પણ હતું; પરંતુ શ્રેષ્ઠિક મહારાજનું રાજ્યપુણ્ય હતું ત્યારે શાલિભદ્રનું ઓગપુણ્ય હતું.



પ્રકરણ ઉદ્ધુ

ધીક્ષા શાલિકદ્ર.

શાલિકદ્રનું મન વૈરાગ્ય યુક્તા થવાથી એક સ્વી તજવા માંડી. ધીક્ષા લેવાની ભાવના એમની એટલી તો વધી પડી હે કયારે અત્રીસ હિંસ પુરા થાય અને પોતે મહાવીરસ્વામીના શિષ્ય થાય. તેમની ધીક્ષાની ઉત્સુક્તાથી શાલિકદ્રની ઐન સુભદ્રા શોક કરવા લાગી, જેથી સુભદ્રાના પતિ ધનનાએ એના શોકનું કારણ પૂછ્યું. સુભદ્રાએ રડતાં રડતાં ને ડચકાં ખાતાં પોતાના સ્વામીને કહ્યું. “ સ્વામી ! મારો ભાઈ શાલિકદ્ર રોજની એક એક સ્વી છોડે છે. સરવાળે અત્રીસે સ્વીએનો ત્યાગ કરીને એ ધીક્ષા અહુણું કરશે.”

“ તારો ભાઈ તો કાયર છે કે રોજની એક એક છોડે-છે. છોડવી તો સામઠી છોડી હેવી વળી ! ” ધનાએ સુભદ્રાને હુઃઅ ઉપર ડામ હેવા માંડ્યો.

ધનાની આવી વાણી સાંલળી તેની સ્વીએએ કહ્યું. “સ્વામી ! એ તો કહેલું સહેલું છે પણ કરવું એતો અતિ હુષ્કર છે. તમે કેમ છોડતા નથી ? ”

એ વૈરાગ્ય અને સુક્ષ્મિના રસીયા ધન્ય શોઠને આ સમયને ઉપયોગ કરવાની ઠીક તક મળી. “ હું નશીબદ્ધાર છું કે સ્વીએ જ મને જગાડી રહ્યી છે, માટે આવી અણુમોલ તક મારેજવા હેવી નહિ જોઇએ. એમ વિચારી તેણે કહ્યું “ વાહ !

તમે મને જગૃત કર્યો તે બહુ સારું કર્યું. અનુભૂતિસે આજથી મેં પણ આठે સ્વીચ્છાનો ત્યાગ કર્યો ને. હવે હું જગવાન પાસે દીક્ષા લેવાને જઉ છું. ”

જન.

ધ્રાની આવી વાણી સાંબળીને સંપૂર્ણ ડેઢવા લાગી. “ સ્વામી ! અમે તો મશકરીમાં વાત કરતી હતી. અનુકરીમાં કરેલી વાતો સારી કરવાની ન હોય. ”

“ મશકરીની વાતો પણ હું સત્ય કરી બતાવીશ. મને દીક્ષા લેવામાં તમે વિનિ રૂપ હતી તે પણ અનુઝળ થઈ તો હવે મને સંસાર છોડવામાં શી વાર છે ? સંસારના પદાર્થો નિરંતર અનિત્ય છે, માટે હું તો હવે દીક્ષા લઇશ. ” એમ ઓલતો ધ્રા શેઠ ઉલ્લો થઈ ગયો.

ધ્રાની દીક્ષા લેવાની ઉત્કંઠા જાણી તેની સ્વીચ્છા પણ તેની સાથે દીક્ષા લેવાને તૈયાર થઈ ગઈ. ધ્રાનો શેઠ પેતાની સ્વીચ્છા સાથે સાતે ક્ષેત્રોમાં ધનનો વ્યય કરી તેમજ હીનહીન જનોને પુષ્કળ દાન આપી મહાવીર પ્રભુની પાસે દીક્ષા લેવાને આપ્યો. તે સાંસળી શાલિકદે પણ જગવાનની પાસે આવીને પ્રત બહુષુ કર્યું. અનુઝળે ધ્રા શાલિકદ બહુશ્રુત થયા.

અડુગની ધારા જેવું ચારિત્ર પાળતા અને કિંચિત પણ અપેક્ષા વગર માસ, બે, માસ ત્રણ માસ, ચાર માસની તપશ્ચિયા કરતા હતા. એવી ઉચ્ચ તપશ્ચિયાથી તેમનાં શરીરનાં હાડ, માંસ, દ્વિધિર વળેરે શોષાઈ ગયાં હતાં. એકદા વિહાર કરતાં સેચો રાજગૃહ નગરે આવ્યા. માસખમણુના પારણાને

માટે બિક્ષા લેવા જવાને ભગવાન પાસે આજ્ઞા લેવાને આવ્યા. ભગવાને શાલિબદ્રને ઉદ્દેશીને કહ્યું. “ ભર ! આજે તમને તમારી માતાને હાથે પારણું થશે.”

ભગવાનનાં વચન અંગીકાર કરી શાલિબદ્ર ધન્ય મુનિની સાથે નગરમાં ગયા. ક્રતાં ક્રતાં તેઓ ભદ્ર શોઠાણીને ઘેર ગયા. બિક્ષાને માટે ગૃહના દ્વાર પાસે ઉલા રહ્યા, પણ તપસ્યાથી કૃશ અંગવાળા આ મુનિએ કોઈના ઓળખવામાં આવ્યા નહિ. થોડી વાર ઉલા રહીને તેઓ ચાલ્યા ગયા.

વ્યાચચિત્તવાળાં ભદ્ર શોઠાણી વીર ભગવાનને, શાલિબદ્રને ને ધના શોઠને વાંદવા જવાની આતુરતામાં તૈથારી કરી રહ્યા હતાં, જેથી કોઈનું ધ્યાન પેલા મુનિએ તરફ ગયું નહિ.

શાલિબદ્ર અને ધના મુનિ નગરના દરવાજમાંથી બહાર નીકળતા હતા, તે સમયે એક ગોવાલણું ધન્યા નામની સ્વી હહી, ધી વેચવાને નગરમાં જતી સામી મળી. શાલિબદ્રને જોતાં એ ગોવાલણના મનમાં અત્યંત ગ્રીતિ ઉત્પન્ન થઈ, જેથી અક્ષિતથી તેમને વંદના કરી દહી વહોરાંયું. મુનિએ ત્યાંથી આગળ ચાલ્યા ગયા.

શાલિબદ્ર ભગવાન પાસે આવીને અંજળી જોડી કહેવા લાગ્યા. ભગવાન ! આપના કથન મુજબ મારી માતા પાસેથી મને આહાર કેમ ન મહ્યો ? ”

શાલીભદ્રનાં વચન સાંભળી પ્રભુ આવ્યા. “ વત્સ ! એ દહી વહેરાવનારી પૂર્વભવની તારી માતા ધન્યા જ હતી.” એમ કહી ભગવાને એનો પૂર્વ ભવ કહી સંભળાંયો.

સંસારના આના નાટકથી જેની મોહમૂદુંઠણી ગઈ છે એવા શાલીભદ્ર સુનિ ગોચરી કરી, અણુશાણુ કરવાને તૈયાર થયા. ભગવાનની આજા લઈ શાલીભદ્ર સુનિ ધન્ય સુનિની સાથે વૈકારગિરિચર ઉપર ગયા. ત્યાં શિલાતલ ઉપર પ્રતિદેખના કરી અજો સુનિએ પાહોપગમ અનશન અંગીકાર કર્યું.

શાલીભદ્રની માતા અને શ્રેષ્ઠિક રાજ ભગવાનને વાંદવાને આવ્યા. ભગવાનને વાંદીને ભદ્ર શેડાણી શાલીભદ્રને જેવાં દ્વારાં પણ એ મહાસુનિ કયાંય જોવામાં આવ્યા નહિ. ત્યારે પ્રભુને પૂછ્યું. “ ભગવાન ! ધન્ય અને શાલીભદ્ર સુનિ કયાં ગયા ? તેએ અમારે વેર વહેરવાને માટે પણ ન આવ્યા ? ”

ભગવાને કહ્યું. “ તે સુનિએ તમારે ત્યાં વહેરવા આવ્યા હતા પણ તમે અહીં આવવાની વ્યાપ્તામાં હોવાથી તમારા જાણવામાં આવ્યા નહિ, ને તેએ આ તરફ આવતા હતા તે સમયે નગરના દરવાજી આગળ શાલીભદ્રની પૂર્વ ભવની માતાએ અકિલથી દહીં વહેરાંયું, તેના વડે પારણું કરી સંસારથી છુટવાને એ અજો મહાસુનિએ વૈકારગિરિ ઉપર જઈ હમણાં જ અનશન અંગીકાર કર્યું ” છે.

ભગવાનની વાણી સાંભળી ભદ્ર શેડાણી શ્રેષ્ઠિક મહા-

રાજ સાથે વૈસારગિરિ ઉપર ગયાં. ત્યાં તે ખજો મુનિઓ પાણા-
છુફડે ઘડેલા હોય તેવા સ્થિર રહેલા તેમના જોવામાં આંદ્રા.

પુત્ર અને જમાઈના કષ્ટને જોતી અને તેમના પૂર્વ
સુખનું રમરણ કરી ભદ્રા શોઠાણી સુંઝાઈ ગયેલી એકદમ
મૂચિંદુત થાઈ ગઈ. વનના મંદમંદ પવનની શિતલ લહેરોથી
તેમ જ શ્રેણીક મહારાજના પ્રયત્નથી સાવધ થયેલી ભદ્રા એ
મુનિઓનાં કષ્ટ જોઈ વિવાપ કરવા લાગી. હા વત્તા ! તમે
દેર આંદ્રા તે પણ મેં અભાગણીએ જાણ્યા નહિ. વધિ
વક્ત થાય છે ત્યારે શું બાકી રાખે છે ? અરે ! હીક્ષા લેવા
છતાં પણ મને આશા હતી કે કોઈ કોઈ હિવસે હું તમારું
દર્શન પામીશ કૃતાર્થ થાઈશ. તમે તો મારો એ મનોરથ
પણ વ્યર્થ કરવા એઠા. અરે ! હું શું કરું ? કયાં જાડુ ?
મારું હુદ્ધય કઠોર છે કે તમારું આવું કષ્ટ છતાં હું જોયા
કરું છું.”

એ મુનિને વંદી નિવાપ કરતી ભદ્રા શોઠાણીને સમ-
જવીને શ્રેણીક મહારાજે શાંત કરી. એહ ચિંતે શોઠાણી,
પોતાને સ્થાનકે ગયાં રાજ પણ ગયો. ને બન્ને મુનિઓ પણ
કાલ કરીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયા.



પ્રકરણ ૩૭ મું.

આ તે ચોર કે શાહુકાર ?

આજ ડેટલાક દિવસો થયાં રાજગૃહી નગરીમાં ચોરીએ.
 થયા કરતી હતી. સીપાઈ લોકો અને કોટવાલ એ ચોરને પકડ-
 વાનો અનેક પ્રયત્ન કરતા, છતાં એ ચોર વિદ્યાસિદ્ધ હોવાથી
 પકડાતો જ નહિ. પ્રતિદિવસની આવી સ્થિતિથી નગરીના લોકો
 કંટાળી ગયા. એક દિવસ શહેરનું મહાજન રાજ કને ક્ર્યાંહ
 કરવા આવ્યું. તેમણે રાજ શ્રેષ્ઠિક પાસે આવીને કહ્યું કે—
 “ સ્વામી ! તમારા જેવા સ્વામી જે પ્રજને હોય તે પ્રજને
 શા પીડા હોય છે ? છતાં આજે એક એવી જતના પીડા
 ઉલ્લી થઈ છે કે જેનાથી અમે ગ્રાસી ગયા છીએ. આખું
 નગર ગ્રાસી રહ્યું છે. તે પીડા એ કે કોઈ ચોર અહૃત્ય
 રહીને અમને હુંટી રહ્યો છે.”

મહાજનની ક્ર્યાંહ સંબળીને રાજ એ કોટવાલને બોલા-
 યો. અરે કોટવાલ ! તમે ચોર થઈને કે ચોરના સહાયક
 થઈને મારો પગાર ખાએ છો. કે શું ? કે જેથી મારી
 પ્રજા ચોરના ઉપદ્રવથી સુક્રત થતી નથી.”

રાજના જવાબમાં કોટવાલે કહ્યું. “ મહારાજ ! કોઈ
 દાહિણ્યોચ નામે ચોર નગરજનોને એવી રીતે હુંટે છે કે
 અમે તેને જોઈએ છીએ પણ તે પકડી શકાતો નથી. વાનરની
 જેમ ડેકી એક ક્ષણું માત્રમાં તે એક ઘેરથી છીજે હેંશ

પહોંચી જાય છે. નગરનો કિલ્લો પણ ઉલ્લંઘી જાય છે ને અમે તેના જવાના માર્ગ જધું છીએ તો તે જણ્ણાતો નથી. એક પગલા જેટલા હુર થયા કે અટ સો પગલાં અમારાથી તે હુર થધ જાય છે, માટે હેવ ! હું તો તેને હણુંવા કે પકડવા સમર્થ નથી. જોઈએ તો આ કોટવાલપણાનો પણો પાણો લઈ વ્યો. ”

કોટવાલની વાણી સાંભળી રાન્નાએ ભાગૃટીની સંજાથી અભયકુમાર તરફ નજર કરી. અભયકુમારે કોટવાલને કહ્યું કે “તમે ચતુરંગ સેના સંજજ કરી નગરની બહાર રાપો. જારે ચોર નગરની અંદર પેસે એટલે લશકરે ચારે બાળુએ હુરતું દૂરી બળબું ને અંદરથી ચોરને ત્રાસ પમાડવો એટલે ચોર સ્વયમેવ સૈન્યમાં આવીને પડશે. ત્યારે પ્રમાદરહિત સાવધાન એવા સુલાટોએ તરતજ પકડી લેવો. ”

અભયકુમારની આજા પ્રમાણે કોટવાલે નગર બહાર સૈન્યને રાખ્યું. થીજે હિવસે ચોરે જેવો નગરમાં પ્રવેશ કર્યો કે તરતજ સૈન્ય તેની પછવાડે થયું ને શાંકિત માણુસને ત્રાસ આપવા માંડયો. ચારે બાળુએ દૂરી વળોલા સૈન્યથી ચોર સપડાઈ ગયો. કોટવાલે અભયકુમાર પાસે તેને હાજર કર્યો.

શ્રેષ્ઠ મહારાજે અભયકુમારને ચોરને શિક્ષા કરવાનો હુકમ કર્યો. “આ ચોરને સુખતમાં સખત શિક્ષા કરનો. ”

અભયકુમારે કહ્યું. “જે કે આપણી યુદ્ધિથી તે સપદાઈ ગયો છે, છતાં તેની પાસે સુહ્ખામાલ કંઈ પણ નથી. સુહ્ખામાલ વગર કે કોઈ પ્રકારના પ્રમાણું વગર એને ચોર ગણી શિક્ષા કરવી તે ન્યાય વિરુદ્ધ છે.” જેથી અભયકુમારે તેને પૂછ્યું “તું કોણું છે ? અને કયાં રહે છે. ? ”

“ રાજગૃહી નગરીની સમીપમાં શાલીથામ નામે ગામ છે. ત્યાંને હુર્ગચંડ નામે કણુણી છું. કંઈ કાસ પ્રસંગે આપના શહેરમાં હું આવ્યો હતો, તેટલામાં આપના માણુસોએ મને પકડીને આપની પાસે હાજર કર્યો છે. બાકી હું નિર્દેષ છું ”

તે માણુસનાં આવાં વચ્ચેન સાંભળી શૈલ્યિક મહારાજ સહિત અભયકુમાર વિચારમાં પડ્યા. શું આ માણુસ સત્ય કહે છે?” તેની આત્રી કરવાને સીપાઠાઓને શાલીથામે તપાસ કરવાને મોદ્દયા. સીપાઠાઓએ શાલીથામ જઈને તપાસ કરી તો ગામલોકોએ કહ્યું કે “હુર્ગચંડ નામે કણુણી અહીંયા રહે છે, પણ તે ગામ ગયેલો છે.”

સીપાઠાઓએ આવીને તે વાત રાજને કહી સંબળાવી. “આહા! સારી રીતે કરાલો દંબ પ્રક્રા પણું જાણી શકતા નથી.”

અભયકુમારે ચોરને સપડાવવા માટે બીજુ યુક્તિ કરી. તે માણુસને ચંદ્રહાસ મહિરા પાદને મુર્ચિર્થત કરી હીથે. પછી તેને દેવહૃદ્ય વખ્તો પહેરાવી દેવતાના વિમાન જેવા મહા-

મૂર્ખ્યવાન રત્નોથી વિલૂષ્ટિ સાત માળના મહેલમાં શાખ્યા ઉપર સુવાડ્યો.

જ્યારે તેનો નિશ્ચા ઉત્તરી ગયો, તે વખતે જ્યાત થઈને આમતેમ જોવા લાગ્યો. તો આંક્ર્યા કરનારી અને આંખને આનંદ આપનારી સમૃદ્ધિ એના જોવામાં આવી. તે સમયે ‘જ્ય જ્ય નંદા જ્ય જ્ય બદ્રા’ એવા મંગળમય શાખ્ય કરતાં નરનારીએ તેના જોવામાં આવ્યા. તે નરનારીએ એને કહેવા લાગ્યાં. “હે ઉત્તમ પુરુષ! તમે અમારા સ્વામી થયા છો. આ ઉત્તમ વિમાનમાં દેવપણે ઉત્પજ્ઞ થયા છો, મારે ધ્રેચ્છપણે કીડા કર્યો, અમે તમારા હિંકર છીએ.”

આવાં ખુશામત યુક્તા ચાઢુ વચ્ચેનો સાંલળી રોહિણેય વિચાર કરવા લાગ્યો. “ શું આ હેવલોએ છે ? હું મનુષ્ય-દોકમાંથી ભરીને અહીંયા શું દેવપણે ઉત્પજ્ઞ થયો છું ? ” એવા વિચાર કરતા તેની આગળ તેમણે સંગીત શરૂ કર્યું.

એટલામાં સુવર્ણની છદી ધારણુ કરનાર એક પુરુષ ત્યાં આવ્યો. તેણુ પેલાં ગંધર્વ નરનારીએને કહ્યુ. “ આ તમે શું આરંભયું ? ”

“અમે અમારા સ્વામી આગળ અમારું વિજ્ઞાન કૌશલ્ય અતાવીએ છીએ.” ગંધર્વોએ કહ્યું

“એહુ સારું, કૌશલ્ય તમે સ્વામીને બતાવો, પણ પ્રથમ હેવલોએનાં આચાર તેમની પાસે કરાવો.” પ્રતિહારીએ કહ્યું.

“ અરે પ્રતિહારી ! નવા સ્વામીના લોકમાં અમે તો એ અધું ભૂલી ગયા. તે શું શું આચાર કરવાના છે? ”

“ અરે નવા સ્વામીના લોકમાં શું એટલું પણ ભૂલી ગયા? તમે કે જે પ્રથમ અહીં નવા હેવ તરીકે ઉત્પન્ન થાય તે ના વચ્ચનથી આ હેવતા છે કે નહિ તેની હું ખાતરી કરી લઈશ. જો હેવતા હશે તો સત્ય ઉત્તર આપીશ. અન્યથા અભય-કુમારનું કપટ જાણીને નેમ ઢીક લાગશે તેવો ઉત્તર આપીશ.

તેણે જેણું તો ઓ લોકોના પગ ભૂમિને અડતા હતા, આંઝે વારંવાર મટકું માર્યા કરતી હતી, પુષ્પમાલા ગલાનિ પામેલી હતી તેમજ શરીર પરસેવા સહિત હતું. એને ખાતરી થધ કે આ હેવતાઓ નથી પણ પોતાને સપદાવવા માટે અભયકુમારની એક ચુક્કિ છે.

પ્રતિહારીએ ઇરીને પૂછ્યું. “ શું વિચાર કરો છો? જેણું હોય તેવું આજે અહીંથાં પ્રથમ પ્રગટ કરવું જોઈએ. ”

“ તારું કહેવું સત્ય છે. પૂર્વે મેં ધણાજ સુકૃત્યો કરેલાં છે. સામુદ્રાને સુપાત્રે દાન કરેલા છે. જિનેશ્વરની ભક્તિ કરેલી છે, જિનબિંબ ભરાવ્યા છે જિનચૈત્યો પણ કરાવેલાં છે, તીર્થયાત્રા, સદગુરુની સેવા વગેરે અનેક સુકૃત્યો કરેલાં છે; તેથી જ હું આવી સમૃદ્ધ પામ્યો છું. ” તે પુરુષે કહ્યું.

“ હવે જે કષ્ટકૃત્યો કર્યો હોય તે કહો. ” ઇરીને પ્રતિહારીએ કહ્યું.

“ સાધુઓના હુમેશાં સત્તસંગમાં રહેવાથી મેં એક પણ હુંજૂત્ય કરેલું નથી ” તેણે કહ્યું.

“ એક સરખા સ્વભાવથી આપો જ-મ કાંઈ વ્યતીત થતો નથી, માટે જે કાંઈ ચોરી, જરી વળે હુંજૂત્યો કર્યાં હોય તે પણ કહો. ”

“ જે એવાં હુંજૂત્યો કરેલાં હોય તો તે દેવલોકમાં આવે અરોકે આંધળો માણુસ શું પર્વત ઉપર ચઢી શકે છે ? ”

પ્રતિહારીએ તે સર્વ વાત અભયકુમારને કહી સંભાળી. અભયકુમારે તે વાત શ્રેષ્ઠિક મહારાજને કહી. એ વાત સાંભળીને શ્રેષ્ઠિક મહારાજ બોલ્યા. “આટ આટલા ઉપાયો છતાં જે ચોર તરીકે ન સપડાય, તેને છોડી સુકવો જોઈએ; કારણું કે નીતિનું ઉદ્વલંઘન કરવું ચોણ્ય નથી. ” રાજના એવાં વચન સાંભળી અભયકુમારે તે ચોરને છોડી મૂક્યો, કારણું કે વંચના કરવામાં ચતુર પુરુષોથી ડાઢ્યા માણુસો પણ ઠગાય છે.

અભયકુમારના પંજમાંથી સુકૃત થયેલા ચોરે વિચાર્યું: “ મારા પિતાના વચનને ધિક્કાર છે કે જેમનું વચન અંગીકાર કરીને મેં ભગવાનનાં વચન સાંભળવાની ઉપેક્ષા કરી; છતાં પણ અનાયાસે સાંભળવામાં આવેલું ભગવાનનું વચન મને કેટલું બધું લાભાદ્યક થયું. તો પછી એમનાં ઘણું વચન સાંભળવામાં આવ્યા હોતા તો કેટલો બધો લાભ થાય ? અહીંતના વચનનો ત્યાગ કરી ચોરની વાણીમાં

મં પ્રોતિ કરી તે સાડું તો નથી જ કર્યું. ” ઈત્યાહિ વિચાર કરતો તે ભગવંતના સમવસરણુમાં ગયો.

પ્રભુની દેશના સાંભળીને તે ખોલ્યો. “ પ્રભુ ! હું યતિ-ધર્મને ચોગ્ય છું ? ”

“ હા, તું યતિધર્મને ચોગ્ય છે. ” ભગવાને કહ્યું.

“ પ્રભુ તો હું ક્રતને અહણું કરીશ, પણ ત્યાર પહેલાં મારે શ્રેષ્ઠિક રાજને કંઈક કહેવાનું છે. ” તે માણુસનું વચન સાંભળી શ્રેષ્ઠિક સભામાં જ એકલો હતો તેમણે કહ્યું “ તારે જે કંઈ કહેવાનું હોય તે નિઃશાંકપણે કહે. ”

“ રાજનુ ! જે ચોારને પકડવાને માટે તમે આટલી બધી મહેનત કરી રહ્યા છો તે રોહિણીય ચોાર હું છું. તમારા નગરને હું જ હુંટી રહ્યો છું, પરન્તુ આ પ્રભુનું એક વચન સાંભળવામાત્રથી હું મોટી આદૃતમાંથી છટકી ગયો છું. ભગવાનના વચનથી વૈરાગ્ય પામેલો હું મારા શુન્દેં કહ્યુલ કરું છું, તેથી તમારે હવે ઓના કોઈ ચોારને શોધ-વો નાહા. મારી સાથે કોઈને મોકલો કે જેથી ચારીને તમામ માલ હું તેમને બતાવું. પછી દીક્ષા અહણું કરી મારો જન્મ સહ્યાલ કરું. ”

રોહિણીયનાં વચન સાંભળી શ્રેષ્ઠિક, અભયકુમાર તેમજ ઓના લોકો એની સાથે બયા. પર્વત, નદી, હુંજ, સમશાન વગેરેમાં જ્યાં ધન દાટેલું હતું તે સર્વે બધું બતાવ્યું.

અલયકુમારે તે સર્વ ધન જેનું હતું તેને સોંપી હીથું, કારણ કે નીતિના જાણુનારા નિર્દેખી મંત્રીએ ભર્યાડાનું ઉદ્દલન કરતા નથી.

પોતાના માણુસોને જે વાત કરવાની હતી તે સમાજી અગવાન પાસે આવ્યો. શ્રેણીક મહારાજે જેમનો નિષ્ક્રમણ મહોત્સવ કર્યો છે એવા રોહિણ્યોએ દીક્ષા: અહણું કરી. કઠળું તપશ્ચિર્યાં કરતો અને નિર્મભ ચારિત્ર પામતો રોહિણ્યું શરીરે કૃશાંગ થઈ ગયો.

વીર અગવાનની રણ લઈ વૈલારગિાર ઉપર તેણે પાદપોષગમન અનશન કર્યું. શુલ્ક ધ્યાનપૂર્વક પંચ-પરમેષ્ઠી મંત્રનું સમરણ કરતાં રોહિણ્યું સુનિ મનુષ્ય હેઠને તળું રૂપગંદોકમાં ગયા.



પ્રકરણ ઉચ્ચ મું.

કષ્ટો શાંતિકા.

ઓક હિલ્સ રાજદરખારમાં મગધરાજ શ્રેણીક રાજ-સિંહાસન ઉપર બીરાજમાન થયેલા હતા તે સમયે શ્વાસ-લેર ધસી આવતા ગુસ્યારો રાજસલામાં આવ્યા અને શ્રેણીક મહારાજને એ હાથ જેડીને અરજ કરી. “ હે ! માળવાનો રાજ બંધમધોત પોતાના ચૌડસામંત રાજાએ

સહિત પાણીના પૂરની જેમ રાજગૃહીને દૃધ્વાને ધર્યો
આવે છે. સસુરના મોળની માઝેક એના સૈનિકોના અથવી
રજથી આકાશ બધું વ્યાપ્ત થઈ ગયું છે. ચૌદ સામંત
રાજીઓ અને પોતે જ્ઞાને પંદર પરમાધાર્મિક હોય તેવો
એ કૂર રાજ શું કરશે તે સમજાતું નથી. ”

શ્રણિક હૃતની વાણી સાંભળીને મુંઝાયો. અભયકુમાર
સાથે એણે ખાનગીમાં મસલત કરી. “ અરે કૂર થહની
માઝેક આ હૃષ્ટને મારે ડેવી રીતે હઠાવવો ? આપણે એને
કાંઈ પણ કારણું આપણું નથી છતાં એ હૃષ્ટ અકારણ
વૈરી થયો છે. ”

“ એ મહોન્મત રાજ પોતાની ઉન્મતતાથી છટકી
ગયો છે, તેમજ તે યુદ્ધ જગાડી અનર્થ કરી રહ્યો છે.
અથે તે યુદ્ધ કરવા આવે. ”

“ પણ આપણે તેના વિશાળ સૈન્ય સાથે પહોંચી
વળવા માટે શું કરવું ? ઐશ્વર્યમાં આપણે તેની સમા-
નતા ડેવી રીતે કરી શકશું ? બણ, ઐશ્વર્યમાં જે અધિક
હોય તેને ડેવી રીતે મહાત કરવો ? ” રાજીએ કહ્યું.

“યુદ્ધથી મહાત કરવામાં યુદ્ધ પણ કામધેનું જેવી છે.”

અભયકુમારે શરૂના સૈન્યને પડાવ નાખવાની જગાએ
રાત્રીને સ્વભયે લોહની પેટીઓમાં સોનૈયા ભરીને હટાવ્યા.

પ્રધોતનું સૈન્ય રાજગૃહી ઉપર ધસી આંથું અને તે જ
ગામે પડાવ નાખ્યો. ને રાજગૃહીને ચંડપ્રધોતની આજાથી
ઘરી લીધી. ચંડપ્રધોતના ઘેરાથી રાજગૃહપતિએ નગરીના
દરવાળ બંધ કરાવ્યા.

અભયકુમારે એક વિધાસુ અને ચાલાક હૃત ચંડ-
પ્રધોત પાસે મોકલીને કહેવરાંથું. અભયકુમારને સં-
દેશો લઈને હૃત ચંડપ્રધોતની છાવણીમાં ગયો. શત્રુનો
માણુસ જાણીને ચંડપ્રધોતના સૈનિકોએ તેને પકડી લીધ્યો.
અને ચંડપ્રધોતની પાસે તેને હજર કર્યો.

ચંડપ્રધોતે હૃતને પૂછ્યું. “ મોલ, તું ક્યાં
જતો હતો ? તુમ જતો હતો ? ”

“ આપના પાસે હું આવતો હતો. ” હૃતે જવાણ
આપ્યો.

“ મારી પાસે ! શા માટે મારી પાસે ? ”
રાજાએ પૂછ્યું.

“ આપને એક શુભ સમાચાર આપવા, મુરશેલીના
સમયમાં આપને મદદ કરવા ”

“ અરે એવકુદે તું તે બઢે છે કે શું કરે છે ?
મને મુરશેલી ! એ મુરશેલીમાં મને મદદ કરવા ? ”
ચંડપ્રધોત આશર્ય પામ્યો.

“ હા આપને મદદ કરવા ? ”

“ હેઠળ હીવાનો જલ્દીય છે, પણ કહે તો ખરો કે તને ડોણે મોકદ્યો છે ? ” રાજાએ પુછ્યું.

“ અભયકુમારે. ”

“ કહે તારા સ્વામીનો શું સંદેશ છે. તે ? ”

“ આપને ખાનગીમાં બાતમી આપીશ. ”

રાજાએ પોતાની ખાનગી બેઠકમાં ફુતને યોલાવ્યો. અહીંથાં રાજ ચંડપ્રધોત એકદો હોવાથી એક લેખ કાઢીને ફૂતો ચંડપ્રધોતના હૃથમાં મૂક્યો અને કહ્યું: “ એકાંતે આપના હિતસ્વી અભયકુમારે આપની લંદગીં બચાવવાને માટે મહદુદ્દ કરવાનું આ કાગળ આપને લઈયો છે. ”

ચંડપ્રધોત રાજાએ અભયકુમારની મહેરાણાપવાળો લેખ વાંચ્યો. તેમાં લઈયું હતું કે “ શિવાહેવી અને ચૈહેલથ્યામાં હું કાંઈપણ લેહભાવ જોતો નથી, તેથી તમે પણ શિવાહેવીના સંબંધથી મારે માનવા ચો઱્ય છો; માટે હે રાજનું ! તમારું એકાંત હિત કરવાની બુદ્ધિએ જણું: પું કું કે તમારા ચૌહે સામંત રાજાઓને એણ્ણિક રાજાએ ઝુટવી હીથા છે. એ તમારા રાજાઓને સ્વાધીન કરવાને માટે એણ્ણિક રાજાએ પુષ્કળ સૌનૈયા મોકદ્યા છે, માટે લાગ જોઈને તમારા સામંતા તમને પદકી એણ્ણિક શાશ્વતે સોંપી દેશે ને પેલા સૌનૈયા લઈ દેશે. તેની ખાત્રી કરવા માટે તમે તેમના તંધુઓ નીચે ઘોડાવી જોનો. ”

પત્ર વાંચીને રાજ વિચારમાં પડ્યો. તેને એક રાજના આવાસ નીચે ચોદાંશું તો ત્યાંથી સોનેયા નીક-જ્યા. રાજ ચમક્ક્યો અને અખ ઉપર ચહીને ઉજજયિની તરફ પલાયન કરવા માફશું. તેના ભાગવાથી સાગર સમુદ્રિષ્ણાણ સૈન્ય પણ ક્ષેત્ર પામી ગયું. પ્રદોતના નાશબાથી એના સામંત રાજાઓ પણ આશ્ર્ય પામ્યા છતા એની પછિવાડે પલાયન કરવા લાગ્યા. એ સૈન્યમાં ડેટલાક મહારથી સમાન વીર પુરુષો હતા તે પણ પ્રદોતના નાશબાથી કાગડાની જેમ નારી ગયા; કારણ કે નાયક વગરના સૈન્યની એમ જ સ્થિતિ હોય છે, પ્રદોત રાજ વાયુવેળે અખ-વડે ઉતાવળે ચાલતો પોતાના નગરમાં પેશી ગયો. તેના સામંતો અને તેનું સૈન્ય પણ પછિવાડે નાશભાગ કરતું ઉજજયિની આવી પડેંશું.

પ્રદોતના નારી જવાથી મગધપતિએ ચોતાનું સૈન્ય એ છાવણીમાં છાડી મુક્ષું ને હાથી, ઘોડા, અવાહીર વળેરે જેટલું લુંટાય એટલું લુંટી લીધું.

ઉજજયિનીની રાજસભામાં પ્રદોત રાજ આગળ તેના સામંત રાજાઓ પણ સૈન્ય સહિત આવી પહોંચ્યા. તેમણે આવીને પ્રદોત રાજને કહ્યું. “ આ શું ? ”

પ્રદોતે પેલો કાગળ તેમના તરફ ઝેંક્યે. કાગળ વાંચી તેઓ મંત્રસુધ્ધ થયા. “ દેવ ! અમે તો આમાં

કાંઈ જાણતાનથી. અભયકુમારનું આ બધું ચાતુર્ય છે.”
સોગન ખાઇને તેઓએ ખાત્રી કરી આપી.

અભયકુમારે પોતાને ઠગ્યો હોવાથી પ્રદોત રાજ તેના
ઉપર ધણ્ણો ગુસ્સે થયો, તેમણે રાજસભામાં બીડુ કેરળયું.
કે “ જે અભયકુમારને બાંધી લાવીને મને સાંપણો તેને હું
ખુશી કરીશ.” એ બીડું અડપવાને કોઈ સમર્થ થયું
નહિ પણ એક ગાણ્યકાંચે તે બીડુ અડયું. “ હે દેવ ! હું
એને લીલામાત્રમાં તમારે સ્વાધીન કરીશ.”

“ ગાણ્યકાંતું” વચન સાંભળી રાજાએ તેને અતુમતિ
આપી કે તે કામ તું કર. તને જેટલી જોઈએ તેટલી
દ્રોયની સહાય હું કરીશ.”

પ્રદોતની આજા પામી ગાણ્યકા ઘેર ગઈ. એણે વિચાર
કર્યો કે “ અભયકુમાર બીજ કોઈ ઉપાયોથી પકડાશે
નહિ, તેથી ધર્મના ખણાને હું ઠગીને સપડાતું.”

રાજાની સહાયથી દ્રોયની મહદ મેળવી, કોઈ બીજ
એ યુવાન ઊંઘોની સહાય લઈને ત્રણે જાણી સાધી
પાસે રહીને જૈનના આચારવિચારને અભ્યાસ કરી
પ્રવીષ્ય થઈ ગઈ. સાધીની ઉપાસના કરતાં તે ત્રણે
ધણ્ણી ખુદ્ધિવાળી હોવાથી અદ્ય સમયમાં ખહુશુત થઈ ગઈ.

તેઓ રાજગૃહ નગરે આવી નગરની બહારના ઉધા-
નમાં પોતાનો નિવાસ રામી શહેરમાં ચૈત્ય જુહારવાને

માટે ચાલી. હર્ષન કરતાં કરતાં એક મંહિરમાં સેવા પૂજ કરી. કપટી શાવિકાએ માલકોશ રાગમાં પ્રલુની સુનિ કરવા માંડી.

બરાબર તે જ સમયે અભયકુમાર તે મંહિરમાં હર્ષન કરવાને આવ્યો. પેલી ખીની ભાવસ્તુતિમાં વિદ્ધ ન થાય એ માટે ક્ષણવાર તે બહાર ઉલો રહ્યો. તેઓ હર્ષન કરીને બહાર નીકળી એટલે અભયકુમારે તેમની સુખ-શાતા પૂછી. “ હે લદે ! કયાંથી આવો છો ? અને ક્ષણ છો ? ”

“ ઉજવિયિની નગરીના ધનાઢ્ય વ્યાપારીની હું વિધવા છું, અને આ બજે મારી પુત્રવધૂએ છે. કમ્ સંગેઝે તે પણ વિધવા થયેલી છે. તેમણે દીક્ષાની મારી પાસે રજ માગી, પણ મેં કહ્યું કે: “ આપણે સાથે દીક્ષા અહણુ કરીશું પણ હાલમાં તો તીર્થયાત્રા કરવા વડે આપણું દ્રોય સફેલ કરીએ. ” આમ વિચારી અમે તીર્થયાત્રા કરતા કરતા અહીં આવ્યા છીએ. ” પેલી કપટી શાવિકાએ કહ્યું.

“ વાહ ! તમાર જેવો સાધર્મિંકનો સમાગમ ભાગ્ય-થોગે જ થાય છે. તમારા હર્ષનનો લાભ થયો એ ઠીક જ થયું. આ સંસારમાં વિવેકીએને સાધર્મી સમાન કોઈ બંધુ નથી. આને તો તમે અમારાં જ અતિથિ થઇ જાએ, કારણું કે સાધર્મિંકનું આતિથ્ય તીર્થથી પણ અતિ પવિત્ર છે.

અભયકુમારનાં જવાણમાં તે કપટી શાવિકા બોલી.

“ તમારું કહેલું નો કે ચુક્કા છે, પણ આજે તો અમે તીર્થ-નિવાસ કર્યો છે, તેથી તમારા અતિથિ શી રીતે થઇએ ? ”

તેમની આવી વૃત્તિથી આધક ખુશી થયેલાં અભય-કુમારે કહ્યું. “ ઠીક ત્યારે આવતી કાલે પ્રાતઃકાળે તમે મારા મેમાન અવશ્ય થન્ને. ”

એક ક્ષણુભાગમાં પ્રાણી પોતાનો જન્મ પૂરો કરે છે, તો પછી હું પ્રાતઃકાળે આમ કરીશ ને તેમ કરીશ એમ સફણુદ્ધિવાળો મનુષ્ય કેમ યાલે ? ” પેલી શાબ્દિકા બોલી.

“ આજે તો ત્યારે હવે તેમ થાયો, આવતી કાવ કરીને હું આમંત્રણ કરીશ.” એમ કહી અભયકુમારે તેમને વિદાય કરી. ભગવાનનાં દર્શનનસ્તુતિ કરી પોતાને ઘર ગયો.

ઓદે દિવસે અભયકુમારે તેમને નિમંત્રણ કર્યું. ઘર હેરાસરમાં દર્શન કરાવી, લોજન કરાવી વચ્ચાલુષણુથી તેમનો સત્કાર કર્યો. સારી રીતે સંતોષ પમાડી તેમને વિદાય કર્યા.

એક દિવસે તે કપટી શાબ્દિકાએ અભયકુમારને નિમંત્રણ કર્યું. તેના નિમંત્રણને માન આપી અભયકુમાર તેમના ઉતારે ગયો. તે કપટી શાબ્દિકાએ અનેક રીતે રેની ભક્તિ કરી. ચંદ્રહાસ મહિરાથી ચુક્કિત જળનું પાન કરાયું, જેથી અભયકુમાર જમીને તેને ત્યાંજ તલકાળ સૂઈ ગયો—નિદ્રાને વશ થઇ ગયો; કાશણ કે નિદ્રા એ મદ્દપાનની

સહુચરી જેવી છે. એવી સ્થિતિમાં સ્થાને સ્થાને સંકટ કરી રાખેલા માણુસો માર્ક્ઝ્ટે અભયકુમારને ઉજગિયિની રવાને કરી દીધ્યો.

અભયકુમારની ભાગ નહીં મળવાથી શ્રેષ્ઠિક મહારાજે તેને શોધવાને ડેક ડેકાણે મનુષ્યો રવાને કરી દીધા. તેઓ શોધ કરતા પેલી કપટી શ્રાવિકાને ત્યાં આવીને પૂછ્યું. “ અભયકુમાર અહીં આવ્યા હતા તે કયાં ગયા ? ”

તોણીએ જણાવ્યું કે “ હા, અહીં આવ્યા તો હતા, પણ લોજન કરીને તત્કાળ ચાલ્યા ગયા છે. ” શોધનાર ત્યાંથી થીજે ચાલ્યા ગયા.

તે કપટી શ્રાવિકા પણ ત્યાંથી પોતાનો સરસા-માન ઉપાડી રવાને થઈ ગઈ, ને માર્ગમાં અભયકુમારને લેગી થઈ ગઈ. અવંતીમાં આવી પહોંચી, તે વેશ્યાએ ચંડપ્રદોતને અભયકુમાર સોંપી દીધ્યો. અને જે ઉપાયથી અભયકુમારને લાવી હતી તેનું બહાહુરીથી વેશ્યાએ વર્ષનું કરી બતાવ્યું.

પ્રદોત રાજાએ તેના જવાબમાં કહ્યું. “ તું આ ધર્મના વિશ્વાસી અભયકુમારને ધર્મના કપટથી પકડી લાવી તે કાંઈ ઢીક કર્યું નહિં. ”

તે પછી અભયકુમારને કહ્યું: “ સો વાતો કરનારા તારા જેવા નીતિનું પુરુષને પણ પોપટને જેમ મહારી પકડી લાવે તેમ આ સી પકડી લાવી. ”

“ રાજન ! તે અધૈણ તમારી બુદ્ધિનો પ્રભાવ છે કે જ્યાં આવી ચુંઠિથી જીએ દ્વારાએ રાજધર્મ વૃદ્ધિને પામે છે.” અભયકુમારે માર્મિક વચને કહ્યું.

અભયકુમારના માર્મિક વચનથી રાજ ચંડપ્રદોત શરણ માયો. કોધાયમાન થયેલા રાજએ અભયકુમારને કાષ્ટના પાંજરામાં નાખ્યો.

પ્રકરણ ઉદ્દ મું.

રાજકુમારી વાસવદત્તા.

માલવપતિ ચંડપ્રદોતના ફરખારમાં ચાર રત્નો હતાં. અનલગિરિ હાથી, લોહઙંધ હૃત, અજિનલીદ્ર રથ અને શિવા-દેવી રાણી એ ચાર રત્ન ગણ્યાતાં હતાં. રાજ વારંવાર લોહઙંધને ભૂગુંકબ્ધ નગરે મેછલતો હતો, જેથી લોકોને ત્રાસ થતો હતો એ ત્રાસમાંથી છુટવાને લોકોએ વિચાર્યું કેઅં હુદ્દ એક એક દિવસમાં પદ્ધતીસ નોજન આદીને આવે છે માટે એનો ઘાટ ઘડી નાખ્યો. રોજ રોજ નવા નવા હુકમો લાવી અમને ડેરાન કરે છે, તો ભડે એ યમપુરીનો મેમાન થાય ? ”

તેનો ઘાટ ઘડવાને એક દિવસે તેના ભાગમાં ભૂજું કાચ્છના લોકોએ વિષમિશ્રિત લાડુ મુકાંયા. ને સારા લાડુ હતા તે લઈ લીધા. ભાટુ લઈને લોહઙંધ અવંતી તરફ ચાદ્યો, હેઠલોક માર્ગ ઉલ્લંઘન કરી ગયા પણી ભૂખ

લાગવાથી તે ભાતુ ખાવાની તૈયારી કરવાં લાગ્યો. એટ-
લામાં રેને અપશુકન થયા. અપશુકનથી વહેમાચેલો તે
ભાતુ આધા વગર આગળ આવ્યો. તે આવાનો વિચાર
કર્યો, તો પાછા ફરીને અપશુકન થયા. વારંવાર અપશુ-
કન થવાથી મૃત્યુના અયથી ડરતો તે ઉજાયિનીમાં
આવ્યો. તે સર્વ વૃત્તાંત પ્રદોતરાને કહી સંભળાવ્યો.

પ્રદોતે અભયકુમારને બોલાવી પેલા ભાતાની પોટ-
લીની પરીક્ષા કરાવી. યુદ્ધિમાન અભયકુમારે પોટલી
સુંધીને તરતજ કહ્યું કે—“ આમાં તથાપ્રકારના વિષથી
દાખિલિષ સર્વ ઉત્પજ થયો છે કે જેથી આ પોટલી
છોડી હોય તો લોહબંધ દુઃખ થઈ જાત; માટે હે
આ પોટલીને અરણ્યમાં જઈને મૂકી દા. ”

એ દાખિલિષ સર્વની અભયકુમારના કથનથી તે પોટલી
યુક્તિ પૂર્વક અરણ્યમાં છોડી હીધી. ત્યાં દાખિલી વૃક્ષો
દુઃખ થઈ ગયાં.

અભયકુમારની યુદ્ધિથી પ્રસન્ન થએલા પ્રદોતે અભય-
કુમારને કહ્યું. “ હું તારી ઉપર પ્રસન્ન થયો છું, માટે
છુટા થવાની માગણી સિવાય બીજું કાંઈ વરદાન માગ. ”

“ હુલમાં એ વરદાન અનામત રાખો, વખત આવે
માગીશ. ” અભયકુમારે કહ્યું.

“ તથાસ્તુ. ” રાણે કહ્યું.

રાજને અંગારવતી રાણીથી ઉત્પજ્ઞ થયેલી વાસવદત્તા નામે કુંવરી હતી. યૌવનવયમાં આવેલી કુંવરી સ્વર્ણ કુળામાં પ્રવીષુ થઈ ગઈ, પણ માત્ર ચોંગ ગુરુ વગર સંગીતકળા તેની અધુરી રહી ગઈ. તેને માટે ચોંગ શિક્ષકની તપાસ કરવાને રાજને પ્રધાનને કહ્યું: “ આ આગામો સંગીત શીખવનાર ગુરુ કોણું થશે ? ”

“ જાણુ ગંધર્વની બીજી ભૂતિં ડેખ તેવો કોશાંભી નગરીનો ઉદ્ઘાયન રાજ છે તે સંગીતમાં પ્રવીષુ છે. તે આ આગામે બરાબર શીખવી શકે ? બહુકૃત મંત્રીએ કહ્યું.

“ પણ એ રાજને અહીયાં લાવવો શી રીતે ? ચુદ્ધ કરી એને પકડી લાવવો બીજું શું ? તે સિવાય બીજો રહ્યો તો જણ્યાતો નથી.” રાજને કહ્યું.

“ વિના કારણે ચુદ્ધ કરી અનેક લુચોની હિંસા કરવી તે ઉચ્ચિત નથી, પણ તેને અહીયાં લાવવા માટે એક ચુક્ષિત કરીએ. ”

“ અને તે ચુક્ષિત ? ” આતુરતાથી રાજને પૂછ્યું.

“ ઉદ્ઘાયન રાજ પ્રતિહિસ વનમાં સંગીત કરવાથી હાથીઓને મોહ પમાડે છે, ને તે જેમ જીતના ઉપાયથી હાથીઓને બાંધી લે છે તેમ આપણે પણ બાંધીને તેને લાવવાનો ઉપાય છે તે એક સાચા હાથીના જેવો એક કાઠનો હાથી જનાવવો. તેમાં યંત્રપ્રયોગ કરવવો કે

જેથી તે ચાલી શકે, એસી શકે વગેરે કિયાઓ કરી શકે. એ હાથીની મધ્યમાં શાસ્ત્રધારી પુરુષોને રાખવા, તેઓ યંત્રથી હાથીને ચલાવે. હાથીને જ્યારે વત્સરાજ પકડવા આવે ત્યારે અંદર રહેલા પુરુષો બહાર નીકળીને તેને બાંધીને અહીંથાં લાવે. એવી રીતે કુણજીમાં આવેલો ઉદ્ઘયન રાજ તમારી ફુહિતાને સંગીત શીખવશો. ”

બહુદ્ધિ અને બહુશુદ્ધ મધ્યાનોની આ ચુક્કિ માત્રવરાજને પસંદ પડી. તરતજ કાણ્ટનો હાથી બનાવ્યો, જેને વનમાં છોડે તો કોઈ જાણે નહિ કે આ કૃત્રિમ હાથી છે. માત્રવરાજે અંદર શાસ્ત્રધારી પુરુષો ગોઠવીને એ હાથી વનમાં છુટો મૂકુણમાં આવ્યો. હાથીને યંત્રપ્રયોગથી ફુરતાં વનચરોએ જોયો. એટલે વત્સરાજને તેના સમાચાર આજ્યા. ઉદ્ઘયન રાજ તેને બાંધી લેવાને વનમાં આવ્યો. પોતાના પરિવારને હુર રાખી પોતે સંગીત કરતો કરતો વનમાં પેઢો. પોતાના સંગીતથી માયાવી હાથીને મોહ પમાડતો તેની પાસે આવી કિંજરનો પરાભવ કરે તેવા મધુર સ્વરથી આલાપ કરવા લાગ્યો. જેમ જેમ ઉદ્ઘયન મધુર આલાપ કરતો ગયો તેમ તેમ હાથીના અંગમાં રહેલા પુરુષો હાથીને સ્તાખ્ય કરવા લાગ્યા. ગનેંદ્રને મોહિત થયેલો જાણી ઉદ્ઘયન હાથીની પાસે આવ્યો અને એક છલંગ મારી હાથીની ઉપર ચઢી એડો. એટલે તરતજ પ્રદોત રાજના સુલટોએ હાથીના ઉદરમાંથી બહાર નીકળી

વત્સરાજને પછી આંખી લીધો. એકાંકી નિઃશરૂ અને વિશ્વાસી ઉદ્યનને ઘેરી લીધો પણ તેણે હાંધ પરાક્રમ બતાયું નહીં.

સુભટોએ ઉદ્યનને માલવપતિની આગળ હાજર કર્યો. માલવપતિએ તેને કહ્યું. “ જે મારે એક આંખવાળી પુત્રી છે તેને તમે તમારી ગાંધર્વવિદ્યા શિખશો. તેને અદ્યાસ કરાવશો તો સુધે મારા ધરમાં રહી શકશો; અન્યથા કારાથણ તૈયાર છે. બોલો શું પસંદ છે ? ”

પ્રદોત રાજનું વચન સાંભળી ઉદ્યન વિચારમાં પડયો. “ હાલમાં તે કન્યાને અદ્યાસ કરાવવાવડે જ મારો કાલ નિર્ગમન થાઓ. આગળ પડશો તેથું હેખાશો. જીવતો નર ભાડા પામશો. ”

તે પછી પ્રદોત રાજ અંતઃપુરમાં ગયો, ત્યાં પોતાની પુત્રી વાસવદત્તાને પોતાની પાસે બોલાવીને કહ્યું. “વત્સ ! તારે માટે શિક્ષકની શોધ કરી છે, તે આવતી કાલથી તને સંગીત શીખવશો, પણ પ્રત્યક્ષ તું એને જેતી નહીં કારણું એ ડોઢીયો. છે તેથી તને એનો ચેપ ન લાગે માટે પડદામાં રહીને શીખજો. ” વાસવદત્તાએ પિતાનું વચન અંગીકાર કર્યું.

વત્સરાજ ઉદ્યને રાજભાગને ગાંધર્વ વિદ્યા શીખવવા માંડી. પ્રદોત રાજએ એક ધીજને ઠગેલાં હોવાથી

તેઓ એક બીજાની સામે જોતા નહિ. કેટલાક દિવસો વચ્ચમાં પસાર થઈ ગયા. વત્સરાજ ઉદ્ઘાયન પકડાઈ જવાની હકીકત કેશાંથી નગરીમાં પહોંચી ગઈ. નગરીમાં હાહા-કાર થઈ રહ્યો. પોતાના રાખને કેવી રીતે છોડવવો, એ માટે તેના મંત્રીએ વિચાર કરવા લાગ્યા. એ મહોન્મત્ત પ્રધોાતને પોતાના રાખને શા માટે પકડયો હશે, તે માટે અનેક વિચારો તે કરવા લાગ્યા. યોગાંધરાય નામે વત્સરાજનો મહા અમાત્ય હતો તે મહાયુદ્ધનિધાન ગણુતો હતો. પોતાના સ્વામીને મુક્ત કરવવા માટે તે અનેક યુક્તિએ કરવા લાગ્યો. એ સિંહના પંખમાંથી છોડવવો તે યુદ્ધ વગર ન જને માટે કોઈપણ યુક્તિથી છોડવવાને તે પુરતી તૈયારી કરી અવંતીમાં આંદ્યો. વત્સરાજની તપાસ કરતો, અને મુક્ત કરવાની ચિંતા કરતો યોગાંધરાય અવંતીમાં સમય વ્યતીત કરવા લાગ્યો.

વાસવદ્ધતાને ગાયનકળાનો અભ્યાસ કરતાં કેટલોક સમય વચ્ચમાં પસાર થયો. અન્યથા વાસવદ્ધતાને લુજાસા થઈ કે પોતાનો શુરૂ આવો કલાચાર્ય અને ગુણ નિષ્પત્ત છતાં એ કેવોક કોઈએ છે તે જોઉ તો ખરી. ! પોતાના શુરૂ કલાચાર્યના વિચારમાં જ તે નિમગ્ન હોવાથી શીખ-વામાં મંદ ઉત્સાહવાળી થઈ ગઈ. વત્સરાજના વારંવાર કહેવા છતાં એનું ધ્યાન રહ્યું નહિ, જેથી વત્સરાજે અવ-તિપતિની કુમારીને કહ્યું કે. “ અરે કાણી ! બરાબરુ શીખવામાં ધ્યાન કેમ આપતી નથી ? ”

પોતાને કાણી કહેવાથી અવંતીપતિની કુમારીએ ડોપ પામીને કહું કે. “ અરે કોઢીયા ! જરા સંભાળને તો આત્મ પોતાની જતને કુષ્ટિપણું છે એ તો જોતો નથી ને મને મિથ્યા કાણી કહે છે ? ”

રાજકુમારીનું વચન સંભળી વત્સરાજે વિચાર્યું. “ જેવી આ કાણી છે તેવો જ હું કુષ્ટિ છું, માટે બજેની વાત જોઈ જાણ્ય છે તો અવશ્ય હું એને જોજી. ” એવો વિચાર કરી અતુર ઉદ્ઘયને બજેની વચનમાં રહેલો ખડકો ફર કર્યો, તો વાદળમાંથી ઝુક્તા એવી નિર્મણ ચંદ્ર-દેખા સમી વાસવદત્તાને જોઈ. વાસવદત્તાએ પણ ક્ષાટેલ આંખે સર્વાંગ સુંદર ઉદ્ઘયનકુમારને જોગ્યો. બજે સુંદર હતા, ચુવાન અને રસ સરિતામાં ઝુલવાને આતુર હતાં. એક ધીજને જોઈને જાણે ઝુશી થયા હોય તેમ અરસ્પરસ મંદ સિમત કર્યું. એ સિમત એમના અતુરાગમાં વૃદ્ધિ કરનારં થયું. સર્વાંગ સુંદર ઉદ્ઘયનકુમારને જોઈ પ્રદોત-કુમારી જોડી. “ હે સુંદરી, મને ધિક્કાર છે કે મારા પિતાના કુટ વચનમાં વિશ્વાસ રાખી હું ઠગાઈ ને આ-ખને જોવાની પણ મેં ધ્રદ્ધા કરી નહીં. ”

“ બાળા ! તારા પિતાએ તને જેવી રીતે ઠગી છે તેમ મને પણ તું કાણી છો. માટે તારં મોં મારે જોતું નહિ એમ કણીને મને પણ ઠગ્યો છે. ઠીક થયું કે, આજે એ ભ્રમ બધો ફર થઇ ગયો. ”

“ સ્વાભાવિક આજે મને આપ કેવાડ કુણ્ઠ છે એ જોવાની આતુરતા થયાથી હું અક્ષ્યાત્માં મંદ ઉત્સાહબાળી થઈ, અને પરિધૂમે ભ્રમ થયો ખુલ્લી ગયો; પણ હવે તો તમે જે કલા મને શીખવી છે તે બધી તમારા ઉપયોગમાં આવો અર્થાત તમેજ મારા પતિ થાઓ.”
વાસવહૃતાએ અનુરાગપૂર્વક કહ્યું.

“ જદો ! હાલમાં તો અહીયાં રહેવાથી જ આપણો ચોગ થાઓ, પણ જ્યારે સમય આવશે ત્યારે હું તને હરી લઈશ.”

અરદ્ધપરસ પ્રીતિવાળાં તેઓનાં મન તે દિવસથી એક-મેક થઈ ગયાં અન્યોચન્ય આલાપ-સંલાપ કરતાં તેમના મનની સાથે શરીર સંખ્યાં પણ થઈ ગયો. એવીરીટે તેઓ સુખપૂર્વક પોતાનો કાલ નિર્મણન કરતાં હતાં, પણ તેમનું હાંપત્ર કોઈના જાણવામાં આવ્યું નહિ. માત્ર કાંચનમાળા નામે વાસવહૃતાની એક ધાત્રી જ તેમનું ચાસ્ત્ર જાણુતી હતી તેથી તેઓ પોતાનો કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યાં ને સંગીતકળાનો અપૂર્વ સ્વાદ લેવા લાગ્યાં.

એક દિવસ અનિદિગ્ય હાથી બંધનસ્થાનના સ્થંભને તોડી મહાવતોને પાડી નાખી છુટો થઈ ગયો ને નગરમાં ભમતાં નભરજનોને ઉપક્રમ કરવા લાગ્યો. મહાવતો રાજ પાસે ક્રીયાઈ કરવા આવ્યા કે “ હેવ !

અનિતગિરિ અંધનસ્થાનથી છુટો થઈ ગયો છે અને તે પકડાતો નથી માટે કોઈપણ ઉપાય તેને પકડો. ”

મહાવતની વાણી સાંભળી રાજ ચિંતામાં પડ્યો. તરત જ એણે અભયકુમારને બોલાવી પૂછ્યું કે “ આ તોઢાને અડેલા હાથીને શી રીતે વશ કરવો, તેને ઉપાય કરો. ”

“ ઉદ્યનકુમાર પાસે સંગીત કરવો તેથી તે વશ થશે. ” અભયકુમારનું વચ્ચન સાંસળી પ્રધાતને ઉદ્યનને આજા કરી. “ અનિતગિરિ પાસે જઈને સંગીત કરો. ”

ઉદ્યને વાસવદતાની સાથે હાથીની પાસે જઈને ગાયન કર્યું તે ગાયન સાંભળી હાથી સ્તરધ થઈ ગયો એટવે તેને બાંધી લીધ્યો. પ્રધોત રાજએ પ્રસ્તુથી અભયકુમારને ખીંચું વરદાન આપ્યું તે પણ પૂર્વની લેમ તેની પાસે જ થાપણું તરીકે રહેવા દીધું.

એક હિવસે મહર્દીએ નગરજનો અને અંતઃપુર પરિવાહ સહિત પ્રધોત સાંજ ઉદ્યાનમાં જતો હતો તે સમયે વત્સરાજનો પ્રધાન યોગાંધરાયણ પણ પોતાના સ્વામીને છોડાવવાના વિચાર કરતો માર્ગમાં ફરતો હતો. તેને આજ ઉપાય મળી જવાથી તે બુદ્ધિની ગરમી નહિ જરૂરી શકવાથી બોલી ઉદ્ઘ્યો: “ તે સુંદર અંગોપાંગવાળી કીને મારા રાજને માટે જ કાંઈ બદ્ધ તો હું યોગાંધરાયણ પણ નહિ ” કારણું કે જેવું

મનમાં હોય છે તેવું કવચિત વચનથી પણ નીકળી જાય છે. એ ગવીષ્ટ વચન બોલતા ચોગાંધરાયણુ ઉપર પ્રધોતન રાજની નજર પડી. તેણું એ ગવીષ્ટવાણી સાંભળી તેથી કટાક્ષપણે તેની સામે તે જેવા લાગ્યો. “ રખેને પોતાના સ્વામીનું તેથી અહિત થાય ” એમ વિચારી ચેદ્ધાઓથી હૃદયના ભાવને જણુનારા ચોગાંધરાયણુ રાજના મનની ડોપવૃત્તિ જાણી લીધી, જેથી તાત્કાલિક યુદ્ધમાં શીરોમણુ એવાં તેણું યુક્તિ શોધી કાઢી. પહેરવાનું વખ્ત કાઢી એણું માથા ઉપર મૂક્યું અને ગાંડા જેવો થઈ ગયો. પ્રેત જેવી વિકૃતિ-આકૃતિ કરતો, અનેક ચેદ્ધા-વિચેદ્ધા ને હાસ્યાદિક કરતો ભરત વગણું છે તેવો દેખાવા લાગ્યો. તેની આવી કુચેદ્ધા જોઈ તેને ભૂત વળગેલું ધારી રાજનો ડોપ શાંત થઈ ગયો ને ત્યાંથી આગળ ચાલ્યો.

સુંદર ઉધાનમાં જ્ઞાનગોઠો કરીને પરવાર્યા પછી ગાંધર્વવિદ્યાની કુશળતા જેવા માટે વત્સરાજ અને વાસવહૃત્તાને ત્યાં બોલાવ્યાં. આજનો અમૃહ્ય અવસર જોઈ વત્સરાજે વાસવહૃત્તાને કહ્યું “ પ્રિયે ! આજે વેગવતી હાથણી ઉપર ઐસી આપણુને નાસ્તી જવાની તક મલી છે માટે તું વેગવતી હાથણીને અફ્ફીયાં મંગાવ .”

સ્વામીનું વચન માન્ય કરીને વાસવહૃતાએ વેગવતી હાથણીને સર્જ કરીને મંગાવો. જ્યારે હાથણીનો તંગ ખાંખવા માંઝો તે સમગે હાથણીએ ગર્જના કરી. તેની ગર્જના સાં-

હાથણીને કોધ જેધીએ કહું કે “ સો ચોજન ગંયા પછી આ હાથણી મ્રાણુ છોડી દેશે. ”

હાથણીને તૈયાર કરો. પછી ઉદ્ઘયનની આજાથી હાથણીની અન્ને પડાએ તેના સુત્રના ચાર ઘડા આંદ્ધા. પછી વત્સરાજ, વાસવહતા, કાંચનમાલા અને વસંત મહાવત હાથણી ઉપર આડદ થયાં. ત્યાં તેનો મહાઅમાત્ય યોગાંધરાયણ આવી પહેંચ્યો. અને એલયો “ ચાલ્યા જાઓ, ચાલ્યા જાઓ. ” હાથની સંસારી ચેષ્ટા કરતો એલયો. વેગવતી હાથણી વેગથી ચાલતી કોશંખીને માર્ગે પડી.

તે પછી ‘આ વત્સરાજ વાસવહતાનું હરણ કરી જાય છે’ એમ ઉંચે સ્વરે એલતો યોગાંધરાયણ ચાલ્યો. અને વેગથી ચાલતી હાથણીને જોઈ સર્વ લોકો તે વાત સમજુ ગયા; કેમકે યુસપણે નારી જઈ ક્ષત્રીએ પોતાનું બત લોાપતા નથી.

બહાર ઉધાનમાં રહેલા પ્રદોત રાજને કાને વાત પહેંચી ગઈ કે વત્સરાજ ઉદ્ઘયન વાસવહતાને ઉપાડી ગયો છે એટલે તે ફોધથી ધમધમતો હાથ ધસના લાગ્યો.

મહાપરાઙ્કભી પ્રદોતરાજ અનિલગિરિ હાથીને તૈયાર કરાવી, તેના ઉપર મહાયોદ્ધાઓને એસાડી ઉદ્ઘયનને પડકાને રવાને કર્યો. પચીશ ચોજન ભૂમિનું ઉજ્જ્વલન થયું તે વારે અનિલગિરિ વેગવતીની પાસે: આવી પહેંચ્યો. ઉદ્ઘયને એ ભય-

કર હાથીને જોઈ પેલા મુત્રના ચાર ઘડામાંથી એક ઘડો ભૂમિ ઉપર પછાડી ફ્રેડી નાખ્યો, અને હાથણીને હંકારી મૂડી. હાથ-ણીનું ભૂત સુંધવાનો લાલચું અનિલગિર ત્યાં ઉલ્લો રહ્યો. મહા મહેનતે માવતે હંકારી તો બીજી વાર નજીક આવતાં બીજો ઘડો ફ્રેડી નાખ્યો. એટલે તેને સુંધવા માટે હાથી રેખાયો. એવી રીતે ચારે ઘડા ફ્રેડી નાખ્યા ને વત્સરાજે અનિલગિરની ગતિને સ્ખલિત કરી નાખી. ચાર કંકડે સેંઝન પૃથ્વીનું ઉદ્ઘાંધન કરી વત્સરાજ કાશાંણી નગરીમાં પહોંચ્યી ગયો. શ્રમિત થદ ગચેલી હાથણી પણ મરણું પામી. હાથી કાશાંણી નગરીની પડોશમાં આવી પહોંચ્યો, તેવામાં કૌશાંણીપતિના સૈનિકો સામે યુદ્ધ કરવાને આવ્યો. વત્સરાજનું સૈન્ય જોઈ અનિલગિરિના મહાવતે હાથીને પાછો વાળ્યો અને અવંતી લેણો કરી દીધ્યો.

ઠગાઈ કરીને વત્સરાજ પોતાની કન્યાને ઉપાડી ગયે દ્વારાવાથી ડેંપમાં થમ સરખો ચંડપ્રદોત યુદ્ધ કરવાને જરૂર થદ ગયો ને પોતાના સૈન્યને તૈયાર થવાનો હુકમ આપ્યો; પણ એના ભાક્ત અને ચાણુંકય મંત્રીઓએ યુક્તિપૂર્વક રાજને સમજાવ્યો. “ દેવ ! આવી બાબતોમાં યુદ્ધ શું કરવું ? ”

“ એવા હૃદને તો યોગ્ય શિક્ષા કરવી. ” રાજએ કહ્યું.

“ પણ મહારાજ ! આપની પુત્રીએ જ સ્વયંવરથી એને પસંદ કર્યો છે. વળી રાજકુમારીના કુમારતને પણ એ

હરનારો છે. બને પરસ્પર મીતિવાળાં છે. એવો સર્વીંગ સુંદર
ઉદ્યન જેવો જમાઈ આપને કયાંથી પ્રાપ થશે ? આપને
જમાઈ તો શોધવો જ પડશે તો પછી આનાથી અધિક જમાઈ
આપ કયાંથી મેલવી શકશો ? માટે આપ એને જ જમાઈ
તરીકે ભાન્ય રાખો. ” પ્રધાનોએ યુક્તિપૂર્વક રાજના ભગ-
જમાં ઠસાંયું.

પ્રધાનોનાં યુક્તિયુક્ત વચનથી પ્રધોત રાજ ખુશી થયો
ને તેણે હધંથી જમાઈપણાને ચોચય કેટલીક વસ્તુઓ મોકલી.

પ્રધોતરાજની આવી વર્તણૂકથી વત્સરાજ અને વાસ-
વહદા ખુશી થયાં. શુણીનું વિન્ન સોયથી ટળી જવાથી પોતા-
ના પુષ્યની પ્રશાંસા કરવા લાગ્યાં. પોતે નિર્વિદ્ધપણે સંસાર-
સુખ લોગવના લાગ્યાં.

એક દિવસ અવંતીમાં આગે હેખાવ દીધો. એ પ્રચંડ
આગ માટે અનેક પ્રથતો કર્યા છતાં એ આગ કાયુમાં આવી
શકે નહિ. પ્રધોતરાજએ એનો ઉપાય અભયકુમારને પૂછ્યો.
“ આ આગને કાયુમાં લાવવાને ઉપાય કહો. ”

જવાબમાં અભયકુમારે કહ્યું. “ આગનો ઉપાય આગ
છે, માટે બીજે કોઈ સ્થળો અધિન સળગાવો જેથી આ અધિ
શાંત થઈ જશે. ” રાજનો તેમ કહ્યું એટલે અવંતીમાં રહાય
શાંત થઈ ગઈ. પ્રધોત રાજએ પ્રસન્ન થઈ ત્રોણું વરદન
આખ્યું તે પણ અભયકુમારે નિર્ધાનની જેમ રાજની પાસે
થાપણ તરીકે રાખ્યું.

પ્રકરણ ૪૦ મું છે યુદ્ધિ કોઈના આપની?

એક દિવસે અવંતીનગરીમાં મરકીનો ઉપદ્રવ વર્ધી પડ્યો. એ મરકીના ઉપદ્રવથી નાસિત થઈ ગયેલી પ્રભાને બચાવવા પ્રધોત રાજાએ અનેક પ્રયત્નો કર્યો, પણ એકે પ્રયત્ન એનો સફલ થયો નહિ ત્યારે પ્રધોત રાજાએ અભયકુમારને કહ્યું. “અભયકુમાર! આ મરકીનો ઉપદ્રવ શી રીતે શાંત થાય ?”

પ્રધોતના જવાબમાં અભયકુમારે કહ્યું, “રાજન ! તમે અન્તાઃપુરમાં જાઓ. ત્યારે તમને દૃષ્ટિથી જે રાણી જીતી લે તેનું નામ મને આપનો.”

રાજ અંતઃપુરમાં ગયો તે સમયે બધી રાણીઓમાં શિવાહેવીએ તેને દૃષ્ટિથી જીતી લીધ્યા, તેથી અભયકુમારને વાત જણાવી. અભયકુમારે કહ્યું. એ મહારાણી શિવાહેવી ભળીબાકુલાથી ભૂતાહિકની પૂજા કરે, અને જે ભૂત શીખાદિપે સામે આવે અથવા આવીને એસે તો તેના સુખમાં દેવીએ પોતાના હાથે એ બળી નાખવો.”

શિવાહેવીએ તે પ્રમાણે કર્યું, અને ઉત્પજ્ઞ થયેલી મહામારી શાંત થઈ ગઈ. રેગની શાંતિ થવાથી રાજાએ ચાચું વરદાન આપ્યું. ચાર વરદાન લોગા થવાથી અભયકુમારે માગણી કરી. “રાજન ! એ ચારે વરદાન સાથે મળવાને ઈચ્છું છું.”

“ ભલે ખુશીથી માંગ. અહોથી છુટા થવા સિવાય હું જે મારીશ તે આપીશ.”

“ તો સાંકળો ત્યારે, તમે અનિલગિરિ હાથી ઉપર મહાવત થઈને એસો, હું શિવાહેવીના ખોળામાં એસું અને અગ્નિલીદુરથના કાણની ચિતા અનાવો. એ લડલડ ચિતામાં આપણે પ્રવેશ કરીએ.”

અભયકુમારની આવી માગણી સાંકળી પ્રધોતરાજ સહક થધ ગયો—એહ પામ્યો. તેની માગણીને આપવાને અસમર્થ પ્રધોત રાજ એલયો. “ ભાઈ ! તારી માગણી પ્રમાણે વર્તવા હું અસમર્થ છું; પણ તને આજથી હું સુકત કરું છું.”

પોતાના બંધીખાનામાંથી અભયકુમારને સુકત કરી કેટ વગેરે આપી રાજગૃહી તરફ વિહાય કર્યો. આલતી વર્ષને પ્રધોત રાજને છન્હું કે—“ રાજન ! તમે તો મને છણ કશીને પકડી લાવ્યા હતા, પણ હું ઘોળે દિવસ, ખરે ખપોરે, ભર-અનારમાં નગરીની વચ્ચમાંથી ‘ હું રાજ છું ’ એવા તમારા પોકારો છતાં હું તમને હરી જઈશ.” એમ કહી અભયકુમાર અનુકૂમે રાજગૃહી નગરીએ આવ્યો.

કેટલોક સમય વચ્ચમાં પસાર થયો, અન્યદી ગણિયુકાની એ સુંદર પુત્રીએને સાથે રાખી અભયકુમાર વણિયુકને વેશ ધારણું કરી અવંતી નગરીમાં આવ્યો. રાજમાર્ગ ઉપર એક

મહાન ભાડે વઈને તે રહ્યો. એક દિવસે પ્રધોત રાજ તે જ રસ્તેથી નીકળતો હતો તેવામાં અભયકુમારના મહાનથી તે જેવો નીકળ્યો તેવી તેની નજર ઉંચે ગઈ, અને પેલી એ રમણીઓને જોઈ. તે લલનાઓએ પણ લક્ષિત, પ્રીતિ અને વિલાસપૂર્વક તેની સામે જોખું અને અખસારા કર્યો. રાગી થયેલા પ્રધોત રાજએ બીજે દિવસે તેમની પાસે એક હૃતી મોકલ્યી. હૃતીએ તેમને ઘણું રીતે વિનવી, પણ તે સ્વીઓએ તેનો તિરસ્કાર કર્યો.

બીજે દિવસે ઇરીને પેલી હૃતી આવી ત્યારે તેમણે ધીમેથી આશેપૂર્વક તિરસ્કાર કરીને કાઢી મૂકી. ત્રીજે દિવસે પણ પાછી તે આવી, ત્યારે પેલી રમણીઓ બાલી કે “આ અમારો બાંધવ અમારી રક્ષા કરે છે ત્યાં અમે શું કરી શકીએ ? પણ તે આજથી સાતમે દિવસે બહારગામ જવાનો છે. તે સમયે રાજ અહીંથાં શુસ રીતે આવે તો જોગ બની શકે.” લલનાઓનો એવો આદેશ પામીને હૃતી ચાલી ગઈ.

હવે અહીં અભયકુમારે પ્રધોત રાજના જેવો એક પોતાનો માણુસ હતો, તેને કૃત્રિમ ગાંડો બનાવ્યો. તેનું નામ પણ પ્રધોત રાખવામાં આવ્યું અને બોકમાં પણ એવું જાડેર કર્યું કે “આ મારો ભાઈ ગાંડો થઈ ગયો છે. તેને મહામુશકેલીએ જળવવો પડે છે. શું કરવું તે કંઈ સુઅતું નથી.” અભયકુમાર પ્રતિદિવસ તેને વૈધના ઘેર લઈ જોતો ત્યારે માંચામાં સુવાડી બાંધીને ભરખાલરની વચ્ચે થઈને લઈ જોતો

હતો. તે વખતે તે પોકાર કરતો મે ગાડાની માઝું આંખમાં અણુ લાવીને કહે તો કે—“હું પ્રધોત છું ને મને આ હરી જય છે.” રોજના તેના આવા પોકારથી લોકો ટેવાઈ ગયેલા હતા.

સાતમે દિવસ આવ્યો ને ચુમ્પણે રાજ અભયના ઉતારે આવ્યો. રાજ નેવો મડાનની અંદર આવ્યો કે અભય-કુમારના સુખટોએ તત્કાળ તે કામાંધને બાંધી લીધો. પછી લોકાની આગળ અભયકુમાર બોલતો કે “આને અમે વૈધને ઘેર લઈ જઈએ છીએ” એમ કહેતાં ભરણાલરમાંથી તેને ઉપાડ્યો. પ્રથમથી જ નગરથી એક કોશ ઉપર સારો અશ્વવાળો રથ તૈયાર રાખેલો હતો, તેમાં નાખીને અભયકુમાર પ્રદોતને રાજગૃહી નગરીએ લાવ્યો. પ્રધોત રાજને શ્રેણ્યુક મહારાજની હજુરમાં હાજર કર્યો. અંધીવાન થયેલો પ્રધોત રાજ સમર્થ છતાં શ્રેણ્યુકની આગળ શરમનો માર્યો નીચું સુખ રાખીને ઉલો રહ્યો.

શ્રેણ્યુક રાજએ તરતજ તલવાર ખેંચી. તલવાર તેની છાતી સામે ધરતો ભગધરાજ બોલ્યો. “બોલ ! કોણ છે તારો અચ્યાવનાર ? આજે તને હું ઢાર કરીશ. મારા હૈયાની અગ્નિ તને મારીને શાંત કરીશ.”

શ્રેણ્યુકનું વચન સાંભળવા છતાં પ્રદોત રાજ તેની સામે જેતો મુંગો રહ્યો. તે ધણ્ણા બળ, સૈનિક અને સમૃદ્ધિવાળો હતો, છતાં અત્યારે તે એકાકી હતો. નિઃશરૂધારી હતો.

ગમે તેવો સિંહ પણ પાંજરામાં પૂરાયેલો શું કરી શકે ? પ્રદોત નિરાધાર હતો, જેથી તે શ્રેષ્ઠિકના થળનો સુંગો મેંએ સાંભળી રહ્યો હતો.

“ બોલની ! કયાં જયું તે તારું બળ ? તારા ચૌદ સામંતરાજાઓ, તારું સૈન્ય, તારા મહારથી ચોડાઓ. બધા કયાં ગયા ? જેના બળથી ઉદ્ધત થધુંને તું વિના કારણે મારો શત્રુ થયો હતો. મારી રાજગૃહી ભાંગવા આવ્યો હતો કેમ ? ”

તથાપિ પ્રદોત રાજ શું જવાખ આપે ? ગમે તેવો સમર્થ છતાં પુરુષ જ્યારે સમય પલટાય છે ત્યારે રાંક થધું જય છે. જે ગાંડીવ ધનુષ્યથી અર્જુન જેવા મહારથી ચોડાએ કૌરવોના સૈન્યને ક્ષોભ પમાડયું એ જ ગાંડીવ ધનુષ્યવાળો. અર્જુન સામાન્ય અપીલથી પરાસ્ત થયો; માટે જ કઢેવત છે હે—

“ સમય સમય બલવાન હૈ, નહિં પુરુષ બલવાન;
કાયે અર્જુન લુંટ્યો, એહી જ ધનુષ્ય એ બાન.”

એ નિઃશરીધારી પ્રદોત સમર્થ હતો, ઘણ્ણા બળવાળો છતાં સમજણુવાળો : હતો. જેથી તે સુંગો રહેવામાં જ સાર સમજ્યો. શ્રેષ્ઠિકની સમશેરની અણી તો તેની છાતી ઉપર હતી તે સિલાય શ્રેષ્ઠિકના સેંકડો સુભઠો સમશેરની અણીથી પ્રદોતને ઝરતા ઉલેલા હતા. એવી સ્થિતિમાં એક નિઃશરી પ્રદોત શું કરી શકે ? જો કે તે સમર્થ હતો

છતાં એ કાંઈ મહારથી વીર નહોતો કે સેંકડો સમગ્રેરધારી સુભટોને પણ પોતે જુતી શકે.

“આજે શિકાર જેમ સવયમેલ શિકારીના પંનમાં સુપડાય તેમ તું અનાયાસે મારા હાથમાં સુપડાયો છે. તારા જેવા દુઃમનને જતો કરું, જીવતો રહેવા દર્દ. એવો હું ભૂર્ભૂ નથી. બસ તારી જીવનદોરી આજે ખલાસ છે. તારે તારા છઠ્ઠદેવને સમરવા હોય તો યાદ કર, એટલો સમય હું તને આપીશ. પછી આ ખરુંગના એક જ વારથી તારું કામ ખલાસ.”

સમયને જાણુનારો પ્રદોત, શ્રેષ્ઠિકનું, એની રાજ-સભાનું, એના સમગ્રેરધારી સુભટોનું અવલોકન કરતો જોવા લાગ્યો. એનાથી એ અધિક એને વૈભવ હતો, ઠક્કાધ, સુભટો, સરદારો, ચોઢાઓ સર્વ કાંઈ હતું; છતાં અત્યારે એમાંનું કાંઈ નહોતું.

પ્રદોતને અત્યારે મૃત્યુ સામે ઉલેલું દેખાયું. અત્યારે એનો રમણીય અને મીઠો સંસાર ઘેરાનમેહાન થઈ ગયો હતો, પણ એવી પરવશતામાં એ શું કરી શકે? જીવન અને મૃત્યુ વચ્ચે એની જીવનનોકા તોલાં આધ રહી હતી. જીવનું કે મરવું એ વિધિને હાથ હતું, બીજો એનો વિધાતા મગધરાજ પોતે જ હતો. એક સુખી અને સમૃદ્ધશાળી સંસારના લાલચું પુરુષને અકાળે મરણું સમયે જે હુઃખ થવું જોઈએ તે અત્યારે પ્રદોત રાજને થતું હતું.

મગધપતિએ સમશેર ઉગામી. “ પ્રદોત ! હોશીયાર ”

અવંતીપતિ સંસારનો લાવયુ અને જીવનની છંચા-
વાળો હતો તે છતાં લુખવાને માટે પ્રાર્થના કરવી તે તેને
યોગ્ય ન લાગ્યું. ગમે તેવો છતાં પોતાનાથી મગધપતિ અદ્ય-
ભળવાળો હતો. અભયકુમારની ખુદ્ધિને આધીન થઇ તે સ્વપ-
ડાઈ ગયો હતો, નહિ કે શ્રેષ્ઠીકની સમશેરથી ? પોતાની દ્વાંદ્વ
આગળ તુચ્છ ગણ્યાતા મનુષ્યની પ્રાર્થના કરવા કરતાં સમયને
આધિન થવું તે જ પ્રદોતને ઢીક લાગ્યું હતું. એણે આજ
સુધીમાં ઘણ્યા યુદ્ધો કર્યાં હતાં, કંઈક રાજાઓને યુદ્ધમાં
પરાસ્ત કર્યાં હતા-માર્યા હતા, એમની સ્વીચ્છાને રડાવી
હતી. એવો માની પુરુષ શ્રેષ્ઠીકની પ્રાર્થના કરે એ
અસંભવિત હતું.

મગધપતિ જેવો પ્રદોત ઉપર ઉપર ધા કરવા જાય છે
તેવો જ તેનો સમશેર સહિત હાથ અભયકુમારે પકડી લીધો.

“ દેવ ! રાજા, બાળક, સ્વીચ્છા અવહ્ય ગણ્યાય છે.
અત્યારે એનું જીવન જો કે આપણે આધિન છે, તેથી એનો
જીવ લઈને ખુશી થવું એ ઢીક ના કહેવાય. ”

“ ત્યારે શું આવા કંઈર શરતુને હાથમાં આવેલો જવા
દેવો કે ? ” રાજાએ કહ્યું.

“ શરતુ ગમે તેવો હોય પણ જો તે શરતે આવેલો
હોય તો એને છાડી મૂકવો જોઈએ. ગમે તેવો સમર્થ છતાં

પ્રદોત અત્યારે આપને શરણે આવેલો છે. શરણે આવેલાને મારી નાખવો એ મંદ નીતિ તો નથી જ. ”

અભયકુમારનાં વચન સાંભળી રાજ શ્રેષ્ઠિકે પોતાની તલવાર મ્યાન કરી. “ રાજન ! તમને હું સુક્તા કરે છું, અને હું છબ્બું છું કે આજથી આપણી મિત્રતાનો સંબંધ કાયમ રહે. ” એમ કહી શ્રેષ્ઠિકે પ્રદોત સાથે હાથ મેલ ઠેર્યો, કેટલાક હિસ્સ મેમાન રાખીને શ્રેષ્ઠિક રાજએ પ્રદોતનું બહુમાન-સન્માન કર્યું ને માન સન્માન સહિત અવંતી તરફ વિહાય કર્યો.



પ્રકરણ ૪૧ મુ

કઠીયારો.

મહાવીરસ્વામીના અગીયાર ગણુધરમાં પદૃધર-મુજય ગણુધર જૌતમસ્વામી હતા, અને સુધર્માસ્વામી પંચમ ગણુધર હતા. અગીયાર ગણુધર છતાં મહાવીરસ્વામીએ પોતાની પાટે સુધર્મા ગણુધરની નિમણુક કરી હતી. આજે સાધુ-સાધ્વીનો પરિવાર ગણ્ય છે તે બધો સુધર્માસ્વામીના પરિવાર કહેવામાં આવે છે: એ સુધર્માસ્વામી પાસે સંસારથી વૈરાગ્ય પામીને એક કઠીયારાએ દીક્ષા અહણ કરી. કઠીયારો ગરીબ હતો, લાકડાનો ભારો લાની, માંડમાંડ તે પોતાનું શુભરાન કરતો હતો; ગરીબ કઠીયારાનું ગાડું

મહામુર્કેલીએ નવ્યા કરતું હતું. સંસારની એવી વિષમ સ્થિતિમાં તે પોતાના દિવસો પચાર કરતો હતો, એટલામાં પૂર્વના ભાગ્યચ્છોળે એને સુધમાર્સવામીનો બોધ લાગ્યો, અને એની પાસે એણે ક્રત અહણું કર્યું.

યથાશક્તિ કઠીયારો તપ કરતો હતો. જ્યારે પારણું કરવાનો સમય આવે ત્યારે આહાર માટે રાજગૃહી નગરીમાં કરવા લાગ્યો. એ રાજગૃહી નગરીના લોકો એને જેહને સામે આંગળીએ ચીંધવા લાગ્યા. “ ઓળખ્યો આને ? આ પેલો કઠીયારો, રોજ લાકડાની લાંદી વેચતો હતો તે ! ”

“ હા હા, એને ઓળખ્યો. બિચારો હુઃખ્યી કંટાળી સાધુ થઈ ગયો. શું કરે ખાવાનું ન મલે ત્યારે ? ” વીજાએ કહું.

“ લાકડાની ભારીમાં શું મલતું હતું. ખાવા જેટલા પૈસા પણ જડતા નહિ. આજે એ નિરાંતે માલમતિદા ખાઈ મજા કરે. શા માટે હીક્ષાન લે ? ”

“ ખાવાનું ન મલે તો સાધુ થશું શું એકાદું છે ? ” એ પ્રમાણે એ કઠીયારા સુનિની મર્શકરી ઉાર મર્શકરી થવા લાગી. લોકો એની નિંદા કરવા લાગ્યા.

પ્રતિદિવસ બિક્ષાને માટે કૃતા રાજગૃહ નગરમાં એ કઠીયારા સુનિની આ સિથિતિ હતી. લોકો એને મોઢે કહેવા લાગ્યા. “ ઠીક કર્યું હો. સાધુ થયો ને રોટલોય પૂરો નહોતો મલતો તે હુવે રોજ માલપાણી ઉપર હાથ નાખે છે ને ? ”

“ ક્રાંયો હુવે તો. બસ માલપાણી ઉડાવ ને મળ કર, ઠીક ચુક્તિ શોધી કાઢી હો ? સાધુ ન થયો હોત તો તને આવું ખાવાપીવાનું કયાંથી મલત ? ” બીજાએ કહ્યું.

રોજની આવી વાતોથી તે કઠીયારો કંટાળી ગયો. ધીરજની પણ હુદ્દ હોય છે. ગમે તેવો તપસ્વી કે ચોણી પણ ધીરજ તે કયાં સુધી ધારણું કરી રહે. હુજ્જનોનાં મર્મવાકયોથી ચોણીજનોનાં પણ હુદ્દય લેહાય તો પણી સંસારીએનાં વાત કયાં ? કઠીયારો જે કે સાધુ હતો છતાં શિખાડ અને અલ્યાસી હતો. પૂર્વના લઘુકર્મીપણુથી એને કઠીયારો છતાં હીક્ષા લેવાની વૃત્તિ થઈ અને સુનિપણું, અંગીકાર કર્યું; છતાં લોકોની આવી મશકરીપૂર્વક નિદાથી તે કંટાળી ગયો. એની ધીરજ ખુટી ગઈ, છતાં એ સાધુ હતો. તે બીજું શું કરી શકે ? આવીશે પરીસહેલા સહન કરવા એ તો સાધુધર્મના સિદ્ધાંતો છે. કિયાએ કરવા ઉપરાંત પીરસહેલાને સમ્યક્પ્રકારે સહન કરવા એના કરતાં અધિક મહત્ત્વા સાધુધર્મ માટે બીજું કષ્ટ હોય ?

રોજની લોડેની આવી વિટંખનાથી કંઠાળેલા કઠી-યારાએ શુરુને પોતાના હુઃખની વાત કરી, “ ભગવાન ! આપની જો આજા હોય તો હું અન્યત્ર વિહાર કરી બાં ! ”

“ કારણ ! ” સુધર્માસ્વામીએ પૂછ્યું.

કારણમાં સુધર્માસ્વામીને પોતાના હુઃખની વાત કહું સંભળાવી. કઠીયારાનો વાત સાંભળીને સુધર્માસ્વામીએ તેને વિચાર કરીને જવાણ આપ્યો. “ ઠીક છે. આપણે સાથે વિહાર કરી જશું, ને તે આવતી કાલે. ”

“ ભગવાન ! મારે લીધે આપને વિહાર કરવાની આવશ્યકતા નથી. આપ સુખેથી અહીયાં રહેઠા. મને તો અહીયાં સમાધિ રહેતી નથી માટે હું વિહાર કરવાને હુંચું છું. ”

“ તે તારું કહેલું ઠીક છે, છતાં આપણે સાથે જ વિહાર કરીશું. ” શુરુનો ઉત્તર સાંભળી કઠીયારો મૌન રહ્યો.

તે પછી અદ્ય સમય વીત્યા બાદ અભયકુમાર સુધર્મા-ગણુધરને વાંદવા આવ્યા. વંદન કરી એઠા પછી કેટલીક ધર્મજોગી થઈ. છેવટે સુધર્માસ્વામીએ કહ્યું. “ અભય-કુમાર ! આવતી કાલે અમે વિહાર કરી જશું. ”

“ ભગવાન ! અચાનક વિહાર કરવાનું કારણ કાંઈ ? ”
અભયકુમારે પૂછ્યું.

“ કારણ તો છે. આ અમારા કઠીયારા સુનિની અહીંયાં લોકો તરફથી અવગણ્યના થાય છે. પૂર્વની એની ગરીબાઈ સાંભળી લોકો એને મર્મવચનોથી હેરાન કરે છે.”

“ ટીક છે. અગવાન એક દિવસ થાલી જાઓ.”
 શુરૂની રજા લઈ અભયકુમાર ઘેર આવ્યો, પણ એના મગજમાં અનેક પ્રકારના વિચારો થયા. “ એહો ! રાજ-ગૃહીની પ્રણ આવી નિર્ણયી છે. થેણુંક જેવા રજા એને આરા જેવો તેમનો નાયક છતાં તેમની આ સ્થિતિ છે ? મહાવીર પ્રભુની દેશનાનેઃ ધોધ નિરંતર વધ્યા કરે, તે ભૂમિના મનુષ્યોની આ સ્થિતિ ? એ લોકોને કેવી રીતે ડેકાણું લાપવા ? ” અનેક પ્રકારના એણે મનસુખા કર્યા.

થીજે દિવસે ત્રણુ ડેટી રત્નનો ટગડેલા રાજગૃહીના અભયદમાં કરાવ્યો. આખી રાજગૃહીમાં ઢાઢેરો પીટાવ્યો કે “ અભયકુમાર આ ત્રણુ ડેટી રત્નો અસુક શરતે આપી હેવા માગો છે. જેને લેવા હોય તે આવો.”

ઢાઢેરો આખી રાજગૃહીમાં ઝૂચ્યો, અને નગરીના અનેક લોકો ત્યાં એકઢા થયા. ત્રણુ ડેટી રત્નો લેવાની ડેાની ઈચ્છા ન થાય ? સંસારના મોહુઅસ્ત પ્રાણીઓ દ્વારા સ્ક્રિવાય બીજી શી ઈચ્છા કરે ? એમને મન દ્વારા એ એક જ મોટી વસ્તુ હોય છે. એ એક જ એમનું લક્ષ્ય

કે ધ્યેય હોય છે. જીવનતું સર્વસ્વ લક્ષ્મી સિવાય બીજું કંઈ હોતું નથી. એ દ્રોય માટે તે શું નથી કરી શકતા ?

નગરીના અનેક લોકો દ્રોય-પેદાં રતનો લેવાને લેગાં થયા. તે સમયે લોકોને ઉદેશીને અભયકુમાર બોલ્યો, “આધુંએ ! સાંભળો, આ રતન અમારે આપી દેવાની ઈચ્છા છે. કહો કોણ લેવાને ઈંતેજર છે ? ”

“ રતનો લેવાને કોણ ન ઈચ્છે ? જો લુંટાવી દેવા ઈચ્છા હોય તો આપ ખસી જીવ એટલે જેના ભાગ્યમાં હુશે તેને આવશે, અથવા તો ઠેંડાંચી દેવા ઈચ્છા હોય તો પણ અમે બધા લેવાને ઈંતેજર છીએ.” માણુસોમાંથી એક જણું બોલ્યો.

“ લુંટાવી દેવા તો ઈચ્છા નથી તેમજ ઠેંડાંચાની પણ ઈચ્છા નથો; છતાં આપવા છે એ ચોક્કસ.” અભયકુમારે કહ્યું.

“ આપવા છે તો આપી દો ત્યારે. અમે લેવાને આતુર છીએ.”

“ પણ એક શરતે મળો, જે માણસ તે શર્સ્ત કણુલ રાખે તેને આ રતનો મળો.”

“ અને તે તમારી શરત શું છે ? ” લોકોએ પૂછ્યું

“ કાયું પાણી, અભિ અને સ્વી આ વણું વસ્તુઓને જે સર્વથા ત્યાગ કરે તે પુરુષ આ રતનો લે.”

અભયકુમારની શરત સંકળી બધા વિચારમાં પડ્યા અને ત્યાં જ રિથર થઈ ગયા. આ ત્રણું શરતમાંથી એક પણ પાળવી અશક્ય હતી તો ત્રણુંની વાત તો અતિ સુસ્કેલ કારેલી હતી. કી, અમિત અને પાણી એનો ત્યાગ શું આપણાથી અની શકે એમ છે? કહિ નહિ, એ મનુષ્યોમાંથી કોઈપણ રતન લેવાને તૈયાર થયો નહિ.

અભયકુમારે પૂછ્યું: “ કેમ કોઈ લેવાને તૈયાર છો કે નહિં? આટલા બધા ભેગા થયા છો, એમાંથી શું કોઈ તૈયાર નથી? ”

“ તમારી શરત પાળવી હુફ્કર છે. જ્યારે એ વસ્તુ એ તળુએ તો પછી આ રતનોનું પણ અમારે શું કામ છે? એ વસ્તુએના સુખની સગવડ આતર જ આ રતનોનું અમારે કામ છે. ”

“ જો તમારે રતનો જોઇએ તો શરત તો છણુલ રાખવી જોઇએ. ”

“ તો તો એ રતનો અમે લેવાને અસર્મર્થ છીએ. ”
બધા ઘોઢ્યા.

“ ત્યારે આ ત્રણ ડોટી રતનો પેલા કઠીયારાના થાએ. ” અભયકુમાર ઘોઢ્યો.

“ શું એ સુનિ કઠીયારાને પાણી, અમિત અને કી-ઓનો ત્યાગ કર્યો છે? ” લોકોએ પૂછ્યું.

“ હા એ થડી પણ વધ્યારે આવો ઉત્તમ પુરુષ,
તેની તમે નિંદા કરો છો. વાહ શું સારા કામ કરો છો ?
તમે આટલું પણ ત્યાગ કરવાને શક્તિમાન નથી ને થીને
ત્યાગ કરે તે કોવાને પણ શું તમે શક્તિમાન નથી કે તમે
ઇધર્યાથી એની નિંદા કરી રહ્યા છો ? એવા ઉત્તમ મુનિની
જનની નિંદા કરી તમે શું લાભ મેળવવાને ઈચ્છી રહ્યા
છો ? ” અભયકુમારની વાણી સંભળી લોકો પર્વતાપ કરવા
લાગ્યા.

“ અરે ! એ મુનિનું અમે વૃથા ઉપહાર્ય કર્યું. અ-
શાનના વશથકી અમે કેવું હુંકર્મ કર્યું ? એવા સાધુ
પુરુષના અવર્ણવાહ બોલવા એ મહાપાપ છે, છતાં આ-
પણે એવું પાપ કર્યું. ” લોકો પોતાની ભૂલ સંભારી એનું
પ્રાયશિક્ત કરવા લાગ્યા.

અભયકુમારે કહ્યું. “ હુલેથી એ મુનિનું કોઈ ઉપ-
હાર્ય કરશો નાહિ. ” લોકોએ તે વાત સ્વીકારી પોતાને સ્થા-
નકે ગયા. અભયકુમાર પણ પોતાને સ્થાનકે ગયો.



પ્રકરણ છ૨ મું

ઓષ્ઠ શું મત કે રાખયે?

સમય સમયનું કામ કરો જ જય છે. કાલ કંઈ કોઈના આટે ચોખારો નથી. નવાનું બુનું અને બુનાનું લુણું કરવાનો તો એનો સ્વભાવ જ છે. જે કામ જગતમાં કોઈ કરવાને શક્તિમાન નથી. માણુસો પોતે પણ પોતાનું કામ કરવાને સમર્થ નથી, ત્યારે તે કામ સમય કરી આપે છે. જગતમાં કેટલાંક કાર્યો એવા હોય છે કે પાંચ કારણુમાંના ચાર કારણો મળેલાં હોય છતાં હજુ કાલસ્થિતિ બાકી હોય. તો તેને તાત્કાલિક ઇણ મળતું નથી. સમય અનુકૂળ થાય ત્યાં લગી તેની રાહ નેવી પડે છે. વિશોષ શું કહીએ? ચક્રવર્તીનું કે વાસુદેવો પણ તે પણુંની પહોંચે કોગવવાને જન્મેલા છે છતાં જન્મીને તરતજ તે પહોંચે તેમને મળતી નથી. જન્મ્યા પછી કેટલોક સમય તેમને બળવાન છતાં એમજ નિર્ઝમન કરવો પડે છે, પણ જ્યારે સમય અનુકૂળ થાય છે, કાળસ્થિતિ પાકી જય છે ત્યારે વાર લાગતી નથી. તેમજ આઠમા સુભૂત ચક્રવર્તીને પરશુરામની કોજનશાળામાં ક્ષત્રીયોના દાઢાએથી ભરેલો થાળ તેમની નજર પડતાં જ ક્ષીર થઈ ગયો. અને થાળ સહસ્ર આરામય ચક્રવર્તી બની ગયું, અને તે જ સમયે તે સુભૂત ચક્રવર્તી કહેવાયા. એ જ ચક્ર મહા બળવાન પરશુરામને મારી

નાખ્યા, ને સુલૂમને છ અંડ વશ કરી આપ્યા. ચક ઉત્પત્તિ થયા પછી બીજી સામન્દ્રી પણ એકઠાં કરતાં વાર ન લાગી. એવા રીતે ખાલી ધડા કરાય છે અને કારેલા ધડા ખાલી થાય છે. એ બધું તોક્કાન કરવાનું કામ સમયને હાથ છે. વિશેષ શું કહીએ ? જગતમાં પ્રાણી માત્રને સુખી કરવાં કે હુઃખી કરવાં એ બધું સમયને હાથ છે.

મગધપતિ શ્રેષ્ઠિક નરપતિને રાજ્ય કરતાં યુવાની ગઈ, પ્રાણાવસ્થાય પણ ગઈ; અને એની પાછળ રહેલી વૃદ્ધાવસ્થા આવી. એમની નજર આગળ એમણે પોતાના કેટલાય પુત્રોને દીક્ષા માટે રજ આપી. જેમ એમના કેટલાય પુત્રોએ દીક્ષા લીધી હતી તેમ એમની કેટલીક સીઓએ પણ દીક્ષા અહણું કરી હતી. તે સિવાય ધર્મા-શાલીભર્દ જેવા કંઈકના મહેત્સવ એમણે કર્યાં હતા; છતાં પોતાને દીક્ષા કેમ ઉછ્ય આવતી નથી તેથી તે સુંઝાયા હતા. દીક્ષાની હૈયામાં એટલી તો અભિલાષા હતી, પાણવાની શક્તિ હતી, અહણું કરવાની આતુરતા હતી. આટલી અધી ધ્રુબી ધ્રુબી છતાં ત્યારે કેમ લઈ શકાતી ન હોતી ? લેવાના પરિણામ કેમ થતા નહોતા ?

મગધપતિએ અભયકુમાર સિવાય પોતાના પુત્ર પુત્રોને આજા કરેલી કે જેમને દીક્ષા લેવાની આકંક્ષા થાય તેમણે એમની દીક્ષામાં ભારી તો અનુમતિ સમજવી. એમણે ફૂકત એમની માતાઓની કે સીઓની અનુમતિ

મેળવવી. એવી જ રીતે ગામમાં પણ એમની એજ આપી
હતી કે જેની દીક્ષા લેવાની છચ્છા હો તેમનો મગધપતિ
પોતે દીક્ષા-મહોત્સવ કરશે. તે સિવાય ખીજુ સાંસારિક
અગ્નિઓ હુશે તે પણ દૂર કરશે. મગધપતિની આઠલી ધીરી
ચારિત્રમાર્ગ તરફ પ્રીતિભક્તિ છતાં એમને અક્ષેસ એટલો
થતો કે “ હું કેમ દીક્ષા લેતો નથી ? મને દીક્ષા લેવાનું
મન કેમ થતું નથી ? ”

ડોછ ડોછ સમયે મગધપતિને વિચાર આવતો ત્યારે તેમને
પારાવાર એદ થતો હતો. “ અરે ! શા માટે મને વત ઉદ્ય
આવતું નથી ? મેં એવું તે શું કૃત્ય કરેલું છે કે ચારિત્ર
લેવાની મને વૃત્તિ-પરિણામ થતા નથી ? હું જાણું છું કે
સંજમની દ્વિચ મને પુરેપુરી છે, તેથી જ હું મારા સ્વી-
પુત્રાહિકને અનુમતિ આપું છું, તે સિવાય ખીજાઓનાં દીક્ષા-
મહોત્સવો પણ હું કરું છું ; પણ એમાં મને શું ? એતો
જે વત લે તેને લાભ. અરે ભગવાન ! એવા વત લેવાની
તીવ્ર મનોભાવના મારી કયારે થશે ? હવે હું કયાં લગી ધીરજ
ધરું ? હવે તો હું વૃદ્ધ થઈ ગયો. શાસ્ત્ર કહે છે કે પુત્ર
કવચધારી થાય ત્યારે પિતાએ પુત્રને રાજ્ય ભગવાવી આત્મ-
સાધન કરવું. મારી નજર આગળ ફેટલાય રાજાઓએ
રાજ્ય છાડી મહાવીર પ્રલુપાસે દીક્ષા લીધી. દશાર્થ-
શદ રાજ, પ્રસભચંદ રાજ, ઉદ્યન રાજ, શું એમને
કમીના હતી ? છતાં તેઓ સંસારનો ત્યાગ કરી દીક્ષિત
થયા પણ મને કેમ દીક્ષાના પરિણામ થતા નથી ? કંઈ

નહિ. બેકે મન તો થતું નથી; આ બધું ખાવું પીવું વગેરે છોડવું તો ગમતું નથી; છતાં પણ હવે મારે અવસ્થા તરફ પણ જોવું બોઇએ, માટે મારા પુત્રોમાંથી એકને રાજ્ય આપી હું મહાવીર ભગવાનના ચરણની સેવા કરું. એમ કરતાં મને દીક્ષા ઉદ્ઘાટન આવશે તો હું ત્રત અહણું કરીશ. હવે રાજ્ય ડોને આપું? હાં, અભયકુમાર ચુબરાજ છે, રાજ્યનો વારસ છે માટે એને માથે રાજસુકૃત મઝી હું મારું આત્મસાધન કરું. વળી એ રાજ્ય સંભાળવાને લાયક છે એટલે મારે ચિંતા પણ કરવાની નથી. હું નિશ્ચિંતપણે ભગવાનની સેવા કરીશ, મારા આત્માને પાવન કરીશ તેમજ મારા અધ્યાત્મિક પુત્રોમાં રાજ્ય માટે તે અભયકુમાર જ હુક્કાર છે એટલે યીન પુત્રોને કલેશ કરવાનું કારણ નથી.” ઈત્યાદિ વિચાર કરતા મગધપતિ શ્રેષ્ઠને એક દિવસ અભયકુમારને ઓલાવીને ખાનગીમાં કહ્યું.
“ વત્સ ! જે તું રાજ્યભાર સંભાળો તો હું મહાવીરસ્વામીનો આશ્રય કરું, માટે આ રાજ્યનો તું આશ્રય કર અને મને આ રાજ્યભારમાંથી સુકૃત કર.”

મગધપતિનાં વચન સંભળી અભયકુમાર ચમક્કો. “ આપ શું રાજ્યભારમાંથી સુકૃત થવા ઈચ્�ા છો. ? ”

“ હા ! અને તે ઓળમાંથી તું મને સુકૃત કર, તો હું ભગવાનની સેવા કરું. ” મગધપતિએ કહ્યું.

“ હેવ ! આપનું કહેલું હીક છે, પણ હજી જરાક

સમયની રાહ જુઓ।” અભયકુમારે વચ્ચમાં બોડાક સમય
વ્યતીત કરવા જણ્ણાંથું.

તું કહે છે તે હીક છે, પણ હવે હું વૃદ્ધ થઈ ગયો
છું. મારે આત્મસાધન તરફ પણ લક્ષ આપવું જોઈએ.
દુનિયાની લોકલજ્જાએ પણ મારે હવે તને રાજ્ય આપી
દેવું જોઈએ. શાસ્ત્ર પણ કહે છે કે પુત્ર કવચધારી થાય
ત્યારે પિતાએ એને રાજ્ય સાંખી પોતે આત્મસાધન કરવું
પણ હું તો હજુ જથી કંઈ કરી શકતો નથી; માટે જેમ
એને તેમ જલદી હું તને મગધનો રાજસુકૃત પહેરાવવા
માણું છું.”

મગધપતિનાં વચ્ચન સાંભળી અભયકુમાર ચમક્કો. “અરે ! મારે હવે શું કરવું ? જે આ રાજ્ય અહેણું કરીશ
તો મારાથી સંયમ લઈ શકાશે નહિ, માટે ભગવાન પધારે
ત્યાં લગી પિતાળને બોલાડી દઈ; પછી જોઈ લેવાશે. મહા-
વીર જેવા તીર્થ કર ભગવાનનો ચોગ પામી હું રાજ્ય ખટ-
પટમાં પડી મતુષ્યભવ હારી જાઈ તો મારી જુદ્ધિને પણ
ધિક્ક છે, મને પણ ધિક્ક છે, મારા આત્માને પણ !”

“આત્માને ધન, દૌલત, વસ્તુ, ઠકુરાધ, રાજ્યલક્ષ્મી તો
ધાર્યાય વાર મળે છે, પણ તીર્થ કર ભગવાનનો ચોગ મળતો
નથી; તેથી જ લુધ્રને સંસારમાં રખાડું પડે છે. જ્યારે ચોગ
મળે છે તો તેને લાભ લઈ શકતો નથી. એવા મૂર્ખાંની
કોઠીમાં હું ગણ્ણાડું એના કરતાં તો એ ભગવાનનાં વચ્ચેને

અલુસરીને હું મારો માનવભવ સહ્ય કરું ” ઈત્યાહિક વિચાર કરીને તુરતજ અભયકુમારે કહ્યું. “પિતાજ ! આપની ઈચ્છા વ્યાજખી છે, છતાં આપ થોડો સમય રાહ જુઓ. પછી જે ચોણ્ય હશે તે કરશું. ભગવાનને પદ્ધતારવા ધો. તમને પણ સેવાનો લાભ મળશે. સવેં સારાં વાનાં થશે. ”

એ મગધ સાઓજયના મહાસ્થંભ ગણુત્તા અથગણ્ય પુરુષોની એ પ્રમાણે ખાનગીમાં વાતચીત થઈ. એને ફંડું આજો સમય પસાર થચો નહિ એટલામાં ભગવાન મહારીર ત્યાં રાજગૃહી આવીને સમવસર્ય. ભગવાનનું આગમન સંભળી મગધપતિ શ્રેષ્ઠિક ભગવાંતને વંદન કરવાને ધામધૂમથી પદ્ધાર્ય. વંદન કરી એઠા પછી દેશના શ્રવણ કર્યા બાદ અભયકુમારે ભગવાનને પૂછ્યું. “ ભગવાન આપના શાસનમાં રાણું દીક્ષા કર્યાં સુધી અહણ કરશે ? ”

અભયકુમારનો પ્રશ્ન સંભળી ભગવાન મહારીર ઉદ્ઘયન રાજખી તરફ અંગુલીનિર્દેશ કરીને બોધ્યા. “ જે આ પુરુષને ઓળખ્યા ? એ પુરુષ કોણ છે તે ? ”

“ કોણ છે ભગવાન, આપ જ જરા સ્પષ્ટતાથી કહો. ”
અભયકુમારે કરીને પૂછ્યું.

“સ્વાધુ, સૌવિર દેશના નરપતિ, વીતભયનગર (લેરા) ના અધિપતિ ઉદ્ઘયન રાણ એ પોતે, સિંહુ, સૌવીર વગેરે સોણ દેશનો એ સ્વામી, વીતભય આદિ ત્રણ સોને ત્રેસદ

નગરોનો એ માલેક, અને હૃદા સુણુટખાંડ રાજીઓનો એ નાયક, બીજા ધણ્ણા સામાન્ય રાજીઓનો એ નેતા અને વિજેતા, એવો મહા પરાક્રમી ઉદ્ઘયન રાજી તે આ પોતે. હુમણું જ એમણે મારી પાસે દીક્ષા અહેણું કરી છે. એમને દીક્ષા આપીને આ આ તરફ જ આવ્યો છીએ. ”

“ ભગવનુ ! આ જગ્યાએ મારા પ્રશ્નમાં તેમનો કંઈ સંબંધ છે ? ”

“ હા, તેથી જ કહું છું. આ ઉદ્ઘયન રાજીએ મારી પાસે દીક્ષા લીધી છે તે જ છેલ્લા રાજ્યિં છે. ”

“ એટલે ? ” અભયકુમારે ઝરીને પૂછ્યું.

“ એટલે એ જ કે એમની પર્ણી ડોષ મોટો રાજી હવે પર્ણી મારા શાસનમાં દીક્ષા લઈ શકો નોહિ. ” ભગવાને કહ્યું.

ભગવાનનું વચન સાંભળી અભયકુમાર ચમક્યો. રાજ્યને તળ મનમાં દીક્ષા લેવાનો જનસુધો કરી અભયકુમાર બોલ્યો. “ ભગવન ! એમણે ડેવા સંચોગ્યોમાં દીક્ષા અહેણું કરી તે એમને કહો. ”



પ્રકરણ ૪૩ મું.

ઉદ્ઘાન રાજબિં.

“ એમના રાજ્યસમયમાં એક હિવસે વિદૃતમાલીફેવે અમારી ભૂર્તિ જનાવી ચંદનકાષના સંપુટમાં ઝુકીને એક વહાણુવઠીને આપેલી. તે વહાણુવઠી તેની આજાથી વીતાભયનગરમાં આવ્યો. ભરબળરમાં આવી તેણે ઉદ્ઘોષણા કરી કે—“ કાષના સંપુટમાં રહેલી આ પ્રતિમાને કોઈ અણુ કરો, અણુ કરો.”

તેની આધોષણાથી તાપસલાદત ઉદ્ઘાનરાજ, ખાલ્સો અને કેટલાક તાપસો ત્યાં આવ્યા. તેમણે પોતપોતાના ધૃષ્ટ દેવેને સંભારી કુહાડીવતી કાષનો સંપુટ તોડવાના અનેક પ્રયત્ન કર્યા. એ કુહાડા ભાંગી ગયા પણ એ સંપુટ હુટ્યો નહિ.

મધ્યાનહી સમય થયો ને જોજનવેળા પણ વહી ગાઈ ત્યારે રાખી પ્રલાપતીને આ સમાચારનો ખાંચ પડવાથી તે પણ પતિ અજા પામીને ત્યાં આવી. સર્વ હંકિકતથી તે જાણીતી થઈ એટલે તેણે રાજને કહ્યું. “ સ્વામી ! એ તો હેવાખિદેવની પ્રતિમા છે, માટે તેમની જ સ્તુતિ કરવાથી તે ઉધરો.” એમ કહી તેણે વીતરાગની સ્તુતિ કરવા માંડી એટલે સંપુટ તરતજ ઉધરી ગયો.

તે પ્રતિમા પોતાના અંતસુરમાં લાઇ જાઓ, સુંદર ચૈત્ય

કરાઈ તેમાં પધરાવી. પ્રતિહિવસ તેની ક્રિકાલ પુલ કરવા લાગ. ચારિત્ર પાળી પ્રભાવતી પ્રથમ હેવલોકે મહિદીક ડેવતા થઈ.

હેવ થયેલા પ્રભાવતીએ ઉદ્ઘાનને પ્રતિષેધવાને અનેક પ્રથતન કર્યા પણ રાજ એધ પાડ્યો નહિ. હેવતાએ જાનથી જોઈને એક ચુક્કિત અજમાવી. એક તાપસે અમૃતફૂલનું ભરેલું પાત્ર લઈને રાજ આગળ આવી લેટ ધર્યું. એ અમૃતફૂલના સ્વાદથી રાજ ધાર્યો જ ખુશ થયો. ખુશ થયેલા રાજને તાપસ નગરની બહાર ઉદ્ઘાનમાં લઈ ગયો. ત્યાં અનેક તાપસો ચુક્કત અમૃતફૂલથી પૂર્ણ વૃક્ષો જોવામાં આઓયા. રાજ ફૂલ તોડીને આવા લાગ્યો. તાપસો રાજને ફૂલ ચુંટતો જોઈ કોથથી મારવાને હોડ્યા. રાજને મારવા માંડ્યો. રાજ તેમના પંનામાંથી છુટકી નાસવા લાગ્યો. તે આગળ ઉલ્લેલા જૈન સાધુઓને શરદ્ધે ગયો. ત્યાં તે ભયરહિત થઈ ગયો. એટલે તાપસો ઉપરનો તેનો રાગ ઉતરી ગયો. ને સાધુઓના ઉપહેથથી તે જૈન માર્ગમાં સ્થિર થઈ ગયો. ત્યારથી રાજ નિરંતર જૈન ધર્મ પાળવા લાગ્યો.

તે સમયમાં ગાંધારહેશને ગાંધાર નામે શ્રાવક લુંતસ્વામીની પ્રતિમાને વંદન કરાય વીતબયનગરમાં આવ્યો. લુંતસ્વામીને વંદન કરી તે કેટલાક હિવસ ત્યાં રહ્યો. અચાનક તેને વ્યાધિ ઉમજી થયો. પેલી કુણજાહસીએ તેની સારી સેવા કરી. તેની ભક્તિથી રંજિત થયેલા ગાંધારે તેને

પેતાની પાસેની ગોળીઓ આપી હીધી અને તેનો મહિમા કરી સંભાવી તેણે હીક્ષા થહર્ય કરી.

ચેલી કુરૂપા કુળજાએ એક ગોળી મોંમાં રાખી ચિંતાન્યું કે—‘હું સુંદર રૂપવાલી થાડું’ એટલામાં તે હેવી જેવી અની ગાઈ સુવર્ણ સમાન કાંતિવાળી તે થઈ જવાથી બોકો સુવર્ણગુલિકાને નામે બોલાવવા લાગ્યા.

સુવર્ણગુલિકાને વરની ચિંતા થઈ કારણું કે આહું સુંદર સ્વરૂપ વ્યર્થ જાય તે એને ગમતું નહોંતું, તેથી પતિ કેણે પસંદ કરવો? “ઉદ્યન તો મારે પિતા સમાન છે, બીજાઓ તો તેના પારા જેવા છે, ત્યારે ચંડપ્રદોત જ મારે પતિ થાઓ એમ ચિંતની બીજી ગોળી સુખમાં રાખી, એટલે હેવતાએ ચંડપ્રદોત આગળ સુવર્ણગુલિકાનું વર્ણન કર્યું.

પ્રદોતરાજ રાતના અનિદિવેગ હાથી ઉપર આવી સુવર્ણગુલિકા અને લુનતસ્વામીની પ્રતિમાને લઈ ગયો ને સ્વામીને સ્થાને તેના જેવી પ્રમાણોપેત બીજી પ્રતિમા સ્થાપન કરી ગયો. પ્રલાટે ઉદ્યન રાજ દર્શન કરવા આગયો તો અન્ય પ્રતિમા નોઈને વિચાર કરવા લાગ્યો કે આમ કેમ? તપાસ કરતો માલુમ પડ્યું કે વિષયાસક્ત સુવર્ણગુલિકાને લઈને ચંડપ્રદોત ઉજ્જ્વલની જતો રહ્યો છે. તેનો સાથે તે પ્રતિમા પણ અદ્વલબહલ કરી ગયો છે. ઉદ્યનને કોધ ચઠ્યો ને યુદ્ધની નોષતો વાગી. પેતાના દશ સુરુટબંધી રાજાઓને પણ તેણે તૈયાર કર્યો.

સંસારસુખમાં પડેલી સુવર્ષાગુલિકાથી જીવંતસ્વામીની ભક્તિ અરાધે ન થવાથી તેણીએ તે પ્રતિમા નળુકમાં રહેનાર ભાજિલ નામના શ્રાવકને આપી દીધી. ભાજિલ શ્રાવક એ જીવંતસ્વામીની નિરંતર ભક્તિ કરવા લાગ્યો.

ઉદ્યન રાજ પોતાના સંમત રાજાએ સાથે ચંડપ્રદોત્ત ઉપર ચઢી આવ્યો. ઉજ્ઝ્વયની સમીપમાં બજે વચ્ચે મહાસંઘામ થયો. એ સંઘામમાં મહાપરાક્રમી ઉદ્યન રાજએ ચંડપ્રદોત્તને બાંધી લીધો ને એને કપાળે દાસીપતિ એવો લેખ કર્યો.

રાજને પોતાના સૈન્યમાં કેદ કરી ઉદ્યન પોતાના સામંતો સાથે અવંતીમાં પેડા ને જીવંતસ્વામીની પ્રતિમા લેવાને તે ગયો; પણ પ્રતિમાણ ત્યાંથી ઉત્થાપન થયાં નહિ. ઉદ્યન નિરાશ થઈ પાણો દ્રાર્યો.

ઉદ્યને લક્ષ્ણકર સહિત પોતાના નગર તરફ જવાની કુચ કરી. અધવચ માર્ગ આવ્યા એટલામાં વર્ષાક્રતુ આવવાથી ત્યાં છાવણી નાખી. વર્ષાક્રતુ પસાર કરી. પણુસણ આવ્યા તેમાં ઉદ્યને ઉપવાસ કર્યો. રસોયાએ પ્રદોત્ત પણ રખેને પોતાને તેર આપવામાં આવે તે લયથી પોતે પણ ઉપવાસ કર્યો.

ઉદ્યને સાધર્મિક જાહેર એને ખુટો કર્યો ને તેને તેના રાજ્યમાં પાણો મોકલી આવ્યો. વર્ષાક્રતુ વીત્યા બાદ ઉદ્યન

પોતાને વીતભયનગર ચાલ્યો ગયો, પણ જ્યાં એની છાવણી હતી ત્યાં પીળુ કેટલીક વસ્તી રેમજ વણ્ણિકજનનો નિવાસ થવાથી ત્યાં ગામ વસી ગયું. દશપુર એ ગામનું નામ પડયું. એ દશપુરનગર પ્રદેશાત રાજને વીતભયનગરની પ્રતિમાના ખર્ચને માટે આપ્યું. જીવંતસનામીની પ્રતિમા અવંતીમાં રહેવાથી ઉદ્ઘયન ઉદાસ રહેવા લાગ્યો., પોતાની શક્તિની બહારની દૈવિક વાતોમાં તે શું કરી શકે ? રાજ ઉદાસ રહેવાથી પેઢો પ્રભાવતી દેવ પ્રત્યક્ષ થયો અને રાજને સમજાવ્યું છે—“ આ પ્રતિમા પણ પ્રાસાધિક છે, અક્ષિતપૂર્વક એની સેવા કરવાથી તે સર્વવિરતિને આપનારી થશે ” રાજને સમજાવી દેવ અદૃશ્ય થઈ ગયો, ત્યારથી નિરંતર ઉદ્ઘયન ફળિલકેવલી-પ્રતિષ્ઠિત તે પ્રતિમાને પૂજવા લાગ્યો.

અન્યથા ઉદ્ઘયનના મનમાં દીક્ષા લેવાનો મનોરથ થયો. તેનો વિચાર જાનથી જાણી અમે ચંપાપુરીથી બહાર કરી વીતભયનગરે સમવસર્યા. રાજ વાંદવાને આવ્યો, વંદન કરી દેશના શ્રવણ કરી દીક્ષા લેવાને ઉત્સુક થયો. રાજય એ પાણતું કારણું છે એમ સમજુને પોતાના મુત્રને તેણે રાજ્ય આપ્યું નહિ ને પોતાના ભાષ્યેક ડેશીને રાજ્ય આપ્યું. પછી એમણે મહોત્સવપૂર્વક અમારી માસે દીક્ષા અહણ કરી. અનેક પ્રકારનાં તપ કરીને તેમણે દેહને પણ શોષણ કરી નાખ્યો. છે. ‘એવા આ ઉદ્ઘયન રાજ તે છેદ્ધા રાજ્યિ છે ” મહાવીર ભગવાને ઉદ્ઘયનનું વૃત્તાંત દુંકમાં કહી બતાવ્યું.

“ લગુવન ! ઉદ્યન રાજ્યિંતું પરિણામે શું થશે ? ”
અભયકુમારે પૂછ્યું.

“ મહાતપસ્વી એ ઉદ્યન રાજ્યિંને અન્યહા અપથ્ય
લોકના સેવનથી મહાબ્યાધિ ઉત્પન્ન થશે, છતાં શરીર
ઉપર નિઃસ્પૃહ શરીરવાળા ઉદ્યનમુનિ હવા કરશે નહિ; તેથી
એમનો બ્યાધિ વૃદ્ધિને પામશે ત્યારે વૈદો કહેશે કે આપ
રોગની શાંતિને મારો દાઢી ખાચો. ”

પછી રાજ્યિં ગાચોનો નોહુડો હશે તે સ્થાનકે આવીને
રહેશે ને દાઢીનો આહાર કરશે. અન્યહા વિહાર કરો તે
વીતભયનગરે આવશે. ત્યાં તેના જાણોજ કેશીને એના
મંત્રીઓ ભરમાનશે. એમના ભરમાબ્યાથી ઉદ્યનને દાઢીમાં
વિષ અપાવવાની તે ગોઠવણું કરશે, એ ત્રણ વાર તો દેવતા
વિષ હરી લેશે, છતાં અન્યહા ઉપયોગ રહિત દેવતા થઈ
જવાથી વિષ સહિત દાઢીનું ઉદ્યન ભક્ષણ કરશે. રાજ્યિંને
ખખર પડશે. ત્યારે પોતાનું અવસાન નળુક જાણુને તે
અનશન કરશે. એક માસ અનશન પાણી ડેવલજાન પ્રાપ્ત
કરી ઉદ્યન રાજ્યિં મોક્ષ જશે. ”

“ લગુવન ! ઉદ્યનના પુત્ર અભિયિંતું શું થશે ? ”
અભયકુમારે કરીને પૂછ્યું.

“ પિતાથી રૂષ થયેલો અભિયિ પોતાની માર્થીના
પુત્ર કોણિષ્ટને શરણું આવશે. કોણિષ્ટ એને સન્માન આપી

પોતાની પાસે રાખશે. શ્રાવકધર્મતું આરાધન કરીને મૃત્યુ પામી પદ્થોપમની સ્થિતિબણો ઉત્તમ દેવતા થશે. ત્યાંથી મહાવિદેહ દ્વૈતમાં ઉત્પન્ન થઈ અકિયિ મોક્ષ જશે.”

લગ્નવાનની દેશના સાંભળી મગધપતિ પરિવાર સહિત દેર આવ્યા ને અભયકુમારે પિતાની આજા માગી. “ ભગવાન મહાવીર જેવા પ્રલુને પામી હું દીક્ષાન અહૃતુ કરે તો મારી બુર્જ શું કામની ? ”

અભયનાં વચન સાંભળી શ્રેષ્ઠિકે રાજ્ય દેવાનો ધણૂ આશ્રહ કર્યો, પણ અભયકુમારે પોતાની વાત છોડી નહિ. આખરે પિતાની રજ મેળવી ભગવાન પાસે દીક્ષા અહૃતુ કરી. અભયકુમારની સાથે તેની માતા નંદાએ પણ સ્વામીની રજ મેળવી દીક્ષા અહૃતુ કરી. ઉત્કૃષ્ટ ચારિત્ર પાળી અભયકુમાર સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.

—→————←—

પ્રકરણ ૪૪ મું.

જાણને અણુકારે.

મગધપતિ શ્રેષ્ઠિકને અભયકુમારની દીક્ષા પછી કંઈક અતદુલાગવા માંડયું છતાં એમને પોતાને દીક્ષા દેવાતું મન થતું નહિ. એક પછી એક એમના કંઈક પુત્રો અને રાણીએઓ એમની આજા મેળવીને દીક્ષા અહૃતુ કરી, પણ પોતાને ચારિત્ર કેમ ઉદ્ય આપતું નથી તેથી એમને પશ્ચાત્તાપ થતો. તેમની

હૃતિમાં એમની તેર રાખ્યો એનંદા, નંદમતી, નંદોત્તરા, નંદ-
દસેના, મહતા, સુમુરુતા, મહાસુરુતા, મરુદેવા, ભદ્રા, સુભદ્રા,
સુજાતા, સુમનાતીતા અને ભૂતદીપ્તા દીક્ષા લઈ, વીશ વર્ષ
દીક્ષાપર્યાય પાળી, અગીયાર અંગનો અદ્યાસ કરી, અનશન
કરી અંતે મોક્ષ ગચેલાં છે. તે જીવાચ શ્રેણીકના તેર પુત્રોએ
દીક્ષા અછણું કરી બીજા દરશ પુત્રોએ પણ દીક્ષા અછણું કરી છે.

અનેક જણુને દીક્ષા અપાવનારને દીક્ષા ઉદ્ઘયમાં ન આવે
તે શું કહેવાય ? શ્રેણીક મહારાજ નિરંતર ઉદ્ઘાસ રહેતા છતાં
રાજ્ય કરતાં હતાં. અરે ! આ વૃદ્ધાવસ્થા આવી ને પણી મૃત્યુ
આવશે, છતાં મને દીક્ષા ઉદ્ઘય કેમ નથી આવતી ? શું દીક્ષા
લેવાને હું અશક્ત છું કે અસર્મર્થ છું ? પાગવાને શક્તિવાન
છું છતાં લેવાનું મન કેમ થતું નથી ? હા ! રાજકડદ્ધિ, લોગ-
વિવાસ મોહમાયાના બંધનોમાં હું આસક્ત છું-બંધાયેલો
છું. મારી એ આસક્તિ છુટ્ટતી નથી. એ બંધન તુટતાં નથી
તો વિરતિ તે કયાંથી ઉદ્ઘય આવે ? દેશવિરતિ સરખી
ઉદ્ઘય નથી આવતી તો સર્વવિરતિ તે કયાંથી જ ઉદ્ઘય આવે ?
હૃતિમાં જવાનું છે તેથી જ વિરતિ ઉદ્ઘય નથી આવતી, કારણ
કે પાંચમે શુદ્ધાવસ્થાનકે વર્તતા વિરતિ પરિષ્ઠામ પામેલા પ્રાયઃ
હુંગતિમાં જતા નથી; પણ મારી સ્થિતિ તો વિચિત્ર છે તો વિ-
રતિતે શી રીતે ઉદ્ઘય આવે ? એર ! તો પણ હુબે રાજભારથી
સુક્ત થઈને મહાવીર ભગવાનની સેવા તો કર્દાં. આજ સુધી
ભગવાનની અખંડ ત્રિકાળ દ્વયલક્ષ્મિતો કરેલી છે, સુવર્ણના

૧૦૮ યવથી હરરોજ સાથીમાં પુરેતા છે, હરોતૃપર્ણથી અકિંત કરેલી છે છતાં હવે કંઈક વિશેષ કરૂં.

રાજગાહી ઉપર અભયકુમારનો હષ્ટ હતો પણ એ મહાતુભાવ તો ભવસભુદ જીતી ગયો. હવે મારા પુત્રોમાં રાજ્યને ચોગ્ય એક કોણિક છે, તો કોણિકને સામ્રાજ્યનો ભાર સૌંપી હું ભગવાનના સેવા કરીશ. એમ રાજ્યને મનમાં નષ્ટી કર્યું.

જ્યારે ઉતાવળીયો કોણિક પોતાના કાલ, મહાકાલ આદિ દશ બંધુઓને લેગા કરી ખાનગીમાં મંત્રણા કરવા લાગ્યો “નોયું, આ સંસારનું નાટક ! આપણો બાપ વૃદ્ધ થયો છતાં રાજગાહી છોડતો નથી. પુત્ર જ્યારે કવચધારી થાય ત્યારે પિતાએ પુત્રને રાજ્ય સૌંપી દેવું જેઠું એને અહેવા આ તો રાજ્યમાં લાલુપી થતો જાય છે. ધન્ય છે આપણું બંધુ અભયકુમારને કે જેણે ચુવાન છતાં રાજ્યલક્ષ્મીને તૃષ્ણુની જેમ છોડી દીધી, પણ આપણે વિષયાંધ પિતા તો રાજ લોગવતાં લંજળ જ પામતો નથી; માટે એ પિતાને બાંધી લઈ આપણે રાજ્ય કરીએ.” કોણિકે પોતાના દશે બાંધવ આગળ આ પ્રમાણે ખાનગીમાં પ્રસ્તાવ કરીને તેમને સમજાયા. “ પછી રાજ ભાવે જેલખાનાની હવા ખાધા કરે ! ”

કાલ, મહાકાલ આદિ બંધુઓ મનમાં કંઈયા તો ખરાદ “ અરે ! જેમે તેવો તોય એ આપણું પિતા ! એની વૃદ્ધા-વસ્થાનો લાલ લઈ આપણે એમને શું કારાશહમાં નાખવાં ?

વૃદ્ધાવસ્થામાં તો ઉલ્લાસી તેમની બહિત કરી તેમને સંતોષના જોઈએ તેને બહારે આવો શીરપાવ ! ”

“ તમે રાજ્યનીતિ સમજતા નથી. રાજ્યનીતિ કેવી છે ? રાજ્ય માટે પુત્ર કે પિતાનો સંબંધ જોવાતો નથી. પિતા હોય તો પણ તે પુત્રને શિક્ષા કરે છે. પુત્ર હોય તે પિતાને કબજે કરે છે. આપણો બાપ તો વિષયાંધ છે તેથી જ કબજે કરવા ચોણ્ય છે. અત્યારે તો એને વ્રતનો સમય છે કે વિષય સોગવવાનો ? ” કેાણ્ણિકે સમજાવ્યા.

“ છતાંય એ આપણા પિતા છે. પિતાલરદુ આપણી શું કરજ છે તે આપણે જાણવું જોઈએ. સાચા પુત્રો એ જ કહેવાય કે જે પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા કરે ! ”

“ કરજ કરતાંય આપણો સ્વાર્થ આપણો પ્રથમ જ્ઞાનવો જોઈએ. અત્યારે આપણે રાજ્ય સોગવવાને લાયક શું નથી ? આપણે રાજ્ય કરવાને સર્વ છીએ છતાં એ બુદ્ધાને કાંઈ પણ વિચાર આવે છે ? માટે એને તો એકદમ કેદ કરી દેવો. ”

“ પણ કેદ કેવી રીતે કરશું ? સુલટો, સૈન્ય, સેનાધિખિત જર્વ પિતાજીને પડશે ઉભા રહેશો ત્યારે આપણું શું થશે ? ”

“ એ એ બદામના નોકરો તો ઉગતા સૂર્યને નમનારા હોય છે; આથમતાને નહિ. એ માટે તમારે કાળજી રાખવી નહિ. કેટલાક સરદારો, સુલટો અને સેનાપતિઓને મેં મારા તાખેદાર બનાવ્યા છે. મારો હુકમજ માત્ર તેઓ અદા કરવાને

બાંધાયલા છે, પણ પિતાને કણજે કર્યો પણી એ અધી પંચાત હું બેંહારી લઈશ. તમારે તેની જીવિતા કરવી નહિં, જે જે વિભાગાં આવશે તે સર્વને હું સારુ કરી નાખીશ ” ડેણિકું કણું

ડેણિકું મહાપરાકમી હતો. એનું પરાકમ હવે ધીરજ અમે તેમ નહેાતું. પોતાનું બળ જગતને બતાવવા ‘તે અધીરે થઈ ગયો હતો. એ મહોન્મત થઈ ગયો હતો. અત્યાર-સુધી માંડ માંડ તે પોતાના પરાકમને છુપાવી રહ્યો હતો. અભય-કુમાર રાજ્યનો ઉત્તરાધિકારી હોવાથી તેમજ મહાન યુદ્ધિ-શાળી હોવાથી જેમ તેમ તે જ પીને બેસી રહ્યો હતો, કારણું કે અભયકુમારની હૃદાતિમાં તે અભયનું કે પિતાનું કાંઈપણ અનિષ્ટ કરી શકે તેમ ન હોતું તેમજ યુદ્ધિમાન અભયની પણ તેના ઉપર નજર પડેલી હતી. તે સાવધ હતો. અભયકુમાર પાસે એ શક્તિઓ હતી-બળ અને યુદ્ધિ જ્યારે ડેણિકું પાસે ફેરફાર બળ હતું. બળથી ગર્વિષ થયેલા તેની યુદ્ધિ કટાઈ ગઈ હતી. તે પૂરો સ્વાર્થિંદ્ધ હતો. પણ આજસુધી અભયકુમાર હોવાથી તે લાયાર હતો. અભયકુમારની હીક્ષા: પણી સીધે તેનો જ રાજ્યહઙ્ક હતો, તેથી હવે તે ઉતાવળો થઈ ગયો હતો. એ ઉતાવળમાં તે અવિચારી પગલું ભારવાને પણ તૈયાર થઈ ગયો હતો. અને તેનો જ માટે તે પોતાના અંધુરોને પોતાના પાપીકાર્યમાં એકત્ર કરી રહ્યો હતો.

હવે શ્રેષ્ઠિકું રાજનું પુષ્ટ પણ ખલાસ થયું હતું, તેથી જ ડેણિકની યુદ્ધિ કરી ગઈ ને અભયકુમાર જે રાજ્યનો

મોટો સ્થંભ હતો તે હુર થઈ ગયો. અલયકુમારનું ગમન એ શ્રેષ્ઠિકની પડતીનું પ્રથમ પગથીયું હતું. બીજુ પગથીયું કોણિકની બુદ્ધિમાં વિકાર થયો તે હતું. કરેલાં પાપો કાળે કરીને ઉદ્ઘય આવે છે એ નિયમને અનુસરીને શ્રેષ્ઠિકનાં પુણ્ય ખલાસ થયાં ને પાપના પડધા એક પઢી એક વાગવા લાગ્યા.

કોણિકે પોતાના બંધુઓ સહિત શુદ્ધ મંત્રણા કરી, તેને બાજે જે દિવસે એકાંતમાં એસી વિચાર-મશશુલ થયેલ મગધપતિની અખર લાઈ લીધી. મગધપતિ એને માથે રાજમુકૃટ મૂકવાની તૈયારી કરી રહ્યો હતો. આજે એ વિચારો તે અમલમાં મૂકવાની તૈયારીમાં હતો. એ વિચારનો અમલ કરવા માટે તેને કોણિકને બોલાવવાને પ્રતિહારીને હાંક મારી. એ હાંકમાં કોણિકના સુભાટો કોઈ ખુલ્લી સમશેરની અણી બતાવતા તો કોઈ બાલાની અણી બતાવવા મગધપતિની ચારે કોર ફરી વળ્યા. મગધપતિ તો આશ્ર્વયસુગ્ધ બની ગયા. “આ શું ?” બાલાની અને સમશેરની અણીયો. પોતાની છાતીની તરફ જોઈ શ્રેષ્ઠિકનું વજસમુ હૈયું કર્યું. “અરે! આ બધું શું ? જાઓ કોણિકને બોલાવો. ? ” મગધપતિએ તેમને હુકમ કર્યો.

પણ તેમનો હુકમ કોઈ સાંભળે તેમ નહોંતું. કોઈ ત્યાંથી અસ્યું નહિ. તે સર્વો મગધપતિને ડારતા ઉભા જ રહ્યા. “ એસી જાઓએ ને કોણિકને બોલાવો. ” બીજુ વાર મગધપતિએ ગર્જના કરતા કણું; પણ કાંઈ વહયું નહિ. ન તો કાંઈ હાલ્યું કે ન તા કોઈ ત્યાંથી અસ્યું.

“ નિમકહરામો ! મારા શુલામો થઈ શું મારી ઉપર

હાથ ચવાવો છો. ? ” શ્રેષ્ઠિક પાસે પડેલી સમયેર લઈ ઉભો થયો ને જેવો તે પેઢાઓ. ઉપર ધા કરવા જાય છે તેવામાં “ખબરદાર ! ” એલતા એક વીરનરે ધર્સી આવી ભાવાની આણી તેના હાથમાં ધુસાડી હીધી. શ્રેષ્ઠિકે પાછા ફરીને જેયું. “ કોણ ? ”

“ હું કોણિક. ” એ ધર્સી આવેલો વીરનર કોણિક હતો તે એટથો.

“ કોણિક ! આ શું ? ” શ્રેષ્ઠિકે પૂછ્યું. એણે તલવાર ઝેંકી હીધી.

“ આ રાજ્યનીતિ ! આજથી મારી શક્તિથી હું રાજ્ય છું. તમે નહિ. ” સુભટો તરફ ફરી હુકમ કર્યો. “ સુભટો ! કેદ કરો એમને. ”

નિઃશબ્દ શ્રેષ્ઠિકને કોણિકના સુભટોએ તરતજ પડ્યી ચતુર્ભૂજ કર્યો. પુષ્ય રહિત અને ભાવીને આધીન થયેલ મગધપતિ હુવે મગધપતિ નહિ પણ સામાન્ય કેદી શ્રેષ્ઠિક થયા. કોણિકના હુકમથી મજબૂત જંજરો શ્રેષ્ઠિકને પહેરાવવામાં આવી.

પછી સુભટોને કોણિકે હુકમ કર્યો. “ લઈ જાઓ, કારાથહમાં ને બરાબર દેખરેખ રાખો. કોઈ મળવા આવે તો મળવા હેશો નહિ, તે છતાં મારી આજાનો જાંગ કરશો તો યમપુરીના મેમાન થશો. ” કોણિકનો હુકમ સાંભળી સુભટો જંજરો સહિત શ્રેષ્ઠિકને રાજમહેલમાંથી કારાથહમાં લઈ ગયા. બીજે દિવસે કોણિક મગધેશ્વર થયો.

પ્રકરણ ૪૫ મું.

કોણિક રાજ.

શ્રેષ્ઠિક નરપતિને કારાથહમાં વાસ કરવીને કોણિક ભગધપતિ થયો. શ્રેષ્ઠિકના કારાથહ ઉપર કોણિકે સખ્ત જાપતો રખાવા માંડયો. કોઈને મળવાને પણ તે જવા હેતા નહિ. ખાનપાન પણ બરાબર આપતો નહિ. તે સિવાય સવાર-સાંજે તે પ્રતિદિવસ સો સો ચાયુકના ઝટકા શ્રેષ્ઠિકને મારતો હતો. એ રીતે ભગધપતિ કોણિક પૂર્વભવનું વેર વસુલ કરતો હતો. હુકૈવને આધીન થયેલો શ્રેષ્ઠિક આ બધું મુંગે મોંએ સહન કરી રહ્યો હતા.

અંતઃપુરની રાણીએ વળેરાએ શ્રેષ્ઠિકને મુકત કરવા માટે અનેક પ્રકારે તોક્કાન કર્યાં. કોણિકને સમજાવવાની પ્રયત્ન કરવામાં આંદોલા, પણ કોણિકે પૂર્વના વૈરની ધુનમાં કોઈનું કહેવું સાંકશ્ય નહિ. પ્રણ પણ વિક્રી તો ગઢ પણ કોણિકને પ્રણ સાથે કાંઈ વૈરભાવ નહોટો, તેથી શામ, દામ, હંડ અને સેદ્ધથી પ્રભાને તો સમજાવી શ્યાંત કરી દીખ્યી. પ્રણનું મનરંજન કરવા માટે એવું તો સરસ એણે રાજય કરવા માંડયું કે જેથી થે.ડા હિવસમાં શ્રેષ્ઠિક અને કોણિકમાં કંદ્ઘપણ લેદ જોવા ન લાગી.

અભયકુમારના જવા પછી શ્રેષ્ઠિકનાં બંધન છોડવાને કોઈપણ સમર્થ થયું નહિ. રાણીએ કે પ્રણ, અથવા તો

પ્રભનાયકો એ દિવસ જરખડ કરી શાંત થઈ ગયા, કારણું કે ડોણ્યુકનો કંઈ પ્રભ ઉપર જુલમ નહોતો કે જેથી પ્રભને નારાજ થવાનું કારણ રહે. પૂર્વભવના વેરનાં સંબંધથી ડોણ્યુક શ્રેણીકને શત્રુ સમાન લેખવતો હતો. જેટલું હુઃખ અપ્યાય તેટલું હુઃખ આપવા તે તૈયાર રહેતો હતો. એની માતા ચેલલણુંદેવીને પણ શ્રેણીક પાસે જવા હેતો નહિ, એણું ચેલલણુંચે જયારે બહુ બહુ કંદું, સમજાવ્યો ત્યારે કેદખાનામાં જવાને ફૂકત તેને એકનેજ માતાની શરમને લીધે રજ આપવામાં આવી હતી. જેથી અવારનવાર તે હરરોજ શ્રેણીકને મળવાને જેલખાનામાં જતી હતી, પણ કંઈ પણ ખાવાનું લઈ જવાની ડોણ્યુકે ચેલલણુને મના કરી હતી.

પ્રતિદિવસ સો સો ચાખુકના પ્રહારને સહન કરનાર શ્રેણીક ચેલલણુા જ્યારે કેદખાનામાં જતી હતી ત્યારે તેને જોઈને તે ઘણો આનંદ પામતો હતો. સો વખત ઘોચેકી સૂરાથી સ્નાન કરી જવાની ઉતાવળ બતાવી તેવા જ કેશે તે જેલખાનામાં જતી હતી, અને એ ડેશમાંથી ટપકતા સૂરાપાનથી શ્રેણીકને અધિક તૃપ્તિ થતી હતી, તેમજ કુલમાંખનો લાડુ સંતાડીને લઈ જતી તે શ્રેણીકને આપતી. એ લાડુ ખાઈને ચેલલણુાના સમાગમથી શ્રેણીકને એઠળો તો સંતોષ થતો કે જાણે સ્વર્ગના વહારખુલનમાં વિહાર કરતો હોયને શું? જેલખાનામાં ચેલલણુંદેવીના સમાગમથી ડોણ્યુકના સો સો ચાખુકની વેહનાને તે ભૂલી જતો હતો.

પિતાને બંધીખાનામાં નાખી રાજ્ય કરતાં કોણિકને કંઈક સમય વહી ગયો. ત્યારે કોણિકને પદ્ધાવતી નામે ખીથી તેજના અંભાર સમે એક પુત્ર ઉત્પન્ન થયો. એ પુત્રની વધામણી લાવનાર દાસ દાસીઓને મોં માગ્યા હાન આપી તેમનું દારદ હુર કરી નાખ્યું. ધાત્રીઓથી લાવન-પાલન કરતો પુત્ર અનુકમે મોટો થવા લાગ્યો. શુભ હિવસે સંસ્કારપૂર્વક ઉદાયી એવું તે પુત્રનું નામ પાડ્યું. ધીજના ચંદની માદ્ક વૃદ્ધ પામતો ઉદાયી રાજકુમાર એ વ્રષ્ટ-વર્ષનો થયો. ત્યારે કાલુકાલુ બોલી સર્વના જીવને આનંદ આપવા લાગ્યો.

એક હિવસ કોણિક રાજ ઉદાયીને ઘોળામાં બેસાડી જમવા એઠો હતો. પદ્ધાવતી તેને પીરસતી હતી, અને તેની માતા ચેલણું એની સામે એઠી હતી. જે સમયે રાજ કોણિક લગભગ અર્ધ લોજન કરી રહ્યા કે એના લોજના થાળમાં ઉદાયીએ મુત્રની ધાર કરી. કોણિક એ મુત્રની ધારના વેગને ન રોકતાં અસખદિતપણે થવા હીધી. પછી મુત્રથી આર્દ્ર થયેતા લોજને હુર કરી આડીનું લોજન એ થાળમાંથી કોણિક આરોગવા લાગ્યો. પુત્ર ઉપરના પ્રેમથી એ લોજન પણ એને સુખદાયક લાગ્યું. પોતાનો પ્રેમ પુત્ર ઉપર કેવો છે તે. માટે તેને ગર્વ થયો. શું મારા જેવો પ્રેમ કોઈપણ પિતાનો પુત્ર ઉપર હશે કે ?

સામે એઠેલી પોતાની માતા ચેલણુંને કોણિક પૂછ્યું.
 “માતા ! કોઈને પોતાનો પુત્ર આટલો બધો પ્રિય હશે કે ?”

મર્વાંધ પુત્રજે ઉત્તર આપતી તેની માતા બોલી.
 “આહ ! શું તને ગર્વ થયો છે ? તું તો ગર્વથી જ અંધુ
 થયો છે. અથવા તો પેતાના પિતાને જ કારાબ્રહમાં પૂર્વનાર
 પુરુષમાં સહયુદ્ધ તે કયાંથી હોય ? એ રવાર્થ સિનાય બીજું
 તે શું હેઠી શકે ? ”

“કેમ વાર્દ ? શું મારા પુત્ર ઉપર મારે પ્રેમ ન્યૂન છે.
 જે, તેના પ્રેમથી તો તેના સુત્રથી ઉચ્ચિષ્ટ થયેલું બોજન
 પણ હું કરી રહ્યો છું માતા ! ”

“ બસને ? એથી વધારે તો નહિ જ ને. જેને તું
 હૃદમન થયો છે અને જેને તું બંધીખાનામાં પૂરીને રોજના
 સ્વાર-સાંજ સો સો કૃટકા લગાવે છે તેના પ્રેમ આગળ
 તારી પ્રેમ તો કંઈપણ હિસાગમાં નથી સમજ્યો ? ”

“ શું મારા પિતાને મારા ઉપર બહુ સ્નેહ હતો ? ”
 કેાળુંકે પૂછ્યું.

“ એ તું હૃદમન કયાંથી સમજે ? તું તો તેમના
 શત્રુઓ ઉત્પજ થયેલો છે. શત્રુઓ ઉત્પજ થયેલા તારા
 જેવા કુલાંગર પુત્રોએ જે કર્તૃનું જેઠાએ, અને જેટલી. હું
 જવું જેઠાએ ત્યાં સુધી તું ગયો છે. તારા પિતાને દીખા-
 વનામાં તું શું ઓછા રહ્યો છે ? ”

“ હું જાણું છું એનો કેટલો બધાં પ્રેમ મારી ઉપર
 હતો તે ? એમ કહી તું એનો બોટો પક્ષ કરી રહી છે. તારી
 એવી ફ્લીલોથી હું બોજનવાઈ જાઉં તેમ નથી સમજું ? ”

“ તું શેનો બોળવાય ! મહાપાપના યોગે જ તારા જેવા પુત્રો ભળે છે. જ્યારે મહાન પુષ્ય કર્થું હોય તો અભયકુમાર જેવા પુત્રો ભળે છે. તારા પિતાએ બજે કરેલાં હતાં એ બજેનાં ફ્રલ એમને અનુફર્મે મદ્યાં. અભયકુમારથી એમને આવું મોટું રાજ્ય છતાં કેવી શાંતિ હતી ? તે પછી તારા જેવા કુલાંગારથી એમને અશાંતિ મળી. ”
ચેલ્દણુંને કહ્યું.

“ શાંતિ પછી અશાંતિ આવે છે એવો સંસારનો સામાન્ય નિયમ છે. ” હસીને ડોણિક ઘોલયો.

“ આવે છે, શા માટે આવે છે ? અશાંતિ તો તારા જેવા કુલાંગારો જ લાવે છે. ખચિત અભયકુમાર જેવા પુત્રને પામી ન હા મનુષ્યભવ જીતી ગઈ ત્યારે તારા. જેવા કુલાંગાર અને પત્થરસમા પુત્રને પામી હું જીવતાં જ કાં ન મરો જઈ, કે અત્યારે આવો સમય જોવાનો મારે સમય આવ્યો. તું મારી કુલિંગમાં કથા ફુફર્મથી આવ્યો કે જેથી મારું સર્વસ્વ નાશ કરનારો થયો. ”

“ એ તો રાજનીતિ છે માતા ! રાજ્યને માટે પિતા પુત્રને હણે છે. પુત્ર પિતાને હણે છે. ”

“ તારી રાજનીતિ બળીને ભસ્મ કાં ન થઈ ગઈ કે તારે માટે રહી ગઈ. તને પાપી બનાવવા રહી ગઈ. પિતાને ઝુની બનાવવાને રહી ગઈ. અભયકુમારને રાજ નહોતું જોઈતું, હતાં તે તો તારા જેવા પાપી કાંઈ થયો નહીં. તારું

પિતાને આપવા માંડેલું રાજ્ય પણ એણે તો અહણું કર્યું
નહિં ને તૃષ્ણુની જેમ તળુને દીક્ષા અહણું કરી, ત્યારે તું
રાજ્યમાં આસક્ત થયેલો પિતાને ખૂની થયો. જગતમાં
પાપીમાં પાપી કહેવાયો. અરે ! પાપી માણુસો પણ પોતાના
માતાપિતાનું તો રક્ષણું કરે છે. તું તો તેનાથીય અધ્યમ
છે. કોણું જણે કે તારે મર્દને કયાં જવું છે ? નહિંતર આવી
કણુંદિ તને ન સુઝે, પણ એ તો જેવી મતિ તેની જ ગતિ. ”

“ અભયકુમારને રાજ્ય આપવા માંડયું ને મને કેમ
ન આપ્યું ? શું રાજ્ય ચલાવવા માટે હું અયોગ્ય હતો
કે મને યાદ ન કર્યો ? નયારે એમણે મને રાજ્ય ન આપ્યું
તો મારે મારી શક્તિનો ચેમતકાર બતાવવો પડ્યો, એમને
પિંજરે નાખવા પડ્યા, કારણું કે એ અભયકુમાર ઠાકો
હતો હું અળખામણો હતો, એમને ? ”

“ તારી આંખમાં કમળો છે તેથી જ તને આવું દેખા-
ય છે. એમને તો તું અળખામણો નહોતો. પણ મને તો
જરૂર હતો. સમજયો. અભયકુમાર પણી તને રાજ્ય ન આ-
પત તો કાને આપત ? જરા તો ધીરજ ધરવી હતી ને ! ”

“ તને અળખામણો હતો તેનું કારણ ? ”

“ કારણ, તું તારા પિતાનો શત્રુ હતો. કોઈક દિવસ
તું તારા પિતાનું સત્યાનાશ વાળણો એવી મારા મનમાં
શંકા હતી. આજે તેં તે ખરી કરી બતાવી, તારી નીચતા
તેં સાખિત કરી છે. ”

“ તને જેવી શંકાઓ કેમ થતી હતી કે હું મારા પિતાનો શરૂ છું ? ”

“ ના કેમ થાય. તું ગર્ભમાં આવ્યો ત્યારે જ મને તારા પિતાનું માંસ ખાવાનો હોછદ થયો. અભયકુમારની ખુદ્ધિથી એ હોછદ જેમતેમ પુરો થયો, પણ એ ગર્ભના પ્રભાવથી મને અનેક ફુલ વિચારો અવિવા લાગ્યા, જેથી ગર્ભને પાડવા માટે મેં અનેક ઔષધો ખાદ્યાં, ભીજાં અનેક ઉપાયો કર્યા, છતાં ગર્ભ તો પડ્યો નહિ ને તું વૃદ્ધિને પાઢ્યો. આખરે એક હિસ્સે તું કુલાંગારનો જન્મ થયો ને મારો પણ છુટકારો થયો. પિતાના વૈરી જેવા તને મેં તરતજ દાસી માર્કેતે નગરની બાહ્ય ઉકરડે નંખાવી દીધો. ”

“ તારા જેવી માતાઓ પણ ખરી. મારા જેવો સમર્થ મુત્ર છતાં તું મારી ઉપર જરા પણ સ્નેહવાળી ન થઈ. અરે ! કુરમાં કુર માતાઓને પણ પોતાના નિરાધાર ભાળાકને નથી તણુ હેતી. ગરીબમાં ગરીબ અને ફુલ જી ન કરી શકે તે તેં કરી બનાવ્યું. ”

“ તારા જેવા કુલાંગારો જન્મે તે કરતાં ન જન્મે તે સારા. તું જન્મ્યો તો તારા પિતાનો નાશ કરનારો થયો. તેં શું કુળમાં દીપક પ્રગટાવ્યો ? ”

“ હું ! કહે તો ખરી, પણ ઉકરડે પડેલા માછં શું થયું ? ”

“ શું થાય ? તારા પિતાને ખખર પડવાથી તે તરતજ તને પણો લઈ આવ્યા ને જીવની જેમ તારું રક્ષણ કર્યું. તાં

ઉકરડામાં કુકડેના પીછાથી તારી એક આંગળી વીંધાઈ ગઈ હતી તે પાકી જવાથી એમાંથી પડં નીકળતું ને તને અત્યંત પીડા થતી હતી, જેથી તું રાતદિવસ રજા કરતો હતો. જ્યારે તારા પિતા તારી એ પરવાળી અંગુલી મુખમાં રાખતા ત્યારે જ તને શાંતિ થતી હતી ને રહતો પણ બંધ પડતો હતો, જેથી તે રાતદિવસ તારી અંગુલી મુખમાં રાખતા હતા ને પર ચુંદી હેતા હતા. એવી રીતે કષ લોગવીને તાડું લાલનપાલન કરનારા પિતાને તારા જેવા અધમાધમ ચુંટે આથી વિશેષ સારો અદ્વિતો બીજો શું આપી શકે ?”

“ સારું, એક વાત કહે. મારા પિતા મને ગોળના લાડુ કેમ મોઝલતા અને હવ્વિહિહ્વને ખાંડના મોઝલતા હતા.”

“ એમાં તારા પિતા શું જણે ? ખાવાતું મોઝલવું એતો મારું કામ છે. તારા પિતાનો તું દ્રેષી છે એમ સમયને તું મને તો અનિષ્ટકારી હતો, જેથી એ બધું મારી મરણશી બનતું હતું.”

શેલસણા દેવીના વચનરૂપી ચાગકાની કોણિકના મન પર કંઈક અસર થઈ અને તે ઘોલ્યો. “ અચીત મેં મૂલ કરી છે. હવે થાપણ રાગેલી ભીલકત જેમ પાણી સૌચે તેમ હું પણ આ રાજ્ય પિતાળને પાછું આપી દઉં.” એમ કહી તે તરફાળ ઉલ્લો થયો. “ હું મારે જ હાથે બેડીયું બાંગી નાખું.” એમ વિચારી તે એકલો દોહંડ ઉપાકી શેખિયુદ્દી પાસે જવાને કારાથ૱ તરફ ઉપડયો-ધસ્યો.

બંધીખાનામાં શ્રેણિક પાસે રહેતા પહેરગીરો યમરાજનો અંધું સમા ડેણિકને લોહદંડ લંઈ ધસી આવતો નેઈ યમક્યા.

વિચાર કરવાનો સમય નહોતો. અમતખામણું કે બીજુ કંઈ મરણવિધિ કરવાની આ તક નહોતી. અતિમ સમય હુવે આવી પહેંચયો હતો, તેથી શ્રેણિક ડેણિક આવે તે પહેલાં તાલપુટ વિષ જીલના અથલાગ ઉપર મૂકી હીધું. એ વિષ મૂકૃતાંની સાથેજ એના પ્રાણું નીકળી ગયા. આત્મા વગરનું જડ શરીર માત્ર ત્યાં રહી ગયું. શરીરમાં રહેલો આત્મા તો એક સમય માત્રમાં પ્રથમ નરક પૂર્ણવીના પ્રથમ પ્રતરે કંઈક અધિક ચોરાસી લાખ વર્ષના આઉઝે ઉત્પન્ન થઈ ગયો. પોણું આડ ધૂનુષ્ય અને છ અંગુલનું તેનું દેહમાન થયું. પરમાધામીકૃત, ક્ષેત્રકૃત અને અન્યોઅન્યકૃત ત્રણું પ્રકારની વેહનાને લોગવતો શ્રેણિકનો આત્મા પૂર્વ કરેલાં પાપોને ત્યાં લોગવવા લાગ્યો.

તીર્થંકર ભગવાને જ્ઞાનથી નેઈને જે કંઈ કહ્યું હોય છે તે કયારે પણ અન્યથા થઈ શકતું નથી. શ્રેણિક મહારાજને ભગવાનની ભક્તિ કરતાં ક્ષાયિક સમયકૃત ઉત્પન્ન થયું, તીર્થંકર નામકર્મ આંધ્રયું; પણ એમનું નિકાચિત નરકાયુષ્ય ડેખપણું પ્રકારે મિથ્યા થયું. નહિ. ત્યાં તો એમને કરેલાં પાપોને ઉપલોગ કરવાને અવશ્ય જવું પડ્યું. નરકના અતિથિ અવશ્ય થવું પડ્યું.

પ્રકરણ પદ્મ મું.

ઉપસંહાર.

હાથમાં લોહદંડ લઇને ધર્સી આવતા કોણું શું જોયું ? આતમા વગરનું શ્રેષ્ઠિકનું કલેપર એના જોવામાં આવ્યું, એ નિઃચેષ્ટ શરીરને કોણું શું કરે ? ભૂત શ્રેષ્ઠિકને જોઈ કોણું છાતી કુટી રૂદ્ધ કરવા લાગ્યો. શ્રેષ્ઠિકના ભૂતયુના સમાચાર અંતઃપુરમાં તેમજ નગરમાં ફરી વળ્યા, ચેલલણું વગેરે શ્રેષ્ઠિકની સ્ત્રીએ રડતી ને માથાં કુટી આવી. કોણુંકનો મનનો મનોરથ એમજ રહી ગયો. એના મનમાં ચિંતવેલું હેવે અન્યથા ફરી નાખ્યું. કોણુંકે રડતાં રડતાં શ્રેષ્ઠિકનું ભૂતકાર્ય કર્યું. પારાવાર પદ્ધતાપ કર્યો, એહ કર્યો, ચેલલણુંહેવીના મનોરથ મનમાં જ રહી ગયા.

શ્રેષ્ઠિકની ભૂતયુક્તિયા કર્યા પણી પણું શ્રેષ્ઠિકને ધણો એહ થવા લાગ્યો. પિતાની સુવા બેસવાની જગાએ. જોઈ તે વાર-વાર શોાક કરતો હતો, જેથી તેના મંત્રીએએ વિચાર્યું કે આમ શોાક કરવાથી આપણો રાજ ભૂતયુ પામી જશો ને રાજ્ય વિનાશ પામશે. માટે રાજનો શોાક તો મુકાવવો જોઈએ. પછી તેમણે એક યુક્તિ કરો. તેમણે એક તાઓપત્ર ઉપર લેખ તૈયાર કરી જુને કરી ભાડારમાં મુકાવ્યો ને રાજના દેખતાં કઢાવી એ-માંથી વંચાવ્યું કે “ પ્રાહ્યાણને પિંડદાન કરવાથી તે મરનાર પિતાને મલે છે. મરનારની પાછળ જેટલું દાન કરવામાં આવે છે તે બધું મરનારને મળે છે.

આ લેખથી રાજાએ શ્રેણિક પાછળ પુષ્ટળ પિંડાન આપ્યું અને પ્રાક્તિકાણણો જમાડ્યા, એટલું કરવા છતાં રાજનો કોક એછો થચો નહિ. કેણિક નરપતિને વારંવાર પિતાની સમૃતિ થદ આવતી હતી. એ સમૃતિથી તે એટલો તો શોકમણ અની જતો હતો કે એ શોકમાં તેનો કેટલોચ વખત પસાર થઈ ગયો.

મંત્રીઓએ રાજ સાથે મહી મંત્રણ કરી કે નવીન નગર વસાવી કેણિક નરપતિએ ત્યાં રાજધાની કરવી કે જેથી શોક એછો થદ જશે. કેણિક ભૂપતિએ એમાં અનુમતિ આપી જેથી મંત્રીઓએ સારી ઉત્તમ જગ્યા જોઇ અંપદ્વકૃષ્ણના નામ ઉપરથી ચંપાપુરી વસાવી. કેણિક નરપતિએ ત્યાં રાજધાની સ્થાપના કરી. ચંપાપુરોની શોલા દિનપતિહિન વખતી આવી.

અન્યથા કેણિક નરપતિને હદ્વા વિહુદ્વલના કારણે વિશાળાપતિ એટલ મહારાજાની સાથે મહાન ભયંકર ચુદ્ધ થયું. એ ચુદ્ધમાં જે પક્ષના મહીને એક કોડ એંશી લાખ સુખટો મૃત્યુ પાની ગયા. એ ચુદ્ધમાં વિશાળાપતિ એટક મૃત્યુ પામીને ભારમાં હેવલોકમાં ઈન્દ્રના સામાનિક હેવ થયા, અને કેણિક નરપતિએ વિશાળાનગરી ઐદાન મેદાન કરી નાખી. એટક નરપતિ સાથેના ચુદ્ધમાં જે કે કેણિક નરપતિને ભય થચો છતાં તેના કાળ મહાકાળ, આહિ દશે ખાંધવો.

શુદ્ધમાં મૃત્યુ પામી ગયા તેમજ તેના અનેક સુલાટો પણ
મૃત્યુવશ થઈ ગયા. ડેણિક નરપાત્રો બાર વર્ષ પર્યાંત
વિશાળા સાથે શુદ્ધ કર્યું. બાર વર્ષને અતે તે વિશાળાને
નાશ કરીને ચ'પાપુરીએ આવ્યો.

કેટલાક સમય બાદ વિહાર કરતા કરતા ભગવાન મહા-
વીરસ્વામી ચ'પાપુરીએ આવીને સમવસ્થા. ભગવાનની
દેશના સાંભળીને કોણિકાની ચેલાણુંઠક કેટલીક સ્વીચ્છાએ
પોતાના પુત્રો મરણ પામવાના શોક વળેના કારણથી ભગ-
વાન પાસે દીક્ષા અહણ કરી. ભગવાન મહાવીરનું આગમન
બાણી કોણિક નરપતિ ભગવાનને વંહન કરવાને આવ્યો.
પ્રલુને નમસ્કાર કરી ઘોણ્ય સ્થાનકે એડો. અંજલી નેડી
ઘોણ્ય સમયે ભગવાનને પૂછ્યું. “ પ્રલુ ! જેએ જન્મથી
મૃત્યુ પર્યાંત લોગને છાડી શકતા નથી એવા ચક્વતરીએ
મૃત્યુ પામીને કદ ગતિમાં જાય છે ? ”

“ લોગોને નહિ છાડનારા ચક્વતરીએ નિયમ
સાતમી નરક પૃથ્વીમાં જાય છે. ” પ્રલુએ કહ્યું. પ્રલુની
વાણી સાંભળી કોણિક નરપતિ કરીને ઘોલ્યો. “ ભગવાન
હું મૃત્યુ પામીને કદ ગતિમાં જઈશ ? ”

“ તું મૃત્યુ પામીને છાડી નરક પૃથ્વીમાં જશો. ”
ભગવાને કહ્યું.

“ સાતમીએ ડેમ નહિ જાઉ ભગવાન ! ! ” કોણિક
પૂછ્યું.

“ તું ચક્રવર્તી નથી માટે. ”

“ હું કેમ ચક્રવર્તી નહિં ? મારે પણ ચતુરંગ સેના
નાં જીવની કંઈ છે. ”

“ તારી પાસે ચક્રાદિક રત્નો નથી. એક પણ રત્ન
ઓછું હોય ત્યાં લગી ચક્રવર્તી થવાતું નથી. ચૌદ રત્નો
આપ થાય ત્યારે જ ચક્રવર્તી થવાય છે. ”

પ્રભુની વાણી સાંભળીને અહંકારમાં પર્વત સમે
કાંબિક નરપતિ ઉલ્લો થયો. નગરીમાં આવી તેણે લોહનાં
એકદ્વિય સાત રત્નો ઉત્પન્ન કર્યાં. પડ્ઘાવતીને તેણે ઓ-
રલ માન્યું. હુસ્તી વગેરે બીજાં છ તેણે પંચદ્વિય રત્નો
ફ્લી લીધાં. તે પછી મોટા પરાક્રમવાળો કેાંબિક મોટી
સેના લઈને ભારતમાં હિંજિન્જય કરવાને ચાલ્યો. અર્ધ
ભરતાર્ધના સર્વ દેશોને સાધતો કેાંબિક વૈતાદ્વગિરિની
તમિલા શુદ્ધ પાસે સૈન્ય સહિત આવ્યો ને ત્યાં પડાવ નાખ્યો.

“ હુંની હુષિત થયેલા તેણે તમિલા શુદ્ધાનાં દ્વાર
ઉધાડવા માટે દ્વાર ઉપર લોહદંડવડે નણ વાર તાડન
કર્યું એટલે તેનો અધિષ્ઠાયક કૃતમાળાદેવ બોલ્યો. “ અરે !
આ ભરવાને કોણ તૈયાર થયો છે ? ”

“ હું ચક્રવર્તી આવ્યો છું છતાં તું દ્વાર કેમ ઉધા-
ઝો નથી ? મારું સન્માન પણ કરતો નથી.” કેાંબિક બોલ્યો.

“ ચક્રવર્તીએ તો બાર થઈ ગયા છે. ” કૃતું
હેલ ખોલ્યો.

“ છતાં ધણું પુષ્ટ કરવાથી હું તેરમેં ચક્ર
થયો છું. કાર ઉધાડ. અશોકચંદ્ર નામે હું ખણ
છું. ” એમ ખોલતા ડેાણિક નરપતિએ ગુજરા કાર હું
કરીને લોહદંડથી તાડન કર્યું. એટલે કૃતમાળ હેવે
આળીને અસ્તમ કરી નાખ્યો. અશોકચંદ્ર (ડેાણિક)
પામીને ત્યાંથી છઢી નરક પુઠવીનો મેમાન થયો.

અભાતશરતુ (ડેાણિક) ના મુત્યુ પછી તેનું
પાછું ચંપાપુરીએ આંધ્રયું ને પ્રધાન. પુરુષોએ તેના
ઉદાયીને મગધના તખત ઉપર બેસાડ્યો. ઉદાયી પણ એ
મઝની રહેવાથી મંત્રીઓએ તેને માટે પાટલી પુત્ર
વસાંધ્રું ને મગધની ગાડી ઉદાયી નરપતિએ પાટલી
નગરમાં સ્થાપન કરી. રાજગાહીમાં પરિવર્તન થતાં
તે તે સમયથી રાજગૃહી અને ચંપાપુરીનો અધઃપાદ
શરૂ થયો. ને હેવે પાટલીપુત્રની છાં વધતી ચાદી
ઉદાયી પછી મગધની ગાડી નંદ નામના ડોધ પુરુષના હાથમાં
અધી. અનુકૂમે મગધના તખત ઉપર નવનંદ રાજીએ થયા.
પહેલાં નંદના સમયમાં કહૃપક નામે નાગર પ્રાણ્ય જૈન તેને
મહા અમાત્મય હતા. તેની પરંપરામાં નંદમાં નંદના સમયમાં
શક્કાળ નામે મહા અમાત્મય થયો. તેને એ પુત્ર હતા. સ્થૂલ
બદ્ર અને શ્રીયક તેમજ તેને સાત પુત્રીઓ હતી. યથા
અદ્ધારિતા, ભૂતા, ભૂતહિતા, સેણ્ણા, વેણ્ણા અને રેણ્ણા.